

# રાષ્ટ્રભાષા વિષે વિચાર

મોહનદાસ કરમચંદ જાનપી



નવજીવન પ્રકાશન મંદિર  
આમદાબાદ

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ ગુજરાતી કૌપીરાઇટ વિભાગ ]

અનુક્રમાંક ૨૫૨૪૬ કિમત ૦-૧૨-૦

ગ્રંથનામ ૨૧૪૨ (માધ્ય) વિષે વિચાર

વર્ગાંક ૪૩: લટર: ૨૦૮૩૫૨

# રાષ્ટ્રભાષા વિષે વિચાર

મોહનદાસ કરમચંદ પાંડી

“હું હુસાની અથડે ઉર્ફ નહિ, પણ હિંદી ઉર્ફ તું રહું ઉત્તરના હિંદી સમજ  
શકે તેવું સંમિલાણ ને નાગરી અથવા ઉર્ફ માં લગાયેલું રહ્ય. આ પૂરી રાષ્ટ્રભાષા,  
આકી અધ્યૂરી. પૂરી રાષ્ટ્રભાષા શીળનારે ચાલ તો બને લિપિ શીળવી જોઈએ ને  
અને રદ જાણવાં જોઈએ. રાષ્ટ્રભાષા આ નિષ્ઠયપૂર્વક માગે છે. કે આ જાણશો તે  
કરશો, નહિ જાણ્યો તે સિંગારો.”



નવજીવન પ્રકાશન માર્કેટ  
આમારાં

મુદ્રક અને પ્રકારાક  
અસ્થુળ ડાલાલાઈ ફેસાઈ  
નવજીવન મુદ્રાલય, અગુપુર, અમદાવાદ

ગુજરાત વિધાયીક અધ્યક્ષ  
અમદાવાદ  
ગુજરાતી કોપીરાઇટ સંગ્રહ

: રૂ. ૨૦ને ૩૫૨ રૂ. ૨૪૫

ઘેલી આવત્તિ, સન ૧૯૪૫: પ્રત ૨,૨૦૦

બાદ જાહેર

મે, ૧૯૪૫

## પ્રકાશકનું નિવેદન

આપણી રાષ્ટ્રભાષા હિન્દુસ્તાની વિષે ગાંધીજીના વિચારો દર્શાવતાં લખાણો. તથા ભાષણોનો આ સંગ્રહ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે, ગાંધીજી પોતાના ‘એ મોદ્દા’માં કહે છે એમ, તે “બરાબર વર્ષતે પ્રગટ” થાય છે. આ કથનમાં આપણે તાંના રાષ્ટ્રભાષાપ્રચારના કાર્યનો ધર્તિહાસ સમાચેરો છે; તેમાંથી ખાસ કરીને છેદ્ધા દાયકાનો.

ગાંધીજીના વિચારોના અભ્યાસનીને ઘબર હશે કે, તેઓશીના ડેળવણી ઉપરના અંથમાં (‘ખરી ડેળવણી’) રાષ્ટ્રભાષા ઉપર એક નોંધો ખડ્દ આપેલો છે. તે પુસ્તક ૧૯૩૮માં પ્રસિદ્ધ કરેલું. તારે દેશમાં રાષ્ટ્રભાષાના રચનાકાર્ય અંગેના તીવ્ર ભતલેદોનો ઉદ્ઘટકાળ હતો. પરંતુ આપણે ત્યાં એના છાંટા નહોતા જાઓ. તેથી એ અંગે નકારી ચર્ચાઓને ગણાને તે પુસ્તકનો પ્રસ્તુત ખડ્દ યોજણો હતો. બાદ નેમ નેમ રાષ્ટ્રભાષાના કાર્યનો અને પદ્ધતિનો વિકાસ થતો ગયો. અને તે પ્રમાણે કાર્ય યોજાતું આવ્યું, તેમ તેમ ભતલેદો અને ચર્ચા આપણે ત્યાં પણ આવતાં ગયાં. (આમ થવામાં રાષ્ટ્રના જીવનનાં ધીજાં ક્ષેત્રોના પ્રવાહો પણ કારણભૂત હતા એ વળી જુદી વાત.) એટલું જ નહિ, આજે રાષ્ટ્રભાષાના રચનાકાર્ય તરીકે પૂરી રાષ્ટ્રભાષાનો પ્રચાર કરવાના કામની આપણા પ્રાંતમાં પહેલ થઈ છે. આથી કરીને, તે સંગતા પ્રશ્ન ઉપરના ગાંધીજીના વિચારો એકસાથે જોવા વિચારના મળે તો સરસ, એ દાણિએ આ સંગ્રહ અહાર પાઓ છે. તેમાં મહદું થાય તેટલા સારુ તે પૂરતી સ્થાની પણ સાથે જોડી છે.

આ સંગ્રહ ઉપરથી વાચક એ પણ જોશે કે, ગાંધીજી ઈ. સ. ૧૯૦૮ થી ને વાત લખતા આવ્યા છે તે જ આજ એક પેઢી નેટલા કાળ બાદ પણ કહે છે: “માત્ર આજે (તે) વિચારો દ્વારા થયા છે અને તેઓએ વધારે સ્પષ્ટ સ્વરૂપ લીધું છે.” રાષ્ટ્રભાષાનો પ્રશ્ન જો ઇતા શિક્ષણુનો હોત તો એક રીતે જોતાં અ; કામ સહેલું થત. પરંતુ રાષ્ટ્રને માટે એક ભાષા ધરવા દ્વારા દેશની એકતાના સાધવામાં પણ મહદું ભાગી શકે છે; તેથી કરીને ડેમી એકતાના પ્રશ્નને પણ

તે રૂપરો છે. આથી કરીને ભાત્ર શિક્ષણ કે સાહિત્ય ઉપરાંત ધીજાં ક્ષેત્રોં  
સંતોષવાઈ તે ધર્માદી વાર નાડું જરૂરિય અન્યો છે. વળી, હિંદુસ્તાની એ લિપિમાં  
લખાય છે; અને આજે તેમાંથી એકને રાખવાના હુરાવ પર પહોંચી નથી શકતું,  
એ દુકીંકિત પણ તેની જોડે વણ્ણાય છે. આમ અનેક કારણે બહુસત્ત્ર બનેલા  
આ સવાલ વિષે ગાંધીજીના વિચારો જોઈશું તો તે બધામાં સૂત્રમણ્ણિવત્ એક  
સણંગ વિચાર રહેલો રૂપીઠ જણ્ણાય છે. વાંચે તેને રાષ્ટ્રભાષાના પ્રચારની  
વિકસતી જરી કર્યાપદ્ધતિ યાદ રાખીને સમજવો જોઈશે. સંગ્રહ મોટે લાગે  
તારીખવાર જેમણ્ણે છે તે તેમ કરવામાં ફાવશે એમ માનીને. કથાંક, વિષયના  
સણંગ નિર્વણની દૃષ્ટિએ, તેમાં ફરજ કરવો આવશ્યક માન્યો છે. પરંતુ તેનાથી  
તારીખવાર વિચાર-પ્રવાહ જેવામાં મુસીબત નથી આવતી.

રાષ્ટ્રભાષા પ્રચારકો તથા સામાન્ય રાષ્ટ્રપ્રેમી સૌને એ મદ્દરૂપ થશે  
એવી આશા છે.

## એ પ્રોલ

લાઈ જુવણુણાએ રાખ્ટ્રલાયા ઉપરનાં મારાં લખાણો ને  
ભાષણોનો સંગ્રહ બરાબર વખતે પ્રગટ કર્યો છે. બધા દેખો તો  
નથી વાંચી ગયો, પણ પહેલાં વિસેક પાનાં વાંચી શક્યો. મારું  
પહેલું ભાષણું \* સન ૧૯૧૭માં થયું ત્યાંથી ઉત્તરાતર મેં કે  
વિચારે દર્શાવ્યા છે તે જ આજે છે. માત્ર આજે વિચારે દર  
થયા છે ને તેઓએ બધારે સ્પષ્ટ સ્વરૂપ લીધું છે. હિંદી,  
ઉર્દૂને મેં સાથે જાણ્યાં છે. હિંદુસ્તાની શાખનો પ્રયોગ  
પણ છુટથી કર્યો છે. ઈદોરના હિંદી સાહિત્ય સંમેલનમાં  
જે મેં ૧૯૧૮ની સાલમાં કલ્યાં હતું, તે જ આજે કરી રહ્યો છું.<sup>x</sup>

\* ઈ. સ. ૧૯૧૭માં ભરત્ય મુકમે મળેલી બીજી ગુજરાતી કણવળી પરિધના  
પ્રમુખપદેથી આપેલા ભાષણું ગાંધીજીએ ‘હિંદી’ ભાષાની વ્યાખ્યા નીચે પ્રમાણે  
કરી છે. (જુઓ પા. ૩) તે ડ્યુરથી સ્પષ્ટ થશે કે, તેમણે ‘હિંદી’ શાખ આજના  
‘હિંદુસ્તાની’ શાખના પર્યાયવાચક શાખ તરીકે વાપર્યો છે:—

“હિંદી ભાષા નું અને કહું છું કે જે ઉત્તરમાં હિંદુ તથા સુસલમાન  
ઓલે જે ને હેવનાગરી અથવા ઉર્દૂ લિપિમાં લખે છે. . . .

“અંદી હલીલ થતી જેવામાં આવે છે કે હિંદી અને ઉર્દૂ એ નોભા  
ભાષા છે. આ હલીલ વાસ્તવિક નથી. ઉત્તર વિલાગમાં સુસલમાન અને હિંદુ  
અન્ન એક જ ભાષા બોલે છે. બેદ શિક્ષિત વર્ગે માડચો છે. . . . જે ભાષા  
ઉત્તર વિલાગમાં જનસમાજ બોલે છે તેને ઉર્દૂ કહો કે હિંદી અન્ન એક જ  
છે. ઉર્દૂ લિપિમાં લખો તો તેને ઉર્દૂ નામે આપોયો; તે જ વાક્યો નાગરીમાં  
લખો તો હિંદી કહેવારો.

“હવે રહ્યો લિપિનો અધડો. હાલ તરત સુસલમાન છોકરા જરૂર ઉર્દૂ  
લિપિમાં લખશો; હિંદુ ધરેનું ભાગે હેવનાગરીમાં લખશો. . . . છેવટે જ્યારે  
હિંદુ-સુસલમાન વચ્ચે જરા પણ શાંકાની નજર નહિ રહે, જ્યારે અવિશ્વાસનાં  
બધાં કારણો દૂર થયાં હોય, ત્યારે જે લિપિમાં નોંધ રહેશો, તે લિપિ બધારે  
ભાગે લખારો, ને તે રાષ્ટ્રીય લિપિ થશો.”

x ઈદોર સંમેલનના વ્યાખ્યાનમાંથી તે ભાગ નીચે હતાર્થી છે (જુઓ પા. ૬):

“હિંદી ભાષા તે ભાપા છે કે જે ઉત્તરમાં હિંદુ અને સુસલમાન બોલે  
જે અને કે નાગરી કે ફારસી લિપિમાં લખાય છે. આ હિંદી સાવ સંસ્કૃતમય

હિંડુસ્તાની એટલે ઉર્દુ નહિ પણ હિંદી ઉર્દુનું રૂડું ઉત્તરના હિંદી સમજ શકે તેવું સંમિશ્રણ ને નાગરી અથવા ઉર્દુમાં લખાયેલું રૂપ. આ પૂરી રાષ્ટ્રકાષા, બાકી અધૂરી. પૂરી રાષ્ટ્રકાષા શીખનારે આજ તો બંને લિપિ શીખવી જોઈએ ને બંને રૂપ જાણુવાં જોઈએ. રાષ્ટ્રપ્રેમ આ નિશ્ચયપૂર્વક માગે છે. કે આ જાણુશે તે કમાશે, નહીં જાણું તે જોશે.

મહાબળેશ્વર

૧-૫-'૪૫

મોહનદાસ કરમચંદ ગાંધી

નથી, તેમ સાવ કારસી શાખાથી ભરપૂર નથી. . . એ જ ભાષા ઓછ કહેવાય કે જે જનસમૂહ સહેલાઈથી સમજ રાકે ગામહિયાઓની બોલી બધા સમજે છે. ભાષાનું મૂળ કરોડો મનુષ્યરૂપી હિમાલયમાંથી ભળશે, અને તેમાં જ રહેશે. હિમાલયમાંથી નીકળતી ગંગા અનંત કાળ સુધી વધા કરેશે, તેમ ગામહિયાની હિંદીનું ગૌરવ રહેશે; અને જેમ નાના પદ્ધાડોમાંથી નીકળતાં ભુરણાંએ સુકાઈ જાય છે, તેમ જ સંસ્કૃતમય અને કારસીમય હિંદીની દરા થશે.

“હિંડુ-મુસલમાન વર્ષે જે બેદ કરવામાં આવે છે તે કૃતિમ છે. તેવી જ કૃતિમાં હિન્હી અને ઉર્દુ ભાષાના બેદમાં રહેલી છે. હિંડુઓની બોલીમાંથી કારસી શાખાનો સર્વથા ત્યાગ કરવો અથવા મુસલમાનોની બોલીમાંથી સંસ્કૃત શાખાનો સર્વથા ત્યાગ કરવો આવશ્યક નથી. એનો સ્વાભાવિક સંગમ ગંગા-યમુનાના સંગમ જેણો શોભાયમાન અને અચળ રહેશે. હું ઉમેદ રાખું છું કે, આપણે હિંદી-ઉર્દુના અધારમાં પડી આપણું બણ ક્રીણ નહિ રીતે.

“લિપિ બાયાત કંઈક તકલીફ જાણુાય છે. સુસલમાન ભાઈઓ અરળી લિપિમાં જ લખશે, અને હિંડુઓ ધાર્યુંઅરું નાગરી લિપિમાં લખશે. રાષ્ટ્રમાં બન્નેને સ્થાન મળવું જોઈએ. અમલહારીને બન્ને લિપિનું જ્ઞાન અવશ્ય હોય નાં જોઈએ. એમાં કંઈક કહિનતા નથી. છેવટે જે લિપિમાં આજી સરળતા હોશે તેનો વિજય થશે. ભારતવર્ષમાં પરસ્પર વ્યવહાર ચલાવવા વાસ્તે એક ભાષા હોલી જોઈએ એ વિષે સંદેહ નથી.”

વળી ૨૧-૧-૧૯૨૦ના ‘યંગ ઇન્ડિયા’માં ‘અપીલ ટુ મદ્રાસ’ એ લેખમાં ગાંધીજીએ નીચે પ્રમાણે રાષ્ટ્રીય ભાષાની વ્યાપ્તા (નુચો પા. ૬) આપી હતી :—

“રાષ્ટ્રીય કામકાજ ચલાવવા માટે અથવા વિચારવિનિમય માટે હિંડુ-સ્તાનીને છાડીને ખીંચ એક ભાષા ભાગે જ રાષ્ટ્રીય માધ્યમ બની રાકે એમ છે. (હિંડુસ્તાની એટલે હિંદી અને ઉર્દુ મળાને નીપજતા સ્વરૂપવાળી ભાષા).”

## અનુક્રમણીકા

પ્રકારાકારનું નિવેદન		૩
એ પોથી		૫
૧. રાષ્ટ્રીય ભાષાનો વિચાર	.	૧
૨. હિંદી સાહિત્ય સમેલન	.	૫
૩. કુંગેસમાં 'હિંદુસ્તાની'	.	૬
૪. અંગેળ નિંદિંહિંદુસ્તાની	.	૧૧
૫. હિંદી શીખી દો	.	૧૩
૬. હિંદુસ્તાની 'નવજીવન'	.	૧૪
૭. સ્વરાજની જરૂરિયાત	.	૧૫
૮. કાનપુર કુંગેસનો ઠરાવ	.	૧૬
૯. સલાચોણી ભાષા	.	૧૭
૧૦. એક લિપિનો પ્રક્રિયા	.	૧૮
૧૧. શિક્ષણમાં રાષ્ટ્રભાષાનું સ્થાન	.	૨૨
૧૨. કરાંચી મહાસભાનો ઠરાવ	.	૨૪
૧૩. એક 'તપ'નું સરવૈદું	.	૨૫
૧૪. આગળનું પગડું	.	૨૬
૧૫. એ સારા ઠરાવ	.	૩૪
૧૬. અભિલ ભારતીય સાહિત્ય પરિષદ	.	૩૬
૧૭. રાષ્ટ્રભાષા હિંદી-હિંદુસ્તાની	.	૪૦
૧૮. મહાસભા અને રાષ્ટ્રભાષા	.	૪૪
૧૯. હિંદી પ્રચાર અને ચારિત્રશુદ્ધિ	.	૪૬
૨૦. હિંદી ચા હિંદુસ્તાની	.	૫૨
૨૧. ગેરસમજનું જણું	.	૫૧
૨૨. વધુ જળો	.	૫૩
૨૩. રાજકીય સંરથા નથી	.	૫૭
૨૪. હિંદી વિંદુ ઉર્દૂ	.	૫૮
૨૫. આવકારપાત્ર નિવેદન	.	૭૨
૨૬. મદાસમાં હિંદુસ્તાનીનું શિક્ષણ	.	૭૪

२७. हिंदुस्तानी, हिंदी अने ડॉ॰	७६
२८. રાષ્ટ્રભાષાનું નામ	१५८
२९. હિંદુસ્તાનીનો શખદકોશ	૮૦
૩૦. રાષ્ટ્રભાષાના પ્રચારકોને	૮૦
૩૧. રેખન લિપિ વિંઠ દેવનાગરી	૮૨
૩૨. સંસ્કૃતની પુનરીયો માટે એક લિપિ	૮૪
૩૩. રાષ્ટ્રભાષાની પ્રચાર.	૮૫
૩૪. પરદેશી ભાષાની ગુલામી	૮૬
૩૫. અંગેજનું સ્થાન.	૯૦
૩૬. હિંદુસ્તાની.	૯૧
૩૭. હિંદી+ડ્રો=હિંદુસ્તાની	૯૪
૩૮. હિંદુસ્તાની શીખો	૯૮
૩૯. હિંદુસ્તાની એલીનો ધતિહાસ	૧૦૦
૪૦. રાષ્ટ્રભાષા વિષે દસ પ્રશ્નો	૧૦૭
૪૧. એક યુક્તિભાજી	૧૧૧
૪૨. હિંદુસ્તાની પ્રચારસભાની સ્થાપના	૧૧૩
૪૩. ગૂજરાતમાં હિંદુસ્તાની પ્રચાર.	૧૧૮
૪૪. એક પ્રશ્નોત્તરી	૧૨૦
૪૫. અભિન ભારતીય હિંદુસ્તાની પ્રચાર સંમેલન પુરણણી	૧૨૨
સૂચિ	૧૩૧

## ૧. રાષ્ટ્રીય ભાષાનો વિચાર

“દરેક કેળવાયેલા હિંદીને સ્વભાવા, હિંદુને સંસ્કૃત, સુસલમાનને અરથી, પારસીને પરિચયનું, અને બધાને હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. કેટલાક હિંદુએ અરથી અને કેટલાક સુસલમાને તથા પારસીએ સંસ્કૃત શીખવું જોઈએ. ઉત્તર અને પશ્ચિમ હિંદુસ્તાનના હિંદીએ તામિલ શીખવું જોઈએ. આખા હિંદુરતાનને જોઈએ તે તો હિંદી હોણી જોઈએ. તે હર્દી અથવા નાગરી લિપિમાં લખવાની ફૂટ ધોર છે. હિંદુ-સુસલમાનના વિચાર ડીક રહે, તેથી આ બંને લિપિ ધણા હિંદીએ જાણી લેવાની જરૂર છે. આમ થતાં આપણે એકખીજની સાથે વ્યવહાર રાખવામાં અંગેજને હંકારી શકીશું.”

‘હિંદુ સ્વરાજ’, (૧૯૦૬) પા. ૧૨૪

નેમ કેળવણીના વાહનનો વિચાર કરવો પણો\* તેમ જ આપણે રાષ્ટ્રીય ભાષાનો વિચાર કરવો યોગ્ય છે. જે અંગેજ રાષ્ટ્રીય ભાષા થવાની હોય તો અંગેજને જરૂરિયાત સ્થાન મળવું જોઈએ.

અંગેજ રાષ્ટ્રીય ભાષા થઈ શકે? કેટલાક વિજ્ઞાન સ્વદેશાલિમાની કહે છે કે, અંગેજ રાષ્ટ્રીય ભાષા થવી જોઈએ એવો પ્રશ્ન જ અજ્ઞાન દશાસ્વચ્છ છે; અંગેજ રાષ્ટ્રીય ભાષા થઈ ચૂકી છે. આપણા નામદાર વાઈસરોયસાહેબે ભાષણું કર્યું છે, તેમાં તેમણે માત્ર તેવી આશા બતાવી છે. તેમનો ઉત્સાહ તેમને ઉપર્યુક્ત શૈલીએ નથી લઈ જતો. વાઈસરોયસાહેબ માને છે કે, અંગેજ ભાષા દણકે દણકે આ દેશમાં વિસ્તાર પામશે, આપણાં કુંડાએમાં તે પ્રવેશ કરશે, અને છેવટે રાષ્ટ્રીય ભાષાની ઉચ્ચ પદની લોગવશે. અત્યારે ઉપર-રૂપક વિચારતાં આ ઘ્યાલને ટેકો મળે છે. આપણા શિક્ષિત વર્ગની દશા જેતાં અંગેજ વિના આપણો કારલાર અટકો પડે એવો આલાસ આવે છે. એમ છતાં જરા ઊંડા ભિતરીશું તો માલ્યમ પડશે કે, અંગેજ રાષ્ટ્રીય ભાષા ન થઈ શકે, ન થવી જોઈએ.

\* ઈ. સ. ૧૯૧૭ માં ભર્ત્ય સુકામે મળેલી બીજી ગુજરાત કેળવણી પરિધિના પ્રમુખપદ્ધતિ આપેલા ભાષણુમાંથી આ ભાગ લીધો છે. મૂળ માટે જુઓ ‘ખરી કેળવણી’ — ગાંધીજી

તારે રાષ્ટ્રીય ભાષાનાં થાં લક્ષણો હોવાં જોઈએ એનો વિચાર ફરીએ.

૧. તે ભાષા અમલદાર સારુ સહેલી હોવી જોઈએ.

૨. તે ભાષાની મારફત ભારતવર્ષનો પરસ્પર ધાર્મિક, આર્થિક અને

રાજ્યપ્રકરણી બ્યવહાર શક્ય હોવો જોઈએ.

૩. તે ભાષા ભારતવર્ષના ધણા લોડા બોલતા હોવા જોઈએ.

૪. તે ભાષા રાજુને સારુ સહેલી હોવી જોઈએ.

૫. તે ભાષાનો ખ્યાલ કરતાં ક્ષણિક કે અલપરથાયી સિથિત ઉપર વજન

ન મૂકું જોઈએ.

અંગ્રેજ ભાષામાં આમાંનું એક પણ લક્ષણ નથી.

પહેલું લક્ષણ છેલ્દું મૂકું જોઈતું હતું, પણ મેં પહેલું મૂકું છે, કેમ કે તે લક્ષણ અંગ્રેજ ભાષામાં હોય એવો આભાસ આવે છે. વધારે વિચાર કરતાં આપણે જોમિયુન કે, હાલ પણ અમલદારવર્ગને સારુ તે સહેલી ભાષા નથી. અહીંના રાજ્યધારણની કદ્દપના એવી છે કે, અંગ્રેજ વર્ગ ઓછો થશે, તે એટલે સુધી કે છેન્ટે વાઇસરોય અને ખીન આંગળીના વેદા પર ગણ્યી શકાય તેટલા અમલદાર અંગ્રેજ રહેશે. મોટો વર્ગ આજે હિંદુ જ છે, ને તે વધતો જ જરો. તે વર્ગને સારુ ભારતવર્ષની ગમે તે ભાષા કરતાં અંગ્રેજ મુસ્કેલ છે એમ તો સ્વીકારી કર્યુલ કરશે.

ધીજું લક્ષણ વિચારતાં આપણે જોઈએ છીએ કે, અંગ્રેજ ભાષા જનસમાજ બોલતી થઈ જય એ શક્ય ન હોય ત્યાં લગી આપણો ધાર્મિક બ્યવહાર અંગ્રેજમાં નહિ જ ચાલે. એટલે દરજને અંગ્રેજ ભાષા સમજમાં પ્રસરે એ અશુદ્ધ જણાય છે.

ત્રીજું લક્ષણ અંગ્રેજમાં ન હોઈ શકે, કેમ કે તે ભારતવર્ષની મોટી સંખ્યાની ઘોલી નથી.

ચોયું લક્ષણ પણ અંગ્રેજમાં નથી, કેમ કે આખા રાજુને સારુ પ્રમાણમાં તે સહેલી નથી.

પાંચમા લક્ષણનો વિચાર કરતાં આપણે જોઈએ છીએ કે, અંગ્રેજ ભાષા ને સત્તા આજે બોગવે છે તે ક્ષણિક છે. ચિરરથાયી સિથિત તો એ છે કે, હિંદુરિતાનમાં પ્રજાના રાષ્ટ્રીય કાર્યમાં અંગ્રેજ ભાષાની જરૂરિયાત થોડી જ પડશે. અંગ્રેજ સાંભાળના બ્યવહારમાં તેની જરૂર પડશે. તે સાંભાળના રાજ્યબ્યવહારની ('ડિપ્લોમસી'ની) ભાષા હશે, એ જુદે પ્રશ્ન છે. તે બ્યવહારને

સારુ અંગ્રેજની જરર રહેશે. આપણે કચાંયે અંગ્રેજ ભાષાનો દોષ નથી કરતા. માત્ર તેને તેના સ્થાન બહાર જવા હેવા નથી માગતા એ જ આમહ છે. સાઓઝની ભાષા તો અંગ્રેજ હશે ને તેથી આપણા માલીયલ, શાખિયાર, ઐનરળ વગેરેને એ ભાષા શીખવાની ફરજ પાડીથું. અને તેઓ હિંદ્ની કીર્તિ ખીંબ દેશામાં જગવશે એમ ખાતરી રાખીથું. પણ રાષ્ટ્રની ભાષા અંગ્રેજ ન હોય. અંગ્રેજને રાષ્ટ્રીય ભાષા બનાવવી એ એસ્પેરેન્ટો ફાખલ કરવા જેવું છે. અંગ્રેજ રાષ્ટ્રીય ભાષા થાય એવી કલ્પના આપણી નિર્ભળતા સૂચવે છે. એસ્પેરેન્ટોનો પ્રયાસ માત્ર અસાન સૂચવશે.

ત્યારે કઈ ભાષા પેલાં પાંચ લક્ષણોનાં છે? હિંદી ભાષામાં એ બધાં લક્ષણો છે એમ કંબૂલ કર્યા વિના ચાલશે જ નહિં.

હિંદી ભાષા હું એને કહું છું કે ને ઉત્તરમાં હિંદુ તથા મુસલમાન ખોલે છે ને દેવનાગરી અથવા ઉર્દૂ લિપિમાં લખે છે. આ વ્યાખ્યા સામે કંઈક વિરોધ જોયે છે.

એવી દીલ થતી જોવામાં આવે છે કે, હિંદી અને ઉર્દૂ એ નોભી ભાષા છે. આ દીલ વાસ્તવિક નથી. ઉત્તર વિભાગમાં મુસલમાન અને હિંદુ અને એક જ ભાષા ખોલે છે. બેદ શિક્ષિત વર્ગ પાંજ્યો છે. એટલે કે, હિંદુ શિક્ષિત વર્ગ હિંદીને ડેવળ સંસ્કૃતમય કરી મૂકી છે, તેથી ડેટલાક મુસલમાન તે નથી સમજ શકતા. લખનીના મુસલમાન ભાઈઓ ફારસીમય ઉર્દૂ ખોલીને તે હિંદુથી ન સમજાય તેવી કરી મૂકે છે. આ બંને પરિભાષા છે ને તેને પ્રણવર્ગમાં કચાંયે સ્થાન નથી. હું ઉત્તરમાં રહ્યો છું, હિંદુ મુસલમાન સાથે ખૂબ ભજ્યો છું, ને મારું હિંદી ભાષાનું શાન ધાણું ઓછું હોવા જ્ઞાં મને તેમની સાથે વ્યવહાર રાખવામાં જરાયે અડયણ નથી આવી. ને ભાષા ઉત્તર વિભાગમાં જનસમાજ ખોલે છે તેને ઉર્દૂ કહો કે હિંદી, બંને એક જ છે. ઉર્દૂ લિપિમાં લખો તો તે ઉર્દૂ નામે ઓળખો, તે જ વાક્યો નાગરીમાં લખો તો હિંદી કહેવાશે.

હવે રહ્યો લિપિનો અધ્યાત્મો. હાલ તુરત મુસલમાન છોકરા જરર ઉર્દૂ લિપિમાં લખશે. હિંદુ ધારે ભાગે દેવનાગરીમાં લખશે. “ધારે ભાગે” શબ્દનો ગ્રયોગ કરું છું, તેમ કે હજરો હિંદુ આજ પણ પોતાનું હિંદી ઉર્દૂ લિપિમાં લખે છે, ને ડેટલાક તો દેવનાગરી લિપિ જાણુના પણ નથી. છેવટે જ્યારે હિંદુ મુસલમાન વચ્ચે જરા પણ શાંકાની નજર નહિં રહે, જ્યારે અવિશાસનાં બધાં કારણો ફૂર થયાં હશે, ત્યારે ને લિપિમાં જોર રહેશે તે લિપિ વધારે ભાગે

લાખાશે, ને તે રાષ્ટ્રીય લિપિ થશે. દરમાન મુસલમાન લાઈએ અને હિંદુ જેણે ઉર્દૂ લિપિમાં અરજી લાખવી હશે તેની અરજી રાષ્ટ્રના સ્થાનમાં કંઘૂલ થવી જોઈશ.

પાંચ લક્ષણો ધારણું કરવામાં આ હિંદીની હરીઝાઈ કરનારી ખીજ એક ભાષા નથી. હિંદીની ખીજ પદ્ધતિ બંગાળી ભોગવે છે. જ્તાં બંગાળી લાઈપણું બંગાળ બહાર હિન્દીનો ઉપયોગ કરે છે. હિન્દી બોલનારો જ્યાં જાય ત્યાં હિંદીનો ઉપયોગ કરે છે ને તે કોઈને આશ્રમ્યકરક નથી લાગતું. હિંદી ધર્મ-પ્રચારકો, ઉર્દૂ મોલવીઓ, આખા હિન્દુસ્તાનમાં પોતાનાં વ્યાપ્તાનો હિન્દીમાં જ આપે છે, ને અભાણું પ્રણ તે સમજ દે છે. અભાણું ગુજરાતી પણ ઉત્તરમાં જઈ હિન્દીનો પ્રયોગ થાડો ધણો કરી લે છે, ત્યારે ઉત્તરનો લૈયો સુંબદ્ધિના શેહની દરવાનગી કરતો છતો ગુજરાતીમાં બોલવાનો ધનકાર કરે છે, ને શેષ લૈયાની સાથે ભાંગ્યુંટું હિન્દી બોલી નાંખે છે. મેં જોયું છે કે, છેક દ્રાવિડ પ્રાંતમાં પણ હિન્દીનો ધ્વનિ સંભળાય છે. મદાસમાં તો અંગ્રેજીની વ્યવહાર ચાલે એ કહેણું બરાબર નથી. ત્યાં પણ મેં મારો વ્યવહાર હિન્દીમાં ચલાયો છે. સેંકડો મદાસી ઉતારુને મેં ધતર વર્ગ સાથે હિન્દીમાં બોલતા સાંભળ્યા છે. વળી મદાસના મુસલમાન લાઈ તો બરોબર હિન્દી બોલી જાણે છે. સમસ્ત હિન્દુસ્તાનના મુસલમાન ઉર્દૂ બોલે છે એ અહીં ધ્યાનમાં રાખવા જેવું છે ને તેઓની સંખ્યા બધા પ્રાંતોમાં નાનીસૂની નથી.

આમ હિન્દી ભાષા રાષ્ટ્રીય ભાષા તરીકે નિર્માણ થઈ ચૂકી છે. તેને આપણે ધણું વર્ષો પૂર્વે રાષ્ટ્રીય ભાષા તરીકે વાપરી છે. ઉર્દૂની ઉત્પત્તિ પણ હિન્દીની એ શક્તિમાં રહેલી છે.

મુસલમાની પાહશાહો ફારસી કે અરધીને રાષ્ટ્રીય ભાષા નહિ બનાવી શક્યા. તેમણે હિન્દી વ્યાકરણું કંઘૂલ રાખી ઉર્દૂ લિપિ વાપરીને ફારસી શખ્દોનો વિશેષ ઉપયોગ કર્યો. પણ જનમાજીની સાથેનો વ્યવહાર તેનાથી પરદેરી ભાષા વડે ન થઈ શક્યો. આ દશા કંઈ અંગ્રેજ રાન્યકર્તને અન્યાન્યાં નથી. જેને લડાયક વર્ગને અનુભવ છે તે જાણે છે કે, સિપાહી વર્ગને સારુ સંશાઓ હિન્દી કે ઉર્દૂમાં રાખવી પડી છે.

આમ હિન્દી જ રાષ્ટ્રીય ભાષા થઈ શકે એમ આપણે જોઈએ છીએ. જ્તાં મદાસના શિક્ષિત વર્ગને સારુ એ સવાલ મુશ્કેલીભર્યો છે.

દક્ષિણી, ગુજરાતી, સિંધી, બંગાળાને તો તે ધણું સહેલું છે. થાડો માસમાં તેઓ હિન્દી ઉપર સારો કાંધુ મેળવી રાષ્ટ્રીય કારબાર તેમાં ચલાવી શકે છે.

ત્યાખ્યાને તેટલું સહેલું નથી. તામિલાદિ દ્રાવિડ વિલાગની ભાષાઓ છે, ને તેની રચના, તેનું બ્યાકરણ સંસ્કૃતથી જુદ્ધાં જ છે. માત્ર શાખાની એકત્તા સિવિય થીજી એકત્તા સંસ્કૃત ભાષાઓ અને દ્રાવિડ ભાષાઓ વચ્ચે જોવામાં આવતી નથી. પણ આ મુશ્કેલી માત્ર વર્તમાન શિક્ષિત વર્ગને સારુ છે. તેઓના સ્વદેશાભિમાન ઉપર આધાર રાખવાનો ને વિશેષ પ્રયાસ કરી હિંદી શીખી જોવાની આશા રાખવાનો આપણુંને અધિકાર છે. લિખિતને સારુ તો જે હિંદીને તેનું પદ મળે; તો દરેક મદાસી નિશાળમાં હિન્દી દ્વારા થાય અને મદાસને થીજી પ્રાંતો વચ્ચે વિશેષ પરિયય થવાનો સંભવ ગ્રામ થાય. અંગ્રેજી ભાષા દ્રાવિડ પ્રણમાં પ્રવેશ નથી કરી શકી. પણ હિંદીને પ્રવેશ કરતાં સમય લાગે તેમ નથી. એ પ્રયાસ તેલણું જાતિ તો આને પણ કરી રહેલ છે. જે આ પરિષદ રાષ્ટ્રીય ભાષા કર્તા થવી જોઈએ એ વિષે એક વિચાર કરી શકે, તો તો કાર્યને સાધવાના ઉપાયો યોજવાની આવશ્યકતા જણાશે. જે ઉપાયો માતૃભાષા વિષે સૂચન્યા છે તેવા, જોઈતા ફેરફાર સાથે, રાષ્ટ્રીય ભાષા વિષે પણ લાશ પડી શકે છે. વિશેષમાં ગુજરાતીને ડેળવણીનું વાહન કરવામાં આપણે જ મુખ્ય પ્રયાસ કરવો રહેશે. પણ રાષ્ટ્રીય ભાષાની ચળવણમાં તો આપું ભારતવર્ષ ભાગ લેશે.

(ઈ. સ. ૧૬૧૭)

## ૨. હિંદી સાહિત્ય સંમેલન

આ સંમેલન\*નું પ્રમુખપદ આપી આપે મને ઉપકૃત કર્યો છે. હિન્દી સાહિત્યની દાખિથી જેતાં, આ સ્થાન માટે મારી યોગ્યતા કર્દી જ નથી, એ હું સારી રીતે જાણું છું. મારો હિન્દી ભાષા ઉપરનો અસીમ પ્રેમ મને આ પદ અપાવવામાં કારણભૂત થયો છે. હું ઉમેદ રાખું છું કે, પ્રેમની પરીક્ષામાં હું હમેશાં ઉત્તીર્ણ થઈશે.

સાહિત્યનો પ્રદેશ ભાષાની ભૂમિ જાણુનાથી જ નક્કો થઈ શકે છે. જે હિન્દી ભાષાની ભૂમિ ડેવળ ઉત્તર પ્રાંત હશે, તો સાહિત્યનો પ્રદેશ સંકુચિત રહેશે. જે હિન્દી ભાષા રાષ્ટ્રીય થશે, તો સાહિત્યનો વિસ્તાર પણ રાષ્ટ્રીય થશે. યથા

\* આ ભાષણું ઈંગ્રેઝમાં મળેલી હિન્દી સાહિત્ય સંમેલનની આડમી એકના પ્રમુખપદ્ધી આપવામાં આવ્યું છું. (ઈ. સ. ૧૬૧૮.)

માણકસ્તથા ભાષા. ભાષા-સાગરમાં સ્નાન કરવાને વાસ્તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી પુનિત મહાત્માઓ આવશે. એટલે સાગરનું મહાત્વ સ્નાન કરનારાઓને અનુરૂપ હોય જોઈએ. આ કારણુસર સાહિત્યની દૃષ્ટિ પણ હિન્દી ભાષાનું સ્થાન વિચારણીય છે.

હિન્દી ભાષાની વ્યાખ્યાનો થોડાક ખ્યાલ કરવો આવશ્યક છે. હું ધણીએ વાર તેની વ્યાખ્યા કરી ચૂક્યો છું કે, હિન્દી ભાષા તે ભાષા છે કે જે ઉત્તરમાં હિન્દુ અને મુસ્લિમાન બોલે છે, અને જે નાગરી કે ફારસી લિપિમાં લખાય છે. આ હિન્દી સાવ સંસ્કૃતમય નથી, તેમ સાવ ફારસી શબ્દોથી લખપૂર નથી. જે માધુર્ય ગામદિયાની બોલીમાં મને હેખાય છે, તે લખનોના મુસ્લિમાન ભાઈઓની બોલીમાં કે પ્રયાગળના પંડિતોની બોલીમાં જણાતું નથી. એ જ ભાષા ઐક કહેવાય કે જે જનસમૂહ સહેલાઈથી સમજ શકે. ગામદિયાઓની બોલી બધા સમજે છે. ભાષાનું મૂળ કરોડો મનુષ્યરૂપી ડિમાલયમાંથી મળશે, અને તેમાં જ રહેશે. ડિમાલયમાંથી નીકળતી ગંગા અનંત કળ સુધી વજ્ઞા કરશે, તેમ ગામદિયાની હિન્દીનું ગૌરવ રહેશે; અને જેમ નાના પદ્ધતોમાંથી નીકળતાં જરણાંઓ સુકાઈ જય છે, તેમ જ સંસ્કૃતમય અને ફારસીમય હિન્દીની હણ થશા થશે.

હિન્દુ-મુસ્લિમાન વચ્ચે જે જેહ કરવામાં આવે છે તે કૃતિમ છે. તેવી જ કૃતિમના હિન્દી અને ઉર્દૂ ભાષાના જેદમાં રહેલી છે. હિન્દુઓની બોલીમાંથી ફારસી શબ્દોનો સર્વથા ત્યાગ કરવો, અથવા મુસ્લિમાનોની બોલીમાંથી સંસ્કૃત શબ્દોનો સર્વથા ત્યાગ કરવો આવશ્યક નથી. બેનો સ્વાભાવિક સંગમ, ગંગા-યમુનાના સંગમ જેવો શોલાયમાન અને અચળ રહેશે. હું ઉમેદ રાખું છું કે, આપણે હિન્દી-ઉર્દૂના ઝડપામાં પડી આપણું બળ ક્ષીણ નહિ કરીએ.

લિપિ બાબત કંઈક તકલીફ જણાય છે. મુસ્લિમાન ભાઈઓ અરથી લિપિમાં જ લખશે, અને હિન્દુઓ ધાણુંખરું નાગરી લિપિમાં લખશે. રાષ્ટ્રમાં બનેને સ્થાન મળવું જોઈએ. અમલદારોને બને લિપિનું જાન અવશ્ય હોય જોઈએ. એમાં કંઈક કહિનિતા નથી. છેન્ટે, જે લિપિમાં જાડી સરળતા હશે તેને વિજય થશે. ભારતવર્ષમાં પરસ્પર વ્યવહાર ચલાવવા વાસ્તે એક ભાષા હોણી જોઈએ, એ વિષે કંઈક સંદેહ નથી. જે આપણે હિન્દી-ઉર્દૂના ઝડપો ભૂલી જઈએ, તો આપણે જાણીએ છીએ કે, મુસ્લિમાન ભાઈઓની ઉર્દૂ જ રાષ્ટ્રીય ભાષા છે. આ વાત ઉપરથી આ સહજ ચાય છે કે, હિન્દી અથવા ઉર્દૂ મોગલ લોકના વખતમાં રાષ્ટ્રીય ભાષા બની રહી હતી. આને પણ હિન્દીની રૂપર્થા કરી શકે

એવી બીજી કાઈ ભાષા નથી. હિન્દી-ઉર્ડુ ભાષાનો અધ્યક્ષ ઓડી દેવાથી ભાષાનો પ્રશ્ન સરળ થઈ જાય છે. હિન્દુઓને થોડાધણું દ્વારસી શર્ષેં જાણવા પડશે; છસ્તલાભી ભાઈઓને સંસ્કૃત શખદંતું જ્ઞાન સંપાદન કરવું પડશે. આવી રીતે લેણુંદેણું કર્યેથી, હિન્દી ભાષાનું બળ વધી જશે, અને હિન્દુ મુસલમાનોની એકતા કરવા વાસ્તે આપણા હાથમાં એક મોહું સાધન આવી પડશે. અંગ્રેજી ભાષાનો મોહુ દૂર કરવા માટે, આટલો વધારે પરિશ્રમ કરવો પડશે કે, આપણું હિન્દી-ઉર્ડુનો અધ્યક્ષ ન ઉણાવવો. લિપિની તકરાર પણ આપણે ઉણાવવી ન જોઈએ.

હિન્દી-ઉર્ડુ રાષ્ટ્રીય ભાષા થવી જોઈએ એ વાતનો માત્ર સ્વીકાર કર્યેથી આપણું મનોરથ સિદ્ધ નહિ થઈ શકે. તો, સિદ્ધ ક્યા પ્રકારે મળી શકે? ને વિદ્યાનોચે આ મંડપને દીપાંન્યો છે, તેઓ પણ પોતાના વ્યાખ્યાનમાં આપણુંને આ વિષયમાં જરૂર કંઈક સંભળાવશે. હું તો કેવળ ભાષાના પ્રચાર વિષે કંઈક કહીશ. ભાષાનો પ્રચાર કરવા વાસ્તે હિન્દીના શિક્ષક હોવા જોઈએ. હિન્દી શીખવા ધ્યાનનાર બંગાળી વાસ્તે મેં એક નાનકડું પુસ્તક બંગભાષામાં જોયું છે. તેથું જ એક પુસ્તક મરાડીમાં છે. બીજી ભાષાઓ બોલનાર માટે આવાં પુરતકો મારા જોવામાં નથી આવ્યાં. આ કામ કરવું જેટલું સહેલું છે તેટલું જ તે આવસ્થક છે. મને ઉમેદ છે કે, આ સમેલન આ કાર્યને શીધતાથી હાથ ધરશે. આવાં પુરતકો વિદ્યાન અને અનુભૂતિ લેખકો પાસે તૈયાર કરાવવાં જોઈએ.

સૌથી વધારે કષ્ટદાયક ભામલો દ્વારિં ભાષાઓના સંબંધમાં છે. તે વિષે તો જરાયે પ્રયત્ન કરવામાં નથી આવ્યો. હિન્દી ભાષાના શિક્ષકો તૈયાર કરવા જોઈએ. આવા શિક્ષકો બહુ જ થોડા છે. આવો એક શિક્ષક પ્રયાગળથી આપણું લોકપ્રિય મંત્રી ભાઈ પુરુષોત્તમદાસજી ટંન મારકૃત મને મળ્યો છે.

હિન્દી ભાષાનું એક પણ સંપૂર્ણ વ્યાકરણું મારા જોવામાં નથી આવ્યું. ને છે તે અંગ્રેજીમાં વિલાયતી પાદરીઓએ બનાવેલાં હોય છે. આવું એક વ્યાકરણું ડો. કેલોગે રચેલું છે, સંશોધન કરી તૈયાર કર્યું છે. હિન્દીની અન્યોન્ય ભાષાઓનો મુકાબલો કરનારાં વ્યાકરણું આપણી ભાષામાં હોવાં જોઈએ. હિન્દીના પ્રેમી વિદ્યાનોને મારી નામ વિનંતિ છે કે આ ખોટ પૂરી પાડે. આપણી રાષ્ટ્રીય સલાહોમાં હિન્દી ભાષાનો ઉપયોગ થવો જોઈએ. કંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓ દ્વારા આ પ્રયત્ન થવો જોઈએ. મારો અભિપ્રાય છે કે, આ સમેલન આગામી કંગ્રેસના કાર્યકર્તાઓ પાસે આ પ્રાર્થના રજૂ કરે.

આપણી ધારાસલાયોમાં પણ રાષ્ટ્રીય ભાષા દ્વારા કાર્ય કરવું જોઈએ. જ્યાં સુધી આમ નહિ થાય, ત્યાં સુધી મળને રાજનીતિના કાર્યમાં ચોગ્ય તાલીમ નહિ મળે. આપણાં હિંદી વર્તમાનપત્રો આ કાર્ય બોહુંધાણું કરે છે. છતાં, મળને અનુવાદ મારફત તાલીમ નથી મળી શકતી. આપણી અદાલતોમાં જરૂર રાષ્ટ્રીય ભાષા અને માન્ત્રીય ભાષાનો પ્રચાર થવો જોઈએ. ન્યાયધીશ મારફત તાલીમ આપણને સહજ રીતે મળી શકે છે; પરન્તુ તે તાલીમથી પ્રણ આપે રહિત છે.

ભાષાની સેવા એવી આપણા રાજ મહારાજાઓ કરી શકે, તેવી અંગ્રેજ સરકાર નહિ કરી શકે. મહારાજ હોલ્કરની ધારાસલામાં, કચેરીમાં અને હોરેક કામમાં હિન્ડીનો અને પ્રાન્તીય બોલીનો જ ઉપયોગ થવો જોઈએ. આવા ઉત્તેજનથી ભાષા બહું ખીલી શકે છે. આ રાજયની પાદશાળાયોમાં આરંભથી અંત સુધી શિક્ષણું માતૃભાષામાં આપવાનો પ્રયોગ થવો જોઈએ. આપણા રાજ મહારાજાઓ ભાષાની ધર્ષણી ભાંચી સેવા કરી શકે છે. હું ઉમેદ રાખું છું કે, મહારાજ હોલ્કર અને તેમનો અધિકારીવર્ગ આ મોટા કાર્યને ઉત્સાહથી ઉપાડી દેશે.

આવા સંમેલનથી આપણું બધું કાર્ય સહજ થશે, એવી સમજ ભબભૂલક છે. જ્યારે આપણે પ્રતિદિન આ કાર્યની ધૂનમાં જ રહીશું ત્યારે જ આ કાર્યની સિદ્ધિ થઈ શકશે. સેંકડો સ્વાર્થત્યાગી વિદ્વાન આ કાર્યને પોતાનું માનશે ત્યારે જ સિદ્ધ થવાનો સંભવ છે.

મને ખેદ તો આ થાય છે કે, કે પ્રાતોની માતૃભાષા હિંદી છે ત્યાં પણ તે ભાષાની ઉન્નતિ કરવા ઉત્સાહ જણુંતો નથી. તે પ્રાતોમાં આપણે શિક્ષિત વર્ગ આપસાપસમાં પત્રવ્યવહાર અને વાતચીત અંગ્રેજમાં કરે છે. વાત નાની છે, પરન્તુ તેમાં રહસ્ય બહું છે. ફાન્સમાં રહેનાર અંગ્રેજ પોતાનો બધી વ્યવહાર અંગ્રેજમાં જ અલાવે છે. આપણે આપણા દેશમાં આપણું મહાન કાર્ય વિદેશી ભાષામાં કરીએ છીએ. મારો નાન્ન પરન્તુ દદ અલિગ્રાય છે કે, જ્યાં સુધી આપણે હિંદીને રાષ્ટ્રીય અને પોતપોતાની પ્રાંતીય ભાષાઓને તેનું ચોગ્ય સ્થાન નહિ આપીએ, ત્યાં સુધી સ્વરાજ્યની બધી વાતો નિરર્થક છે. આ સંમેલન દ્વારા ભારતવર્ષના આ મોટા પ્રશ્નનું નિરાકરણ થઈ જાય, એવી મારી આશા અને પ્રશ્ન પ્રતિ ગ્રાર્થના છે.

### ૩. કોન્ટ્રેસમાં 'હિંદુસ્તાની'

મદ્રાસ શષ્ઠ હું અહીં તેના લોકિક, એટલે કે, આપા મદ્રાસ ધ્યાલાકાના, બધી દ્રવિડ ભાષાઓ ખોલતા લોકો, એ અર્થમાં વાપરું છું.\*

હું જોઉ છું કે, કોન્ટ્રેસનું કામકાજ મુખ્યત્વે હિંદુસ્તાનીમાં ચાલ્યું તેથી શ્રી. એની એસંટ નારાજ થયાં, અને એવા આશ્ર્યજનક નિર્ણય ઉપર તે પહોંચ્યો છે કે, કોન્ટ્રેસ આથી કરીને એક રાષ્ટ્રીય મરીને પ્રાંતિક સલા બની ગઈ છે. શ્રી. એસંટ અને હિંદની તેમણે કરેલી સેવાઓ માટે મને લારે માન છે. હિંદ માટે સ્વરાજનો વિચાર તેમના જેટલો લોકપ્રિય ખીજ ડાઈએ કર્યો નથી. આપણામાંના ઉત્તમ અને ઉમરે નાના લોક પણ એમનો ઉઘામ, એમની ધગશ અને એમની સંગૃહન શક્તિને પહોંચી ન શકે; અને આ બધું તેમણે હિંદની સેવાથી અર્પ્યું છે. પોતાની પ્રૌઢ ઉમરનો ઉત્તમ લાગ એમણે હિંદની સેવામાં આપ્યો છે, અને તેમાં તે લોકમાન્ય રિણકથી કદાચ ખીજ નંબરની લોકપ્રિયતા પામ્યા છે, જે ગોઝ જ છે. પરંતુ, અત્યારે, ભણેલા હિંદીએના મોટા લાગને તેમના વિચારો માન્ય ન હોવાથી, તે કાંઈક લોકમાન્યતામાં જાતર્યાં છે; અને હિંદુસ્તાનીથી કોન્ટ્રેસ પ્રાંતિક સલા બની એવા એમના વિચારથી જાહેરમાં જુદા પડતાં મને દુઃખ થાય છે. મારો નામ મત છે કે, આ એક ગંભીર ભૂલ છે, અને તે તરફ ધ્યાન ખેંચવાની મને ફરજ પડે છે.

૧૯૭૧થી, એક છોડી, બધી કોન્ટ્રેસ એસ્ક્રોમાં હું ગયો છું. તેનું કામકાજ અંગેઝ્લને બદલે હિંદુસ્તાનીમાં ચલાવવાની ઉપયોગિતાની દાખિયે મેં તેમનો ખાસ અભ્યાસ કર્યો છે. સેંકડો પ્રતિનિધિઓ અને લન્ઝરો પ્રેક્સ્ડો જોઉ મેં વાતો કરી છે; લોક૦ રિણક અને શ્રી. એસંટ સુધ્યાં બધા જાહેર કાર્યકર્તાઓ કરતાં કદાચ વધારે પ્રેરણ હું કર્યો છું અને અલણું ભણેલા મળાને વધારે લોકને મળ્યો છું; અને હું સમજપૂર્વક એવા નિર્ણય ઉપર પહોંચ્યો છું કે, રાષ્ટ્રીય કામકાજ ચલાવવા માટે અથવા વિચારવિનિમયને માટે, હિંદુસ્તાનીને છોડીને ખીજ એક ભાષા લાગ્યે જ રાષ્ટ્રીય માધ્યમ અની શકે એમ છે. (હિંદુસ્તાની એટલે હિંદી અને ઉર્દૂ મળાને નીપળતા સ્વરૂપવાળી ભાષા). તેમ જ, બહેળા અનુભવને આધારે બધાયેલો એ પણ મારો પાડો મત છે કે, છેલ્યાં એ વર્ષ ખાદ કરતાં

(\* ૨૧-૧-૧૯૭૦ના 'અંગ હાઇસ' માનો 'અપીલ હું મદ્રાસ' એ કેખ.)

બાકીનાં ખધાં વરસોમાં કો-ગ્રેસનું કામ લગભગ ખાંડું જ અંગ્રેજીમાં ચલાવવાથી રાષ્ટ્રને ધાર્યું હેઠળું પડ્યું છે. ઉપરાંત હું કહેવા માગું છું કે, એક મદાસ છલાકા બાદ કરતાં ખીજે ખધે, રાષ્ટ્રીય કો-ગ્રેસના પ્રેક્ષકા તથા પ્રતિનિધિઓનો મોટા ભાગ અંગ્રેજ કરતાં હિંદુસ્તાનીમાં હેમેશ વધારે સમજ શક્યો છે. તેથી કરીને, ને આર્થિક પરિણામ આવ્યું છે તે તો એ છે કે, આ ખધાં વર્ષોના લાંબા ગાળામાં કો-ગ્રેસ દેખવા પૂરતી જ રાષ્ટ્રીય રહી છે; લોકેળીશ્વરીની ખરી કિંમતથી આંકૃતીએ તો તે કદી રાષ્ટ્રીય નહોતી. દુનિયાનો ખીજે કાર્ધિકાણ દેશ હોત તો, આ જાતની સભા, કે જે વર્ષ પ્રતિવર્ષ પોતાની લોકપ્રિયતામાં વધતી જ ચાલી છે, તે, પોતાના ઉછ્વાસના આયુષ દરમિયાન, લોકો આગળ તેમની પોતાની ભાગામાં વિધવિધ પ્રક્રો ચર્ચાને તોડ લાવત, અને એમ કરી તેમને રાજ્યદારી શિક્ષણ આપત. તેથી કરીને, ગઈ કો-ગ્રેસ ઐટકની ખીજ જાણ્યો લલે ગમે તે હો, પરંતુ તેની અગાઉની ઐટકા કરતાં તે વધારે રાષ્ટ્રીય તો ચોક્સ હતી, અને તે એ કારણથી કે, મોટા ભાગના પ્રેક્ષકા તથા પ્રતિનિધિઓ નેનું કામકાજ સમજ્યા હતા. શ્રી. બેસંટથી જે શ્રોતાઓ કંદાળ્યા હતા તો તે એટલા માટે નહીં કે તેઓને તેમનું સાંભળવાની પડી નહોતી કે તેમના પ્રત્યે અવમાન હતું; પણ તે એટલા માટે કે, રસિક અને ભારે કીમતી હેવા છતાં તેમના વ્યાગ્યાનને તે સમજ શકતા નહોતા. અને જેમ જેમ રાષ્ટ્રીય ભાવના જગતી જરો અને રાજ્યદારી શાન અને શિક્ષણની ભૂખ જાધરો, — અને તેમ થવું પણ જોઈએ જ, — તેમ તેમ અંગ્રેજીમાં પોલનારા માટે આમ-શ્રોતાઓના ધ્યાનપાત્ર બનવાનું અધરું ને અધરું થતું જરો; લલે ને પણી તે પોલનાર ગમે તેવો શક્તિશાળી કે લોકપ્રિય કુમ ન હોય. તેથી હું મદાસ છલાકાના લોકને વિનંતી કરું છું કે, જાહેર કામ કરતારાયોએ હિંદુસ્તાની શીખની જોઈએ, એ તમે સમજ લો. મદાસ બાહુરના શ્રોતાઓ વગર મુશ્કેલીએ હિંદુસ્તાની ઓધીવતી સમજ શકે છે. દ્વારાં દ સરસ્વતી ઉત્તર હિંદુ બાહુરના શ્રોતાઓને પોતાના હિંદુસ્તાની વક્તૃતથી વશ કરી દેતા હતા, અને સામાન્ય માણુસો પણ વગર મુશ્કેલીએ એમનું હેઠળું સમજ શકતા હતા. કો-ગ્રેસનું કામકાજ અંગ્રેજીમાં ચાલવાને લઈને રાષ્ટ્રને ખરેખર ધાર્યું અમલું પડ્યું છે. એનો અર્થ એ થયો કે, ઉપર જેટલા મદાસ છલાકાના લોક હિંદુસ્તાની વક્તાને સમજ નથી શકતા. મેં મુસલમાન વસ્તી બાદ કરી છે, કુમ કે મદાસ છલાકાના મોટા ભાગના મુસલમાનો હિંદુસ્તાની સમજે છે, એ સૌ જાણે છે. એટલે ત્યારે સવાલ

આ છે :— તે ધ્લાકાના ડેઝ લાખ માણુસોનો ધર્મ શો છે ? તેમને માટે હિંદે અંગ્રેજ શીખવું એમ ? કે પણ બાકીના ર૭૭૦ લાખ હિંદીઓને અર્થે તેમણે હિંદુસ્તાની શીખવી જોઈએ ? સ્વ. ન્યાયમૂર્તિ કૃષ્ણસ્વામીએ, પોતાની અચૂક સહજાયુધીથી પામી જઈને સ્વીકાર્ય હતું કે, દેશના જુદા જુદા લાગે વર્ષોના વહેવાર માટે હિંદુસ્તાની જ એક સંલિખિત માધ્યમ છે. અત્યારે કોઈ આ વિધાનનો વિરોધ કરતું હોય તો મને તેની અખર નથી. હજારો લોડા અંગ્રેજ ભાષાને પોતાનું માધ્યમ બનાવે એ બનવા જોગ નથી, અને બનવા જોગ હોય તો પણ તે જરાય ધર્યાયા જેવું નથી; અને તેનું સાઢું કારણ એ છે કે, અંગ્રેજ મારકૃત મળતું ઉચ્ચ તથા પારિબાધિક રાન આમ જનતામાં પહોંચી નહિ શકે; તે તો ત્યારે બને કે, જે એ જાનનો પ્રસાર ઉપલા વર્ગોમાં કોઈ દેશીભાષા મારકૃત થાય. દા. ત., સર જગદીશચંદ્ર બેંજાનાં લાખાણ બંગાળીમાંથી ગુજરાતીમાં ઉતારવાં એ, હક્કસીના અંગ્રેજુને ગુજરાતીમાં આણવા કરતાં, સહેલું છે.

અને બાકીના હિંદેને સારુ મદ્રાસીઓએ હિંદુસ્તાની શીખવી જોઈએ, એ વિધાનનો સાર શો ? એનો એનુલો જ અર્થ કે, મદ્રાસના જે જાહેર કાર્ય કરતાંએ હિંદ બધાર કામ કરવા ધર્યા છે અને મદ્રાસ ધ્લાકા અહાર રાષ્ટ્રીય સભાઓમાં ભાગ લેવા ચાહે છે, તેમણે એક વર્ષ રેજ એક કલાક હિંદુસ્તાની શીખવામાં ગાળવો જોઈએ. એક વર્ષના આવા પ્રયત્નને અંતે કેટલાય હજાર મદ્રાસીઓ, એણામાં એણો, કોન્ટ્રેસના કામકાજનો સાર તો સમજતા થઈ જઈ શકરો. ધ્લાકાના અનેક ભાગમાં હિંદીપ્રચાર કાર્યાલયો તેમની પાસે પડેલાં છે, જ્યાં હિંદુસ્તાની શીખવા ધર્યાનારને વગર ફીએ તે શીખવામાં આવે છે. . . . .

(ચં. ઈ., ૨૧-૧-૧૯૨૦)

#### ૪. અંગ્રેજ વિ. હિંદુસ્તાની

તાજેતરમાં ભગેલાં સાહિત્ય સમેલનનોનું કામકાજ જે કોઈ એ નિહાળું હશે તો તેને સ્પષ્ટ થયું હશે કે, આપણી રાષ્ટ્રીય જાગૃતિ માત્ર રાજકારણમાં જ રહેલી નથી. આ સમેલનોમાં જે ઉત્સાહ દેખાયો તે સારો ફેરફાર બતાવે છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં દેશી ભાષાઓને, આપણા વિચારમાં યોગ્ય સ્થાન આપવા લાગ્યા છીએ. રાજ રામમોહનરાયની લવિષ્વવાણી હતી કે, એક

હોડો હિંદુ અંગેણ ખોલતો દેશ બનસે; તે વાતના આજે ખાલું સારા અહો નથી. આપણું કેટલાક જાણીતા ભાષણેસો અંગેણની રાષ્ટ્રભાષા તરીકાની તરફેણું કરવા તરફ ઉત્તોળો નિર્ણય બાંધી હો છે. અત્યારે ડોર્ટની ભાષા તરીકાની અંગેણની પ્રતિધાંથી તે વધારેપડતા એંચાઈ જાય છે. પણ તેઓ એ જોવાનું ચૂકી જાય છે કે, અંગેણની હાલની પ્રતિધાં આપણને માનમદ નથી, અને સાચ્ચા લોકશાહી જુર્સાના ઉદ્ઘયને તે પોષક નથી. થોડાક સો અમલદારોની સવધને ખાતર કરોડો ભાષણેસો એક પરદેશી ભાષા ભાણી પડે એ તો એહોહાપણાની હુદ્દ છે. ધણી વાર આપણું ભૂતકાળના ધ્રતિહાસમાંથી એવું સાબિત કરવા માટે દ્વારલો આપવામાં આવે છે કે, દેશની મધ્યરસ્થ સરકારને મળખૂત કરવા માટે એક રાષ્ટ્રીય ભાષાની જરૂર છે. લોડો માટે સામાન્ય એક માધ્યમની જરૂર વિષે ડોઈ વિવાદ નથી. પરંતુ તેવી ભાષા અંગેણ ન હોઈ શકે. અમલદારોએ દર્શાભાષાઓ સ્વીકારવી જોઈએ.

અંગેણવાદીઓને અપીલ થતો ખીંચે એક ખ્યાલ હિંદનું સાંભાળ્યમાં સ્થાન છે. સાદ્ય શખ્ષેમાં એ હલીલ કહીએ તો તેનો સાર એ છે કે, ૧૨ કરોડથી વધારે નહિ એવા સાંભાળ્યના ખીંચે લોડાને ખાતર હિંદના ૩૧ કરોડે પોતાના સામાન્ય માધ્યમ તરીકે અંગેણ સ્વીકારવી.

આ પ્રશ્નના દરેક અભ્યાસીએ પહેલી જે હક્કાકત ધ્યાનમાં લેવાની છે તે એ કે, દોઢ સહીના વિટિશ રાજ બાદ અંગેણ હિંદની રાષ્ટ્રભાષાનું સ્થાન લેવામાં નિષ્ઠળ નીવડી છે. ચોક્સ, એક પ્રકારની લાંગીતૂરી અંગેણ આપણાં શહેરોમાં આ બાબતમાં ઝાવી હોય એવું લાગે છે. પરંતુ આ હક્કાકતથી તો, જેઓ મુંબઈ કલાકા જેવાં શહેરોમાં ઐસી આપણા રાષ્ટ્રીય પ્રશ્નનો અભ્યાસ કરવાનું લઈ એડા છે તેઓ જ અંનાઈ શકે. અને આપરે એ વસ્તી પણ કેટલી છે ? હિંદની વરતીના ભાગ ૨.૨ ટકા ૫ !

અંગેણવાદીઓ ખીંચે હક્કાકત ભૂલે છે તે એ છે કે, આપણી ધણી-ખરી દેશીભાષાઓ આપસમાં ભળતી છે, અને તેને પરિણામે, મદ્રાસ ધ્લાકા સિવાય બધા પ્રાંતોને હિંદી રાષ્ટ્રભાષા તરીકે ગોકૃતી આવે છે. હિંદીના પક્ષનો આ લાલ અને આપણી હાલની રાષ્ટ્રીય જગ્યાતિ જોતાં, અંગેણને આપણે શી રીતે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી શકીએ ? \*

(ખ. ઈ., ૨૧-૪-૧૯૨૦)

\* ( દેશી ભાષાઓનો પક્ષ ) 'The Cause of the Vernaculars' એ લેખભાંધી.

## ૫. હિંદી શીખી લો

૧

કોક દહેડો દવીડ ભાઈયિહેનો હિંદીનો અભ્યાસ ગંભીરપણે કરવા લાગી જરો, એવો મને લારે વિશ્વાસ છે. અતેજી પર કાણુ મેળવવા ને મહેનત તેઓ કરે છે તેનો આડમો ભાગ પણ હિંદી શીખવામાં તેઓ કરે, તો બાકીના હિંદનાં દ્વાર આજ તેમને માટે બધ્ય છે તેને બદ્દલે તેઓ આપણી નોંઠે એક ઘનરો, કે જેવા પૂર્વે કદી નહોતા. કોક કહેરો કે, આ દ્વારા તો એજ બાળુ લાગે છે, એ હું જાણું છું. દવીડ લોડા સંખ્યામાં આંખ છે; એટલે રાષ્ટ્રની શક્તિની કરકુસર એમ સૂચિને કે, હિંદના બાકીના બધા લોડા દવીડી હિંદ સાથે વાત કરી શકવા માટે તામિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ શીખે તેના કરતાં, તેઓએ બાકીના હિંદની સામાન્ય ભાષા શીખવી નોઈએ. તેથી જ કરીને, ગયા ૧૮ માસથી, અલહાબાદના હિંદી સાહિત્ય સમેલનના આશરા તળે, જોરથી હિંદી પ્રચારનું કામ મદ્દાસ ધ્લાકામાં ચાલે છે. ગયે અડવાડિયે મુખ્યમાં અગરવાલ મારવાડી સમેલન મળેલું, તેને મેં અપીલ કરી તેના જવાબમાં તેણે તાં ને ત્યાં શ. ૫૦,૦૦૦, મદ્દાસ ધ્લાકામાં પાંચ વર્ષ હિંદી પ્રચારકામને માટે, ઉધરાની આપ્યા. . . . આ ઉદ્ઘરતાથી અલહાબાદના સમેલનની તથા જે દવીડ લોડા મારા મતના છે કે, પૂર્ણ રાષ્ટ્રીય વિકાસને ખાતર મદ્દાસે હિંદી શીખી લેવું નોઈએ, તે બધાની જવાબદારી વધી જાય છે. ડોઈ દવીડ એમ ન વિચારે કે, હિંદી શીખવું જરાય અધરું છે. રોજના મનોરંજનના સમયમાંથી જે પદ્ધતિસર થોડો વખત કાઢવામાં આવે, તો એક વર્ષમાં સામાન્ય ભાણુસ હિંદી શીખી લઈ શક. એમ પણ સૂચવવાની હામ ભીડું છું કે, હવે મોટી મ્યુનિસિપાલિટીએ પોતાની શાળાઓમાં હિંદીનો વૈકલ્પિક અભ્યાસ દાખલ કરે. અનુભવ પરથી હું કદી શકું છું કે, દવીડ ભાળોડા અજખ સરળતાથી હિંદી શીખી લે છે. દક્ષિણ આહિકામાં વસતા લગભગ બધા તામિલ-તેલુગુ-ભાષીઓ સમજ પૂર્વક હિંદીમાં વાતચીત કરી શકે છે, એ તો ડોકને જ ખખર હશે. તેથી હું હિંમતબોર આશા સેવું છું કે, મદ્દાસના યુવાનો મઝીત હિંદી શીખવાની જે સવડ ઉદ્ઘર મારવાડીઓએ આપી છે તેની કદર કરશે — એટલે કે, તે સવડનો લાલ ઉદાવશે.

(ચ. પ., ૧૯-૬-'૨૦)

હિંદુની ખીજ કોઈ ભાષા ન શીખવાનો બંગાળને પૂર્વભૂષણ છે તેથી, અને દ્રવિડ લોકને હિંદુસ્તાની શીખવાની મુશ્કેલીને લઈને, હિંદુસ્તાની ન જાણવાથી, હિંદુના ખાડુના લાગથી અલગ પડી જતા પ્રાતો એ છે — બંગાળ અને મદ્રાસ, સામાન્ય બંગાળી માણુસ રોજ ત્રણ કલાક જો હિંદુસ્તાની શીખવા પાછળ આપે તો, ખરેખર એ માસમાં તે શાખી લે; અને તે જ વેગથી દ્રવિડ માણુસને માસ લાગે. તેટલા જ વખતમાં બંગાળી કે દ્રવિડી અંગે કરી લેવાની આશા ન રાખી શકે. હિંદુસ્તાની જાણુનાર કરતાં અંગે જાણુનાર હિંદીની સંખ્યા ઓછી છે. અંગે જાણે તે ઓછી સંખ્યા જોડે જ વિનિમયનાં દાર થિયે. ત્યારે, હિંદુસ્તાનીનું કામચલાડિ રાન તો ધણી મેડી સંખ્યામાં આપણું દેશભાઈએ જોડે વિનિમય કરવાની શકૃતિ આપે. હું આશા રાખું છું કે, બંગાળી અને દ્રવિડ ભાઈએ આવતી કોન્ફ્રેસમાં હિંદુસ્તાનીનું કામચલાડિ રાન મેળવીને આવશે. આપણી સૌથી મેડી સભા જો જનતાના વધારેમાં વધારે લોકો જે ભાષા સમજે તેમાં ન બાલે, તો જનતાને માટે તે ખરેખરો ધડો લેવા લાયક ન બની શકે. દ્રવિડ ભાઈએની મુશ્કેલી હું સમજું છું; પરંતુ માતૃભૂમિ માટેના તેમના પ્રેમ અને ઉદ્ઘંટ આગળ કરું અધરું નથી.

(અ. ઈ., ૨-૨-'૨૧)

## ૬. હિંદુસ્તાની 'નવજીવન'

'નવજીવન' ની હિંદી આવૃત્તિ કાઢવાની જવાબદી હું લડું એવી ઉત્કંઠા કેટલાક હિંદીભાષી ભિન્નો ધરાવે છે. એ કરવા હું પોતેય આતુર છું. પણ અત્યાર સુધી તે બની શક્યું નથી. 'નવજીવન' અને 'યંગ ઈડિયા' ના સંપાદનને પહોંચી વળવાનું કામ જ પૂર્તું મુશ્કેલ છે. પરંતુ હું મારા વિચારો અને સિદ્ધાતો પર કિદ્યા છું એમાં શાંકા નથી. મારો દફ મત છે કે, હિંદે સારુ તે સારા છે, અને પૂરી નભતાથી કહું તો, સૌને માટે તે સારા છે. અને તેથી કરીને હું ભિન્નો અને કાર્યકર્તાએના, હિંદી આવૃત્તિ કાઢવાના દ્વારાને વશ થાડું છું. અને ખર્ખર છે કે, અનેક હિંદી અનુવાદો દેશના જુદ્ધ જુદ્ધ ભાગોમાં બહાર પડે છે. પરંતુ છથ્થા એવી છે કે, 'નવજીવન' અને 'યંગ

ઇડિયા 'માંથી પસંદ કરેલા લેખાનો સત્તાવાર ને સરળ અનુવાદ એક પત્રમાં ભેગો મળી જય. એ કામ હવે કરવામાં આવે છે.

આ આવૃત્તિની હિંદી ભાષા ખરેખર હિન્દુસ્તાની — એટલે કે, હિંદુ મુસ્લિમાન બેઝને સમજાય એવા સાદ્ય શખ્ષોવાળી, હિંદી અને ઉર્દૂ મળાને નીપણતા સ્વરંપની ભાષા હશે. તેમાં અલાંકાર ટાળવાનો પ્રયત્ન કરવામાં આવશે. ખરં જેતાં તે જ લખાણ સાથોસાથ ઉર્દૂ લિપિમાં છપાવીને આપવાનું મને ગમે; પણ તે હાલ તો ન થઈ શકે. . . .

યાં ઈ. ૧૮-૮-'૨૧

[હિન્દુસ્તાની પ્રચાર સલા (ઇ. સ. ૧૯૪૨) આને ને કાર્ય કરી રહી છે તેના સંબંધમાં, ઉપરની 'યંગ ઇડિયા'ની નોંધ શ્રી. કાકાસાહેબ કલેક્ટર ગાંધીજીને મોકલી આપી હતી. 'હરિજનભંડુ'ના તા. ૬-૮-૧૯૪૨ના અંકમાં તેમાંથી ઉતારીને ગાંધીજીએ તે ઉપર ને દૂંકી નોંધ કરી હતી તે અહીં સાથે જ નોઈ કેવી ઠીક પડશે. તે નોંધ આપ છે : ]

ને વિચારો આને હું દર્શાવી રહ્યો છું તથા નેના ઉપર વિશેષ ભાર મૂકી રહ્યો છું, તે જ વિચારો મેં વરસો પહેલાં દર્શાવ્યા હતા, એ વસ્તુની આ ઉતારો મને તેમ જ વાચ્યકોને યાદ આપે છે. તે એ કે, મોટી સંઘામાં લોકોએ એકસરખી સુગમતાથી હિંદી તથા ઉર્દૂ ઓલતા અને લખતા થઈ જવું જોઈએ. . . .

(દ. બં., ૬-૮-'૪૨)

## ૭. સ્વરાજની જરૂરિયાત

[બેબગામ કોન્સેસના પ્રમુખપદેથી આપેલા ભાષણુમાં 'સ્વરાજની ઇપરેઝા' આંક્ષતાં જણાવેલી તેની જરૂરિયાતોમાં રાષ્ટ્રભાષા અંગે કહેલો કરેલો અહીં ઉતાર્યો છે.]

પ્રાંતિક સરકારોની, ધારાસભાએની તેમ જ અદાલતોની ભાષા ચોક્કસ મુદ્દતની અંદર તે તે પ્રાંતની ને ભાષા હોય તે કરી નાંખવી; સૌથી વડી અદાલત (પ્રિવી કાઉન્સિલ)ની ભાષા હિન્દુસ્તાની રાખવી અને લિપિ હેવનાગરી અગર હારસી. મધ્યવર્તી સરકાર તેમ જ ધારાસભાની ભાષા પણ હિન્દુસ્તાની રાખવી. આંતરરાષ્ટ્રીય રાન્યપ્રકરણુની ભાષા અંગેણ રાખવી.

મને ઉમેદ છે કે, ઉપલી ઇપરેઝામાં મારી દણિએ મેં રણ્ણ કરેલી સ્વરાજન્યની ડેટલીક જરૂરિયાતોને લગતા મારા ખ્યાલોને શેખ્સપ્લીના ગણી

તમે હસ્તી નહિ જ કાઢો. મેં ઉપર ગણું વેલી વસ્તુઓ દેવા અખે ડિપાડવા આને આપણું મને હેઠળી તૈયારી કદાચ નહિ હોય, પણ આપણું સંકલ્પણા છે? કંઈ નહિ તો આવે, આપણે એવું સંકલ્પણ તો ડેળવીએ જ. . . .

( ન. ઇ.નો વધારો, ૨૬-૧૨-'૨૪ )

## ૮. કાનપુર કોન્ટ્રેસનો ઠરાવ

[ કાનપુર કોન્ટ્રેસમાં ( ધ. સ. ૧૬૮૫ ) નીચે પ્રમાણે ઠરાવ થયો હતો : ]

આ કોન્ટ્રેસ ઠરાવે છે કે, ( બંધારણું કલમ ઉત્તમાને નીચે સુજાપ સુધારવામાં આવે કે, ) કોન્ટ્રેસ, મહાસમિતિ તથા કાર્યવાહક સમિતિનું કામકાજ સામાન્ય રીતે હિંદુસ્તાનીમાં ચલાવવામાં આવશે. જે વક્તા હિંદુસ્તાનીમાં ન ખોલી શકે એમ હોય, અથવા જ્યારે જરૂર હોય તારે, અંગ્રેજ કે કોઈ પ્રાંતીય ભાષા વાપરી શકાશે.

પ્રાંતિક સમિતિઓનું કામકાજ સામાન્ય રીતે તે તે પ્રાંતની ભાષામાં ચલાવવામાં આવશે. હિંદુસ્તાનીનો ઉપયોગ પણ કરી શકાય.

[ આ ઠરાવની નાંદ કેતાં ગાંધીજીએ 'ધ. ધ.' તથા 'ન. ઇ.' માં નીચે પ્રમાણે લખ્યું હતું : ]

હિંદુસ્તાનીના ઉપયોગ બાબતનો ઠરાવ લોકમતમાં મોટી પ્રગતિ કરનારો છે. આપણું કામકાજ હજ સુધી ધંણે ભાગે અંગ્રેજ ભાષામાં ચલાવવું પડે છે એ વસ્તુ પ્રતિનિધિઓ તથા મહાસમિતિના સભ્યોના મોટા ભાગને માટે ચોક્કસ નિર્દ્દ્યપણું છે. કેંક દહોડો તો આપણે છેવટના નિર્ણયે પહોંચવું જ જોઈએ. જ્યારે તેમ થશે, ત્યારે અમુક વખત તો કેટલીક અગ્રવાડ, કેટલોક હૈન્યાભળાપો થશે જ. પરંતુ જેટલું જલદી આપણું કામકાજ હિંદુસ્તાનીમાં ચલાવવા લાગીએ, તેટલું રાષ્ટ્રીય વિકાસને માટે તે સારું જ થશે.

( ધ. ધ., ૭-૧-'૨૬ )

\* બને તેટલે દરજને હિંદી ઉદ્ઘૂરી જ મહાસભામાં ઉપયોગ થવો જોઈએ એ ઠરાવ મહત્વનો ગણ્યાય. તેને જે મહાસભાના અધા સભ્યો માન આપે, તો ગરીબીને મહાસભાના કાર્યમાં રસ આવે.

( ન. ઇ., ૩-૧-'૨૬ )

## ૬. સભાચ્યોની ભાષા

૧

આમજનતા માટે સામાન્ય માધ્યમની ભાષા હિંગી કે હિંદુસ્તાની છે, અંગ્રેજ નહિં, એ વસ્તુ સલા ગોવનારાઓને વારંવાર યાદ આપવાની જરૂર લાગે છે. મેં જેણું છે કે, આ પ્રવાસમાં મને ધણે પ્રસંગે અંગ્રેજમાં માનપત્રો અપાય છે; ૧૯૨૧માં એવું નહોંનું. આની ઐદૂર્ઘી જરિયાના ખાણિયાઓના માનપત્ર વખતે ઉધાડી તરી આવી. હજરોની એમની સભામાં ભાગ્યે ૫૦ જણ અંગ્રેજ સમજી શકતા હશે; ત્યાં અંગ્રેજમાં મને માનપત્ર વાંચી સંભળવા પ્રયત્ન થયો! મોડી સંખ્યાના લોક સરળતાથી હિંગી સમજત, અને બંગાળી તો ધણું સમજત. તેમના મહાજનના પદ્ધતિધારીઓ બંગાળના હતા. મારા ઘ્યાલથી જો અંગ્રેજ કૃષું હતું, તો તે સાવ જિનજરી હતું. બંગાળીમાં માનપત્ર લખી મને હિંગી કે અંગ્રેજ અનુવાદ તેઓ આપી શકત. પરંતુ, તે મોડી સલાને માથે અંગ્રેજ મારવું એ તો એમનું અપમાન થાત. મને આશા છે કે એવો વખત આવી રહ્યો છે કે, જે કામકાજ એવી ભાષામાં ચક્કાવાય કે જેને મોટા ભાગના લોક ન સમજે તો તેમણે એવી સભાઓ છોડી ચાલ્યા જવું જોઈએ. આ બાબતમાં મેં પ્રમુખનું ધ્યાન ખેંચ્યું કે તરત વિનયથી તેમણે તે વંચાઈ ગયું છે એમ માનિને સલા આગળ ચાલવા દીધી, એ તેમને માટે સારું કહેવાય. આ બનાવ સૈને ધડો લેવા લાયક બનો; ખાસ કરીને વાંધ, તામિલ-નாડ, કેરળ અને કર્ણાટકમાં, તેમની સુસ્કેલીની મને ખખર છે. પરંતુ હવે તો છેલ્દાં છ વર્ષથી તેમને ત્યાં હિંગીપ્રચાર માટે એક સખ્ખી સંસ્થા કામ કરે છે. તેમનાં માનપત્રો તે તે પ્રાંતની ભાષામાં હોય ને મને તેનો હિંગી અનુવાદ અપાય. દ્રવિડ પ્રદેશ માટે મેં હમેશા અપવાદ રાખ્યો છે, અને ત્યાંના લોકે ઘણાં બતાવતાં મેં અંગ્રેજમાં ભાષણું કર્યા છે. પણ મને જરૂર લાગે છે કે, મોડી જાહેર સલામાં તેમણે અંગ્રેજ છોડવા માટે સમય ' હવે આવી લાગ્યો છે. ખરું જેતાં, જનતામાં જપાટાઅંધ પ્રગતિ કરવાનો માર્ગ આપણું અંગ્રેજ-ભાષી નેતાઓ રોકી રહ્યા છે; તેઓ હિંગી શીખતા નથી. શીખનારા દરરોજ જે ત્રણ કલાક તે પાછળ આપે, તો દ્રવિડ પ્રદેશમાંથી તે ત્રણ માસની અંદર સહેલાઈથી આવડી જથ્ય. આમાં જેને શાંકા હોય તેઓ હિંગીપ્રચાર કર્યાલયને

અજમાની જુઓ. . . . હિંદુસ્તાનના ૨૦ કરોડ ઉપર લોક ને ભાષા સમજે  
છે તેને ન જાણવા માટે, આજાસ કે નામરજી વિના ભીજું હોઈ ખણું નથી.

બ. ઈ., ૨૦-૧-'૨૭

૨

[ છત્રપુર ( જિલ્લા ગંગામ )માં આપેલા ભાષણુમાંથી ]

. . . આ ગામડામાં પણ મને અંગ્રેજમાં ભાષણ આપવાની શિક્ષારસ થઈ હતી; આ મને દેશની પુત્રીએ પ્રત્યે દ્રોહ, અને પરદેશી ભાષા પ્રત્યે ખોટો મોહ બતાવે છે. અંગ્રેજ પ્રત્યે મને દ્રોષ નથી, પણ હું હિંદીને એકલીને રાજકોણમાં તરીકે માનું છું, એટલે તેને માટે મને વધારે પ્રેમ છે. અને એ જ કારણે હું હિંદુસ્તાનના શિક્ષિત વગેનિ હિંદી રાજકોણમાં બનાવવાનો આગાહ કરી રહ્યો છું. હિંદીની મારફતે જ આપણે ભીજા પ્રાતોની ભાષાઓની સાથે સંબંધમાં આવી શકીએ એમ છીએ, અને તેની પ્રગતિ કરી શકીએ એમ છીએ. પરદેશી ભાષા દ્વારા શીખવાને લીધે આપણાં બુદ્ધિ અને હૃદયનો વિકાસ બંધ ન થઈ ગયો હોત, તો આપણે દેશની પાંચ જ ભાષાઓ સહેલે શક્યી શક્યા હોત.

ન. ઈ., ૧૮-૧૨-'૨૭

૩

[ કરાંચીનાં વેપાર-ઉદ્યોગનાં મંડળોના સંઘના વાર્ષિક સમારંભ ( ઈ. સ. ૧૯૩૧ )  
નિભિતે આપેલા પ્રાસ્તાવિક ભાષણુમાંથી ]

મારા અંગ્રેજ મિત્ર મને માઝ કરશે કે, હું તમારી આગળ રાજકોણમાં જ મારે જે કહેવાનું છે તે કહીશ. આ પ્રસંગે મને ૧૯૧૮માં યુદ્ધપરિષદ આ જ સ્થાને થયેલી તે યાદ આવે છે. જ્યારે યુદ્ધપરિષદમાં ભાગ લેવા વિષે અતિશય અર્થાત્ કર્યા પણી હું કામૂલ થયો, ત્યારે મેં તેમને વિનંતી કરેલી કે, પરિષદમાં મને હિંદી અથવા હિંદુસ્તાનીમાં બોલવાની છૂટ આપવામાં આવે. આ વિનંતી કરવાની કર્ણી જરૂર નહોતી એ હું જાણું છું, છતાં વિનિયની ખાતર એ આવશ્યક હતું, નહિ તો વાઇસરોયને આધાત પહોંચત. તરત જ તેમણે મારી વિનંતી સ્વીકારી અને ત્યારથી મને આ બાયતમાં વધારે હિંમત આવી. અને આજને એ જ સ્થાને હું એ જ પ્રથાનો અમલ કરવાનો છું. અને બ્યાપારીસંઘના સભ્યોને પણ હું નઅતાપૂર્વક સ્વચ્છિશ કે, દેશીએના આ સંઘમાં જ્યારે દેશીએની સાથે જ તમારે કામ લેવાનું છે અને આજકાલનું વાતાવરણ તમારી ઉપર અંસર કરી રહ્યું છે ત્યારે, તમારો ધર્મ છે કે, તમે તમારું કામકાજ રાષ્ટ્રીય ભાષામાં

અલાવો. પ્રમુખ મહાશયનું વ્યાખ્યાન હું અતિશય ધ્યાનપૂર્વક સાંલળી રહ્યો હતો. એ સાંલળાતાં જ મને થયું કે, એ વ્યાખ્યાનની અસર આ સભા ઉપર કરવા ચહાતા હો. અથવા મારો હૃદય ઉપર કરવા ચહાતા હો, તો વિદેશી ભાષાથી એ કી રીતે થઈ શકે? હિંદુસ્તાન સિવાય બીજી ગમે તે આગામ કે ગુલામ દેશમાં જાઓ તો પણ અહીંની વિચિત્ર દ્વારા ભાગ્યે જ કૃતાંય જોવાની મળશે. દશિણું આફિક્ઝ જોવડા નાનકડા દેશમાં અંગ્રેજ અને ડય લાષા વચ્ચે દુંડ ચાલ્યું, અને આખરે પરિણામ એ આવ્યું કે, અંગ્રેજે અને ડય લોકો વચ્ચે સમજૂતી થઈ અને બંને લાષાને સરબું સ્થાન આપવામાં આવ્યું. બહાદુર ડય લોકો પોતાની માતૃભાષા છોડવા તૈયાર નહોતા. . . .

૧. ૭, ૧૨-૪-'૩૧

## ૧૦. એક લિપિનો પ્રક્રિ

કેટલાક વખત પહેલાં એક ગુજરાતી પત્રલેખકે 'નવજીવન'ને એક પત્ર લખી સલાહ આપી હતી કે, તમારે 'નવજીવન' દેવનાગરીમાં છાપવું જોઈએ અને એ દ્વારા આખા ભારતવર્ષ માટે એક લિપિની આવસ્યકતા છે એવી તમારી માન્યતાને બ્યવહારમાં ઉતારી બતાવી જોઈએ. બધી હિંદી ભાષાઓ માટે એક જ લિપિ હોવી જોઈએ અને તે દેવનાગરી જ હોઈ શકે, એવો મારો દઠ વિશ્વાસ છે. છતાં 'નવજીવન'માંની મારી નોંધમાં જણાવેલાં કારણોસર હું એ પત્રલેખકની સલાહને અનુસરી શક્યો નથી.\* એ કારણોની અહીં પુનરુક્તિ કરી એના પર

\* નવજીવન પૃ. ૮, પૃ. ૩૩૬ ઉપર આપેલાં કારણો નીચેના હેતારા પરથી જણાશે:

"જે 'નવજીવન'ના વાંચનારાયોનો ધારો મોટો લાગ 'નવજીવન' દેવનાગરી લિપિમાં પસંદ કરે તો હું 'નવજીવન' દેવનાગરીમાં છાપવાની ચર્ચા સાથીએ સાથે તુરત કરું. વાંચનારનો અભિપ્રાય નાણ્યા વિના પહેલ કરવાના મારી હિંમત નથી.

એક લિપિના પ્રચાર કરતાં, જે પ્રક્રિયાનો મેં વર્ષો થયાં વિચાર કર્યો છે અને જે પ્રક્રિયાનું અતિશય મહત્વના ગણ્ય છું, તેનો પ્રચાર ધર્યો વધારે અગાધનો ગણ્ય છું. 'નવજીવન' ધર્યાં સાહસ એડિયાં છે. પણ તે બધાં મૌલિક સિદ્ધાંતોને અગે દેવનાગરી લિપિને અર્થી 'નવજીવન'ના પ્રચારને હાનિ પહોંચાવવાનું સાહસ હું ન એડું.

'નવજીવન' વાંચનાર વર્ગમાં ધારો બહેનો છે, કેટલાક પારસી છે, કેટલાક મુસલમાન છે. એ બધાને દેવનાગરી લિપિ અશક્ય નહિ તો મુશ્કેલ તો પડે જ, એવો

અહો હું ભાર કેવાની જરૂર નથી જોતો. પરંતુ દેશમાં આવેલી મહાન રાષ્ટ્રીય જગ્યાતિ આ વિચારને માત્ર લોકપ્રિય કરવાની જ નહિ, પણ એ હિંદુમાં કંઈક સંગીન કરવાની આપણુંને જે તક આપે છે, તે આપણે ઝડપી લેવી જોઈએ, એ વિષે શંકા નથી. હિંદુ-મુસ્લિમ ગાંડ્ધેય, બેશક, પરિપૂર્ણ સુધારાના માર્ગની આડે આવે છે. પરંતુ દેવનાગરી લિપિ હિંદમાં સાર્વત્રિક થઈ જય ત્યાર પહેલાં, સંસ્કૃત અને દ્રાવિડી કુળની બધી ભાષાઓ માટે એક જ લિપિ રાખવી એવો હિંદુ હિંદો વિચાર થઈ જવો જોઈએ. અત્યારે તો આપણે ત્યાં બંગાળમાં બંગાળી લિપિ, પંજાબમાં ગુરુમુખી, સિંધમાં સિંધી, ઉત્કલમાં ઓଡિયા, ગુજરાતમાં ગુજરાતી, આંધ્રમાં તેલુગુ, તામિલનાડુમાં તામિલ, કેરળમાં મલયાલમી, કર્ણાટકમાં કર્ણાટકી (કન્નડી) છે; અને તેમ બિહારમાં ફૈથી અને દક્ષિણમાં મોડીની વાત તો વળી છેડેલો. જે આ બધી લિપિઓને સ્થાને બધાં વ્યવહારું અને રાષ્ટ્રીય કામોદ્દીમાં દેવનાગરીને સ્થાપી શકાય, તો એ ધણી મોડી પ્રગતિનું પગલું ભર્યું ગણ્ય. હિંદુ હિંદ્ની એકતામાં એથી મહદ્વ થાય અને જુદી જુદી ગ્રાંટો પણ પરસ્પર એથી નિકટતર સંબંધમાં આવે. જુદી જુદી દેશી ભાષાઓનું અને લિપિઓનું જેને કંઈ પણ જ્ઞાન છે તે સ્વાનુભવ પરથી જાળું છે કે, નવી લિપિને હસ્તામલકૃત કરવામાં કેટલો વખત જય છે. બેશક, પોતાના દેશપ્રેમની ખાતર કશ્યું મુશ્કેલ નથી, અને જુદી જુદી લિપિઓ, તેમાંની કેટલીક તો ધણી સુંદર છે, તેની પર કાયુ મેળવવામાં ખર્ચેદો સમય ડેઈ પણ રીતે નિર્થક ખર્ચો ન જ ગણ્ય. પરંતુ આ ત્યાગભાવનાની લાઘો લોકો પાસે આશા રખાય એમ નથી. રાષ્ટ્રીય નેતાઓએ એમને માટે માર્ગ સરળ કરવો જોઈએ. એથી હિંદુસ્તાન માટે આપણી પાસે એક સહેલાઈથી બંધખેસતી કરી શકાય એવી સાર્વત્રિક લિપિ હોવી જોઈએ, અને દેવનાગરી સિવાય ડેઈ લિપિ એટલી બંધખેસતી કરી શકાય એવી તૈયાર નથી. આ જ હેતુ પાર પાડવા માટે એક અભિલ ભારતીય મંડળ છે વા હતું. એ અત્યારે શું કરે છે એની મને ખખર નથી. પરંતુ જે આ કામ કરવાનું જ હોય તો કાં તો એ મૂળ મંડળને મજબૂત

મને કથ છે. જે મારી આ ગણ્યતરી ખરી હોય, તો મારાથી ‘નવજીવન’ દેવનાગરી લિપિમાં ન છાપી શકાય. દેવનાગરી લિપિને પ્રચાર મારો ખાસ વિષય ન હેઠાથી, તેમાં મારાથી પહેલ કરવાનું જોખમ ન એડી શકાય, એમ મને લાગે છે. ગુજરાતી ‘નવજીવન’ દેવનાગરી લિપિમાં છખાય તો પણ હિંદી નવજીવનની આવશ્યકતા તો રહે જ. તેના વાંચનાર ગુજરાતી ન સમજ રાડે.”

કરવું જોઈએ કે કાં તો આ કામ માટે એક નવું ભાગુણ સ્થાપવું જોઈએ. હિંદી વા હિંદુસ્તાનીનો રાષ્ટ્રમાણ તરીકે ફેલાવો કરવાની હિલચાલ સાથે અને ગૂંઘની ન નાખવી જોઈએ. એ કામ ધાણું ધીમું ધીમું પણ સિથરતાથી ચાલી જ રહ્યું છે. એક લિપિનો વપરાશ એક ભાષાના ફેલાવાને સરળ બનાવશે. પરંતુ એ બંનેનું કામ અમુક હા સુધી જ સાથે સાથે ચાલશે. હિંદી વા હિંદુસ્તાનીની યોજના પ્રાંતિક ભાષાઓનું સ્થાન લેવાની નથી; એનો હેતુ એમાં પૂર્તિ કરવાનો અને આંતરપ્રાંતીય ઉપયોગમાં આવવાનો છે. જ્યાં સુધી હિંદુ-મુસ્લિમ વિદ્વાનું ચાલુ છે ત્યાં સુધી એ ઝારસી લિપિમાં લખાયેલી અને ઝારસી યા અરથી શાખ્દોના વધારાપડતા ભરવાવાળી ઉર્દૂનું વા દેવનાગરીમાં લખાયેલી અને સંસ્કૃત શાખ્દોના વધારે ભરવાવાળી હિંદીનું રૂપ લે છે. પણ જ્યારે બંને કોમેનાં હુદ્દ્ય એક થરો, ત્યારે એક જ ભાષાનાં એ એ રૂપો એકખીજમાં મળો જશો, અને એ બેના પરિણામરૂપ એવી, પોતાના પૂર્ણ વિકાસ અને અર્થશક્તિ માટે આવસ્યક હોય એવા સંસ્કૃત, ઝારસી, અને અરથી વા બીજા શાખ્દોવાળી એક ભાષા આપણુંને મળશે.

પરંતુ જુદા જુદા પ્રાંતોના દોડો પ્રાંતિક ભાષાઓ સહેવાઈથી શીખી શકે એટલા માટે એક લિપિની યોજના તો બીજી બંધી લિપિઓને નિઃશાંકપણે સ્થાનઅષ્ટ કરવા માટે છે. આ હેતુ સાધવાનો સારામાં સારો ભાર્ગ એ છે કે, પ્રથમ તો, ગુજરાતમાં છે એમ, હિંદુભરતી બંધી શાળાઓમાં, વિશેષ નહિ તો હિંદુઓ માટે તો, દેવનાગરી શિક્ષણ દ્રરજીયાત કરી હેતું, અને પછી જુદી જુદી દેર્શી ભાષાઓના અગત્યના સાહિત્યને દેવનાગરીમાં છપાવવું. અમુક પ્રમાણુમાં આવો પ્રયત્ન કરારનો થઈ પણ ચૂકુંછો છે. દેવનાગરીમાં ભાગેલી ગીતાંજલિ મેં જોઈ છે. પરંતુ એ પ્રયત્ન મોટા પ્રમાણું પર કરવાની જરૂર છે. વળી આવાં પુસ્તકોના ફેલાવા માટે પ્રચારકામ પણ કરવું જોઈએ. હિંદુ-મુસ્લિમાનનો મેળ કરવા માટે કાઈ પણ રચનાત્મક સૂચના કરવી અત્યારે તો ક્રેશન બદાર ગણ્યાય છે, એ હું જાણું છું. અતાં આ પત્રમાં મેં કહ્યું છે તે મારાથી ક્રી કલ્લા વિના રહેવાનું નથી કે, પોતાના મુસ્લિમાન લાઈઓની નજીક આવવું હોય તો હિંદુઓએ ઉર્દૂ શીખનું જોઈએ અને પોતાના હિંદુ લાઈઓની નજીક આવવું હોય તો મુસ્લિમાનોએ હિંદી શીખનું જોઈએ. હિંદુ અને મુસ્લિમાનોની સાચી એકતામાં જેને અદ્ધા છે એમણે એકખીજ તરફના તિરસકારના અત્યારના લયંકર ઉદ્ગારો અને વર્તનથી ગભરાવાની જરૂર નથી. અદ્ધાની જે કાઈકિંમત હોય તો જેમનામાં

એ હોય તેમણે જ્ઞારે જ્ઞારે શક્ય હોય ત્યારે ત્યારે પરસ્પર ઉદ્દારતા, એમ અને સભ્યતાનાં સર્વ કાર્યો, ડેઝિને ઘૂસથુરૂપ ન લાગે એમ પણ સહિતાથી, કરતાં રહ્યાં, અને એકખીજની ભાષા શીખવી એ એ દિશામાં ભરી શક્ય એવું ઓછામાં ઓછું પગલું છે. ભાવિક મુસલમાનોએ લખેલી ધર્માં સારી કિટાબો દારા મુસલમાનો કુરાન અને પયગંભર વિષે શા વિચારો ધરાવે છે એ હિંદુઓએ જાણું; અને એટલાં જ સારી રીતે લખાયેલાં ભાવિક હિંદુઓનાં પુરસ્તકો દારા હિંદુઓ ગીતા અને શ્રીકૃષ્ણ વિષે શા વિચારો ધરાવે છે એ મુસલમાનોએ જાણું, એ શું તે તે પદ્ધોએ અરૂપાન અને ધર્માંધ નિંદાએ લખેલાં એકખીજનાં ધર્મ-પુરસ્તકો અને એના પ્રેરકો વિષે લખેલી તમામ ખરાબ વસ્તુઓ જાણવા કરતાં સાંચું નથી ?\*

બંગ ઇડિયા, ૧૪-૭-'૨૭

## ૧૧. શિક્ષણમાં રાષ્ટ્રભાષાનું સ્થાન

૧

“ધર્મી રાષ્ટ્રીય સંસ્થાઓમાં હજ પણ માતૃભાષા અને લિંગી ભાષા પ્રયોગ હુલ્ક્ષ રહ્યાં કરે છે. ધર્મી શિક્ષકોને પણ હજ માતૃભાષા મારફત અગર હિંદુસ્તાની મારફત શિક્ષણ આપવાની અગત્ય સમજાઈ નથી. આનંદની વાત છે કે, શ્રી. ગંગાધરરાવે રાષ્ટ્રીય શિક્ષણમાં રસ લેનારાઓની એક સભા બોલાવી છે. . . .”

(બેદગામ કોન્ફેસના વ્યાપ્તાનમાંથી, ન. ૭., ૨૬-૧૨-'૨૪)

\* આ જગાએ, ગાંધીજીએ ગાંગડી ગુરુકુલમાં મંદિરી રાષ્ટ્રીય રિલાયુ પરિષહને પ્રમુખરથાનેથી આપેલા વ્યાપ્તાનમાં જાણુવલો નાથેનો વિચાર પણ નોંધ કેવો છે :

“સંસ્કૃત શીખવાની ફરેક હિંદી વિદ્યાર્થીના ફરજ છે. હિંદુઓની તો છે જે, પણ મુસલમાનાની પણ, કારણ આપરે તો તેમના વરદાન પણ રામ અને હૃષ્ણુ હતા, અને તેમને ઓળખવા માટે સંસ્કૃત જાણું જોઈએ. પણ મુસલમાનોની સાથે સંબંધ રામવાને માટે તેમની ભાષા જાણવાની હિંદુઓની પણ ફરજ છે. આજે આપણે એકખીજની ભાષાથી ભાગતા કરીએ છીએ, કારણ આપણે યાગલ એન્યા છીએ. એકખીજ પ્રયે દ્રોષ અને ભય રામવાનું જે સંસ્થા શીખવે છે તે રાષ્ટ્રીય નથી જ એમ અનીત માનજો.” (ન. ૭., ૨૭-૩-૧૯૨૭)

૬

દ્રોપિલેન, મદ્રાસ, માં હિંદુ હાઈસ્કુલમાં સર ડી. વિજયરાધવાચારિયર 'હિંદના શિક્ષણમાં હિંદીનું સ્થાન' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપે એ ખીના જમાનાની નિશાની છે, અને છેલ્લાં સાત વર્ષથી મદ્રાસની હિંદી પ્રચાર સલા ને પ્રચારકામ કરે છે તેની સિદ્ધિની સાખિતીઓ છે. હિંદના ૩૦ કરોડ લોકમાંથી ૧૨ કરોડ હિંદી બોલે છે ને ખીના ૮ કરોડ તે સમજે છે, તથા હુનિયામાં સોથી વધુ બોલાતી ભાષાઓમાં હિંદી વીજે નંબરે છે, 'એ વસ્તુ જ પોતે, દરેક હિંદી શીખવી જોઈએ એનું સંગીન કારણ છે' — એ ખતાવવામાં વ્યાખ્યાતાને કથી મુશ્કેલી ન પડી. "તે ભાષા ઠિક શીખવાને માટે છ માસનો સમય પૂરતો છે," એમ એ વિદ્ધાન વક્તાએ કહ્યું તે બરોબર છે. તેમણે દલીલ કરી કે, "હિંદના શિક્ષણમાં હિંદીને ફરજિયાત સ્થાન મળવું જોઈએ. શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત અભ્યાસની ભાષા એ હેવી જોઈએ." અને અને તેમણે કહ્યું, "એ દહોડો કચારે આવે કે જ્યારે પહેલાં આપણે હિંદી ને પણી મદ્રાસી કે બંગાળી હોઈએ! અને માટે આપણે સૌ ઉત્કંદ છીએ. આ બાબતમાં બડા ગુનેગાર હોય તો મદ્રાસી છે. તેઓ જે મોટી સંખ્યામાં હિંદી શીખવા માટે, તો એ દહોડો વહેલો આવે."

હિંદી શીખવા માટે દ્વાર્ણિણુવાસીઓ માટે હિંદી પ્રચાર સલાની પૂરતી બધી સવડો તૈયાર છે. એટલે પોતાના પ્રાંત પેડો જે આપણને હિંદ માટે સાચો પ્રેમ હોય, તો જરૂર વગર ઢાલે આપણે સૌ હિંદી શીખીએ, અને એ નામોશીમાંથી બચ્ચીએ કે, આપણી લોકપ્રિય સલા ને મહાસમિતિ તેનું કામકાજ કુલ નહિ તોય મોટે લાગે અગ્રેજમાં ચલાવીએ છીએ. મેં ધર્શી વાર કહ્યું છે તે ફરીને કહું છું કે, હિંદી વાટે પ્રાંત-ભાષાઓને દ્વારાવવાનો મારો ધરાદો નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું કે જેથી પ્રાતો એકમેકનો જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે, પ્રાંતભાષાઓ ને હિંદી એવી અથી સમૃદ્ધ બને.

( અ. પ., ૨૩-૮-'૨૮ )

## ૧૨. કરાંચી મહાસભાનો ઠરાવ

૧

[કરાંચી મહાસભાએ સ્વરાજ્યમાં નાગરિકોના ભૂળ હુકો જણાવતો ને ઠરાવ કરેલો તેમાંનો સંસ્કૃતિ, ધર્મ, ભાષા, લિપિ ઇંગ્રેઝી બાબતોને લગતો ભાગ નીચે આપ્યો છે:]

“. . . મહાસભા જહેર કરે છે કે, તેના તરફથી ને ડોઈ બંધારણું કથ્યુલ કરવામાં આવે તેમાં આટલી બાબતોનો સમાવેશ થયો જોઈએ અથવા સ્વરાજ સરકારને તેનો અમલ કરવાની શક્તિ મળવી જોઈએ:

૧. પ્રજાના ભૂળ હુકો, જેમાં નીચેના તો હેઠાન જ જોઈએ: . . .  
 (ગ) અંતરાત્માને અનુસરવાની, અને પ્રજાકીય સુલેહશાંતિ અને સદ્ગારની આડે ન આવે એવી રીતે ધાર્મિક માન્યતાની અને આચરણુંની સ્વતંત્રતા,  
 (ધ) નાની ડેમેની સંસ્કૃતિ, ભાષા અને લિપિએની રક્ષા, . . . (ય)  
 ડોઈ પણ શહેરીને તેનાં ધર્મ, ન્યાતળત કે માન્યતા અથવા લિંગભેદને કારણે જહેર નોકરીમાં, સત્તા કે માનના હેઠાબાં, અને ડોઈ પણ વેપાર કે ધર્મીય કરવામાં કુશી અહ્યણુંનો અલાવ. . . .

૨. ધર્મની આબતમાં સરકારની નિષ્પક્ષતા. . . .”

(ન. અ., ૫-૪-'૩૧)

૨

[તે ઠરાવ પર ભોવતાં ગાંધીજીએ ઉપરની બાબતો વિષે કરેલો હલ્દેખ નીચે મુજબ હતો :—]

નાની ડેમેની ભાષાલિપિની રક્ષા કરવામાં આવશે એમ આમાં જણાવ્યું છે. મુસલમાનોની સભ્યતા કંઈક અનોપી છે એમ મુસલમાનો માને છે — જેકે મારી દાખિએ ડિંગી ઉર્દૂ સભ્યતા બને સરખી છે. કુરાન અને મહાભારતમાં મને જુદી જુદી વરતુ નથી મળતી, પણ એક જ મળે છે. પણ મુસલમાનો પોતાની સભ્યતાને નિરાળી વરતુ માને છે, એટલે આપણે સહિષ્ણુતા ડેળવીએ, આત્મનિરીક્ષણું ડેળવીએ. એટલે આપણે તો મુસલમાનોની ખાતર ઉર્દૂ શીખવાનો પ્રયત્ન કરીએ, લિપિ પણ જણીએ. સ્વરાજ આવ્યા પણ આપણે આનો કાયદો કરીએ તો એ કુદરતી વાત થઈ પડે, એટલે આજથી જ આપણે એ વાત આપણું દિવમાં સમજી લઈએ.

(ન. અ., ૫-૪-'૩૧)

## ૧૩. એક 'તપ'નું સરવૈયું\*

તામિલ નાડ પરિભદ્ધની સાથે જ હિંદી પ્રચાર પરિષદ ભરાઈ એ સુચિભૂનું. દક્ષિણ ભારતના લોડાઓએ આવતે વરસે હિંદી બોલીને સમજી શકે એવા પ્રતિનિધિઓ મોકલવાનું વચ્ચેન આપેલું છે. આપણે કૃતિમ રિથિતિમાં ન જીવતા હોત તો દક્ષિણમાં વસતા લોડાને હિંદી શીખવામાં કષ્ટ ન લાગત, વ્યર્થતા તો ન જ જણાત. હિંદીભાષી પ્રજાને દક્ષિણની ભાષાઓ શીખવાની જરૂર છે તેના કરતાં દક્ષિણવાસીઓને હિંદી શીખવાની જરૂર અવસ્થ વધારે છે. આખા હિંદુમાં હિંદી બોલનાર અને સમજનારની સંખ્યા દક્ષિણની ભાષા બોલનારના કરતાં ઘમણી છે. પ્રાંતીય ભાષા કે ભાષાઓના બહલામાં નહિ પણ તેના ઉપરાંત પ્રાંત પ્રાંત વચ્ચેના સંસર્ગ માટે એક સર્વસામાન્ય ભાષા હોવી જોઈએ. એ તો હિંદી-હિંદુસ્તાની જ હોઈ શકે. કેટલાક જેએ પોતાના મનમાંથી લોકસમૂહને ભાતલ કરી નાખે છે તેએ અંગેલુને હિંદીની જોડાનેડ ચાલનારી નહિ પણ એકમાન શક્ય રાષ્ટ્રભાષા ગણે છે. પરદેશી ઝૂંસરીની મોહિની ન હોત તો આ વાત કદ્યનામાં પણ ન આવત. જેમને રાષ્ટ્રીય કાર્યમાં વધુ ને વધુ ભાગ દેવો પડવાનો છે તેવા દક્ષિણના લોકસમૂહને માટે કંઈ ભાષા શીખવી વધારે સહેલી છે — પોતાની ભાષાઓ અને જેની વચ્ચે ધણું શાખ્યો સમાન છે અને જે તેમને એકદમ લગભગ આખા ઉત્તર હિંદ સાથે સંસર્ગમાં આગે છે એવી હિંદી, કે મૂડીલર લોડાના વાપરતી સર્વાંશ વિદેશી એવી અંગેલ ? આ પસંદગીનો ઘરો આધાર માણુસની સ્વરાજની કદ્યપના પર રહેલો છે. સ્વરાજ જે અંગેલ બોલનાર હિંદીઓનું, તેમને માટે જ થવાનું હોય, તો બેશક અંગેલ જ રાષ્ટ્રભાષા હોય. પણ સ્વરાજ જે ભૂમે મરતાં કરોડાનું, નિરક્ષર કરોડાનું, નિરક્ષર બહેનોનું, દલિત અંતનોનું અને તે સૌને માટે થવાનું હોય, તો હિંદી એ જ એકમાન રાષ્ટ્રભાષા થક્ક શકે એમ છે. તેથી, જેએ ભારા જેવા વિચારના છે તેએ, ગયાં બાર વર્ષના વ્યવરિથત પ્રચારકાર્યને પરિણામે હિંદીએ જે લારે પ્રગતિ કરી છે, તેના અહેવાલને વધાવી દેશો :

“હિંદી શીખવા માંઠનાર  
હિંદીનું કામચકાઉ જ્ઞાન મેળવનાર

૪,૦૦,૦૦૦  
૨,૫૦,૦૦૦

\* ‘દક્ષિણમાં હિંદી પ્રચાર’ એ નામનો લેખ આ છે.

હિંદીની પરીક્ષાઓમાં એસનાર	૧૧,૦૦૦
પરીક્ષાઓમાં પાસ થનાર	૧૦,૦૦૦
હિંદી પ્રચાર સભાએ પોતાના શાખાનામાં કાપેલી વાચનમાળાની ચોપડીએ	૩,૦૦,૦૦૦
તેમાંથી વેચાયેલી	૨,૫૦,૦૦૦
પ્રસિદ્ધ કરેલી ચોપડીએના પ્રકાર	૩૫
(આ તમામ ચોપડીએની અનેક, અને તેમાંના ઓફની ભાર, આવૃત્તિએ થયેલી છે.)	
આજ સુધીમાં હિંદી જ્યાં શીખવાઈ છે એવાં કેન્દ્રો	૪૦૦
અસારે ચાલતાં કેન્દ્રો (કલ)	૧૫૦
સીધાં અંકુરા તળે ચાલતાં કેન્દ્રો	૨૫
ફિલ્મ આરી, 'ડેમાં જ્યાં પરીક્ષા દેવાયેલી એવાં કે દ્રો	૧૧૩
તાલીમ પામેલા રિસ્કડો	૨૫૦
આજ સુધી બેગુ કરેલું અને ખર્ચેલું દબ્બ	૩. ૨,૫૦,૦૦૦
ઉત્તર ભારતમાંથી બેગુ કરેલું	૩. ૧,૫૫,૦૦૦
દક્ષિણ ભારતમાંથી ..	૩. ૮૫,૦૦૦"

આપણે આશા રાખીએ કે, આ મંગલ વર્ષમાં આ પ્રગતિનો વેગ હજુ  
પણ વધશે અને તેને માટેનું બધું ધન દક્ષિણમાંથી જ મળી રહેશે. રાષ્ટ્રકાણ  
શીખવાની અને ભારતવર્ષને અખંડ અને એકિકૃપ બનાવવાની દક્ષિણની ઉત્કર્ષાની  
એ કુસોટી થશે.

ન. છ., ૨૧-૯-'૩૧

## ૧૬. આગણતું પગલું

[ ૧૯૧૮માં હિંદી સાહિત્ય રામેલનની ઈટોર ણેઠક ખાઈ ગાંધીજીએ દક્ષિણ ભારતમાં  
રાષ્ટ્રકાણ પ્રચારકામ હપ્પાડ્યું. તેના ડારાન ફળનો જ્યાલ ગયા દોખમાં કાંઈક મેળાંયો.  
તા. ૨૦-૪-૧૯૩૫ મિનોરમાં ને સામેલનની રજભી ણેઠક થઈ, ત્યારે ગાંધીજ ભીજ વાર  
તેના પ્રમુખ થયા. અને તે શ્યાનેથી આગળ હવે શું કરવું તેની જાંખી કરાની. ૧૯૧૮  
નેમ ૧૯૩૫ની આ રાઝ્યાત રાષ્ટ્રકાણપ્રચારના કાગમાં નોએં પડી આવતો તખ્કો  
ગળાય. પ્રમુખયદેથી આપેલા વ્યાખ્યાનનો નીચે આપેલો જાગ તે દર્શાવે છે.]

ઈશ્વરની ગતિ ગહન છે. ઓક્ટોબર માસમાં હું આ બોજો ટાળતો હતો.  
આ પણ પૂજનીય માલવીયજી મહારાજનું હતું. પણ એમની તબિયત બગડવાને

લીધે, અને એમને વિદેશ જવું હતું તેથી, તેમણે રાજુનામું મોકદ્યું બીજો પ્રમુખ ચ્યૂટવામાં તમને કંઈક મુસીબત હતી. મારું નામ તો સ્વાગત સમિતિની આગળ હતું જ. મારી આગળ જ્યારે સ્વાગત સમિતિના સંકટની વાત કરવામાં આવી, ત્યારે હું લાચાર થઈ ગયો અને આ પદ સ્વીકારવાની મેં હા પાડી.

એ હા પાડવાનું મારી પાસે બીજું કારણ તો હતું જ. ગયે વરસે જ્યારે મારી પાસે આ અધિવેશનનું પ્રમુખપદ લેવાની માગણી આની, ત્યારે મેં દક્ષિણ ભારતના હિંદી પ્રચારને માટે એ લાખ રૂપિયા માગ્યા. પણ આજકાલ એ લાખ રૂપિયા એ કામને માટે ડોણું આપે? ‘હાં, પ્રયત્ન કરીશું. આપ પ્રમુખપદ લેશો તો સક્રિયતા મળશે’ — એવી એવી સમિતિની વાતોમાં ફ્લાઇંગ જલ એવો ભોગો હું કચાં હતો? મેં તો એ લાખની બાંધધરી માગી. મેં જાણ્યું કે, એને લાધે મિત્રોએ મને છોડી દીધો.

પણ ભગવાનને તો બીજું જ વાત કરવી હતી. એને મારી મારકે હિંદી પ્રચારની કંઈક વધારે સેવા લેવી હતી. માલવીયજી મહારાજ ન આવી શક્યા. દુર્ઘટર એમને શતાયુ કરે. મેં આપનાં અધિવેશનોના અહેવાલો થોડાક જેયા છે. પહેલવહેલું અધિવેશન સન ૧૯૧૦માં થયેલું. એના પ્રમુખ માલવીયજી મહારાજ જ હતા. એમના કરતાં મોટો હિંદીપ્રેમી ભારતવર્ષમાં આપણું કચાયે નહિ મળે. તેઓ આજ પણ આ પદ પર હોત તો કેવું સારું થાત! એમનું હિંદી પ્રચારનું ક્ષેત્ર ભારતબ્યાપી છે; એમનું હિંદીનું શાન ઉત્કૃષ્ટ છે.

મારું ક્ષેત્ર બધું મર્યાદિત છે. મારું હિંદી ભાષાનું શાન નહિ જેવું છે. તમારી પ્રથમ પરીક્ષામાં હું પાસ ન થઈ શકું. પણ હિંદી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ ડેઢિનાથી ભાતરે એવો નથી. મારું ક્ષેત્ર દક્ષિણમાં હિંદી પ્રચારનું છે. સન ૧૯૧૮માં તમારું અધિવેશન અહીં થયેલું, ત્યારથી દક્ષિણમાં હિંદીપ્રચારના કામનો આરંભ થયો છે. એ કામ ત્યારથી ઉત્તરોત્તર વધતું જ ગયું છે. ધનના અભાવને કારણે એ રોકાનું ન જોઈએ. . . .

તમે પૂછશો કે, કેવળ દક્ષિણમાં હિંદીપ્રચારને માટે કેમ? મારો ઉત્તર એ છે કે, દક્ષિણ ભારત કંઈક નાનો સુલક નથી. એ તો એક મહાદ્વીપ જેવો છે. એમાં ચાર પ્રાંત અને ચાર ભાષાઓ છે: તામિદ, તેલુગુ, મલયાળી અને કાન્દી. વર્ષતી લગભગ સચા સાત કરોડની છે. આટલા માલુસોમાં જે આપણે હિંદી પ્રચારની જરૂર જરૂરીએ તો બીજા પ્રાતોમાં પણ ધણી સરળતા થઈ જશે.

નોકે હું આ ભાષાઓને સંસ્કૃતની પુનીઓ માનું છું, તો પણ એ હિંદી, ગુજરાતી, અંગાળી, આસાની, પંજાબી, સિંધી, મરાહી ને ગુજરાતીથી લિખ છે. એમનું વ્યાકરણ હિંદીથી છેક જુદું છે. એમને સંસ્કૃતની પુનીઓ કહેવામાં મારો આશય એટલો જ છે કે, એ બધીમાં સંસ્કૃત શાખા પૂરતા પ્રમાણમાં છે, અને જ્યારે સંકટ આવી પડે છે ત્યારે તે સંસ્કૃત માતાને પોકાર કરે છે ને તેના નવા શાખદરપી દૂધ પીએ છે. પ્રાચીન કાળમાં એ લલે સ્વતંત્ર ભાષાઓ હોય; પણ હવે તો તે સંસ્કૃતમાંથી શાખા લઈને પોતાનું ગૌરવ વધારી રહી છે. એને સંસ્કૃતની પુનીઓ કહેવાનાં બીજાં પણ ડેટલાંક કારણો છે; પણ એને અન્યારે જવા દઈએ.

ગમે તેમ હો, એટલી વાત તો નિર્વિવાદ છે કે, દક્ષિણમાં હિંદીપ્રચાર એ સૌથી કદણું કામ છે. છતાં, અદ્ધર વરસમાં ત્યાં વ્યવસ્થિતપણે ને કામ થયું છે તેને પરિણામે, આટલાં વરસમાં છ લાખ દક્ષિણાસીઓએ હિંદીમાં પ્રવેશ કર્યો; ૪૨,૦૦૦ પરીક્ષામાં ઐહા; ૩,૨૦૦ જગાએ હિંદીનું શિક્ષણ અપાયું, ૬૦૦ શિક્ષક તૈયાર થયા, અને આજે ૪૩૦ જગાએ કામ ચાલી રહ્યું છે. સન ૧૯૬૩થી સ્નાતક પરીક્ષા પણ શર થઈ, અને આજે સ્નાતકોની સંખ્યા ૩૦૦ની છે. ત્યાં હિંદીની ૭૦ ચોપડીઓ તૈયાર થઈ, ને મદ્રાસમાં એની આઠ લાખ નકલો છપાઈ. ૧૭ વરસ પહેલાં દક્ષિણની એક લાઈસ્ટ્ઝ્યુલમાં હિંદી શીખવવામાં આવતી નહોતી, પણ આજે ૭૦ હાઈસ્ટ્રીલમાં હિંદી શીખવાય છે. બધા મળીને ૭૦ કાર્યકર્તા એમાં કામ કરે છે. આજ સુની ચા પ્રેયાસમાં ચાર લાખ ઇપિયા અરચાયા છે, તેમાંના અડ્યાથી કંઈક એઓ ઇપિયા દક્ષિણમાંથી મળ્યા છે. અહીં એક વાત કહેની જરૂરની છે. કાકસાહેબ એમના નિરીક્ષણ પણી કહે છે કે, દક્ષિણમાં બહેનોએ હિંદીપ્રચારને માટે ધણું કામ કર્યું છે. તેઓ એનો મહિમા સમજ ગઈ છે. તેઓ એટલે સુધી ભાગ લઈ રહી છે કે, ડેટલાંક પુરુષોને એવી ચિંતા થવા લાગી છે કે જે ને સ્વીઓ ચા રીતે ઉઘમી બનશો તો ધર કોણ સંભાળશો?

આટલી પ્રગતિ સંતોષજનક માની શકાય? આવા વૃક્ષને આપણે હજુ વધારે વધારવું ન જોઈએ? આજે જ્યારે મને ચા સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે પણ ને હું આ સંસ્થાને ચિરસ્થાયી બનાવવાનો પ્રયત્ન ન કરું, તો મારા જેવો મૂર્ખ કોણ ગણાય? મને બીજી વાર ચા પણ લેવાનો કંઈ પણ અધિકાર હોય તો તે ડેવળ મારા દક્ષિણાના હિંદીપ્રચારને લાધે જ છે. લલે એ

કાર્યમાં મેં ડોર્ચ હેઠો લઈને કામ ન કર્યું હોય; પણ દરહાલતમાં એ વૃક્ષતું સિંયન કરવામાં તો મેં પૂરતો ભાગ લીધો જ છે. . . . .

મેં આપને આ સંસ્થાની ઊજળી બાળુ જ બતાવી છે. એની મતલબ એ નથી કે એની કાળી બાળુ છે જ નહિ.

“જરૂર ચેતન ગુણુદોષમય, વિશ્વ કીનહ કરતાર;  
સંત હંસ અહંહિ પથ, પરિહરિ વારિવિકાર.”

નિષ્ઠળતા પણ સારી પેઠે મળી છે. બધા કાર્યકર્તા સારા જ નીકળ્યા એમ પણ ન કહી શકાય. બધું કામ આરંભથી અંત સુધી સારું જ રહેત તો જરૂર આથીએ સુંદર પરિણામ આવી શકત. પણ એટલું તો કહી જ શકાય કે, ખીજ પ્રાંતોના હિંદીપ્રચારની સાથે આની તુલના કરવામાં આવે તો આ કામ અદ્વિતીય ગણ્યાય.

હવે રહી એક લાખના ખરચની વાત. ‘આ ખરચ આ સંમેલનના પ્રયાગમાં આવેલા મુખ્ય કાર્યાલયમાંથી થવાની જરૂર નથી? એમ ન થાય તો એથી આ સંમેલનનું અપમાન નહિ થાય?’ આ પ્રશ્નોના જવાબમાં મારે નાખ્યે એ કહેતાનું છે કે, એમાં અપમાનની વાત જ નથી. આ સંમેલન ન હોત તો દ્વારાણું ભારત હિંદીપ્રચાર સભા પણ ન હોત. સત્તા ૧૯૧૮માં આ જ શહેરમાં આ જ સંમેલનની છાયામાં એ સંસ્થાનો ઉદ્ઘલવ થયો. તે પછીના ધતિહસમાં જવાની જરૂર નથી. અંતમાં એ સંસ્થાને સંમેલને સ્વતંત્ર બનાવી, અથવા એમ કહો કે ‘ડેમીનિયન સ્ટેટ્સ’ આપી દીધું. એથી સંમેલનનું ગૌરવ વધ્યું જ છે, એણું નથી થયું. સંમેલનની સાથે સંબંધ રાખનારી બંધી સંસ્થાઓ સ્વાવલંખી બની જાય તો એથી વધારે હર્ષની વાત સંમેલનને માટે કુર્ચ હોઈ શકે? તમારી પાસેથી એક લાખ રૂપિયાની જે લિક્ષા ભાગવામાં આવે છે તે આ સ્વતંત્ર સંસ્થાને માટે છે. એને પણ જોડે તો આ સંમેલનનો જ ફરકાવવાનો છે.

પણ તો પછી એ પ્રશ્ન જોડે ખરો કે, શું ખીજ પ્રાંતોની વાત છોડી દેવી? શું બીજા પ્રાંતોમાં હિંદી પ્રચારની આવશ્યકતા નથી? અવસ્થ છે. મને દ્વારાણું પ્રત્યે પક્ષપાત નથી, કે ખીજ પ્રાંતો પ્રત્યે દેખ નથી. મેં ખીજ પ્રાંતોને માટે પણ પૂરતો પ્રયત્ન કર્યો છે; પણ કાર્યકર્તાઓના અલાવને લીધે તાં એટલી શું, થોડી પણ સફળતા નથી ભગી શકી. બિયારા બાબા રાધવદાસ ઉત્કલ, બંગાળ અને આસામમાં હિંદીપ્રચારને માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. કંઈક

સહજતા પણું મળી છે, પણું એને નહિ જેવી ભાનવી જોઈએ. જે કંઈ પણું મદ્દદ એમને મારાથી અપાવી શકાય એમ હતું, તે અપાવવાનો પ્રયત્ન પણું મેં કર્યો છે. બાબાજી ( એટલે બાબા રાધવદાસ)ની મારફતે આસામમાં ગોઢાડી, જોરહટ, શિવસંગર અને નવગાવમાં પ્રયત્ન ચાલી રહ્યો છે. તાં ૧૬૦ વિદ્યાર્થીઓ લણે છે. એ વિદ્યાર્થી અને એ વિદ્યાર્થીનીએને છત્રવૃત્તિ આપીને કાશી વિદ્યાપીઠ અને પ્રયાગના મહિલા વિદ્યાપીઠમાં લાણુવા મોકલવામાં આવ્યાં છે. એક આસામી ભાઈ ખરહજ ( જિ. ગોરખપુર)માં હિંદી લણે છે ને ત્યાંના લોકોને આસામી ભાષાવે છે. આસામી પ્રતિક્રિત લોકો આ પ્રચારકાર્યમાં એણો રસ દે છે. જે મદ્દદ બાબાજીને મળી છે તે એક જ વરસને માટે છે.

ઉત્કળમાં કટક, પુરી અને ખરહમપુરમાં કંઈક પ્રયત્ન ચાલી રહ્યો છે. ઉત્કળને વિષે એક મોટી આશાજનક વાત એ છે કે, શ્રી. ગોપથંદુ ચોધરી અને એમનાં ધર્મપત્ની રમાદેવી હિંદીપ્રચારમાં ધણે રસ દે છે. પોતાનાં ખાળકોને પણ એમણે હિંદીનું હીક હીક જાન આપ્યું છે. એ સહુ આજકાલ ગામધામાં રહીને એવી જ રચનાત્મક સેવા કરે છે. એવા કેટલાક થીજા પણ ત્યાણી ઝર્યકર્તા ઉત્કળમાં છે. એટલે ઉત્કળમાં હિંદીપ્રચારની આરા અવસ્થ રાખી શકાય.

બંગાળમાં તો એક સમિતિ પણ અની હતી; બધું થયું હતું. હિંદી પર પ્રેમ રાખનાર બંગાળીઓ પણ ધણ્ણા છે. શ્રી. રામનાંદ્યાય શ્રી. બનારસીદાસ ચતુર્વેદીની મદ્દદી 'વિશાલ ભારત' પ્રસિદ્ધ કરે છે. એ કંઈ નાનીસૂતી વાત નથી. કલકત્તામાં હિંદીપ્રેમી મારવાડી સજગનો પણ એણા નથી. તોપણું બંગાળમાં જે કંઈ થઈ રહ્યું છે તે બધું જ એણાનું જોઈએ.

પંનાયની વાત. હું જવા દર્દી છું, કેમ કે પંનાયમાં ઉર્દૂ તો સહુ સમજે છે. તાં તો કેવળ લિપિની વાત રહી જય છે. એ પ્રશ્ન પર નિચાર કરવાને માટે કાકાસાહેબના પ્રમુખપદ નીચે લિપિપરિશ્વ ભરવાની છે, એટલે એ વિષે હું કંઈ કહેવા ચંચાતો નથી. હવે રહ્યા સિંધ, મહારાષ્ટ્ર, અને ગુજરાત. એ નણું પ્રાતોમાં જે કંઈ થઈ રહ્યું છે તે ભાગ્યે જ ઉલ્લેખ કરવા નેટલું હોય. પણ મને ઉમેદ છે કે, આ જ સમેલનમાં આપણે ત્યાંને માટે પણ કંઈ ને કંઈ રચનાત્મક કાર્ય કરવાનો નિશ્ચય કરીશું.

ખરી મુસીઅત તો એ છે કે, સમેલનના ઉદ્દેશોમાં તો અન્ય પ્રાતોમાં હિંદીપ્રચારને મોઢું સ્થાન આપવામાં આવ્યું છે, પણ મારું એ કહેવું અનુભિત નહિ ગણ્યાય કે, સમેલને નેટલું જોર પરીક્ષાઓ પર દીધું છે તેટલું આ પ્રચારકાર્ય

પર નથી આપણું. મારી વિનંતી છે કે, આ સમેલનમાં આપણે આ વિષે ખાનપૂર્વકુલવિચાર કરીને આ બાઅતમાં કંઈક સ્પષ્ટ નીતિ અહણું કરવી જોઈએ.

મારો અભિગ્રાય એવો છે કે, અન્ય પ્રાંતોમાં હિંદીપ્રચારને સમેલનનું મુખ્ય કાર્ય બનાવવાનું જોઈએ. જે હિંદીને રાજ્યભાષા બનાવવી હોય તો પ્રચારકાર્ય સર્વવ્યાપી અને સુસંગઠિત હોય જ જોઈએ. આપણે ત્યાં શિક્ષકોનો અભાવ છે. સમેલનના મુખ્ય મથુરમાં હિંદી શિક્ષકને માટે એક વિદ્યાલય હોય જોઈએ. તેમાં એક તરફ હિંદી પ્રાંતવાસી શિક્ષકાં તૈયાર કરવામાં આવે, અને તેમને જે પ્રાંતને માટે તેઓ તૈયાર થવા માગે તે પ્રાંતની ભાષા શીખવવામાં આવે; અને બીજી બાજુ બીજા પ્રાંતોના વિદ્યાર્થીઓને પણ દાખલ કરીને તેમને હિંદી ભાષાવવામાં આવે. એવો પ્રધાસ દર્શિણું માટે તો કરવામાં આવ્યો પણ હતો; એને પરિણામે આપણને પંડિત હરિહર શર્મા એને હથીડેશ મળ્યા.

તમે જણો છો કે, મારી સલાહથી કાકાસાહેય કાલેલકર દક્ષિણમાં પ્રચારકાર્યનું નિરીક્ષણું કરવા અને પંડિત હરિહર શર્માને મદદ કરવા ગયા હતા. એમણે તામિલનાડ, મલાર, નવાજુકોર, મૈસુર, આંધ્ર અને ઉત્કળ સુણી અમણું કર્યું, હિંદીપ્રેમીઓને મળ્યા, અને કંઈક ધન પણ લેગું કર્યું. એ પ્રવાસમાં એમણે જેયું કે, ડેટલાક લોડા એમ માને છે કે, આપણે પ્રાંતીય ભાષાઓનો નાશ કરીને હિંદીને આખા ભારતવર્ધની એકમાત્ર ભાષા બનાવવા માગીએ છીએ. આ ગેરસમજથી ભરમાઝની તેઓ આપણું પ્રચારનો વિરોધ પણ કરે છે. મને લાગે છે કે, આપણે આ બાઅતમાં આપણી નીતિ વિષે ખુલાસો કરીને આવી ગેરસમજને દૂર કરવી જોઈએ. દંભેશાં હું માનતો આવ્યો છું કે, આપણે કોઈ પણ સ્થિતિમાં પ્રાંતીય ભાષાઓને ભૂમિ નાંખવા નથી માગતા. આપણા ભત્તલબ તો ઇક્ઝા એટલી જ છે કે, બિન લિન પ્રાંતોના પરસ્પર સંબંધને સારુ આપણે હિંદી ભાષા શીખીએ. એમ કહેવાનો અર્થ એવો નથી કે હિંદી પ્રત્યે આપણને કંઈક પક્ષપાત છે. હિંદીને આપણે રાજ્યભાષા માનીએ છીએ. તે રાજ્યભાષા થવાને લાયક છે. તે જ ભાષા રાજ્યીય અર્જ શકે જેને વધારેમાં વધારે લોડા ભાલત હોય અને જે શીખવામાં સુગમ હોય. એવી ભાષા હિંદી જ છે એ વાત આ સમેલન સન ૧૯૧૦થી બતાવતું આવ્યું છે, અને એને વજન આપવા જેવો વિરોધ આજ સુધી સાંભળવામાં આવ્યો નથી.

કાકાસાહેય ડેટલાક લોડાના મનમાં બીજી એક ગેરસમજ જોઈ. ડેટલાક માને છે કે, આપણે હિંદીને અંગેજનું સ્થાન આપવા માગીએ છીએ. ડેટલાક

તો એટલે સુધી માને છે કે, અંગ્રેજ જ રાજ્યકાલાથા બની શકે એમ છે, ને બની પણ ગર્હી છે.

હિંદી જે અંગ્રેજનું સ્થાન દે તો ઓછામાં ઓછું મને તો સારું જ લાગશે. પણ અંગ્રેજ ભાષાના મહત્વને આપણે સારી રીતે જાણીએ છીએ. આધુનિક શાનની પ્રાપ્તિ, આધુનિક સાહિત્યનું અધ્યયન, આખા જગતનો પરિચય, અર્થપ્રાપ્તિ, રાજ્યાધિકારીઓની સાથે સંબંધ, એ અને એવાં બીજાં કર્મો માટે અંગ્રેજનું શાન આપણું જરૂરનું છે. છંચા ન હોય તોયે આપણે અંગ્રેજ શીખવી પડશે. એમ જ બની પણ રહ્યું છે. અંગ્રેજ આંતરરાજ્યીય ભાષા છે.

પણ અંગ્રેજ રાજ્યકાલાથા કદી ન બની શકે. આજે એનું સામ્રાજ્ય હોય એમ અવસ્થય દેખાય છે ખરું. એનાથી બચવાનો પૂરો પ્રયત્ન કરવા છતાં, આપણાં રાજ્યકાલાથા કામકાજમાં અંગ્રેજએ ઘણેણ પ્રભાવ જમાવ્યો છે. પણ એટલાથી આપણે એવા ભ્રમમાં ન પડું નોકારે કે અંગ્રેજ રાજ્યકાલાથા બની રહી છે. એની કસોરી આપણે દરેક પ્રાંતમાં સહેલાઈથી કરી શકીએ છીએ. બંગાળ અથવા દક્ષિણ ભારતને જ દાઈએ, કેમ કે ત્યાં અંગ્રેજનો પ્રભાવ સહૃદી વધારે છે. ત્યાંની જનતાની મારફતે આપણે કંઈ પણ કામ કરવા માગીએ તો તે આજે હિંદી દારા ભલે ન કરી શકીએ, પણ અંગ્રેજ દારા તો નહિ જ કરી શકીએ. હિંદીના બેચાર શશ્વતોથી આપણે આપણે ભાવ કંઈક તો પ્રગટ કરી જ દઈએ, પણ અંગ્રેજથી તો એટલો પણ નહિ કરી શકીએ. હા, એમ અવસ્થય માની શકાય કે, હજુ સુધી આપણે ત્યાં એક પણ રાજ્યકાલાથા થવા પામી નથી. અંગ્રેજ રાજ્યકાલાથા છે. એમ હેતું સ્વાભાવિક પણ છે. અંગ્રેજ એથી આગળ વધે એ હું અસંભવિત માનું છું, પછી ભલે ગમે એટલો પ્રયત્ન કેમ ન કરવામાં આવે. હિંદુસ્તાનને જે ખરેખર એક રાજ્ય જનાવતું હોય તો, કોઈ માને કે ન માને પણ, રાજ્યકાલાથા તો હિંદી જ બની શકે; કેમ કે ને સ્થાન હિંદીને મળ્યું છે તે બીજી કોઈ પણ ભાષાને કદી મળી નહિ શકે. હિંદુ મુસ્લિમાન બંને મળાને લગભગ બાબીસ કરેડ મનુષ્યની ભાષા, થોડાથણું ફેરફારો સાથે, હિંદી-હિંદુસ્તાની જ છે. તેથી ઉચિત અને સંભવિત તો એ જ છે કે, દરેક પ્રાંતમાં એસાંતની ભાષાનો, આખા દેશના પરસ્પર વ્યવહારને માટે હિંદીનો, અને આંતરરાજ્યીય ઉપયોગને માટે અંગ્રેજનો વાપર કરવામાં આવે. હિંદી બોલનારાઓની સંખ્યા કરોડોની રહેશે, પણ અંગ્રેજ બોલનારાઓની સંખ્યા થોડાક લાખથી આગળ કદી નહિ વધી શકે. એ માટે પ્રયત્ન પણ કરવામાં જનતા પ્રયોગ કર્યો ગયાશે.

મેં હમણું હિંદીનહિંદુસ્તાની શખદનો પ્રયોગ કર્યો છે. સન '૧૮માં જ્યારે તમે મને આ જ પદ આપેલું ત્યારે પણ મેં એમ જ કહ્યું હતું કે, હિંદી એ ભાષાનું નામ છે જે હિંદુ અને મુસ્લિમાન કુદરતી રીતે વગર પ્રયત્ને ઘોલે છે. હિંદુસ્તાની અને ઉર્દૂમાં કરો ફરક નથી. દેવનાગરી લિપિમાં લખાય ત્યારે તે હિંદી, અને અરધભાષામાં લખાય ત્યારે ઉર્દૂ કહેવાય છે. જે લેખક કે વક્તા વીણી વીણીને સંઝૂન કે અરધી-કુરસીનો જ પ્રયોગ કરે છે, તે દેશનું અહિત કરે છે. આપણી જનતામાં પ્રચલિત થઈ ગયા હોય એવા બધી જાતના શખદો રાષ્ટ્રભાષામાં આવવા જોઈએ. શ્રી. ધનસ્યામદાસ બિરલાએ કહ્યું છે તે બરાબર જ છે કે, જુદી જુદી પ્રાંતીય ભાષાઓમાં જે શખદો રૂઠ થઈ ગયા છે અને જે રાષ્ટ્રભાષામાં આવવાને લાયક છે, તે રાષ્ટ્રભાષાવાદીઓએ લઈ લેવા જોઈએ. દરેક વ્યાપક ભાષામાં એ અહુણુશક્તિ રહે જ છે. એટલા માટે તો તે વ્યાપક બને છે. અંગ્રેજીએ શું નથી લીધું? લેટિન અને ગ્રીકમાંથી કેરલાયે શખદપ્રયોગો અંગ્રેજીમાં લેવાયા છે. આધુનિક ભાષાઓને પણ તેઓ છોડતા નથી. એ ભાષાતમાં એમનું નિષ્પક્ષપણું પ્રશંસાપાત્ર છે. હિંદુસ્તાની શખદો અંગ્રેજીમાં ડિક ડિક આવી ગયા છે. કેટલાક આદ્ધિકારી પણ લેવાયા છે. એમાં-એમનો 'મુક્ત વ્યાપાર' (ફી ટ્રેડ) કાયમ જ છે. પણ મારા આમ કહેવાની મતલબ એ નથી કે, પ્રસંગ વિના પણ આપણે ભીજી ભાષાઓના શખદ લઈએ, જેમ આજકાલ અંગ્રેજ અણેલા જુવાનો કરે છે. આ વ્યાપારમાં વિવેકદાષિ તો રાખવી જ પડશે. આપણે કંગાલ નથી, પણ કંન્યૂસ પણ નહિ બનીએ. ખુરસીને ખુશીથી 'ખુરસી' કહીશું, એને માટે 'ચતુર્ખાદ પીઠ' શખદનો પ્રયોગ નહિ કરીએ.

આ પ્રસંગે મારા હુઃખ્યની પણ થોડીક વાત કરી લઈ. હિંદી ભાષા રાષ્ટ્રભાષા અને યા ન અને, હું એને છોડી નથી શકતો. તુલસીદાસનો હું પૂજારી રહ્યો, એટલે હિંદી પર મારો મોહ રહેવાનો જ. પણ હિંદી ઓલતનારાઓમાં રવીદ્રિનાથ ક્રયાં છે? પ્રકુલ્ષયંત્ર રાય ક્રયાં છે? જગદીશ ઐઝ ક્રયાં છે? એવાં થીજાં પણ નામ હું બતાવી શકું. હું જાણું છું કે, મારી અથવા મારા જેવા હળવોની ધ્યાન માત્રથી એવી વ્યક્તિઓ થોડી જ પેહા થવાની છે? પણ જે ભાષાને રાષ્ટ્રભાષા બનાવું છે, તેમાં આવી મહાન વ્યક્તિઓ હોવાની આશા રખ્યાશે જ.

\*વધીમાં અમારે ત્યાં એક કન્યાશ્રમ છે. ત્યાં સંમેલનની પરીક્ષાને માટે કેટલીક છોકરીઓ તૈયાર થઈ રહી છે. શિક્ષકો, અને છોકરીઓ પણ, કુરિયાદ કરે છે કે, જે પાહ્યપુસ્તકો નીમવામાં આવ્યાં છે તે બધાં વાંચવા લાયક નથી.

કુરિયાદને ખાત્ર પુસ્તકો શુંગારરસથી લરેલાં છે. હિંદીમાં શુંગારરસાહિત્ય સારી પેઠે છે. એ તરફ ટેલાક વરસ પહેલાં શ્રી. બનારસીદાસ ચતુર્વેદીએ મારું ધ્યાન ઘેંચ્યું હતું. જે લાખાને આપણે રાજ્યભાષા બનાવવા માગતા હોઈએ, તેનું સાહિત્ય સ્વર્ચછ, તેજસ્વી અને ઉચ્ચગામી હોવું જોઈએ. હિંદી ભાષામાં આજકાલ ગંદા સાહિત્યનો ધર્ણો પ્રચાર થઈ રહ્યો છે. ધાર્યાના સંચાલકો આ બાધતમાં અસાવધ રહે છે ને ગંદકીને પોષણ આપે છે. હું મારું છું કે, સમેલને આ બાધતમાં ઉદ્ઘાસીન ન રહેવું જોઈએ. સમેલનની તરફથી સારા લેખકોને પ્રોત્સાહન મળવું જોઈએ. લોકોને સમેલનની તરફથી પુસ્તકોની પસંદગીમાં પણ કંઈક મદદ મળવી જોઈએ. આ કામમાં મુર્સીબત અવશ્ય છે. પણ મુર્સીબતથી આપણે થોડા જ લાગી શકીએ છીએ?

પરીક્ષાઓનાં પાકયપુસ્તકમાંથી એક પુસ્તકને વિષે, દેવનાગરી લિપિ સારી રીતે જાળુનાર એક મુસલમાનની પણ કુરિયાદ છે. એ પુસ્તકમાં મોગલ આદશાહો વિષે સારી જોડી વાતો છે, જે અધી ઐતિહાસિક પણ નથી. મારી નાની વિનંતી છે કે, પાકયપુસ્તકોની પસંદગી સ્ફક્ષમ વિવેકપૂર્વક થવી જોઈએ, એમાં રાજ્યીય દાખિ રખાવી જોઈએ, અને પાકયકમ પણ આધુનિક આવશ્યકતાએને ઘ્યાલમાં રાખીને નજી થવો જોઈએ. હું જાળું છું કે, મારું આ અંધું કહેવું મારા ક્ષેત્રની અધાર છે. પણ મારી પાસે જે કુરિયાદો આવી છે તે તે તમારી સામે રજૂ કરવાનો મેં મારો ધર્મ માન્યો છે.

## ૧૫. એ સારા ઠરાવ

ઇદોરમાં ભરાયેલા હિંદી સાહિત્ય સમેલને ટેલાક ઉપયોગી ઠરાવો પસાર કર્યા છે. એમાંના એક ઠરાવમાં હિંદી ભાષાની વ્યાખ્યા આપેલી હતી; અને ધીનમાં એવો અભિગ્રાય દર્શાવિલો હતો કે, જે લાખાઓ સંસ્કૃતમાંથી જિતરી આવેલી છે અથવા જેના પર સંસ્કૃતનો ધર્ણો પ્રભાવ પડેલો છે તે અધી ભાષાએ દેવનાગરી લિપિમાં લખાવી જોઈએ.

પહેલા હરાવનો ઉદ્દેશ એ વસ્તુ પર ભાર મૂકવાનો છે કે, હિંદી આંતિક ભાષાએનો નાશ કરી તેનું સ્થાન પડાવી દેવા છંછતી નથી, પણ તેની પૂર્તિઃપ અનવા છંછે છે, અને હિંદી ભાષા બોલનારનાં અભિવ્યક્ત ભારતીય કાર્યકર્તાનાં

જાન અને ઉપયોગિતામાં વધારો થાય છે. જે ભાષા ઉર્દૂ લિપિમાં લખેલી છે, પણ જેને મુસલમાન અને હિંદુ બંને સમજી શકે છે, તે પણ હિંદી જ છે, એ હકીકતને સ્વીકાર કરીને, સંમેલન ઉર્દૂ લિપિનું વિરોધી છે એવી મુસલમાતોની શંકા તેણે દૂર કરી છે. સંમેલનની પ્રમાણભૂત લિપિ તો દેવનાગરી જ રહેશે. પંજાબના હિંદુઓમાં તેમ જ બીજે દેવનાગરી લિપિનો પ્રચાર કરવાનું કાર્ય તો ચાલુ જ રહેશે. આ દુરાવથી દેવનાગરી લિપિનું ભૂલ્ય જરાયે ચોણું થતું નથી. એ દુરાવથી તો, મુસલમાતો આજ સુધી જેમ ઉર્દૂ લિપિમાં લખતા આવ્યા છે, તેમ લખવાના તેમના ઇકનો સ્વીકાર કરેલો છે.

બીજી દુરાવનો વ્યવલારું અમલ કરવાના ઉદ્દેશથી દેવનાગરી લિપિના વાપરની શક્યતા કેટલી છે તે શાધી કાઢવાને, અને દેવનાગરી લિપિને લખવામાં વધારે સહેલી, અને આજને છે એટલા અક્ષરોથી જે ઉત્ત્યારો થઈ શકતા નથી તે ઉત્ત્યારેને માટેના અક્ષરો જીમેરીને વધારે સંપૂર્ણ અનાવવા માટે, જે ફેરફારો ને વધારા કરવાના જરૂરી લાગે તે કરવા માટે, કાકાસાહેંગ કાલેલકરના પ્રમુખપદ નીચે એક સમિતિ નીમવામાં આવેલી છે.

જે આંતરમાંત્રીય સંઘેચો વધવાના હોય અને પ્રાતો પ્રાતો વચ્ચેના વ્યવહારનું વાહન હિંદી અનવાની હોય, તો આ જાતનો ફેરફાર આવશ્યક છે. જેમણે હિંદી સાહિત્ય સંમેલનના ધેય પર સહી કરી છે, તેમણે બીજે ભાગ તો પચીસ વરસથી સ્વીકાર્યો છે. લિપિની ચર્ચા ધર્ણી વાર થઈ છે, પણ એનો ઉકેલ આણવાનો ભારે પ્રયત્ન કરી થયો નથી. અને છતાં આ દુરાવના પહેલા ભાગમાંથી બીજે આપોઆપ ફુલિત થતો હેખાય છે. એથી હિંદુસ્તાનની બીજી ભાષાઓ શીખવાનું અતિશય સાદું ને સહેલું થઈ જય છે. બંગાળીમાં લખેલી રવીદ્રાનથની ‘ગીતાંજલિ’ને બંગાળીઓ સિવાય બીજું કોઈ વાંચી શકતું નથી; તે જ્યારે દેવનાગરી લિપિમાં છપાય ત્યારે તેનો આસ્વાદ સૌ લઈ શકે છે. એમાં સંસ્કૃતમાંથી આવેલા ધર્ણા શણ્ણો છે તે બીજા પ્રાતના લોડો સહેલાઈથી સમજી શકે. આ કથન સાચું છે કે નહિ એની કસોઈ ગમે તે માણસ કરી શકે છે. આપણે ભવિષ્યની પેઢીઓ પર જુદી જુદી લિપિઓ શીખવાનો નકારો બોને ન નાંખવો જોઈએ. તામિલ, તેલગુ, મલયાણી, કાન્ડી, જિડિયા અને બંગાળી શીખવા ધર્યાછનારને જ લિપિ શીખવાની ફરજ પાડવી એ કૂરતા છે. મુસલમાન ભાઈઓ એમનાં લખાણો દારા શું કહે છે ને કરે છે એ તેને જાણું હોય તો ઉર્દૂ લિપિ શીખવી પડે એ તો જુદી મેં સ્વહેશ અથવા મનુષ્યજ્ઞતિના પ્રેમીને માટે

કાર્ય અહુ મોટો કાર્યક્રમ નથી બતાવ્યો. આજે જુદી જુદી લિપિઓરપી અલેખ દીવાળે બણી રહેલી છે, તેણે અન્ય ભારતીય ભાષાઓ શીખવાનું અને બીજા પ્રાતોને માટે હિંદી શીખવાનું કામ વિના કરણું અવસ્થું કરી મુક્કું છે. કાકાસાહેબની સમિતિનું કામ એ રહેશે કે, એક બાજુ આ સુધારાની તરફે જુમાં લોકમત કેળવવો, અને બીજી બાજુ, હિંદી કે પ્રાતિક ભાષાઓ શીખવા ધ્રયણારનાં સમય ને શક્તિતરી, દેવનાગરી લિપિ જ બધી ભાષાઓ માટે વાપરવાથી, કેટલી બચત થાય છે, એ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ કરી બતાવવી. કોઈ એમ ન માની એસે કે આ સુધારાથી પ્રાતિક ભાષાઓનું મહત્વ ઘટશે. યુરોપની અનેક ભાષાઓને માટે એક જ લિપિનો સ્વીકાર કરવાથી તેના પ્રાતોની વચ્ચેનો સંસર્ગ જેમ સહેલો બન્યો, તેમ આપણે ત્યાં પણ એક લિપિ દ્વારા કરવાથી પ્રાતિક ભાષાઓ સમૃદ્ધ જ થશે.

૬૦ બં૦, ૫-૫-'૩૫

## ૧૬. અભિલ ભારતીય સાહિત્ય પરિષહ

૧

[આ પરિષહનો ઉદ્દેશ હિંદના જુદા જુદા પ્રાતો વચ્ચે એકમેકમાં રાંસકારિક અને જાહીયિક સંબંધો વધારવાનો છે; અને એ સંબંધો એવા નહિ કે જેની અસર પુસ્તક લખનાર કેટલાક ગણ્યતર લોકોમાં જ પૂરી થઈ જય, પરંતુ તે અસર જિત્ત જિત્ત પ્રાતોની આભીષુ જનતામાં પણ પહોંચની જોઈએ.

નાગપુરમાં પરિષહની પહેલી બેઠકના પ્રસૂઅસ્થાનેથી આપેલા લેખિત વ્યાખ્યાનમાંથી.]

“વિદ્વાન લોગ એક ફૂસરેકે સાહિત્યકા કુછ જ્ઞાન પાવે, ધતને હી સે હુમેં સંતોષ હેઠેકા નહીં હૈ. હુમેં તો હેઠાતી સાહિત્યકી ભી દરકાર હૈ ઔર દેખાતિયોમેં આધુનિક સાહિત્યકે પ્રચારકી. શરમકી બાત હૈ કે ચૈતન્યકી પ્રસાદી ભારતવર્ષકે સારે ભાષા-ભાષિયોંડા અગ્રાધ્ય હૈ. તિરુવેલ્લુવરકા નામ તક શાયદ હમ સખ નહીં જનતે હોંગે. ઉત્તર ભારતકી જનતા તો ઉસ સંતકા નામ જનતી હી નહીં. ઉસને થોડે શખ્દોમેં જૈસા જ્ઞાન હિયા હૈ વૈસા બહુત કમ સંત લોગ કર સકે હું. ધસ આરેમેં ધસ વખત તો તુકારામકા હી દૂસરા નામ મેરે ખ્યાલમેં આતા હૈ.

“ અગર હમ સારે હિંદુસ્તાનકે સાહિત્યકે વિશાળ ક્ષેત્રમાં પ્રવેશ કરેં તો કુચા ઉસકી કુછ સીમા—મર્યાદા હોની ચાહિયે ? મેરી દાખિયેં તો અવસ્થા હોની ચાહિયે. મુજે પુસ્તકોંકાં સંખ્યા ખઢાનેકા મોહ કબી નહીં રહા હૈ. પ્રત્યેક પ્રાન્તકી ભાષામેં લિખ્યો ઔર છૂપી પ્રત્યેક પુસ્તકકા પરિચય દૂસરી સખ ભાષામેં હોના મેં આવસ્યક નહીં માનતા હું. ચૈસા પ્રયત્ન યદિ સંલઘ ભી હો તો ઉસે મેં હાનિકર સમજતા હું. જો સાહિત્ય એકચકા, નીતિકા, શૌયાદિ ગુણોંકા, વિજ્ઞાનકા પોષક હૈ, ઉસકા પ્રચાર પ્રત્યેક પ્રાન્તમેં હોના આવસ્યક ઔર લાભજાયક હૈ.

“ આજકલ શૃંગારયુક્ત અશ્વલીલ સાહિત્યકી ખાટ સખ પ્રાન્તોમેં આ રહી હૈ. ડોઈ તો યાંત્રણ તક કહેતે હૈ કે એક શૃંગારકો છોડ કર ઔર ડોઈ રસ હૈ હી નહીં. શૃંગાર રસકો ખઢાનેક કારણું એસે સજાજન દૂસરોકા ‘ત્યાગી’ કહ કર ઉનકી ઉપેક્ષા ઔર ઉભાસ કરતે હૈન. જો સખ ચીજોંકા ત્યાગ કર એહતે હૈ વે ભી રસકા તો ત્યાગ નહીં કર પાતે. કિસી ન કિસી પ્રકારકે રસસે હમ સખ ભરે હૈન. દાદાભાઈને દેશકે લિયે સખ કુછ છોડા થા; વે તો બડે રસિક થે. દેશસેવા હી ઉન્હોને અપના રસ બના રક્ખા થા. ઉસીમેં ઉન્હેં પ્રસન્નતા મિલતી થી. ચૈતન્યકા રસાલીન કહેના રસકો હી નહીં જનના હૈ. નરસિંહ મેહતાને અપનેકા લોગી બતાયા હૈ, યધારી વે ગુજરાતકે લક્ષ્મિ-શિરોમણિ થે. આપકો ન અખરે તો મૈં તો યાંત્રણ તક કહુંગા કી મૈં શૃંગાર રસકો તુચ્છ રસ સમજતા હું; જખ ઉસમેં અશ્વલીલતા આતી હૈ તથ ઉસે સર્વથા ત્યાજય માનતા હું. યદિ મેરી ચલે તો મૈં છસ સંસ્થામેં એસે રસકો ત્યાજય મનવા હું. છસી તરહ કૌમી લૈદોકા, ધર્માન્ધતકો તથા પ્રજામેં અથવા વ્યક્તિયોમેં વૈમનસ્યકા જો સાહિત્ય ખડાતા હૈ ઉસકા ભી ત્યાગ હોના આવસ્યક હૈ.

“ યહ અર્થ કિસે કિયા જાય ? મુન્દીજી ઔર કાકાસાહભને હમારા ભાર્ગ એક હદ તક સાઝ કર રક્ખા હૈ. વ્યાપક સાહિત્યકા પ્રચાર વ્યાપક ભાષામેં હી હો સકતા હૈ. એસી ભાષા અન્ય ભાષાકી અપેક્ષા હિંદી-હિંદુસ્તાની હી હૈ. હિંદીકા હિંદુસ્તાની કહનેકા મતદાય યહ હૈ કે ઉસ ભાષામેં ફારસી મુહાવરેક શાખાઓંકા ત્યાગ ન કિયા જાવે.

“ અંગ્રેજ ભાષા કબી સખ પ્રાન્તોકે લિયે વાહન ( યા માધ્યમ ) નહીં હો સકતી. યદિ હમ સચ્ચમુચ હિંદુસ્તાનકે સાહિત્યકી વૃદ્ધ ચાહતે હોય, લિખ લિખ

ભાષાઓમેં જે રલ છિપે પડે હોએ, ઉનકા પ્રચાર ભારતવર્ષું કરોડોં મનુષ્યોમેં કરના ચાહતે હોએ, તો હમ હિંદુસ્તાનીકા મારફત હી કર સકતે હોએ.

૬૦ બાંં, ૧૭-૫-'૩૬

૨

[ મદાસ, ભારતીય સાહિત્ય પરિષદની ભીજુ એકના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણુમાંથી ]

આ પરિષદનું ધ્યેય સર્વ ગ્રાંતિક સાહિત્યોમાંથી રત્નો વીણી લેગાં કરીને હિંદી ભાષા મારફતે પ્રજાને પહોંચાડવાનું છે. એને સારુ હું તમને એક વિનંતી કરવા છાયું છું. દરેક જણે પોતાની જન્મભાષા તો સરસ રીતે જાળવી જ જોઈએ, અને હિંદી મારફતે ભીજુ દેશી ભાષાઓના મલન સાહિત્યનો પરિચય પણ કરવો જોઈએ. પણ આ પરિષદનું ધ્યેય આપણા લોકોમાં ભીજી ગ્રાંતિકા ભાષાઓ શીખવાની છાયા જગત કરવાનું છે. દાખલા તરીકે, ગુજરાતીઓએ તામિલ શીખવી જોઈએ, અંગાળીઓએ ગુજરાતી શીખવી જોઈએ, વગેરે. હું તમને અનુભવ પરથી કહું છું કે, ભીજુ દેશી ભાષા શીખવી એ જરાયે અધરું નથી; પણ એને માટે બધી ભાષાઓ એક જ લિપિમાં લખાતી થાય એ બહુ આવસ્યક છે. તામિલનાડુમાં એ કામ અધરું નથી, કેમ કે આ સાદી હકીકત જ જોઈએ. આપણી પ્રગતના નેવું ઉપરાંત ટકા નિરક્ષર છે. એમને આપણે નવેસર એકડો ધૂંઠાવવાનો છે. તારે એમને આપણે એક જ લિપિ મારફતે અક્ષરજાન આપીને આરંભ કેમ ન કરીએ? યુરોપના લોકોએ એક લિપિનો પ્રયત્ન કરીને તેમાં પૂરી સફળતા મેળવી છે. કેટલાક લોકો એટલે સુધી કહે છે કે, આપણે યુરોપ પાસેથી રોમન લિપિ લઈને આપણે ત્યાં દાખલ કરવી જોઈએ. ધણા વાદવિવાદ પદ્ધી એવો એકમત દેખાય છે કે, રાજ્યલિપિ ભીજુ કોઈ નહિ પણ દેવનાગરી જ થઈ શકે. ઉર્દૂને એની હરીકુ ગણુવામાં આવે છે. પણ હું માનું છું કે, ઉર્દૂ કે રોમન એકમાં દેવનાગરીના જેણી સંગૂર્ણતા અને ઉચ્ચારણુશક્તિ રહેલી નથી. તમારી ગ્રાંતિક ભાષાઓની સામે હું કંઈ નથી કહેતો. તામિલ, તેલગુ, મલયાળમ અને કન્નડ તો કાયમ રહેણી જ જોઈએ અને રહેશે પણ ખરી. પણ આ પ્રદેશમાં નિરક્ષર માણસોને આ ભાષાઓ દેવનાગરી લિપિ દ્વારા તમે કેમ ન શીખવો? આપણે જે રાજ્યએ એકત્તા સાધવા માગીએ છીએ તેને માટે દેવનાગરીનો સ્વીકાર કરવો અતિ આવસ્યક છે. આમાં માત્ર આપણાં ગ્રાંતિક અલિમાન અને સંકુચિત વૃત્તિ છેછવાનો જ સવાલ રહેલો

છે, અનુભ જરાગે મુખીમત નથી. તામિક કે ઉર્દૂ લિપિ મને ગમતી નથી એવું નથી. હું એ બને જાણું છું. પણ માનુભુમિની સેવા, જેની પાછળ મારા જીવનની પ્રત્યેક ક્ષણું વપરાઈ રહી છે અને જેના વિના મારે જીવનું અશક્ય થઈ જાય, તે કરતાં કરતાં હું શીખ્યો છું કે, આપણે આપણી પ્રજા પરના બિનજરરી ઘોંઝાઓ ઓછા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધણી લિપિન્યો શીખવાનો ઘોંઝે અનાવસ્યક અને સહેજે ટળા શકે એવો છે. એટલે સર્વ પ્રત્યેના સાક્ષરોને મારી વિનંતી છે કે, તેઓ આ વિષેના મતબેદો દૂર કરે, અને આ અતિ અગત્યના વિષયમાં એકમત થાય. ત્યારે જ ભારતીય સાહિત્ય પરિષદના ક્રમને સંશોધના મળી શકે.

\*

\*

\*

આજે આપણા સાહિત્યમાં યહું થોડા લોકા, મૂહીભર ભણેલા લોકા જ રસ લે છે. ભણેલામાં પણ સાહિત્યમાં ખરેખરો રસ લેનાર તો બહુ જ ઓછા હોય છે. ગામડાંમાં તો આપણે મિલકુલ પ્રવેશ જ કર્યો નથી. સેવાગ્રામમાં એક ટકા જોઈલા માણુસો પણ સાહિત્ય વાંચી શકતા નથી. અમારા રાતના વર્ગમાં છાણું વંચાતું સાંભળતા પૂરા જ માણુસો પણ નિયમિત આવતા નથી. આ નિરક્ષરતા દૂર કરવાનું ભગીરથ કામ આપણે કરું રહ્યું છે. એ આપણાથી મૂહીભર માણુસો વડે શા રીતે થઈ શકશે? એટલે મારે તમારો સૌનો સાથ જોઈએ છે. . . .

મને સાહિત્યને ખાતર સાહિત્યનો રોાખ નથી. માણુસોને અક્ષરરસાન આપવું જ જોઈએ એવું પણ હું માનતો નથી. બુદ્ધિના વિકાસને માટેનાં ધણું સાધનોમાં અક્ષરરસાન એક હોવું જોઈએ ખરું, પણ ભૂતકાળમાં આપણે એવા પણ બુદ્ધિના મહાપ્રભાવવાળા માણુસો જોયા છે જે સાવ નિરક્ષર હતા. એટલે જ પરિષહે માત્ર અતિ શુદ્ધ ને આરોગ્યપ્રદ એવા સાહિત્યની સેવા કરવાની પોતાની ભર્યાદી આંકડી છે. એમાં જો તમારો હાર્દિક સહકાર ન હોય અને તમે તમારી ભાગ્યાઓમાંથી યોગ્ય સાહિત્ય બેગું કરી આપવા તૈયાર ન હો, તો આ કામ કેમ બની શકે?

## ૧૭. રાજ્યભાષા હિંદી-હિનુસ્તાની

[ બેંગલોરમાં હિંદી અધ્યાત્મનસમારંભને પ્રસંગે આપેલા પ્રવચનમાંથી ]

આજે જેમને પદ્ધતી ને પ્રમાણુપત્ર મળ્યાં એમને હું ધ્યયવાદ આપું છું, ને આશા રાખું છું કે, તેઓ રોજ પોતાનો અભ્યાસ ચાલુ રાખી પોતાના શાનમાં શૃદ્ધિ કરતાં રહેશે. સામાન્ય શાળા કોલેજેમાં ભાગું જનારા પોતાની ‘કસ્ટિયર’ માટે ત્યાં જાય છે, પરીક્ષાને માટે ભાગે છે, અને પરીક્ષાનો ઓરડો છોડ્યો કે તેની સાથે તેમની ઓપરીઓ. અને માંબલાં ભાગું અધ્યુતર અધું ભૂલી આવે છે. ધણ્ય શાન કરતાં પદ્ધતી માટે વધારે પરવા કરતારા હોય છે. પરંતુ આજ જેમને અહીં પદ્ધતી મળી છે તેમણે પદ્ધતિને ખાતર તે લીધી નથી. તેનું સાદું કારણ એ છે કે, હિંદી પ્રચાર સભા નોકરીઓ મેળવી આપવાના ઉદ્દેશવાળા સંસ્થા નથી. તમને મળેલી આ પદ્ધતી તમારા શિક્ષક તમને આપેલા શાનના ચિહ્ન માત્ર તરીકે છે. અલખતા, એ તદ્દન શક્ય છે કે, તમારામાંથી થોડાક જણ આ હિંદી શાનમાંથી કમાણી કરી શકો; પણ જરૂર અમારો એ ઉદ્દેશ નથી.

આજનાં સઝળ વિદ્યાર્થીઓમાં મોટા લાગની બહેનો છે એ. જોઈ મને આનંદ થાય છે. હિંદીપ્રચાર અને ભારતમાતાના ઉજગળણ લાવિષ્યની એ નિશાની છે, કેમ કે મારી દઢ માન્યતા છે કે, હિનુસ્તાનની મુક્તિ તેની સ્વીએના ત્યાગ અને શાન પર આધાર રાખે છે. સ્વીએની સલાએમાં હું હેમેશ એક વસ્તુ જેર દ્ધનિ કહેતો આવ્યો છું કે, જ્યારે આપણે આપણાં હેવેની કે પ્રાચીન વીર સ્વીપુરુષો વિષે બોલીએ છીએ ત્યારે આપણે સ્વીનું નામ પહેલું મૂકીએ છીએ. જેમ કે સીતારામ, રાધાકૃષ્ણ, નાની કે રામસીતા કે કૃષ્ણરાધા. આ રિવાજ રહેસ્યહીન નથી. આપણે ત્યાં સ્વીનું સંભાન થતું અને એમનાં કાર્ય તથા લાયકાતની આસ કદર કરતી. આ જૂતા રિવાજને આપણે અકષરશા: અને અર્થશા: ચાલુ રાખવો જોઈએ.

આ પ્રસંગે હું હિંદી-હિનુસ્તાની જ રાજ્યભાષા શા માટે એનાં થોડાક રૂપણ કારણો જણાવીશ. જ્યાં સુધી તમે કણૂટકમાં રહો છો. અને એની બહાર તમારી નજર નથી, ત્યાં સુધી કન્નાંનું શાન તમારે માટે અસ છે. પણ તમારા એકાદ ગામડામાં જોશો તોય જણુંશે કે, તમારી નજર અને દાયિમર્યાદા વિસ્તર્યાં છે. તમે કણૂટકની નજરે નહિ પણ હિંદી નજરે વિચાર કરતાં થયાં છો. કણૂટક બહાર બનતા અનાવોમાં તમને રસ પડે છો. પરંતુ આ રસ, જો

વાણીનું સર્વસાધારણ માધ્યમ કે વાહન ન હોય તો, બહુ આગળ ન જઈ શકે. સિંધ કે યુક્ત પ્રાંતના લોક જોકે કણ્ણાટકી ડેવી રીતે સંબંધ બાંધી કે સંભાળી શકવાનો? આપણા કેટલાક જણ માનતા ને હજુ કદાચ માનતા હશે કે, અંગ્રેજ આવું માધ્યમ થઈ શકે. જો આપણા લાણેલાગણેલા થોડાક હજાર માણસોનો જ પ્રશ્ન હોત તો તો એ જરૂર ચાલત. પણ મને ખાતરી છે કે, એટલાથી આપણામાંથી કાંઈ ને સંતોષ નહિ થાય. હું ને તમે ચાહીએ છીએ કે કરોડો લોકો આંતરપ્રાંતીય સંબંધ આપે. અને તે તો, અંગ્રેજ દ્વારા શક્ય હોય તોય, પેઢીઓ સુધી પણ નથી થઈ શકવાનું, એ ઉઘાડી વાત છે. તે અધારે અંગ્રેજ શા માટે શીખવું જોઈ એ એતું કંઠું કારણ નથી; અને કભાવાનું એ ચોક્કસ ને સંગીન સાધન તો જરૂર નથી જ. આવી જતની એની કાંઈ કિંમત કદાચ હશે તોય તે, જેમ જેમ વધારે લોક તે ભાષણે તેમ તેમ, ધૃબાની, વળી, અંગ્રેજ ભાષાનામાં જેવી મુસ્કેલી છે તેવી હિંદી-હિંદુસ્તાની ભાષાનામાં જરાયે નથી. અંગ્રેજ ભાષણાં એટલી વાર લાગવાની એટલી એમાં કદી લાગવાની નથી. એવી ગણતરી છે કે, હિંદી-હિંદુસ્તાની ઓલનાર ને સમજનાર હિંદુ મુસલમાનેની સંખ્યા ૨૦ કરોડથી વધારે છે. શું ૧ કરોડ ૧૦ લાખ કણ્ણાટકી સ્વપુરુષોને તેમનાં પોતાનાં ૨૦ કરોડ ભાઈભિલોને જે ભાષા જોવે છે તે શીખવાનું નહિ ગમે? અને તેઓ ખૂબ સહેલાએથી તે શીખી શકે એમ નથી? આ પ્રશ્નનો ઉત્તર હમણાં જ એક બીજાએ મારું ખાસ ધ્યાન એંચ્યું તે પરથી ભળી રહે છે. તમે બધાંએ લેડી રામના હિંદી વ્યાખ્યાનનો કન્નડી અનુવાદ સાંભળ્યો. તેમાં એ વસ્તુ પર તમારું ધ્યાન આકર્ષિયા વગર નહિ રહ્યું હોય કે, લેડી રામના વણું હિંદી શખ્ષે ભાષાંતરમાં સીધા લેવાયા હતા — જેવા કે, પ્રેમ, પ્રેમી, સંધ, સલા, અધ્યક્ષ, પદ, અનંત, ભક્તિ, સ્વાગત, અધ્યક્ષતા, સંમેલન. આ બધા શખ્ષે હિંદી કન્નડી બેઉમાં છે. હવે ધારો કે, કાંઈ આ ભાષણું અંગ્રેજ કરતો હોત તો તે આમાનો એક શખ્ષ વાપરી શકત? કદી નહિ. આ એકએક શખ્ષેના અંગ્રેજ પર્યાય ઓતાએને માટે નવાજ હોત. એટલે જ્યારે આપણા કેટલાક કણ્ણાટકી મિત્રો કહે છે કે હિંદી એમને અધરી લાગે છે, ત્યારે મને હસવું આવે છે; પણ ગુરસો અને અધીરાઈ પણ એણ્ણાં નથી આવતાં. રોજ થોડાક કલાકના ખાંતપૂર્વક અભ્યાસથી મહિનાનું કામ એ છે, એ મારી ખાતરી છે. મને ૧૭ વર્ષ થયાં, એટલે હવે પાકું પાન ગણ્ણાડિં. પરંતુ કન્નડી અનુવાદ સાંભળતો હતો ત્યારે, તમે ખાતરીથી માનજો કે,

મને લાગ્યું કે જો રોજ થોડા કલાક અભ્યાસ કરવા લાગું તો કન્નડી શીખી જતાં મને આહ દાઢાથી વધારે ન લાગે. નામદાર શાસ્ત્રી કે મારા જેવા અધ્યુંક ડાન લોકને છોડો તો બાકીના તમે ખધા સાવ જુવાન છો. તમારી પાસે શું રોજના ચાર કલાક એક મહિના સુધી હિંદી શીખવા પાણી દેવાની શક્તિ નથી? ૨૦ કરોડ જેટલા તમારા જ દેશાંધવોની જોડે સંબંધ બાંધવા એટલો સમય આપવો એ શું તમને અહુ લાગે છે? હવે માનો કે, તમારામાંથી જે અંગ્રેજ નથી જાણું તે એ શીખવાનો દરાવ કરો છો. તમે માનો છો કે, રોજ ચાર કલાકથી મહિનામાં તમે તે શીખી શકોશો? કદી નહિ. હિંદી શીખવી એ આવી રમત વાત છે તેનું કારણ એ છે કે, હિંદુના દિંહુચો જે ભાષાઓ બોલે છે — દાખિણાની ચાર ભાષાઓ સુખ્યાં — તે ખધીમાં ધણા સંસ્કૃત શખ્યાં છે. જૂના કાળમાં ઉત્તર દાખિણાનું વચ્ચે સંબંધ સંસ્કૃત દ્વારા ચાલતો એ ધતિભાસની વાત છે. આજે પણ દાખિણાના શાસ્ત્રીઓ ઉત્તરના શાસ્ત્રીઓ જોડે સંસ્કૃતમાં વાર્તાવાપ કરે છે. અનેક પ્રાંતીય ભાષાઓમાં ફરક મુખ્યત્વે વ્યાકરણુનો છે. ઉત્તર ભારતીય ભાષાઓનું તો વ્યાકરણ પણ સરખું છે. દાખિણ ભારતીય ભાષાઓનું વ્યાકરણ અદ્યતા લિન્ન છે, અને તેઓ સંસ્કૃતની અસર તળે આવી તે પહેલાં તેમના શખ્યાં પણ લિન્ન હતા. પણ હવે એમણે પણ ધણા સંસ્કૃત શખ્યાં સ્વીકાર્યાં છે; તે એટલે સુધી કે, હું દાખિણામાં કરું છું તારે એની ચારે ભાષામાં જે બોલાય એનો સાર પડી લેતાં મને મુશ્કેલી નથી પડતી.

હવે આપણું મુસલમાન મિત્રોની વાત પર આવું. પોતપોતાના પ્રાંતીની ભાષા તો જણે તેઓ સ્વાલ્પાવિક રીતે જણેજો; ઉપરાંત તેઓ ઉર્દૂ જણે. હિંદી અને હિંદુસ્તાની કે ઉર્દૂ વચ્ચે કરોજ જ ફરક નથી. એજિનું વ્યાકરણ એકસરખું છે; લિપિને કારણે એજમાં જે ફરક છે તે છે; અને એનો વિચાર કરતાં જણાય છે કે, હિંદી, હિંદુસ્તાની અને ઉર્દૂ એ ત્રણે શખ્યાં એક જ ભાષાના વાચ્યક છે. જો આ ભાષાઓના શખ્યાલોણા તરફ જોઈએ તો દેખાય છે કે ધણાખરા તેમના શખ્યાં એક છે. એટલે એક લિપિનો પ્રશ્ન, જે આપોઆપ ભડકલી જશે, તે આહ કરીએ તો મુસલમાનોને કશી મુશ્કેલી આમાં નથી.

એટલે, ફરી પાણી મારા શરીરના મુદ્દા ઉપર આવતાં, જો તમારી દાખિયાદી ઉત્તરમાં શ્રીનગરથી દાખિણામાં કન્યાકુમારી સુધી અને પદ્મિમભાં કરાંચીથી પૂર્વમાં હિસુગઠ સુધી વિસ્તરતી હોય, — ને એટલી એ વિસ્તરણી જોઈએ પણ ખરી, — તો તેને માટે તમારી પાસે હિંદી સિવાય ખીંચું કાંઈ નથી. મેં તમને બતાવ્યું

કે, અંગે આપણી રાજ્યભાષા થઈ શકે એમ નથી. મને અંગે સામે આણુગમો કરો. નથી. થોડાક પંદિતો માટે અંગેણું જ્ઞાન જરૂરનું છે; આંતર-રાજ્યીય સંબંધી સારુ અને પદ્ધિમના વિજ્ઞાનના જ્ઞાન સારુ એતી જરૂર છે. પરતુ એનાથી જે સ્થાન લઈ ન શકાય એવું જ્યારે એને આપવામાં આવે છે ત્યારે મને હુંઘ લાગે છે. મને શંકા નથી કે એવો પ્રયત્ન અફૂળ જ જય. સૌ પોતપોતાને સ્થાને જ શોભે.

એક નાહકનો ડર તમારા મગજમાં છે તે કાઢી નાખવા હું ઈચ્છાં છું. કન્ફરને ભોગે હિંદી શીખવવાની છે શું? તે કન્ફરને ધકેલી કાઢશો શું? જિલ્લો હું દાવો કરીને કહું છું કે, જેમ જેમ આપણે વધારે હિંદીપ્રયાર કરીશું તેમ તેમ આપણી પ્રાંતીય ભાષાઓના અભ્યાસને આપણે વિરોધ ઉત્તેજન આપીશું, એટાં જ નહિ એની શક્તિ પણ વધારીશું. અને આ હું મારા જુદા જુદા આતોના અનુભવથી કહું છું.

લિપિ સંબંધી એ શાખા : હું દક્ષિણ આધિકામાં હતો ત્યારે પણ માનતો કે, સંસ્કૃતમાંથી નીકળેલી બધી ભાષાઓની લિપિ દેવનાગરી હેઠળી જોઈએ; અને મને ખાતરી છે, દ્રાવિડી ભાષાઓ પણ દેવનાગરી માર્ગને સહેલાઈથી શીખી શકાય. તામિલ, તેનું અને થોડા દ્વિવસ કાન્દી, મતયાલમ પણ તેની તેની લિપિ દ્વારા ભાણુવાનો પ્રયત્ન મેં કર્યો છે. હું તમને કહું કે, જ્યાં હું જોઈ શકતો હતો કે, જે ચારે ભાષાની એક દેવનાગરી જ લિપિ હોત તો તે બધી હું જરા વારમાં શીખી શકત, ત્યાં આગળ મારે ચાર ચાર લિપિઓ શીખવી પડે, તેથી હું તો ડરનો માર્યો ગભરાઈ જ ગયો. મારા જેવા ચારે ભાષા ભાણુવાની હોંશવળાને માટે એ ડરદો બધો ભારે ખોજે! અને દક્ષિણનિવારિઓ માટે પોતાની જન્મભાષા ઉપરાંત બીજી ત્રણ ભાષાઓ શીખવા દેવનાગરી લિપિ સારામાં સારી સવડવાળી થઈ પડે, એ જણુદ્વારા કરી દલીલની જરૂર છે ખરી? હિંદી રાજ્યભાષાના પ્રશ્ન સાથે લિપિનો પ્રશ્ન બેળવી હોવો ન જોઈએ. મેં એનો જે ઉલ્લેખ કર્યો છે તે હિંદની બધી ભાષાઓ ભાણુવા ધ્યાનનારની મુશ્કેલી બતાવવા પૂરતો જ.

૬૦ ૫૦૨, ૫-૭-૩૬

[ મદાસ હિંદી પહોંચાન સમારંભમાં આપેલા માંગળિક ભાષણુમાંથી ]

..... મને થયું, ગુજરાતી તો રાજ્યભાષા ન જ થઈ શકે. દેશની વસ્તીના ઉંમા ભાગથી વધારે લોકો એ ભાષા બોલતા નથી. એ ભાષામાં મને

તુલસી-રામાણુ શ્રી રિતે ભગે ? પછી મને થયું, મરાડિનું કેમ ? મરાડી ભાષા વિષે મને અનુરાગ છે. મરાડી બોલનાર ગ્રનભાંથી મને ડેટલાયે સરસ સાથીએ મળેલા છે. મહારાધ્રીએમાં જે કાર્યશક્તિ, ત્યાગ અને વિદ્વત્તા રહેલાં છે તેની મને ખબર છે. એ ભાષા લોકમાન્ય ટિપ્પણી અહુ જ સફળતાથી વાપરીને સમૃદ્ધ અનાવી છે. છતાં એ આપણી રાજ્યકાલાખાન થઈ શકે એમ મને લાગ્યું. હું આ પ્રમાણે મારા મન સાથે દીલ કરતો હતો ત્યારે હિંદી ભાષા બોલનાર લોકોની સંઘા ડેટલી છે એની મને ખબર નહોતી, અને છતાં મને મનમાં જીવી આવ્યું કે રાજ્યકાલાખા તો હિંદી જ થઈ શકે, બીજી ડોઈ નહિ. બંગાળીની સુંદરતા હું સમજ શકતો નહોતો ? સમજ શકતો હતો. અને ચૈતન્ય, રામભોડન રાય, રામકૃષ્ણ, વિવેકાનંદ, અને રવીન્દ્રનાથ ઢાકુરની ભાષા તરીકે મારા મનમાં એને વિષે ભારે માન હતું. અને છતાં મને લાગ્યું કે, બંગાળીને આપણે પ્રાંત પ્રાંત વચ્ચેના વ્યવદારની ભાષા ન અનાવી શકોયે. પછી પ્રશ્ન થયો કે, દક્ષિણ ભારતની ડોઈ ભાષા રાજ્યકાલાખા થઈ શકે અરી ? મને એ ભાષાએતનું છેક જ અજ્ઞાન હતું એમ નહિ. . . પણ તામિલ કે દક્ષિણ ભારતની બીજી ડોઈ ભાષા રાજ્યકાલાખા શ્રી રિતે થઈ શકે ? હિંદી, જેને પાણીથી હિંદુસ્તાની કે ઉર્દૂ એ બીજે નામે ઓળખવામાં આવી છે, તે જ રાજ્યકાલાખા થઈ શકે એમ હતું, અને રાજ્યકાલાખા હતી પણ એ જ.

૬૦ ખં. ૪-૪-'૩૭

## ૧૮. મહાસભા અને રાજ્યકાલાખા।

૧

[મદાસમાં મળેલી હિંદી સાહિત્ય સમેલનની એકમાં, રાષ્ટ્રીય મહાસભાને તેજું બધું કામકાજ હિંદી-હિંદુસ્તાનીમાં જ ચલાવવાની ભલામણ ફરનારો કે ફરાવ થયો હતો\* તેના પર ગાંધીજીએ કરેલું ભાષણું]

\* એ ફરાવ આ પ્રમાણે હતો :—

“આ સમેલન હિંદી રાષ્ટ્રીય મહાસભાની કાર્યવાહક સમિતિને વિનાતી કરે છે કે, હવે પછી મહાસભા, મહાસમિતિ, અને કાર્યવાહક સમિતિના કામકાજમાં અંગેલ ન વાપરતાં તેને બદલે હિંદી-હિંદુસ્તાની જ વાપરવાનો ફરાવ કરવામાં આવે; ‘માત્ર કે લોકો હિંદી-હિંદુસ્તાનીમાં પોતાના ભાવ પૂરેપૂરા પ્રગટ ન કરી શકે તેમને અંગેલમાં

આપણે હિંદીને રાજ્યકાયા તરીકે સ્વીકારવાની તરફેણુમાં હરાવો પસાર કર્યા કરીએ, જ્તાં ને મહાસલા હમેશાની પેટ પોતાનું કામ ચલાવ્યાં કરે, તો આપણું કામ કીડીને વેગે જ આગળ વધે. આ હરાવમાં મહાસલાને પ્રાંત પ્રાંત વર્ણને વહેવારની લાખા તરીકે અંગેળુને ન ચાલવા હેવાની વિનંતી કરેલી છે. એમાં કહેણું છે કે, અંગેળુને પ્રાંતિક લાખાઓ કે હિંદી એકનું સ્થાન ન લેવા દ્વારા જોઈએ. અંગેળુએ લોડાની લાખાઓને હાંડી ન કાઢી હોત તો આજે પ્રાંતિક લાખાઓ આશ્ર્ય ઉપજાવે એવી સમૃદ્ધ બની હોત. દ્યંગંડે તેના રાજ્યકાય વ્યવદારની લાખા તરીકે હેચ્યને સ્વીકારી હોત, તો આજે અંગેળ સાહિત્યનું નામ પણ ન હોત. નોર્મનોના વિજય પછી દ્યંગંડમાં હેચ્ય લાખા ચાલતી હતી, પણ પછી ‘શુદ્ધ અંગેળ’ની તરફેણુમાં જુવાળ આવ્યો. એને લીધે આજે આપણે જોઈએ છીએ તે મહાન અંગેળ સાહિત્ય પેદા થયું છે. યાદુથ હુસેન સાહેભે કહ્યું તે સાવ સાચ્યું છે. મુસલમાનોના સંસર્ગની આપણા સંસ્કાર અને સુધારા પર બહુ ભારે અસર પડેલી. એટલે સુધી કે, સ્વઠ પંડિત અધોધ્યાનાથ જેવા માણુસો ફરસી અને અરથીના ખાં બન્યા હતા. એમણે અરથી અને ફરસીના અભ્યાસને જે વખત આપ્યો તે બધો જન્મલાખાને આપ્યો હોત, તો એમણી જન્મલાખાની ભારે પ્રગતિ થાત. તે પછી અંગેળએ અસ્વાકાહિક સ્થાન લીધું, તે આજ લગી ચાલુ રહ્યું છે. યુનિવર્સિટીઓના અધ્યાપકો અંગેળમાં છટાદાર લાખણો કરી શક્યો, પણ પોતાના વિચાર પોતાની જન્મલાખામાં વ્યક્ત નાહીં કરી શકે. સર ચંદ્રશેખર વેંકટ રામનની બધી શોધખોળ એમણે અંગેળમાં લખેલા લોખોમાં પડેલી છે. જેએ અંગેળ નથી જાણુતા તેમને તો એ શોધખોળની કરી જ ખખર પડે એમ નથી. એથી જિલ્લાનું રશયાની સ્થિતિ જુઓ. ૧૯૧૭ માં ત્યાં વિષેલવ થયો તે પહેલાં જ એ લોડાએ બધાં પાછચપુસ્તકો (વિજાનનાં પણ) રશયન લાખામાં જ રચવાનો હરાવ કરેલો. લેનિનના વિષેલવની તૈયારી ખરી રીતે તો એજણે જ કરી. જ્યાં લગી મહાસલા પોતાનું બધું કામકાજ ને ચચ્યાએ.

ખાલવાની છુટ રહે. કાઈ સન્ધ્ય હિંદી-હિંદુસ્તાનીમાં ખાલી ન શકતો હોય અને પોતાની પ્રાંતભાખામાં ખાલવા ધાર્યે, તો તેને તેમ કરવાની છુટ હોવી જોઈએ, અને તેના ભાષણુંના હિંદી-હિંદુસ્તાનીમાં અનુવાદ કરવાની ગોઠવણું કરવી જોઈએ.

“કાઈ માણુસને કાઈ પ્રસંગે પોતાનું કહેણું સભાજનોના અમુક વર્ગને સમનવચ્ચ માટે અંગેળમાં ખાલવાની જરૂર જણાય, તો તેને પ્રમુખની રણ લઈને અંગેળમાં ખાલવાની છુટ હોવી જોઈએ.”

હિંદીમાં ને તેની પ્રાંતિક શાખાઓ પ્રાંતિક ભાષાઓમાં ચલાવવાનો નિર્ધાર ન કરે, ત્યાં લગી આપણે જનસમૂહની જોડે સંસર્ગ બાંધી શકવાના નથી.

આ ફરાવની સાથે જોટલો સંઅંધ હિંદી સાહિત્ય સંમેલનને છે, તેટલો જ ભારતીય સાહિત્ય પરિષદ્દને છે, કેમ કે ભારતીય સાહિત્ય પરિષદ્દનો ઉદ્દેશ પ્રાંતિક ભાષાઓનો વિકાસ સાધવાનો છે; અને જે મહાસભા આ ફરાવ ન સ્વીકારે તો ભારતીય સાહિત્યનો ઉદ્દેશ એટલે અંશે એળે જથું.

હું ભાષાની અંધપૂજા કરું છું એમ નથી. આપણી ભાષાને ભોગે સ્વરાજ મળતું હોય તો હું તે લેવાની ના પાડું એમ નથી; જોક સત્ય અને અહિંસાને ભોગે મળતું હોય તો તે લેવાની ફરગિજ ના પાડું. પણ હું ભાષા વિષે આટલો બધી આગ્રહ રાખું છું તે એટલા માટે કે, તે રાજ્યિય એકતા સાધવાનું એક સંબળ સાધન છે, અને તેની સ્થાપના જોટલી દદ થાય તેટલી આપણી એકતા વિશાળ અને સંગીન બને.

દેરેક માણસે પોતાની જન્મભાષા ઉપરાંત હિંદી અને એક ધીતર પ્રાંતની ભાષા શીખવી જોઈએ એમ હું કહું છું એથી ભડકી નહિ જતા. ભાષાઓ તો સહેલાઈથી શાખી શકાય છે. મેઝસ મૂલરને ૧૪ ભાષા આવડતી હતી. અને હું એક જર્મન યુવતીને આગળું છું, તે જ્યારે પાંચ વરસ પહેલાં આ દેશમાં આવી ત્યારે ૧૧ ભાષા જાણું હતી તે હવે હિંદુસ્તાનની બેગણું ભાષા શીખી ગઈ છે. પણ તમે તો, ડાણુ જાણું કેમ, તમારા મન આગળ એક મોટો છાઉ ભાલો કરો છે ને માની લીધું છે કે, તમારથી હિંદીમાં તમારા વિચાર પ્રગતિ ન કરી શકાય. મહાસભાના બંધારણુમાં ૧૨ વરસ થયો હિંદુસ્તાનને રાજ્યભાષા તરીકે સ્વીકારવામાં આવી છે, જ્તાં આપણે જરાયે પ્રગતિ નથી કરી, એમાં આપણું આગસ રહેલું છે.

યાકુબ હુસેન સાહેબે મને પૂછ્યું કે, “તમે ‘હિંદિહિંદુસ્તાની’ શબ્દનો આટલો આગ્રહ કેમ રાખો છો ને એકલા ‘હિંદુસ્તાની’ શબ્દથી સંતોષ કેમ નથી માનતા ? ” આ આખી વસ્તુની ઉત્પત્તિનો ધીતિહાસ મારે તમને આપવો જોઈએ. છેક ૧૯૧૮માં હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે મેં હિંદી ભાષા બોલનાર સમાજને સુચના કરેલી કે, તેઓ હિંદીની વ્યાખ્યાનો વિચાર કરીને તેમાં ઉર્દૂનો સમાવેશ કરે. ઈરી પાછો ૧૯૩૫માં હું સંમેલનનો પ્રમુખ થયો ત્યારે, ‘જે ભાષા હિંદુ અને મુસ્લિમાન બંને બોલે છે અને જે દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં

લખાય છે તે' એવી 'હિંદી' શાખણી ચોક્કસ વ્યાખ્યા કરવાની એમ કરવામાં મારો હેતુ હિંદીની અંદર મૈલાના શિખલીની પાંડિત્યવાળી ઉર્દૂ તેમ જ પાંડિત શ્યામસુંહરદાસની પાંડિત્યવાળી હિંદી બનેનો સમાવેશ કરવાનો હતો. પછી ભારતીય સાહિત્ય પરિષદ આવી. એ સમેલનની જ એક શાખા છે. મારી સૂચનાથી 'હિંદી' ને બદલે 'હિંદી-હિંદુસ્તાની' એ શાખદ સ્વીકારવામાં આવ્યો. એમાં અધ્યાત્મ હુક સાહેભે મારો સખત વિરોધ કરેલો. પણ એમની સૂચના મારાથી સ્વીકારી શકાય એમ ન હતું. 'હિંદી' શાખદ હિંદી સાહિત્ય સમેલનનો હતો, ને તેની વ્યાખ્યા એમાં ઉર્દૂની સમાસ થાય એવી રીતે કરવાને મેં એમને સમજનેલા; એટલે એ શાખદ હું છોડી હેત તો હું મારા પોતા પર ને સમેલન પર અત્યાર કરત. આપણે યાદ રાખવું જોઈએ કે, 'હિંદી' શાખદ હિંદુઓનો બનાવેલો નથી; મુસ્લિમાનોના આગમન પછી ઉત્તર ભારતના હિંદુઓ ને ભાષા બોલતા ને શીખતા હતા તે ભાષા સૂચવવાને એ શાખદ અનાવવામાં આવેલો. અને હવે જ્યારે હિંદુઓ તેમ જ મુસ્લિમાનો એ ભાષાનાં ને અનેક રૂપાંતરો વાપરે છે તે અધ્યાત્મ સમાવેશ થાય એવી 'હિંદી' શાખણી વ્યાખ્યા કરવામાં આવી છે, ત્યારે શાખદને સારુ આ જવ્યો શે?

તે પછી બીજી એક વસ્તુનો વિચાર કરવાનો રહે છે. દશ્મિણુ ભારતની પ્રાંતિક ભાષાઓનો વિચાર કરીએ તો, તેમને તો સંસ્કૃતપ્રાચ્યુર હિંદી જ ગમશે, કેમ કે સંસ્કૃત શાખદો ને સંસ્કૃત ઉચ્ચારથી તેઓ અત્યારે પણ પરિચિત છે જ જ્યારે હિંદી અને હિંદુસ્તાની કે ઉર્દૂ એકરૂપ થઈ જશે અને ખરેખર હિંદુસ્તાનની રાજ્યભાષા અનશે, અને હિન્મતિહિન તેમાં પ્રાંતિક શાખદનો ઉમેરો થતો જશે, ત્યારે અંગ્રેજીનું શાખદભાગ છે એના કરતાં પણ વધારે સમૃદ્ધ એનું શાખદભાગ થશે. એટલે હવે મને આશા છે કે, હું 'હિંદી-હિંદુસ્તાની' શાખદનો આયા કેમ રાખું છું એ તમે સમજું શકશો.

તે પછી, જેઓ મહાસલામાં એકલી હિંદી-હિંદુસ્તાનીની જ વાપર આલુ થાય એથી ડરે છે, એવાંદોને હું એક નાની સરખી સૂચના કરું. તમે કાઈ હિંદી દૈનિક પત્ર કે સારું પુસ્તક ખરીદી રાખો, રોજ નિયમિત રીતે પાંચ મિનિટ પણ એમાંથી અમુક ભાગ મેરોથી વાચો, જાણુંતાં હિંદી લખાણો. ને ભાષણોમાંથી ફરજ વિષી કાઢો ને તે શુદ્ધ ઉચ્ચારણને સારુ એકલા ઐસીને બોલી જાઓ, રોજ થોડાક હિંદી શાખદોં નવા શીખવાનો નિયમ કરો; તો હું તમને આતરી આપું છું કે, આટલા નિયમિત નિત્યપાઠી તમે છ મહિનામાં,

રમરણુથકિત પર નધારેપડતો એંગે પડ્યા વિના, હિંદી-હિંદુસ્તાનીમાં તમારા વિચાર સારી રીતે પ્રગટ કરતા થઈ શકશો॥

રૂ. ૫૦, ૧૧-૪-'૩૭

૩

[ મહાસભાની કાર્યવાહક સમિતિએ પોતાની નીતિ સ્પષ્ટ કરતો હરાવ ૧૬૩ઠમાં પસાર કરેલો તે અહીં સાથે જ જેવો ઢીક પડશે માની નીચે ઉતાર્યો છે.]

કોન્ગ્રેસની મહાસમિતિની તાજેતરમાં ભરાયેલી સભામાં ડૉ. અશરદે ખાનગી રાહે રળ્યુ કરેલા હિંદુસ્તાની વિષેના હરાવની બાબતમાં કાર્યવાહક સમિતિને અફ્સોસ છે કે, અનેક પ્રકારના સુધારાઓથી થયેલા ગોટાળને લીધે એ હરાવ ડાડી જવા પામ્યો. પણ મહાસભાની જે સ્થિતિ અંધારણું નીચેની કલમમાં વર્ણવવામાં આવી છે તેમાં આ હરાવના ડાડી જવાથી ડેર્ઝ જાતનો ફરક પડતો નથી :

“ કલમ ૧૬ (ક) મહાસભા, મહાસમિતિ અને કાર્યવાહક સમિતિનું કામકાજ સામાન્યપણે હિંદુસ્તાનીમાં ચાલશે. વક્તા હિંદુસ્તાનીમાં એલવા અસમર્થ હોય તો, અથવા તો પ્રમુખ જ્યારે જ્યારે રળ આપે તારે, અંગ્રેજ ભાષા અથવા ડેર્ઝ પ્રાંતિક ભાષાનો ઉપયોગ કરી શકશે. (ખ) પ્રાંતિક સમિતિનું કામકાજ સામાન્યપણે તે તે પ્રાંતની ભાષામાં ચલાવવામાં આવશે. હિંદુસ્તાનીનો પણ ઉપયોગ કરી શકશે.”

મહાસભાની ચાલતી આવેલી પ્રથા અનુસાર, હિંદુસ્તાની એ ભાષા જે જે ઉત્તર હિંદ્ના લોડા વાપરે છે અને જે દેવનાગરી અથવા ડર્ઝ લિપિમાં લખાય છે.

વસ્તુત: મહાસભાની એ નીતિ રહેલી જ છે કે, તમામ સભાઓમાં અને મહાસભા-સમિતિઓના કામકાજમાં હિંદુસ્તાનીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. કાર્યવાહક સમિતિ આશા રાખે છે કે, આ પરસની આખર સુધીમાં મહાસભાવાદીઓ રાષ્ટ્રભાષામાં એલવાની તૈયારી કરી લેશે, જેથી મહાસભાની સભાઓમાં ડે મહાસભા-સમિતિઓનાં કાર્યાલયમાં આંતરપ્રાંતીય વ્યવહારને સારુ તે પછી અંગ્રેજનો ઉપયોગ કરવાની જરૂર ન રહે. માત્ર પ્રમુખ જ્યારે જ્યારે આવશ્યક હોય તારે અંગ્રેજનો ઉપયોગ કરવાનગી આપી શકશે.

રૂ. ૫૦, ૮-૧૦-'૩૮

## ૧૯. હિંદીપ્રચાર અને ચારિત્રશુદ્ધિ

૧

ગ્રામ મહિનાની ૨૬મી તારીખે ભદ્રાસમાં દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભાની છેવટની પરીક્ષામાં પસાર થયેલાં યુવક્યુવતીઓને પ્રમાણુપત્રો આપવાને મને પદ્ધતીદાનસમારંભ રહાયે હતો. પદ્ધતી લેનારાંઓને પ્રમાણુપત્રો આપવાને મને નોતરવામાં આવ્યો હતો. એમને ત્રિવિધ પ્રતિશા લેવાની હતી, તેમાં હિંદી-હિંદુસ્તાનીનો પ્રચાર, સ્વહેશની સેવા, અને હિંદી પ્રચાર સભાની પ્રતિષ્ઠાની રક્ષા અર્થે ચારિત્રશુદ્ધિ, એમ ત્રણ પતો લેવાનાં હતાં. પ્રતિશાના છેલ્લા એ ભાગ તરફ મેં પદ્ધતીધરોનું ખાસ ધ્યાન ખેંચ્યું. પણ સેવા અને ચારિત્રશુદ્ધિ વિષેનાં પત દાખલ કરવામાં પ્રતિશા ઘડનારાઓનો ખાસ ધરાયો હતો. એમનો એવો અલિઆય હોવો જોઈએ કે, સભા દ્વારા પદ્ધતી મેળવનાર યુવકો અને યુવતીઓ સેવાલાવથી હિંદીનો પ્રચાર કરે અને તેમનાં ચારિત્ર અણીશુદ્ધ હોય, તો એ એ વસ્તુઓ એ પદ્ધતીધરોની પ્રતિષ્ઠામાં વધારો કરે અને તેઓ જાતે જ હિંદી-હિંદુસ્તાનીને લોકપ્રિય કરવાને સારામાં સારું જહેરાતનું સાધન બની જાય. તેથી મેં એમણે એમણે પદ્ધતી લેતી વખતે કરેલી પ્રતિશાનું સ્મરણું કરાયું. મારા કહેવાનું સમર્થન કરવાને મેં એમની આગળ એક હિંદી શિક્ષકના પતનની ખખર મારી પાસે આવેલી ને એ પતનથી હિંદીપ્રચારના કાર્યને કેટલી લાનિ થઈ છે એ વિષે બે શાખા કહા.

\*

\*

\*

જે સંસ્થાઓ જોડે મારો નિકટનો સંબંધ રહ્યો છે તેમને જનસમૃદ્ધય—  
પુરુષો તેમ જ ખીચ્યાની સાથે કામ લેવાનું રહ્યું છે. એ સંસ્થાઓ સેંકડો સ્વયંસેવકોની મારફત કામ ચલાવે છે. એમને નૈતિક સિવાય બીજુ ડાઈ પણ પ્રકારની સત્તા હોતી નથી. સ્વયંસેવકોને વિષે મ્રણ વિશ્વાસ રાખે છે, કેમ કે એમનાં ચારિત્ર તો શુદ્ધ જ હોય એમ મ્રણ માની લે છે. જે ક્ષણે તેઓ ચારિત્રશુદ્ધિ વિષેની શાખ ગુમાવે, તે ક્ષણે જ એમની પ્રતિષ્ઠા ને એમની અસર ઓછી થઈ જશે. પાપમાં સંઝોવાયેલી સંસ્થા કે વ્યક્તિઓને પાપની પ્રસિદ્ધિ કરી નુકસાન થયું નથી. . . .

આ વરતુ ભીનમ્યોના કરતાં દક્ષિણ ભારતના શિક્ષકોને વધારે સખળપણે લાગુ પડે છે. દક્ષિણ ભારતમાં પડવાનો રિવાજ નથી. ત્યાં છોકરાઓ કરતાં છોકરીઓ હિંદીમાં વધારે રસ લેતી જણાઈ છે. શિક્ષકો એમના ધંધાને કરણે જ એમના શિષ્ય અને શિષ્યાઓ પર જે નૈતિક અધિકાર બોગવે છે તેથી વહેમ ભરી જાય છે ને એક પ્રકારનો વિશ્વાસ, જે સામાન્ય રીતે ન રખાય, તે શિક્ષકો વિષે રખાય છે.

એવી ભત્તલયની સુયના થઈ ચૂકો જ છે કે, હિંદીપ્રચાર સભાએ સોચે સો ટકા સુરક્ષિત બનવાનને સારુ છોકરીઓને ખાનગી શિક્ષણ આપવાની પ્રથા છેક જ અંધ કરી દેવી જોઈએ. હું આ અલિપ્રાયમાં સંભત થઈ શક્યો નથી. આપણે ગમે તેટલી કાળજ રાખીએ તોચે પતનના દાખલા તો બનવાના જ. એટલે આપણે જેટલી સાવચેતી રાખીએ એગ્રલી ઓછી છે. પણ છોકરીઓનું ખાનગી શિક્ષણ અંધ કરવું એ નીતિની આખતમાં હેવાળું કખૂલ કરવા બરોઅર છે. આપણે ગલરાઈ જવાનું તે હતાશ થઈ જવાનું કશ્યું કારણું નથી. મારી જાણ પ્રમાણે હિંદી શિક્ષકોએ સામાન્યપણે ચારિત્રશુદ્ધિની આખતમાં નિષ્કળંક રહીને પોતાનું કામ કર્યું છે. પતન સિક્ષ થયું હોય એવો એક દાખલો મેં પ્રભાસી અનો રાખ્યો નથી. આપણે લાલચને નોતરીએ નહીં, તેમ જ લાલચને છેક જ ટાળવાને સારુ લોઢાનાં પાંજરાંમાં પણ ન પુરાઈએસીએ. લાલચ વણનોતરી આને ત્યારે તેની સામે ટક્કર ગીલવાને આપણે તૈયાર રહેવું જોઈએ. . . .

૬૦ બં૦, ૪-૪-'૩૭

## ૨

[ વર્ધામાં હિંદી પ્રચારકોનું અધ્યાપનમંહિર ઉઘાડતાં આપેલા વ્યાપ્યાનમાંથી ]

પ્રચારકો ચારિત્રશીલ હોવા જોઈએ એમ કલીને રાજેન્દ્રભાષુએ મારો ઓળો હળવો કર્યો છે. જેમનામાં પૂરતું અક્ષરજ્ઞાન નહિ હોય તે નહિ ચાલે એ તો કહેવાની જરૂર જ નથી. પણ એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, જ્યાં ચારિત્રની આવસ્યક લાયકાત નહિ હોય ત્યાં. અક્ષરજ્ઞાનની લાયકાત પણ કામ નહિ આવે.

આ પ્રચારકોએ હિંદીની જે વ્યાપ્યા દુઃહોર સાહિત્ય સમેલને કરી છે. તેવી હિંદી ઉપર કાખુ મેળવવો પડશે. જે ભાષા ઉત્તર હિંદુસ્તાનના હિંદુ અને મુસ્લિમાન ઓળે છે અને જે હેવનાગરી કે ઝારસી લિપિમાં લખાય છે તે હિંદી,

એની એવી વ્યાખ્યા એ સમેલને એ વરસ ઉપર કરેલી છે. એ ભાષા પર કાબૂ મેળવવોં એનો અર્થ એ છે કે, આમદાર બોલે છે એવી સહેલી હિંદી-હિંદુસ્તાની પર તો કાબૂ મેળવવો. જી, પણ તે ઉપરાંત પંડિતોની સંસ્કૃતમય હિંદી અને મૈલવીઓની ફરસી અરથીથી ભરેલી ઊર્ધ્વ ઉપર પણ કાબૂ મેળવવો જોઈએ. એના શાન વિના હિંદીમાં નિષ્ણાત થયા કહેવાય જ નહિ; જેમ ચોસર, સિવિટ્ અને જોન્સનનું અંગેજ જાણ્યા વિના અંગેજમાં પારંગત થયા કે વાલ્મીકિ અને કાલિદાસનું સંસ્કૃત જાણ્યા વિના સંસ્કૃતમાં પારંગત થયા ન કહેવાઈએ.

પણ આ પ્રચારકોમાં દેવનાગરી કે ફરસી લિપિનું અજ્ઞાન હોય કે હિંદી વ્યાકરણનું અજ્ઞાન હોય તે ચલાની લેતા હું તૈયાર થાઈં, પણ ચારિત્રનો અભાવ ચલાની લેતા એક ક્ષણું પણ તૈયાર ન થાઈ. આપણું અહીં એવા માણસો નથી જોઈતા. અને જે તેવા ઉમેદવારોમાં એવો ડોઈ હોય તો તે વખતસર જ ચાલ્યો જાય. એમને જે કામ કરવાનું છે તે કંઈ સહેલું નથી. અંગેજ જાણુનારા લોકોનો એક સથળ વર્ગ એવો છે જે કહે છે કે, અંગેજ જ હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા થઈ શકે. કાર્યી પ્રયાગના પંડિતો હિંદીને સંસ્કૃતમય બનાવી દેવા માગે છે. ને દિલ્હી લખતૌના આદિગો ઉર્ભુમાં ફરસી શષ્ટો દાંસી દાંસીને ભરવા માગે છે. ત્રીજ ને વર્ગની સામે આપણે લડવાનું છે તે ‘પ્રાંતિક ભાષાઓ ભયમાં છે’ એવી ખૂબ ઉદ્ઘાનનારાઓનો છે.

આ વર્ગની સામે ખાથ ભિડવામાં એકલું પાંડિત્ય કામમાં નહીં આવે. એ પંડિતોનું કામ નથી પણ ફરીરોનું — અણીશુદ્ધ ચારિત્રવાળા ને નિઃસ્વાર્થ માણસોનું છે. એ વસ્તુની તમારામાં ખાની હશે તો તમે જે લોકોમાં કામ કરતા હશો તેઓ તમને માર મારે તોએ હું એમનો વાંક નહીં કાઢું. એમણે કંઈ અહિંસાની પ્રતિસા લીધેલી નથી.

તેમ જ પૈસાથી પણ આપણું જાણી મદદ થવાની નથી. . . . એટલે હું આજ સવારે તમને એ જ કહેવા આવ્યો છું કે તમે આ કામમાંથે ચારિત્રનો ફુળો આપો.

## ૨૦. હિંદી યા હિંદુસ્તાની

૧

એક સંમાનિત ભિત્રે લખેલો ભારે બોધક પત્ર વાચક આ અંકમાં\* જોશો. નાગપુરમાં અભિલ ભારતીય સાહિત્ય પરિષદ્દનો ગ્રારંલ કરવા હાલમાં મળેલા પ્રતિનિધિઓ આગળ એ વાંચી અતાવાયો હતો. એને મળતો એક ભીજે પત્ર અન્ય એક મુસ્લિમ ભિત્રે મારી પર મોકલ્યો છે; અને એની સાથે, ગયા એપ્રિલની ૨૭મી તારીખના ‘યોગ્યે ફોનિકલ’માં આ વિષય પર લખાયેલા અગ્રલેખની કાપવી ભીડી છે. આ એ પત્રો અને એ અગ્રલેખ એક આંતર-પ્રાંતીય ભાષા વિષેના મારા વિચારોને સામાન્યપણે રજૂ કરેનારા છે. અતાં, મને ભય છે કે, કદાચ એમની સાથેની મારી આ સંમતિને ડેટલીક ભર્યાદાઓના રહેલી છે, જે મારે જહેર કરવી જોઈએ. આ ભર્યાદાઓને ભર્યાદા નામ આપો તોપણું, તેમનો ધરાહા આ મારા ભિત્રોનું જે મંતવ્ય છે તે જ સાધવાનો છે.

પ્રથમ તો મારે, ડેટલાક મુસ્લિમાનોને શાંકાભય રહેલો છે, તે પતવાને જોઈએ. આજ આખું વાતાવરણ શાંકાભય અનેલું છે. ડેટાઈ પણ માણુસનું કર્યા કે કથન શાંકાદિષ્ટ સિવાય જોવામાં જ નથી આવતું. આ સ્થિતિમાં, મારા મત પ્રમાણે, ઉત્તમ માર્ગ એ છે કે, નેચો હિસ્થી સંપૂર્ણ ઝાંખી એકચ ચાહે છે અને એ વિષે આશાંકા લાવવાનું પોતે જતે કશું કારણું નથી નિપાતાયું, એવા લોકાએ, આ કે તે આજૂના ક્ષણિક આવેશોને વશ થયા વગર, નિર્ભય-પણું સાચે માર્ગ ચાલ્યે જવું, — તેમાંથી, આવા આવેશોને જ્યાં સ્થાન નથી, એવી પરિષદ જેવી બાબતોમાં તો ખાસ કરીને.

પરિષદનો હેતુ આ છે :— હિંદુની બધી ભાષાઓમાં જે સર્વોત્તમ સાહિત્ય હોય તે એકહું કરવું અને તે દેશની જનતાના મોટામાં મોટા ભાગને પહોંચે એમ કરવું; એટલે, માધ્યમની ભાષા એવી હોવી જોઈએ કે જે મોટામાં મોટા ભાગ સમજતો હોય. નિઃશાંક ઉર્દૂ હિંદુની અનેક ભાષાઓમાં એક છે અને એમાં એવા રલલાંડર પડેલા છે કે જે આખા હિંદુને મળવા જોઈએ. વળી, મુસ્લિમ મનોદ્શાને જાણવા ધર્યાછતો, અથવા તો ધર્સનામ ધર્મનું જે સ્વરૂપ હિંદુસ્તાનની

\* નજુએં આ પ્રકરણને અંતે પરિષિષ્ઠ.

પરિસ્થિતિમાં અવતર્યું છે તેને વિષે બધું જાણવા ચાહેતો ડોઈ પણ હિંદી ઉર્દુ સાહિત્યનો પરિચય મેળવવાનું છોડી ન શકે. અને હાલમાં જે પરિષહની સ્થાપના કરવામાં આવી છે તે જે વર્તમાન ઉર્દુ સાહિત્યમાં ભગતા રલબંડારો હિંદી જનતા આગળ નહિ ઉધાડે તો તે તેના હેતુ અને ફરજમાં ચૂકશે.

પત્ર લખનાર મિત્ર એક ભૂલ કરી છે તે સુધારવાની જરૂર છે. મિત્ર માને છે તેમ અનારસમાં નહિ, પણ અલહાબાદમાં શ્રી. ટંડનજીએ આપેલા વ્યાપ્યાનની પૂરી નકલ એમની પાસે નહિ હોવી જોઈએ; નહિ તો, એમણે જે ભારે ભૂલ કરી છે તેવી તે ન કરત. તે એમ માને છે કે, ટંડનજીએ હિંદી બોલનાર બાળીસ કરોડની વાત કરી ત્યારે તેમના મનમાં આજની કૃતિમ હિંદી લખનાર માત્ર જ હતા. પણ એમણે તો સારુ જણાવેલું કે, વિદ્યાચલની ઉત્તરમાં વસતી વિશાળ જનતાને અનુલક્ષિને આ કહું છું; તેની અંદર જ કરોડ મુસલમાનો પણ આવી જય છે, જોએ પણ એછે—વતે અંશે એ જ લાષા એલે છે અને સમજે છે, કે નેની ઉત્પત્તિ નજ લાષામાંથી છે અને જેનું વ્યાકરણ પણ એનું જ સમાન છે. આવી લાષાને જે ‘હિંદી’ એતું નામ અપાયું છે એ નવું નથી. એ નામ તો, મુસલમાન લેખકોએ, પોતે ઉત્તર હિંદના લોક માટે જે લાષામાં લખતા અને જે એમના હિંદુ ભિરાદરો પણ ચોક્કસ પણે વાપરતા, તે લાષાને આપ્યું હતું. પણ એમાં તડ પણાં, અને દેવનાગરી લિપિમાં લખાતી હિંદી ઉત્તર હિંદના હિંદુઓની, અને અરભી કે ફારસી લિપિમાં લખાતી ઉર્દુ તે પ્રદેશના મુસલમાનોની લાષા ગણાવા લાગી. એમ કહેવું કે ઉર્દુ આખા હિંદના મુસલમાનોની લાષા છે એ તો આજ પણ મુશ્કેલ છે. મને ખરાર છે કે, અદીલાઈ એને અને મને અમારી ઉર્દુ દ્વારા મલખારના મોપલા આગળ વાત કરવામાં મુશ્કેલી પડેલી; અમારે મલયાદમી દુલાખિયાથી કામ લેવું પડેલું. એવી જ મુશ્કેલી અમને પૂર્વ અંગાળાની અસ્ય મુસલમાન વર્સીમાં પણ અનુભવવી પડેલી. એટલે, જે વસ્તુ મારા પત્રલેખક મિત્ર સૂચવવા માગે છે તે જ વસ્તુ ટંડનજી અને રાજેન્દ્રભાણુ તેને માટે ‘હિંદી’ શબ્દ વાપરીને સૂચવે છે. એને અહે ‘હિંદુસ્તાની’ શબ્દ વાપરવાથી એઓને સૂચવવાની વસ્તુ કાંઈ વધુ સ્પષ્ટ થાત એમ નથી.

પરંતુ, પત્રલેખકની એ ઇરિયાદ પાડે પાયે છે કે, ટેટલાડ ઉત્તર હિંદના લેખકો કહે છે કે અમે હિંદીમાં લખીએ છીએ, પરંતુ તે એવી હોય છે કે

ને ઉત્તરનાથ બહુ થોડા જ લોક સમજે. કૃત્રિમ જડખાતોડ ભાષાનું અને એમ, એમનો એ પ્રયત્ન નિષ્ઠળ જવા જ અંકારેલો છે.

તો પઢી પત્રલેખક મને પૂછે કે, હુ “હિંદી યા હિંદુસ્તાની”નો આગઢ શા મારે રાખું? માત્ર ‘હિંદુસ્તાની’ જ શા મારે નથી કહેતો? આનું એક સરળ કારણ તો એ છે કે, મારા જેવા નવા માણસે ૨૫ વર્ષથી ચાલતી આવેલી સંસ્થાને, જ્યારે એનું નામ અદ્દલવાની જરૂર સ્પષ્ટતઃ પુરવાર નથી થઈ ત્યારે તેને તેમ કરવા કહેવું, એ મારે મારે ઉછાંછળાપણું કહેવાય. નવી પરિષદ આ જૂની સંસ્થાનું બાળક છે; એનો ધરાદો ઉત્તરના હિંદુ અને મુસ્લિમાન બેઝની સેવા કરવાનો છે; આ બેઝ ક્રમો એક જ પોતાની સાધારણ માતૃભાષા બોલે છે: એનું નામ હિંદી કહો કે હિંદુસ્તાની, એ મહત્વની વાત નથી. મારે મારે એ બેઝ શાખા સમાન અર્થના જ છે. પરંતુ, હુ કે ભાષા કહેવા માયું છું એને મારે જો કાઈ ‘હિંદી’ શાખાવાપરે, તો મારો એમની સામે વાંધો ન હોય.

‘અભિલ ભારતીય’ શાખા સ્વીકાર્યો છે એની સામે પત્રલેખકનો વાંધો હું નથી સમજતો કે શા સારુ. આપા હિંદુસ્તાનમાં બધા હિંદુઓ તો જરૂર એ શાખાપ્રોગ જાણે છે. અને હું હિંમતથી કહું છું કે, ઉત્તરના મોટા આગના મુસ્લિમાનો પણ એ સમજશે. આપણા જમાનાની હિંદી સંસ્કૃતિ આજે ઘડાઈ રહી છે. આજ એકમેક સાથે અધડતી લાગતી એવી બંધી સંસ્કૃતિઓનું એક સુસંભિશણ નિપણવા મારે આપણામાંના ધ્યાન લોક મર્થી રહ્યા છે. જો કાઈ સંસ્કૃતિ એકાડી રહેવા મથે તો તે જીવિત ન રહી શકે. શુદ્ધ આર્ય સંસ્કૃતિ જેણી કાઈ ચીજ આજ હિંદમાં હુયાત નથી. આર્ય લોક અહીંના ભૂગ્રા વતની હતા કે આ દેશ પર ચડી આવી ધૂસી જનારા હતા, એ પ્રશ્નમાં મને બહુ રસ નથી. મને મહત્વ લાગે છે એ સત્ય હકીકતનું કે, મારા પુરાણપૂર્વનો પૂરી ધૂઠી એકમેકમાં ભાગ્ય અને આ જમાનાના આપણે બધા એ સંભિશણનું ફળ છીએ. આપણે તે આપણી જન્મભૂમિનું અને આપણને વહનાર આ નાનકડી ધરતીમાતાનું ભલું કરીએ છીએ, કે એને ભારરપ થઈએ છીએ, એ તો ભવિષ્યે જ બતાવનું રહ્યું. મારે મારે આટલી વાત સાઝ છે કે, નવી પરિષદ અને હિંદી સાહિત્ય સમેલન બેઝનો ઉદ્દેશ હિંદની બધી ભાષાના ઉત્તમાંશો એકાડ કરવા દ્વારા સૌનું સર્વસાધારણ ભલું કરવાનો છે. જો એમનો એ ધરાદો નથી તો તેઓ નાથ પામરો. પરંતુ, એ પ્રકારના સુસંભિશણનો એ અર્થ ન

થવો જોઈએ કે, જેમાં ચાર્ય અસર હોય એ બધું છાડું જોઈએ, જેમ એનો એ અર્થ પણ ન થાય કે, જેમાં અરથી અસર હોય—અરથી જ માત્ર શું કામ ? જેમાં અંગ્રેજ કે ખીજ કોઈ પણ અસર હોય—તેથી છાડું જોઈએ.

આ અહુવાદિયે હું મારી દૂલીલ આટલે અટકાવું. હજુ કેટલાક મહત્વના સુદ્ધા ચર્ચાવાના બાકી છે, તે ખીજે અહુવાદિયે લેવા આશા રાખું છું.

૬૦ ૮૦, ૧૭-૫-૩૬

૨

ગયા લેખમાં હું બતાવી ગયો કે, ‘હિંદી’ અને ‘હિંદુરતાની’ શબ્દોને શા માટે હું પર્યાયવાચી માનું છું અને શા સારે ‘હિંદી’ શબ્દોને પ્રયોગ રાખવો જરૂરનો છે.

ગયા અંકમાં જે પત્ર પ્રસિદ્ધ કરેલો એમાં ‘હિંદી’ શબ્દ સામે આ પ્રમાણે વિરોધ રજૂ કરેલો : “ભૂતકાળમાં મુસલમાનો આ ભાષાને બણુતા, અને એને સાહિત્યની ભાષાના ગૌરવપદે ચડાવવા એમના હિંદુ બિરાદરોથી વધુ નહિ તોય તેમના જેટલી મહેનત તેમણે કરેલી. પરંતુ, એ ભાષા સાથે એવા સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવો પણ જેડાયેલા છે કે જે એક કોઈ સમૂહને નામે મુસલમાનો અપનાવી નથી શકતા. એ ઉપરાંત, એ ભાષા આજ પોતાનું ખાસ શબ્દલાંદેણ ધડી રહી છે, જે સામાન્યતઃ માત્ર ઊર્દ્વ જાણુનારને નથી સમજાતું.”

જો ભૂતકાળમાં જૂના મુસલમાનો લિંગી ભણુતા ને એને સંસ્કૃત કરતા, તો આજના મુસલમાનોએ એ શું કામ છોડું જોઈએ ? આજની હિંદી કરતાં ત્યારની જૂની હિંદીમાં જરૂર જીલટા વધારે ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવસંબંધો હતા. અને એવા સંબંધો કોઈ ભાષાના છે માટે શું એને ત્યાગ કરવો જોઈએ ? અરથી કે ફારસીના ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવસંબંધોને કારણે શું મારે તે છોડવી જોઈએ ? જો મારી ખંગળા ન હોય કે જો મારો તે પ્રત્યે અણુગમો હોય, તો જીલે હું એમની મારા પર અસર ન થવા દઉં. આપણે વધા સગા ભાઈ જેવા છીએ; અને જો એ મૂમાણે આપણે હળીમળીને રહેવું હોય, તો એકખીજની સંસ્કૃતિની આપણે લડક તો ન જ રાખવી જોઈએ.

અને હિંદીમાં સંસ્કૃત શબ્દોના ઉપયોગ સામે એવો બધો ઝગડો શા માટે કે તે ભાષાની જ સામે થવા સુધી પહોંચતું પડે ? સાદ્ય પ્રયાલિત શબ્દોને બહલે સંસ્કૃત શબ્દો મૂકવાની કે તહલવ શબ્દો કાઢી તેના મૂળ તત્ત્વમ

સંસ્કૃત વાપરવાની હૃત્તિમ પદ્ધતિ જરદર નિંદા છે ને તેનાથી કર્ણ માધુર્ય હલાય છે. પરંતુ, રાજ્ય જેમ વિકસણો તેમ સંસ્કૃત શખદોનો અસુક અંશો ઉપરોગ સંસ્કૃત જ જાણતા હિંદુઓને હાથે વખતવાનો એ અનિવાર્ય છે; જેમ, અરથી જ જાણુતા મુસલમાનોને હાથે અરથી શખદોનો વખતવાનું અનિવાર્ય છે. અને, એડ એક જ ભાષા વાપરતા હોય અને ડોર્ચિને ખાસ આમ કે તેમ પક્ષપાત ન હોય તે છીએં, આમ અનવાનું. એટલે શિક્ષિત હિંદુ મુસલમાનોએ એડ ઇપો જાણવાં જોઈશે. અને આ વસ્તુ બધી જ વર્ધમાન ભાષાઓ માટે સત્ય નથી? શિક્ષિત અંગેઝેમાં એ આપણે જોઈ એ છીએ. આપણે તાં તો એ મુશ્કેલી આવી પડેલી છે કે, અત્યારે આપણે હૃદયમેળ નથી અને આપણા ઉત્તમ માણુસોમાં પણ પરસ્પર શંકાલાવનું અરે પેસી ગયું છે.

જેમ અંગેઝેમાં એક જ ભાષાનાં કોઈ વોલની, લોડેશાયરની અને મિડલ-સેક્સની બોલી એવાં નણું નામ છે, તેમ જ આપણે તાં હિંદી, હિંદુસ્તાની અને ઉર્દૂ એમ એક જ ભાષાનાં નણું લિન્ન નામો છે. આજ આપણે જે છરાદો રાખ્યાએ છીએ તે નવી ભાષા નિપળવાનો નહિ, પરંતુ નણું નામોથી ઓળખાતી એક જે ભાષા છે એને આંતરપ્રાંતીય ભાષા તરીક વ્યવહારમાં જીતારવાનો. મને લાગે છે કે, ‘હંસંમાં વપરાતી ભાષાનો શ્રી. મુનશીએ સાચો અચાવ કર્યો છે. ધારો કે એક તામિલ કે તેલુગુ લેખનું હિંદી યા હિંદુસ્તાની કરવું છે. તો, જેમ અરથી લેખનું હિંદી યા હિંદુસ્તાની ભાષાંતર કરવામાં અરથી શખદો લગભગ અનિવાર્યપણે આવવાના, તેમ જ તામિલ તેલુગુના ભાષાંતરમાં સંસ્કૃત શખદો આવવાના જ. બંગાળીમાં સંસ્કૃત શખદો ઘૂય છે; હુવે જે રવીન્દ્રનાથની ગીતાંજલિનો હિંદી અનુવાદ કાળજીપૂર્વક એમાં સંસ્કૃત શખદો ન આવવા હે, તો ગીતાંજલિનું કર્ણ માધુર્ય ઓછું થવાનું જ. મૌલની અધ્યાત્મ સાહેબ અને અકીલ સાહેબ જેવા સાહિત્ય-સેવી મુસલમાનોએ આપણી સર્વસાધારણું એક ભાષા માત્ર હિંદુઓની જ ન બની એસે એ સંભાળવા સારુ આ એક ભાષામાં પોતાનો ખાસ ક્ષાળો ઓપવો જોઈએ. મારું ચાલે તો હુ એમને ઉર્દૂ માત્ર મુસલમાનોની જ ભાષા તરીક ગણીને ચાલવામાંથી સમજનીને પાછા વાળી લાવું; એમ જ સાહિત્યસેવી હિંદુઓને હિંદીને માત્ર હિંદુઓની જ ભાષા ગણુવામાંથી વાળી લઉં. એમાંથી ડોર્ચિ જે પાછા ન વાળી શકાય તો, આ એક ભાષાનું ગમે તે નામ લલેને પણી કહે, પણ ઉત્તરના હિંદુ મુસલમાનોને માટે એક ભાષા નીપજરો નહિ. એટલે, એણામાં ઓછું આ બાયતમાં આપણે

નામનો અધડો કરવાની જરૂર નથી. જે ખરા હૃદયથી આપણે વસ્તુ એક જ છુદ્ધિએ ધીએ, તો પછી તેનું નામ ગમે તે કહો.

એવટે, લિપિનો સવાલ રહે છે. અત્યારે મુસલમાનો દેવનાગરીનો આગ્રહ કરે એ વિચાર બહારની વાત છે અને મોટી હિંદુ જનતા અરથી લિપિને આગ્રહ કરે એનો તો એથીય ઓછો વિચાર કરી શકાય. એટલે, મેં ‘હિંદી યા હિંદુકષ્તાની’ની વ્યાખ્યા આ પ્રમાણે સૂચની છે: “દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં લખાતી, ઉત્તરના હિંદુ મુસલમાનો સામાન્યપણે જે ખોલે છે તે ભાષા.” અને આ વ્યાખ્યાને, તેની સામેના વિરોધ જ્તાં, હું વળગી રહું છું. પરંતુ, એ વાત સ્થાચી છે કે, દેવનાગરીને અંગેની એક હિલચાલમાં હું સંપૂર્ણ સંમતિથી જોડાયેલો છું. આ હિલચાલ લિન્ન લિન્ન પ્રાંતોની બધી ભાષાઓ માટે — જેમાં સંસ્કૃત શાસ્ત્રભાષા મેદં છે એવી માટે ખાસ કરીને — એક લિપિ યોજવા સારુ છે. ગમે તેમ હોય, અત્યારે હિંદુની બધી ભાષાઓના સર્વશ્રેષ્ઠ કીમતી લંડારોમાંથી દેવનાગરીમાં ઉતારવાનો પ્રયત્ન એ દ્વારા થઈ રહ્યો છે.

૬૦ બા'ં, ૨૫-૫-'૩૯

૩

પરિચાષ્ટ

[પ્રકરણની રાઢમાં કહેયો ‘આરે સંમાનિત મિત્રે લખેલા’ પત્રનો સારભાગ નીચે આપ્યો છે ]

ઘણું વર્ષથી રાષ્ટ્રીય મહાસભા એવી હિમાયત કરતી આવી છે કે, આપણા એક રાજકીય આદર્શના ચાવશ્યક અંગ તરફ આપણી એક ભાષા હોલે નેઈએ. આ એક ભાષાને શું નામ આપવું એ પ્રશ્ન ભાગત મહાસભાએ ઉર્દૂ અને (હિંદી ભાષાઓ નેટે કરી ચોગણી સમબૂત નથી કરી, હંતું મહાસભા મંડળોમાં એને ‘હિંદુકષ્તાની’ કહેવામાં આવતી. પરંતુ, આપ તો જણો છો કે, નામો સાથે જોડાયેલા ભાવ તથા અથેને કારણે તેમનું રાજકીય અને સામાજિક મહત્વ આરે છે; એથી કરીને આપણી એક ભાષાનું નામ એ અતિ મહત્વનું છે.

અન્યાર સુધી, ઉર્દૂ જ એક એવી ભાષા છે કે જે એક પ્રાંતીય કે એક સાંપ્રદાયિક વાદામાં નથી પુરાયેલો: આખા હિંદુના મુસલમાનો એ જોતે છે, અને ઉત્તરમાં એને ઓલનાર મુસલમાનો કરતાં હિંદુઓની સંખ્યા મોટી છે. આપણી એક ભાષાને ઉર્દૂ ન કહી રાજકીય તોથ તેનું નામ એવું તો હોલું નેઈએ કે જે દ્વારા મુસલમાનોએ તેને અંગે જે ખાસ ભાગ કર્યો છે (અને આ ખાસ ભાગ તે ઓછોવસે અંશે એક એવી ભાષા ધર્મનોએ.) તે સૂચવાઈ જતો હોય. આ હેતુ ‘હિંદુકષ્તાની’ નામ આપવાથી સરે છે, ‘હિંદી’ નામથી નથી સરી શકતો. ભૂતકાળમાં મુસલમાનો આ ભાષાને ભાણુતા

અને એને સાહિત્યની ભાષાના ગૌરવપણે વડાવવા, એમના છિંદુ બિરાફરીથી વધુ નહિ તોથ તેમના કેટલી મહેનત કરેલી છે. પરંતુ, એ ભાષા સૈધે એવા સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવો પણ લોડપેવા છે કે ને એક કોમી સમુદ્દરને નમે સુસલભમાને અધનાની નથી રહીતા. એ ઉપરાંત, એ ભાષા આજ પોતાનો ખાસ રાખબાળ ધરી રહી છે, ને સામાન્યતા: માત્ર ઉદ્દેશ્યનારે નથી સમજવતો.

ઉદ્દેશ્ય અને છિંદુસ્તાની વચ્ચે કરી ગોયાંનો કરતો નથી જણો; પણ છિંદી અને છિંદુસ્તાની વચ્ચે થયા હતો સારુ જોવામાં આવે છે. તેથી કરીને જ ઉપરની રન્દૂચાત પ્રસ્તુત સમજ મેં ભારપૂર્વક કરી છે. ગયા વર્ષની હિંદેર પરિષહ વેળાનું આપનું વ્યાખ્યાન ચોક્સ એમ સુચચનાનું હતું કે આપ એ એને સમાનાર્થક સમગ્રે છો. અને ‘હંસ’ માસિકના પહેલા અંકના આહિવિચનમાં આપે જણાયું છે કે એક એક અર્થવાચક છે. મને પૂરેપૂરી ખાતરી છે કે, આપને મન છિંદી એટલે આમજનતા ને ભાષા જાણે છે અને તેથી એમની ડેણવણી અર્થે ને ઉત્તમ માધ્યમનું કામ દઈ શકો એ ભાષા છે. પરંતુ એના ફેલાવને માટે કામ કરી રહેલ ઘણ્ણાની ‘હિંદી’ એ નથી. એટલે તેચો જ્યારે ‘હિંદુસ્તાની’ ને બહલે ‘હિંદી’ શબ્દ વાપરે છે ત્યારે શબ્દ-ભાંડાળ, રુચિ, અને રાજકીય સાંપ્રદાયિક ભાવોના પણ સાશોસાથ બહલો થઈ જય છે. અને હું આપને આ વલાશુની રામે ધ્યાન આપવા વિનાની કરું છું. કેમ કે કદાચ ભારતીય સાહિત્ય પરિષહ પણ એની ઓળ થઈ પડી હોય એમ લાગે છે.

એક સાવ નાનકડી વાતનું ઉદ્ઘાટણ ટાંકી મારું મંત્રય સમજવું: સાહિત્ય પરિષહને ‘હિંદુસ્તાની’ નહિ, પણ ‘ભારતીય’ કહેવામાં આવી છે, તે થા સારું ‘ભારત’નો કરો અર્થ હોય તો એ છે કે, આયોનું છિંદ; કેળી અંદર, સુસલભમાનો અને છિંદી જીવન ઘડવામાં એમણું આગેવા કરોણા જ નહિ પરંતુ ચોકાસ અને પરિવર્તનનાં કેટલાં સૈકનોય સમાવેશ નથી થતો. આમાંથી વાડાબંધી અને પાછા જવાનું સૂચન નથી થતું? વળા, જ છિંદી પરિષહો અમને માઝલવામાં આવેલ છે તેમાં આમભાયાના બેગણુથી વધારે શબ્દો નથી; ‘નીચે વિચે હુંએ’ એવા સામાન્ય પ્રયોગને બદલે ‘નિભાલિભિત’ કેવા શુદ્ધ સાંસ્કૃત પ્રેણાંનો કરવામાં આવ્યા છે; પરિણામે, નેકે મન નાગરી વિધિ આવડે છે છતાં આ પરિષત્ત સાવ નથી સમજતા.

સાંસ્કૃત અને અરણીમાં ધારિમાધિક શબ્દો શરદ્ધર છે એ તો સાવ સારું ધીના છે પરંતુ છિંદના એક ભાષા એમાંથી ગાન્ધી એકનો જ આધ્યાર ન લઈ શકે; કારણ કે ને અરણી પરદેરી ભાષા કરો તો સાંસ્કૃત કરી સામાન્ય રીતે એલાતી હતી એમ નથી, અને ને ચાલુ છિંદી ભાષા ધ્યાનથી લુંચો તો જણાશો કે એમાં વપરાતા ભધા સાંસ્કૃત શબ્દો, કાળે કરીને, ખૂબ બદલાતા ગયા છે, અને તે એ કારણે કે તે સહેલાઈથી હચ્ચારી શકતા નથી,— સુસલભમાનોથી નહિ, પરંતુ છિંદી જનતાથી. ‘આમ’ કે ‘વર્ષ’ એવા દુંકા શબ્દો પણ ‘ગાંબ’ અને ‘પરસ’ થઈ ગયા છે. છિંદીના. ઘણ્ણા

હિમાયતીએ આ બધી બીનાએ ભૂલેલા છે, કરણ કે તેઓ આ અને બીજા અનેક શખ્ષોનાં મૂળ સંસ્કૃત રૂપો પાછાં લાવવા લાગ્યા છે. સંસ્કૃત શખ્ષોનાં ઇથાંતરો બધાં ઉર્દુએ સ્વીકારેલાં છે. એટલે, ઉપરનું વદણ પાંડિત્ય, અજ્ઞાન કે પક્ષપાતને લઈને છે એ તો હું ન કહું. પરંતુ આઠથું સાવ સાફ હેખાય છે કે, આ ભિત્રો જીવતી જોવાતી આમનાખાનો સીંધા પ્રચાર કરવા કરતાં હિંદી જીવને આર્થિત્વથી રંગવાની પાછળ વધારે મંડલા છે. જોતાની જ કેમની પ્રગતિ કે પરાગતિ પાછળ ને અમારી હિંદુભાઈએ મથના ચાહે તો તેમાં સુસલમાનોને કશા લેવાહેવા ન હોય; તો પછી, આવી ચળવણો કાણાના પ્રક્ષથી બરોખર કાળજ લઈને અલગ રાખવી જોઈએ, એ તો સાચી પ્રમાણિકપણુંની વાત છે.

આહિલ સાહેબના પત્રના ઉત્તરમાં શ્રી કનૈયાલાલ મુનશા લખે છે કે, ગુજરાતી, મરાઠી, બંગાળી અને કેળના કોકોએ ‘ને સાહિત્યસૃષ્ટિની પરંપરા નિર્મી’ છે તેમાં શુદ્ધ ઉર્દુ અંશ નહિ જેવો જ છે એટલે અમારી હિંદી આપોચ્ચાપ સંસ્કૃતમધ્ય હિંદી સહજ રીતે હોવાની.’ તો, પ્રથમ તો એ કહું કે, શુદ્ધરાતી, મરાઠી ને બંગાળીમાં ઝારસી શખ્ષો સારી સંગ્ઘાંથામાં છે એ હું જાણું છું; એટલે, ગુજરાત બંગાળના હિંદુઓએ પરસ્પર તથા સુગ્રંતમાનોનાં નશ્ક આવવા માટે એમની ભાષા સંસ્કૃતમધ્ય કર્ણી જોઈએ એમ સ્વીકારવા હું તૈયાર નથી ગણી, આપણુંને ‘શુદ્ધ ઉર્દુ અંશો’ની પરવા નથી: આપણું તો ઉત્તર હિંદની જવાની ભાષા, ને તેના હિંદુપ્રોગ્રામની લેવાહેવા છે. એક ભાષા ઘડવાના પાચા તરીકે આ જવાની આમભાષા ને લેવામાં આવે, તો સુસલમાનો તેમાં સંગ્ઘીન સહદાર આપ્યી શકે. પણ ને સંસ્કૃત પર પાછા જવાય તો, એને અર્થ એ કે, સુરાતમાનોને અને તેમણે હિંદી બંગાળી તથા ગુજરાતીની ભૂતકાળમાં કરેલી સેવાને નાલેખાય છે. અને આવી હિસ્તિનાં અમારો સહકાર ભાગવો એ તો આત્મધાત કરવામાં આવે જને જ મહદ ઇંગ્રેઝે એવી ભાગવી કર્યા ગાંધી નારાખર ન થયું?

હિંદી-ઉર્દુનો આ પ્રશ્ન કોઈ થઈ પડે એવી અરાખર લીતિ રહેલી છે એ. શ્રી પુરુષોત્તમદાસ ટંડને આ માનુના પદેલા આડવાડિયામાં ભનારસમાં હિંદી સંગ્રહાલય જોવાવાને પ્રસંગે આપેલા વ્યાખ્યાન ગરથી સાફ જાણાય છે. એમણે કહું કે, એરિયાની વધરેમાં વધારે જનસંખ્યામાં જોવાની ભાષાઓમાં ચાની પણ હિંદીનો નંબર આવે છે. બીજા શખ્ષોમાં એને અર્થ એ થયો કે, આપણે એકભાષાનો પ્રશ્ન સિદ્ધ થઈ ચૂક્યો છે; હિંદી એકભાષા જવાની છે, કેમ ક મૌય ભાગની હિંદી જનતા એ જોવે છે; ‘હિંદુસ્તાની’ના પક્ષકારો સંખ્યાખળમાં પાછા હજાલી રાક્ષાય, એટલે એમણું કાંઈ લેખું રહી ન શકે. પરંતુ એકમેકનાં માથાં ભાગવાનું એ નેમ ઉકેલનો ઉપાય નથી, એમ જ માથાં ગણવાનું પણ છે. શ્રી ટંડના કહેવાનો સાચો અર્થ ગમે તે હશે; પરંતુ મને લાગે છે કે, ‘કોમા ચુકાના’ જેવી બીજી પદ્ધતીની લાવવાની ભૂમિકા તૈયાર થઈ રહી છે.

આમાંથી ભયાવી રડે એવાં આપની પ્રતિષ્ઠા અને આપના વ્યક્તિત્વમાં રહેલો વિશ્વાસ જ છે. નીચે હું કેટલાક સુદ્ધા આપું છું; મારો નમ્ર મત છે કે, તે ખુલ્લિ-પુરઃસર અને એકભાષા પડવાને માટે સંગીત પાયાડું છે. વિચારી જેતાં જે આપને એ યોગ્ય લાગે — આપને જ યોગ્ય લાગે એમ નહિં, પરંતુ જે ઉદ્દેશો સારવા અણે એ છે એમને ખાતર પણ, — તો તે આપ જહેર કરશો. અત્યારે તો હું એ પરથી એ મનોરથ બાંધી રહ્યો છું કે, તે બાહને, તેમના ઉપરથી આપ જહેર કાંઈક કહેવા પ્રેરાશો.

સુદ્ધાનો આ છે :—

૧. આપણી એક ભાષાને ‘હિંદુસ્તાની’ કહેણી, ‘હિંદી’ નહિં.
૨. હિંદુસ્તાનીને કાઈ પણ કોમની ધાર્મિક પરંપરા સાથે કરો. આસ સંબંધ છે એમ ન ગણુવામાં આવે.
૩. કાઈ શાફ્ટ લેવા છોડવાનો. વિવેક તે દેશી પરહેશી જે એ ન્યાયે નહિં, પણ તે કેવા પ્રચલિત છે એ જ ન્યાયે હોય.

૪. હિંદુ લેખકો વાપરતા બધા ડર્દી શાખો અને સુરિલમ લેખકો વાપરતા બધા હિંદી શાખોને પ્રચલિત ગણુવા. ડર્દી અને હિંદી જ્યાં એક અલગ ભાષા તરીકે હોય ત્યાં, અથબત, જા લાગુ ન પડે.

૫. પારિભાષિક રાખોની પસંહગીમાં, આસ કરીને રાજકીય પરિભાષામાં, સંસ્કૃત છે માટે પહેલી પસંહગી ન અપાય; પરંતુ ડર્દી, હિંદી અને સંસ્કૃત શાખોમાંથી સરળભાવે પસંહ થાય જોવો બનતો બધો અવકાશ રાખાય.

૬. હેવનાગરી અને અરભી એવ લિપિઓ પ્રચલિત અને સત્તાવાર ગણુવામાં આવે. અને જે સંસ્થાઓની નીતિરિતિ હિંદુસ્તાનીના સત્તાવાર પ્રચારકોના હાથમાં હોય ત્યાં એવ લિપિ શાખવાની સવડ રાખવામાં આવે.

સુસ્તિવિમ માગળીઓ જેવા જા સુદ્ધા જે એમ કેટલાક મિત્રોને લાગશે; પરંતુ ને એમ નથી. પણ હું એદિંબં જાણું છું કે, કાઈ પણ પ્રકારની આવી જતની જાતરી આપ અને પરિષહ તરફથી ન અપાય તો એકભાષાના પ્રશ્નની સેવામાં સુરિલમ સાહિત્યકારોની શક્તિ સંયોજવાની વાત અસ્થાને છે. અને તેથી જ જા સૂચનાઓ મેં આપની આગળ રન્દૂ કરી છે. મન ખાતરી છે કે, તે બધારેપણી હશે તો આપ ક્ષમા કરશો. અને અધિત્ત હશે તો ન રોષાશો. મારે તો એક ફરજ બળવવાની હતી, તે આપને ઉપરની વિનંતી કરીને બળવી. આપના નિર્ણય માટે મને અપાર ગાન છે. અને આપની અગાધ ન્યાયમુલ્કિ તથા સદ્ધિષ્ઠુતામાં મારો વિશ્વાસ છે.

## ૨૧. ગેરસમજનું જાળું

મારી પાસે અનેક ઉર્દૂ ભાપાંની ડેટલીક કાપલીઓ આવેલી છે, તેમાં બોધા જ વખત પર સ્થપાયેલી ભારતીય સાહિત્યપરિષદમાં થયેલા કામકાજ વિષે અને તેના સંબંધમાં બાધુ રાજેન્ડ્રપ્રસાદ, બાધુ પુરુષોત્તમદાસ ટંડન, પંડિત જવાહરલાલ અને મારી સામે સખત જ નહિ પણ કંઈવી ટીકાઓ કરેલી છે. એમાં અમારા પર ને હેતુઓ અને બદદાનતનું આરોપણ કરેલું છે તે અમારા ડાઇનિં મનમાં પણ કદી આવ્યાં નથી. પરિષદમાં શું થયું કે અમે શું કર્યું એ સમજવાની પણ એ લેખકોએ તકલીફ લિધી નથી. તેઓ માને છે કે, એ પરિષદના મૂળમાં અમારી એવી દાનત છે કે ઉર્દૂને હણવી હિંદીને આગળ ધ્યાપવી, અને હિંદીને એવી સંસ્કૃતમય કરી મૂકીવી કે તે મુસલમાનોને સમજવી અશક્યવત થઈ જાય. અલહાબાદમાં હિંદી સાહિત્ય સમેલનના સાહિત્યના સંગ્રહસ્થાનનું ઉદ્ઘાટન કરતી વખતે બાધુ પુરુષોત્તમદાસ ટંડને આપેલા ભાષણમાંથી તેઓ એવું પણ અનુમાન કાઢે છે કે, ‘લગભગ ૨૩ કરોડ હિંદીઓ હિંદી બોલે છે નહિ તો સમજે તો છે જ’ એમ એમણે કહ્યું એમાં સાચી હકીકતને અવળા ડિપમાં રજૂ કરી હતી. આ લખાણોમાં ખીંચાં પણ ગર્લિત કટાક્ષો ભરેલાં છે. તેની નોંધ લેવાની મારે જરૂર નથી, કેમ કે એ કટાક્ષો જેમાંથી ઉદ્ભલ્યાં છે તે ગેરસમજે બની શકે તો દૂર કરવી એટલો જ મારો ઉદેશ છે.

હેલ્લી ટીકાને કાઈએ. ટંનજીનું આખું ભાપણ આ લેખકાની સામે હોત તો તેઓ જાણુત કે, તેમણે ૨૩ કરોડની સંખ્યા ગણ્ણાવી તેમાં ઉર્દૂ બોલનાર હિંદુ અને મુસલમાનોને સમાવેશ ધરાદાપૂર્વક કર્યો હતો. તેથી તેમણે ‘હિંદી’ શાખ વાપરતાં તેમાં ઉર્દૂનો સમાવેશ કર્યો હતો. ૧૯૭૫માં ધૂદ્દારમાં પસાર થયેલો દૂરાવ, જેમાં ટંનજી પણ સામેલ હતા, તે દૂરાવમાં, જે ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુઓ અને મુસલમાનો બોલે છે અને જે દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં લખાય છે તે, એવી હિંદીની વ્યાખ્યા કરવામાં આવી છે; એટલું ધ્યાનમાં રાખવામાં આવે તો મેં ઉપર કહેલી વાત સ્પષ્ટ સમજશે. આ ટીકાઓના લખનારાઓને આ વ્યાખ્યા જાણુતા હોત તો તેમને કાઈ પણ કારણે — સિવાય કે તેમને ‘હિંદી’ નામ સામે જ વાધો હોય — ફરિયાદ કરવાપણું નહોતું. ‘હિંદી’ નામ જ તેમને અળભામણું હોય તો એ દુઃખની વાત છે. ઉત્તર હિંદુસ્તાનની ભાષા માટે મૂળ શાખ ‘હિંદી’ છે. ‘ઉર્દૂ’ એ નામ એક વિશિષ્ટ ઉદેશને સારુ ખાસ અપાયેલું છે, એ જાણ્યુતી વાત છે. ઉર્દૂ લિપિ પણ મુસલમાન રાજકર્તાઓની

સગવડને ખાતર બહારથી આણુને આ દેશમાં દાખલ કરેલી. એ ને અતિલાસિક કુમ હોય તો, ‘હિંદી’ શખ્ષ જ્યાં લગી ઉર્દૂનો સમાવેશ થાય એવા વિશાળ અર્થમાં વાપરવામાં આવે, ત્યાં કંઈ એની સામે કરી વિરોધ ન થવો જોઈ એ. ગમે તેમ હો, બહુ બહુ તો મતબેદ હોય જ તો તે આટલી એક જ ખાખતનો છે કે, એક જ વસ્તુ સુચવવાને એક શખ્ષ વાપરવો કે ખીનો.

હિંદીને સંસ્કૃતમય કરી મૂકવા વિષેની ફરિયાદમાં કંઈક વળૂદ છે, કુમ કે હિંદીના કેટલાક લેખકો એમનાં લાખાણેમાં વિના કારણું સંસ્કૃત શખ્ષને દાખલ કરવાનો આગાહ રાખે છે. કેટલાક ઉર્દૂ લેખકો એટલા જ અ-કારણું ફારસી કે અરથી શખ્ષનો વાપરવાનો આગાહ રાખે છે, તેમની સામે પણ એવો આક્ષેપ લાવી શકાય, ને એ આક્ષેપ પણ વળૂદવાળો ગણ્યાય. એથીએ ખરાખ તો એ છે કે, તેઓ ભાષાનું વ્યાકરણું પણ બદલી નાંખે છે. આ અતિરેકા કાળે કરીને ભૂંસાઈ જરી, કુમ કે એવી ભાષા જનસમૂહ કરી નહિ વાપરે. જે ભાષા જનસમૂહથી સમજ ન શકાય એવી અધરી હોય તે અલપળું જ નીવડવાની.

ભારતીય સાહિત્યપરિષદું ધ્યેય તો એ છે કે, ઉપર આપેલી વ્યાખ્યા પ્રમાણેની હિંદી દારા લિખ લિખ પ્રાતોમાં પ્રગટ થતા ઉત્તમ વિચારરાશિને આખા ભારતવર્ષ માટે સુલભ કરવો. કેટલાક ટીકાકારો કહે છે એમ, આ પ્રવૃત્તિમાં કરી બદલનત નથી તેમ કંઈક ડોમી પક્ષપાત પણ નથી.

‘હિંદી-હિંદુસ્તાની’ એ શખ્ષપ્રેરોગ મારા કહેવાથી સ્વીકારયો હતો. હિંદીની ઉપર આપેલી વ્યાખ્યાનો અર્થ એક સામાસિક ‘શખ્ષમાં વ્યક્તા થાય એટલા માટે એ શખ્ષપ્રેરોગ સ્વીકારયો’. ‘હિંદી-હિંદુસ્તાની’ને બહલે માત્ર ‘હિંદુસ્તાની’ અથવા ‘હિંદી-ઉર્ડૂ’ એ શખ્ષ વાપરવા, એવી સુચના મૌલની અખદૂલ કાદર સાહેબે કરી હતી. મને આ એમાંથી એક શખ્ષપ્રેરોગ સામે વાંધો નથી; પણ ભારતીય સાહિત્ય પરિષદ પોતાના ઊગમસ્થાનની ઉપેક્ષા કરી શકે એમ નહેતું. એ કલ્પનાનો ઊગમ ઈદ્દોરના હિંદી સાહિત્યસંમેલનમાં થયો, અને નાગપુરમાં એ સંમેલનના આશ્રય નીચે ભારતીય સાહિત્ય પરિષદને મૂર્તા રૂપ અપાયું; એટલે ‘હિંદી’ રાખવો આવશ્યક ગણ્યાય એ સ્વાભાવિક હતું. એની જગ્યાએ ‘ઉર્ડૂ’ શખ્ષ વાપરવો કુમ અયોગ્ય હતો એનાં કારણ હું આપી ચૂકુંચો છું. પણ મેં બતાવવાને પ્રયત્ન કરો છે કે, હિંદી હિંદુસ્તાની અને ઉર્ડૂ એ પર્યાય શખ્ષનો છે, અને લગભગ એક જ ભાષાને માટે વપરાય છે.

## ૨૨. વધુ જળાં

જે માણુસ સત્યની શોધમાં છે તેને કોઈને રાજ કરવાને લખવું કે બોલવું  
પોસાથ નહિ. ભારા ભાર્ગમાં આવી ચડેલી સર્વ વસ્તુઓમાં સત્ય શોધવાની  
મારી લાંઘી સાધના દરમ્યાન, હું જાણું છું કે, તે તે વખતે પ્રસ્તુત એવા  
વિષયોમાં ભારું કહેવું સાચું હતું એમ સૌને ગળે ઉતારવામાં હું ભાગે જ  
સફળ થયો છું. હિંદીપ્રચારની આભતમાં મેં કેટલાક મુસલમાન મિત્રોને નારાજ  
કર્યા છે તો હિંદુ મિત્રોને ઓછા નારાજ કર્યા નથી. પણ ભારા ટીકાકારો મારી  
જ્ઞાન વિષે મારી ખાતરી ન કરવે લાં લગી, કેવળ તેઓ ધર્યે છે એટલા  
જ માટે હું ભારા વિચારો બદલું એવી અપેક્ષા તેમણે ન રાખવી જોઈએ.  
એક પત્રલેખક તો કહે છે કે, ભારું કહેવું તર્ક અને ધતિજાસ બનેની દિશિએ  
સાચું છે છતાં મુસલમાન ટીકાકારોને અતુકૂળ થવાને સારુ જ મારે ભારા  
વલણમાં ફેરફાર કરવો જોઈએ. એ મુસલમાન ટીકાકારો ધર્યે છે કે હું એક  
જ સર્વસામાન્ય ભાષા સૂચયવાને સારુ ‘હિંદી-ઉર્દૂ’ અથવા તો એકલો  
‘ઉર્દૂ’ શાશ્વત પ્રચિનત કરાવું. એમનો વાધો એ ભાષા સામે નથી. પણ એ  
ભાષા અત્યાર સુધી જે નામે ચાલી છે તે નામ સામે છે. હવે મારી પસે એક  
કાગળ આવ્યો છે તેમાં થોડા મહિના પર એંગલોરમાં થયેલા હિંદીપ્રચાર  
પદ્ધતીદાન સમારંભમાં મેં આપેલા ભાષણ સામે જુદા દિશિબિંદૂથી ફરિયાદ કરેલી  
છે. એ કાગળ લાંબો છે. તેમાંથી હું નીચેના અહુ પ્રસ્તુત એવા ઉતાર આપું છું :

“એંગલોરના પહોંચાન સમારંભ વાગતના આપના ભાષણમાં આપે ૧ કરેાડ  
૧૦ લાંબ કાર્યાચારી શીપુરુષોને, ઉત્તર ભારત સાથે સંબંધ બાંધવાને સારુ, હિંદી  
શીખવાનું કહ્યું છે. જે માણુસો માતૃભાષાની ડેળવણી પામી ચૂક્યાં છે એટલાને જ  
આપે એ ચિનંતા કરી નથી. બધાં જ માણુસો માતૃભાષા સારી પેડે જાણે છે એમ માની  
કષ્ટએ તોપણ જનસમૂહ માતૃભાષા સિવાયની બીજી ભાષા શાખે એ શક્ય તેમ જ  
ઇછ નથી; શક્ય હોય તોયે સ્વાભાવિક નથી. આખા હિંદુસ્તાનમાં કામ કરનારા  
રાષ્ટ્રસેવકો, વેપારીઓ અને બિજન કર્યાં ઉત્તર ભારતના લોકો જેઠે રોજ સંબંધમાં  
આવતા હોય તેઓ જ હિંદી શીખી રાકે, તેમણે જ શીખવી જોઈએ. કંઈ પ્રચાર  
નહિ થાય તોયે ગરજના માર્યા તેમને એ ભાષા શીખવી પડયો.

આપ કલો છો કે, હિંદી પ્રાંતિક ભાષાઓને હંદાવી તેનું સ્થાન લેતી નથી પણ  
તેમાં પૂર્તિ કરે છે; પણ વ્યવહારમાં એમ બનતું નથી. તામિલનાડુના શિક્ષિત વર્ગોના  
મોટો ભાગ આને તામિલમાં નહિ પણ અંગ્રેજમાં વિચારો કરે છે ને લાગણ્યાં

પણ એ જ ભાષામાં અનુકૂળ છે. એમણે તામિલની પ્રેરપૂરી હિસેક્ષા કરી છે. ‘અમને તામિલ સારી રીતે બોલતાં લખતાં આવડહું નથી, પણ અમે છટાહાર અંગેલ બોલી લખી રાકીએ છીએ’, એમ એ લોકો જહેર સભાઓમાં ને બીજી જગત્યે ગર્વબેર કરે છે, એ આપ લખ્યો ત્યારે આપ સમજશો. કે તેઓ કુંડા જિંડા સંસ્કૃતિક દાસ્તલમાં પણ્યા છે. હવે એમાંના કેટલાક તામિલ કરતાં વધારે અંગેલની મદ્દથી હિંદી શીખવા લાગ્યા છે. એનું પરિણામ તો એનું એ જ આવવાનું છે. અંગેલને બદલે તેઓ હિંદીમાં વિચાર કરતા થશો. કોઈ ગુજરાતી આપને કહે કે, ‘હું હિંદીમાં સુદૂર નિયંધ લખ્યા રાડું પણ ગુજરાતીમાં નહિ’, તો આપ અને માટે હિતનીર થશો. ને આપને થશો કે આપણો હેઠાં પૂર્ણ સ્વરાજથી હળુ ધંધો ફૂર છે. તામિલનાડમાં ધણું કહેવા લાગ્યા છે કે, ‘અમને તામિલ કરતાં હિંદી વધારે સારી આવડે છે.’

માણ્યસે પોતાની માતૃભાષાને ઉવેખનિન બીજી કોઈ પણ ભાષા-ભણી દેવોની ભાષા બદલે હોય-શીખવી ન નેર્છિએ. આ બાબતમાં હિંદીના અનૂતલણા લોકો આગળ હું આપને દાખલો ટંકતો. હિંદી ભારતવર્ષની રાષ્ટ્રભાષા છે એમ આપ કહો છો ‘ખરા, પણ આપે ‘આત્મકથા’ કે ‘દક્ષિણ આસ્ત્રિકનો સત્યાગ્રહ’ હિંદીમાં નહિ પણ ગુજરાતીમાં લખ્યા છે. આપે એ પુસ્તકો હિંદીમાં લખ્યાં હોત તો આપ ને કહો છો તે ધણું લોકો આપના જ શાખાઓમાં જાળ્યી રાકત. પણ આપે તો એ ગુજરાતીમાં જ લખવાનું પસંદ કર્યું. આ બાબતમાં આપના ઉપરેશ અને આચરણમાં કુરક છે, છતાં હું આપનું આચરણ શુદ્ધ ને ચોણ્ય માનું છું. તેથી હું દંદસું હું કે, લોકો આપના ઉપરેશ પ્રમાણે ન ચાલતાં આપના આચરણનું અનુકરણ કરે.

સ્વરાજના અર્થ એ ન હોના નેર્છિએ કે, જીદી ભાષાએ બોલનારા પર કોઈ એક ભાષા પરાંયે લાદનામાં આવે. પ્રધાન પણ તો માતૃભાષાને જ અપાંનું નેર્છિએ. ભારત-વર્ષની રાષ્ટ્રભાષા હિંદીને ગૌણું પણ જ આપી રાકાય. સાચી પ્રેરણને ઉત્તુન ભાવના માતૃભાષા દ્વારા જ મળી શકે

હવે લિપિના પ્રશ્ન પર આવું. ૪-૫-૧૯૩૫ ના ‘હસ્તિન’માં, ઇદોરના હિંદી સાહિત્યસંભવને પસાર કરેલા ડરાના વિષે લખતાં, આપે ઉર્દૂ લિપિ વિષે જે પક્ષપાત બતાવ્યો છે તે મારી સમજમાં જિતરી શકતો નથી. બેંગલોરના પહોંચાનસમારંભના ભાષણુમાં પણ આપે ઉર્દૂ લિપિ માટે એવો પક્ષપાત બતાવ્યો છે. આપ સંસ્કૃતમાંથી જિતરી આવેલી અથવા તેની ધર્યી અસર તળે આવેલી બધી હિંદી ભાષાઓની લિપિને નારા કરીને, કેચો એ અનેક ભાષાઓએ શીખવા માગે તેમને માટે દેવનાગરી લિપિને પ્રચાર કરવા માગો છો. હિંદુ અને સુસલમાન બોલે છે એ એક જ ભાષાને માટે આપ દેવનાગરી ને ઉર્દૂ બંને લિપિ સાચવવા માગો છો. બીજાઓ, જે પણ કરોડાની સંખ્યામાં છે અને જેઓ જુહી જુહી આખા બોલવા કેરલા અલાગી છે, તેમણે પોતાની લિપિઓને નારા થવા દર્ઢ તેનું સ્થાન દેવનાગરીને બેના દેણું, એટલું

જ નહિ, પણ ૧૩ કરોડ છિંદુ અને ૭ કરોડ સુસલમાનની ખોલી સમજવા ને તેમની સાથે સંસર્ગમાં આવવાને હિંદી-હિંદુસ્તાની શીખવી અને વધારામાં ઉર્દુ લિપિ પણ શીખવી! આ હસવા જેવી વાત નથી લાગતી? આ ભારેમાં ભારે જુલસ નથી? આ નીતિનું સીધું પરિણામ એ જ આવવાનું કે, બંને લિપિમાં લખાતી હિંદી સિવાયની બધી ભાષાઓ નાખું થવાની, કેમ કે બધી ભાષાઓ હેવનાગરી લિપિમાં લખાતી થશે, બધા હિંદી શીખી જશે, અને પ્રાંતિક માતૃભાષાઓના બધા મહત્વના અંથેનો હિંદીમાં અલુચાહ થશે. આ પરિણામ આપણી સર્વોની જનમભૂમિ ભારતવર્ષને માટે હિતકારક થશે કે કેમ એનો આપ ક્ષણુભર વિચાર કરો એમ હું દચ્છું હું. આપ અનેક લિપિઓને સંહાર કરવા માગો તે પહેલાં એક જ લાષા માટે લખાતી એ લિપિ — હેવનાગરી અને ઉર્દુ — માથી એક ઉડાલી દેવાનો પ્રયત્ન આપે ન કરવો જેઈએ? એક જ ભાષા જોવનારા સુસલમાન અને છિંદુ એ જુદી જુદી લિપિ શા સારુ વાપરે?”

કણ્ણાટકનાં ૨ કરોડ ૧૦ લાખ ખીપુરુષોને સૌને મેં હિંદી-હિંદુસ્તાની શીખવાનું કહ્યું હોય એવું મારી જાણુમાં નથી. જેઓ કદી પણ ઉત્તર ભારતના લોકોના સંસર્ગમાં આવે છે તે બધા હિંદી-હિંદુસ્તાની શીખે તો મને ધણે જ સતેજ થઈ જય. પણ જ્યાં પ્રાંતભાપા હિંદી નથી એવા પ્રાંતનાં બધાં માણુસો હિંદી શીખે તો, આ પત્રલેખક ધ્યાં છે તેમ, હું હુંઘી ન થાઉં, એટલું જ નહિ પણ એ વસ્તુને બધાવી લાઉ. દરેક પ્રાંત પોતાની ભાષા જાણવા ઉપરાંત અધિલ ભારતની ભાષા જાણે — આખું આરતવર્ષ એક અધિલ ભારતીય ભાષા જાણે, એ મણ કે સ્વાસ્થાવિક શા માટે નથી? એવું જીન ડેવળ એબા નેટલા સુશિક્ષિત લોકોને જ શા માટે મળે ને વિશાળ જનસમૂહને કેમ ન મળે? ૩૦ કરોડ ઉપરાંતનું આખું રાખું એ ભાષા જાણે તો એ સંસ્કારિતાની ખૂલ્લાંયે ખૂલ્લ સાચી વાત છે.

પણ સૌથી મોટી દુર્લભ્યની વાત તો એ અને કે, કોઈ પ્રાંત, આ પત્રલેખકની ઇરિયાદ પ્રમાણે, તામિલનાડુમાં આજે ચાલી રહ્યું છે તેમ, પોતાની ભાષાની ઉપેક્ષા કરીને બીજી ભાષાને આપનાવે. તામિલનાડુના ભારા અનેક પ્રવાસો પરથી આ પત્રલેખકના જેવો જ મારો પણ પાડો અલિમાય બંધાયો છે. પણ હવે થોડા વખતથી એ પ્રાંતમાં સ્થિતિ સુધરતી દેખાય છે. અને દરેક પ્રાંતમાં સુશિક્ષિત લોકો જનસમૂહની સાથે સંસર્ગમાં આવવાના પ્રસંગો શોધવાની જરૂર જેમ જેમ બધારે સમજશે તેમ તેમ, ઘની શકે ત્યાં બધી,

બીજી બધી ભાષા કરતાં પ્રાંતિક ભાષાને પ્રથમ પદ આપવાની હિયાનો વેગ અનાયસે વધતો જરો.

અંગ્રેજ અને હિંદી-હિંદુસ્તાની વચ્ચે રાષ્ટ્રભાષા બનવાની હુમેશની હરીકાઈનો આ પત્રલેખક સહેજ ઈશારો કર્યો છે. હું જ્યારથી જાહેર જીવનમાં દ્વારા થયો ત્યારથી મારો નિશ્ચિત મત બંધાયેલો છે ને તે મેં જાહેર કર્યો છે કે, અંગ્રેજ ભારતવર્ષની રાષ્ટ્રભાષા કદી ન થઈ શકે, ન થબી જોઈએ; રાષ્ટ્રભાષા તો હિંદી એટલે કે હિંદુસ્તાની — ને ભાષા ઉત્તર ભારતના કરોડો હિંદુમુસલમાન યોલે છે તે — જ થઈ શકે. અંગ્રેજને રાષ્ટ્રભાષા ગણુવાનો પ્રયત્ન કરવાથી જનસમૂહ અને અંગ્રેજ ભણુલા વર્ગો વચ્ચે કાયમનું અંતર જીભું થવાનું, અને દેશની એના ધ્યેય પ્રત્યેની પ્રગતિ પાછી પડવાની. મેં કૂરી ઇરિને સમજાવ્યું છે કે, અંગ્રેજને આપણી સંસ્કૃતિમાં ચોક્સસ સ્થાન છે. અંગ્રેજ રાજકર્તાઓને અને આખા પાશ્ચાત્ય જગતને સમજવા સારુ, અને પશ્ચિમ પાસે ને આપવા જેનું છે તે હિંદુસ્તાનમાં લાવવા સારુ, આપણામાંથી થોડાએ પશ્ચિમમાં સૌથી વધારે પ્રયત્નિત અંગ્રેજ ભાષા શીખવી જોઈએ. પણ જે નિરક્ષર જનસમૂહ અને શિક્ષિત વર્ગો વચ્ચે એકત્ર સાધવી હોય તો એથી હજાર ગણા હિંદીયોએ હિંદી-હિંદુસ્તાની જાળુવી રહી છે.

પ્રાંતિક ભાષાને બધલે હિંદીને અગ્રસ્થાન અપાવું જોઈએ એવી સલાહ આપવાનો અપરાધ પણ મેં કર્યો છે એમ આ પત્રલેખક માને છે, એ મારો અલિપ્રાય વિષેનું એમનું નર્સું અજાન છે. આ બાયતમાં મારા સિદ્ધાંત અને મારા આચરણ વિષે કરો ઇરક નથી. માતૃભાષાને અગ્રસ્થાન અપાવું જોઈએ એ કુથને હું હાર્દિક ટેક આપું છું.

લિપિની ભાષાતમાં આ પત્રલેખકનો લય સાચો છે; અને મારો ને અલિપ્રાય છે તેને સારુ મને બેઠ પણ નથી. સંરકૃતમાંથી જીતરી આવેકી કે તેની સાથે નિકટનું સંગપણું ધરાવતી જુદી જુદી ભાષાઓને મારે એક જ લિપિ હોવી જોઈએ, અને તે દેવનાગરી જ છે. જુદી જુદી લિપિએ એ એક પ્રાંતના લોકોને બીજી પ્રાંતાની ભાષા શીખવામાં નક્કમા અંતરાયરિપ છે. યુરોપ એક રાષ્ટ્ર નથી છતાં તેણે સામાન્યપણે એક લિપિ સ્વીકારી છે. એક જ ભાષાને મારે દેવનાગરી અને ઉર્દૂ બને લિપિએ હું સહન કરું છું એ વસ્તુ વિસંગત. છે, એ હું જાણું છું. પણ મારી એ વિસંગતતા નરી એવકૂશી નથી. અત્યારે હિંદુમુસલમાન વચ્ચે ધર્મણ ચાલે છે. શિક્ષિત હિંદુ અને મુસલમાન એકુભીજા

પ્રયે બને એટલાં વધારે આદર અને સહિષ્ણુતા બતાવે એમાં ડાખાપણ છે ને એ જરૂરતું પણ છે. એટલે દેવનાગરી કે ઉર્દૂ લિપિ વચ્ચે વિકલ્પ રાખેલો છે. સહભાગ્યે પ્રાંત પ્રાંત વચ્ચે ધર્મણું નથી. એટલે આ સુધારો, કેનાથી પ્રાંતો વચ્ચે અનેક રીતે સ્નેહસંબંધ વધવાનો છે, તે ખાસ છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે, આપણું પ્રજાનો બાળ મોટો ભાગ છેકે જ નિરક્ષર છે. એના પર, માત્ર ઐડી ભાગના કે વિચારની મંદ્તાને કારણે, જુદી જુદી લિપિઓ શીખવાનો ઓને નાંખવો એ આપધાત કરવા બરોબર છે.

૬૦ બાં. ૧૯-૮-૧૯૩૯

## ૨૩. રાજકીય સંસ્થા નથી

હિંદી પ્રેમીઓને ખખર હશે જ કે, હિંદી સાહિત્ય સમેલનનું આવતા વરસનું અધિવેશન સિમલામાં થવાનું છે. એક સજાજન સિમલામાં કામ કરે છે તે લખે છે કે, આ સમેલન રાજકીય સંસ્થા છે ને એનું વલણ મુસલમાનોનું વિરોધી છે એવા સંશ્ય સિમલામાં કટલાક લેઝાને છે. હું એ વાર એનો પ્રમુખ થયો છું એટલે એધાડકપણે કંઈ શકું છું કે, આ સંસ્થાને રાજ્યપ્રકરણું જોડે કરી જ લેવાહેવા નથી. રાજ મહારાજાઓ તરફથી એ સંસ્થાને આશ્ય મળેલો છે. તેમાં તદ્દ્યુપ અનીને કામ કરનાર કેટલાયે માણસો એવા છે જે મહાસલાયાદી નથી. રાજ મહારાજાઓ ધખું વાર એનાં અધિવેશનોમાં હાજરી આપે છે. વડોદરાના ના. મહારાજ એક વરસે તેના પ્રમુખ થયેલા. હું જાણું છું કે, એ સંસ્થામાં મુસલમાનોનો વિરોધ કરવાની વૃત્તિ બિલકુલ નથી. એવી વૃત્તિ જરા પણ હોવાની શકી મને આવી હોત તો હું એનો પ્રમુખ ન થયો હોત. મુસિલમવિરોધીનો અર્થ ઉર્દૂવિરોધી એવો નહીં કરવામાં આવતો હોય, એવી આશા હું રાખું છું. ધણા લોડા ઉર્દૂવિરોધી અને મુસિલમવિરોધી એ એ શર્પદો એક જ અર્થના હોય એવી રીતે વાપરે છે. પણ એ વહેમ છે. પંજાય, હિંદી અને કશમીરમાં ધણા હિંદુ મુસલમાન બંનેની ભાષા ઉર્દૂ છે. જે ભાષા ઉત્તર હિંદુસ્તાનના હિંદુ અને મુસલમાન ઘોલે છે અને દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં લખે છે તે ભાષા હિંદી, એવી એની વ્યાખ્યા ૧૯૩૫માં દુદોરમાં મળેલી, હિંદી સાહિત્ય સમેલનની બેઠકમાં કરવામાં આવી છે, એ સુચક

વસ્તુ છે. એટલે હું આખા રાખું છું કે, મુસ્લિમવિરોધી એ શષ્ઠ ઉર્દૂવિરોધીના અર્થમાં વાપરેલો હોય તોપણું, આ પત્રલેખક ને શંકને વિષે લખે છે તે શંકા ફૂર થશે, અને સિમલામાં લરાનારા હિંદી સાહિત્ય સમેલનના અધિવેશનની તૈયારીનું કામ, સમેલનના ધ્યેય કે વલણ વિષે કશી શંકા કે સંશય વિના, ચાલવા માંડશે.

૬૦ ૮૦, ૧૩-૪-૩૭

## ૨૪. હિંદી વિં ઉર્દૂ

હિંદી ઉર્દૂનો સવાલ તો હમેશાનો થઈ પડ્યો છે. આ સવાલ વિષે મેં મારા વિચાર ધર્થી વાર પ્રગટ કર્યા છે, છતાં તેની મુનરક્તિ થઈ શક એવી છે. કશી દલીલો આપ્યા વિના માત્ર મારી માન્યતા કહી જાઓ છું :

હું માનું છું કે—

૧. હિંદુસ્તાની અને ઉર્દૂ એ વણે શષ્ઠો એકજ ભાષાના — જે ઉત્તરમાં હિંદુ તેમ જ મુસ્લિમાન એલે છે અને દેવનાગરી અથવા ફારસી લિપિમાં લખે છે તેના — વાચક છે;

૨. આ ભાષા, જે હિંદુ અને મુસ્લિમાન બંને વાપરતા, તેને માટે ‘ઉર્ડુ’ શષ્ઠાની ઉત્પત્તિ થઈ તે પહેલાં, ‘હિંદી’ એ જ નામ વપરાતું.

૩. ‘હિંદુસ્તાની’ શષ્ઠ પણ એ જ ભાષા સૂચવવાને પાછળથી વપરાવા લાગ્યો. (એની તારીખની મને ખખર નથી).

૪. હિંદુ અને મુસ્લિમાન બંનેએ ઉત્તરના આમર્ગના કરોડો લોકો સમજે એવી ભાષા એલવાનો પ્રયાસ કરવો જોઈએ.

૫. તે છતાં ધાર્યા હિંદુ ડેવળ સંસ્કૃત શષ્ઠો જ વાપરવાનો આગ્રહ રાખશે, ને તે પ્રમાણે ડેટલાક મુસ્લિમાન ડેવળ ફારસી કે અરથી શષ્ઠોથી અરેલી ભાષા વાપરશે. જ્યાં લગી એ ડેમમાં એકળીનને વિષે અવિશ્વાસ ને અણગાપણું છે, ત્યાં લગી આ વસ્તુ આપણે સહી લેવી પડશે. જે હિંદુએ અમુક વિષયના મુસ્લિમાનોના વિચારો સમજવા માગતા હશે તે ફારસી લિપિમાં લખેલી ઉર્ડૂ શીખશે; અને તે જ પ્રમાણે જે મુસ્લિમાનો અમુક વિષયના

હિંદુઓના વિચાર સમજવા માગતા હશે તે દેવનાગરી લિપિમાં લખેલી હિંદી શીખશે.

૬. આખરે જ્યારે આપણાં હૃદય એક થશે, સો પોતપોતાના માતોને અહલે સમસ્ત ભારતવર્ષને પોતાનો દેશ ગણી તેને વિષે અભિમાન ધરાવશે, અને કોણી રીતે આપણે એક જ વૃદ્ધનાં ઇણને જુદાં જુદાં છતાં એક ગણીને સ્વાદથી ખાઈએ છીએ તેમ, સર્વ ધર્મો એક જ ભૂગમાંથી ઉહ્લાલેલા છે એવું સમજશે ને આચરણે, ત્યારે આપણે પ્રાંતિક ઉપયોગને માટે પ્રાંતલાખાઓને કાયમ રાખીને, આખા રાષ્ટ્રને માટે એક લિપિમાં લખાતી એક રાષ્ટ્રલાખા નાપરતા થાએયાં.

૭. ક્રાઈ પણ પ્રાંત કે જિલ્લા કે ડેમ પર હિંદીની ક્રાઈ પણ એક લિપિ કે એક પ્રકાર પરાણે લાદવાનો પ્રયત્ન કરવાથી દેશનું લિલ બગડે એમ છે.

૮. રાષ્ટ્રલાખાના પ્રશ્ન ધાર્મિક ભલભેદથી અદળ રીતિ વિચારવે જોઈએ.

૯. રોમન લિપિ હિંદુસ્તાનની રાષ્ટ્રલિપિ ન થઈ શકે, ન થવી જોઈએ. હરીક્રાઈ ડેવળ ફારસી અને દેવનાગરીની વચ્ચે જ હોઈ શકે. દેવનાગરીમાં જે સ્વભાવસિદ્ધ ગુણ છે તેનો વિચાર કરે મૂકીએ તોપણું, એ હિંદુસ્તાનની રાષ્ટ્રલિપિ થવી ધર્ટે છે, ડેમ કે ધર્ણીભરી પ્રાંતિક લિપિઓ દેવનાગરીમાંથી ઉહ્લાલી છે ને તેથી એમને માટે એ જ લિપિ શીખવામાં સૌથી વધારે સુગમ છે. છતાં એ લિપિ મુસલમાનો પાસે, એટલું જ નહીં પણ એ લિપિ ન જાણુનાર ખીંઠ સૌની પાસે, પરાણે સ્વીકારવાનો પ્રયત્ન ન જ થવો જોઈએ.

૧૦. ઉર્ફને દિંદીથી નોણી ગણીએ તો મેં ઉર્ફની સેવા કરેલી છે. તે આં : દ્રદોરમાં દિંદી સાહિત્ય સંમેલને મારા કહેવાથી ૧૬૩ કલમમાં આપેલી વ્યાપ્યા સ્વીકારી, અને નાગપુરમાં ભારતીય સાહિત્ય પરિષદે મારા કહેવાથી એ વ્યાપ્યા કથ્યુલ રાખી, અને આંતરપ્રાંતીય વ્યવહારની સર્વસામાન્ય ભાષાને ‘હિંદી-હિંદુસ્તાની’ એ નામ આપ્યું; અને એમ કરીને રાષ્ટ્રલાખાને સમૃદ્ધ કરવાના અને એ ભાષામાં સર્વ પ્રાતોના ઉત્તમોત્તમ વિચારોને ઉનારવાના પ્રયત્નમાં હિંદુ તેમ જ મુસલમાન બંને ભાગ લઈ શકે એને માટે પૂરેપૂરે અવકાશ આપ્યો છે.

૪

[ શ્રી. જવાહરલાલ નેહુંએ આ વિષય પર અગ્રેજમાં એક સરસ પત્રિકા લખેલી છે તેમાં કરેલી નીચેની સૂચનાઓ\* આહી ઉતારું છું. મોં ક૦ ક૦ ગાંધી ]

૧. આપણું જાહેર કામકાજ પ્રાંતભાષામાં ચાલવું જોઈ એ અને ડેળવણી પણ  
એ જાં ભાષામાં આપાની જોઈ એ. એ પ્રદેશમાં એ ભાષા પ્રધાન ભાષા રહેવી જોઈ એ.  
આ કામને સારુ નીચેની હિંદી ભાષામાનો સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવે:  
હિંદુસ્તાની (હિંદી તેમ જ ઉદ્દી), બંગાળી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ,  
મલયાણમ, ગુજરાતી, આસામી, સિંધી, અને કેટલેક અંશે પુરુષ તથા પંનણી.

૨. હિંદુસ્તાની બોલનારા પ્રદેશમાં હિંદી તેમ જ ઉદ્દી (તેમની લિપિઓ સાથે)  
બંનેનો સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવે. જાહેરનામાં બંને લિપિમાં નીકળવાના  
જોઈ એ. અદાલત કે સરકારી કચેરીને કાગળ લખતાં માણુસ બેમાંથી ગમે તે લિપિ  
વાપરી રકે; અને ભીજી લિપિમાં લખેલી નકલ પહોંચાડવાનો હુકમ ન થવો જોઈ એ.

૩. હિંદુસ્તાની બોલનારા પ્રદેશમાં સરકારી ડેળવણીનું વાહન હિંદુસ્તાની હોઈ,  
બંને લિપિ સ્વીકારવારો ને વાપરી રક્ખાશે. દેરેક વિધાયી કે તેનાં ભાષાપ લિપિની  
પસંદગી કરશે. વિધાયીઓને બંને લિપિ શરીખવાની ફરજ નહિ પાડવામાં આવે, પણ  
દાઈસ્કૂલમાં એમને એ શરીખવાનું ઉતેજન આપી રકાય.

૪. હિંદુસ્તાની (બંને લિપિમાં લખેલી) ને અભિસ ભારતની રાજ્યભાષા તરીકે  
સ્વીકારવામાં આવશે એટલે આખા હિંદુસ્તાનમાં કોઈ પણ માણુસને કોઈ અદાલત  
કે સરકારી કચેરીને હિંદુસ્તાની (બેમાંથી ગમે તે લિપિમાં લખેલી) માં કાગળ લખવાની  
છૂટ રહેશે ને તેને એની ભીજી લિપિ કે ભાષામાં લખેલી નકલ આપવાની જરૂર નહિ  
જ પાડવામાં આવે.

૫. દેવનાગરી, બંગાળી, ગુજરાતી અને મરાઠી લિપિઓનું ઓક્સિક્રિપ્ટ કરવાનો,  
અને થાપવામાં, ટાઇપ કરવામાં ને આધુનિક ચાંચિક સાધનેમાં કામ લાગે એલી  
સંયુક્ત લિપિ પેદા કરવાનો પ્રયત્ન થવો જોઈ એ.

૬. સિંધી લિપિને ઉદ્દી લિપિમાં બેળવી દેવી જોઈ એ, અને ઉદ્દી લિપિને બની  
રકે એટલી થાપવા, ટાઇપ કરવા વગેરેમાં કામ લાગે એલી રીતે, સાદી બનાવવી જોઈ એ.

૭. દક્ષિણ ભારતની લિપિઓને દેવનાગરીને મળતી બનાવવાની શક્યતા ડેરીલી  
છ એનો વિચાર કરવો જોઈ એ. અને એ શક્ય ન લાગે તો પણ દક્ષિણ ભારતની  
ભાષાઓ — તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાણમ — ને માટે એક સમાન લિપિ  
યોજવાનો પ્રયત્ન કરવો જોઈ એ.

૮. રામન લિપિમાં અનેક લાલ હોવા છતાં, એથામાં એણું અત્યારે તો, આપણી  
ભાષાઓને માટે એ લિપિને વિચાર આપણાથી થઈ રકે એમ નથી. એટલે આપણી

\* 'હિંદી-ઉદ્દી' એ ભાષાને આ સૂચનાઓ '૫૦ બંં'માં પ્રસિદ્ધ થઈ હતી.

પણ એ લિપિઓ હોવી નેઈએ : એક તો સંયુક્ત દેવનાગરી—આંગણી—ગુજરાતી—મરાઠી ; અને ઉર્ડૂ—સિંધી ; અને જરૂર જાણ્યાય , અને દક્ષિણ ભારતની લિપિઓ દેવનાગરીને મળતી ન જનાવી રહાય તો, દક્ષિણ ભારતની ભાષાઓને માટે એક લિપિ.

૯. હિંદુસ્તાની ભાષા બોલનાર પ્રેરણમાં હિંદી અને ઉર્ડૂમાં જુદા જુદા પ્રવાહમાં વહેવાનું ને વિકસવાનું ને વલણ હેખાય છે તેથી ભડકવાની જરૂર નથી, તેમ એમાંથી એકેના વિકસમાં અંતરાય નાંખવાની જરૂર નથી. ભાષામાં નવા અને વધારે કઢણ અને ગહૂન વિચારેનો પ્રવેશ થાય એટલેક આંશો બને એ સ્વામાનિક છે. એમાંથી એકેનો વિકસ થયો તો એથી ભાષાની સમૃદ્ધિ વધયો. આગળ જતાં જેમ જગતના પ્રવાહો અને રાષ્ટ્રવાહનું દ્વારા આ હિંદુસ્તાન વધયો, તેમ એની વર્ચ્યે મેળ સધારો અને લોકરિક્ષણું ને લીધે પણ એમાં અમુક પ્રમાણમાં એકધારાપણું ને સમાનતા આવશે.

૧૦. ભાષા (હિંદી, ઉર્ડૂ કે ખીજ હિંદી ભાષાઓ) વાપરતાં જનસમૂહ તરફ નજર રાખવી નેઈએ ને તેઓ સમજ શકે એવી ભાષા બોલવી નેઈએ, એ વસ્તુ તરફ આપણે ભાર ભૂકવો નેઈએ. આમબર્ગના લોકો સમજ શકે એવી સાહી ભાષામાં લેખણોએ લખતું નેઈએ, ને ને પ્રશ્નો આમબર્ગના જીવનને રૂપર્ચ કરે છે તેની ચર્ચા તેમણે કરવી નેઈએ. દરખારી તેમ જ આડંખરી શૈલી અને જરૂરતોડ શખ્ફોના વાપરને ઉત્તેજન ન આપતું નેઈએ. અને સાહી જેરદાર શૈલી ખીલવણી નેઈએ. અના ખીલ લાભ તો છે જ, પણ તે ઉપરાત એનાથી હિંદી અને ઉર્ડૂનો મેળ પણ સધારો.

૧૧. ‘મૂળ’ અંગેજના ધોરણ પર ‘મૂળ’ હિંદુસ્તાની ખીલવણી નેઈએ. આ ભાષા સાહી હોય, એમાં વ્યાકરણ નહિ જેવું હોય, ને હજારેક શખ્ફોનો ભંડાળ હોય. એ ભાષા સંપૂર્ણ હોવી નેઈએ, બધા સામાન્ય ભાષણ અને લખણું ને માટે કામ લાગે એવી હોવી નેઈએ, અને છતાં એ હિંદુસ્તાનિના ચોકણાની અંદર જ એસાડેલી ને એ ભાષાના વધારે અભ્યાસને માટે આરંભણ હોવી નેઈએ.

૧૨. આવી ‘મૂળ’ હિંદુસ્તાની ખીલવણા ઉપરાત આપણે હિંદુસ્તાની (હિંદી અને ઉર્ડૂ બંને) માં, અને બની શકે તો ખીજ હિંદી ભાષાઓમાં પણ, વાપરવાની વૈજ્ઞાનિક, ઔદ્યોગિક, રાજકીય અને વેપારી પરિસ્થિતા નક્કી કરવી નેઈએ. જ્યાં જરૂર પડે ત્યાં આવા શખ્ફો વિદેશી ભાષાઓમાંથી લઈ ને જેવા ને તેવા આપણે ત્યાં દ્વારા કરવા નેઈએ. આપણી પોતાની ભાષાઓમાંથી એવા ખીલ શખ્ફોની યાદીએ બનાવવી નેઈએ, જેથી ઉદ્યોગ, વિજ્ઞાન અને એવા ખીલ વિષયોમાં આપણી પાસે ચોક્કસ અથ્વ સુચનારા અને સર્વ ભાષામાં સમાન એવા શખ્ફોનો ભંડાળ તૈયાર થઈ જય.

૧૩. સરકારી ડેગવણીનું ધોરણ એવું હોતું નેઈએ કે ડેગવણી વિદ્યાર્થીની જરૂરમાંભાષામાં આપાય. દરેક ભાષાવાર પ્રાંતમાં પ્રાથમિકથી માંગને યુનિવર્સિટી લગ્નિનું શિક્ષણ તે પ્રાંતની ભાષામાં આપાય. દરેક પ્રાંતમાં, જેમની જરૂરમાંભાષા ખીજ કાઈ

હિંદી ભાષા હોય એવા નિધાર્થીઓની સંગ્રહા પૂરતી હોય, તો તેમને તેમની જન્મ-ભાષામાં પ્રાથમિક કેળવણી મેળવવાનો હક રહેશે. માત્ર તેઓ કોઈ સંગ્રહકરેલા મથકની ઠીક ઠીક નજીક રહેલા હોવા જોઈ એ. એ સંગ્રહા જે પૂરતી મોટી હોય તો એમને હાઈસ્કુલની કેળવણી પણ એમની જન્મભાષામાં આપવાનું બની શકે. પણ એવા બધા નિધાર્થીઓએ જે પ્રાંતમાં રહેતા હોય ત્યાંની ભાષા ફરજિયાત વિષય તરીકે જાણવી પડશે.

૧૪. હિંદુસ્તાની ન બોલનાર પ્રહેશમાં 'મૂળ' હિંદુસ્તાની હાઈસ્કુલોમાં શીખવાની જોઈએ, અને તે કઈ લિપિ દ્વારા શીખવી એ શીખનારની મરણ પર છોટું જોઈએ.

૧૫. યુનિવર્સિટીની કેળવણી પ્રાંતકાશા મારફતે આપાવી જોઈએ. હિંદુસ્તાની (એમાંથી ગમે તે લિપિમાં) અને એક વિદેશી ભાષા ફરજિયાત શીખવાની જોઈએ. વધારાની ભાષાએ ફરજિયાત શીખવાનો ચા નિયમ બાંચા ઔદ્યોગિક શિક્ષણને ન કાણું પડનો જોઈએ, લેકે એમાં પણ અનેક ભાષાનેનું જ્ઞાન હોય એ ધૃત તો છે જ.

૧૬. વિદેશી ભાષાએ તેમ જ આપણી પ્રાચીન ભાષાએ શીખવાની સંગ્રહ આપણી હાઈસ્કુલોમાં કરવી જોઈએ; પણ અસુક ખાસ અવયાસકરને માટે અથવા તો યુનિવર્સિટીના શિક્ષણની તૈયારી કરવી હોય તે સિવાય એ વિષયો ફરજિયાત ન રખાવા જોઈએ.

૧૭. વિદેશી સાહિત્યોમાંથી પ્રાચીન અને આધુનિક સુંહર અંથાના અનુવાદો હિંદી ભાષાએમાં થવા જોઈએ, જેથી આપણી ભાષાએવાનો બીજી હેઠાના સંરક્ષારો, સાહિત્યો ને સામાજિક પ્રવૃત્તિએવાની સાથે સંસર્ગ સધાય ને તેને લાભે આપણી ભાષાએવાની શક્તિ વધે.

૬૦ બં૦, ૨૨-૮-૧૯૩૭

## ૨૫. આવકારપાત્ર નિવેદન

મૌલની અધ્યાત્મ હક્કસાહેબ અને આખુ રાજેન્દ્રપ્રસાદે મળાને હિંદી-ઉર્ડુ-વાદ વિષે જે નિવેદન પ્રગટ કર્યું છે, તે પરથી એવી આશા બાંધી શકાય ખરી ઢે, એ વાદ હવે બંધ થશે, અને જેએ અંતરમાંતીય ભાષાના વિકાસમાં રસ ધરાવે છે તેઓ એ પ્રશ્નો એના શુણુદેખની જ દાખિએ વિચાર કરી શકશે, ને સૌ સાથે મળાને કરી શકે એવી ક્રમની ઘોળના ઘોળા શકશે. એ નિવેદન આ પ્રમાણે છે :

“પટનામાં તા. ૨૮ મી ઓગસ્ટે ખિલાર ઉર્દુ સમિતિની સલા થયેલી તે પ્રસંગે અમને હિંદુસ્તાની ભાષાના સવાલ વિષે એકધીજની સાથે તેમ જ ખીલ કેટલાક મિત્રો સાથે ચર્ચા કરવાની તક મળી હતી. ઉર્દુ-હિંદી-હિંદુસ્તાનીના વાહની ભાષાતમાં ને ગેરસમને દુર્લભી પેહા થઈ છે તે દૂર કરવાને અમે આતુર હતા. અમને કહેતાં આનંદ થાય છે કે, આ પ્રક્રણાં અનેક અંગલખાંગની ચર્ચા અમે કરી તેને પરિણારે, આ વાદને અંગે ઉપરિથિત થયેલા અનેક પ્રશ્નોમાં અમારી વચ્ચે ઢીક ઢીક એકમત છે એમ અમે જોઈ શક્યા. અમે એ વાતમાં સહૃભત છીએ કે, હિંદુસ્તાની એ હિંદુસ્તાની રાષ્ટ્રભાષા થબી જોઈએ, અને ઉર્દુ તેમ જ નાગરી બંને લિપિમાંલાભાની જોઈએ, સરકારહરભારમાં તેમ જ કેળવણીમાં એ બંને લિપિને માન્યતા મળવી જોઈએ. ‘હિંદુસ્તાની’ અમે તે ભાષાને કહીએ છીએ જે ઉત્તર હિંદુસ્તાનમાં ઘણા જ મોટા ભાગના લોકો બાદે છે; અને અમે માનીએ છીએ કે, જે શખ્ષે સાધારણું વ્યવહારમાં વપરાતા હોય તે પસંદ કરીને હિંદુસ્તાની શખ્ષેભાડોળમાં દાખલ કરવા જોઈએ. વળી અમે એમ પણ માનીએ છીએ કે ઉર્દુ તથા હિંદી બંનેને તેમ જ સાહિત્યમાં વપરાતી ભાષાઓને વિકાસ માટે પૂરેપૂરી તક આપવી જોઈએ. અમારી સૂચના એવી છે કે, ઉર્દુ અને હિંદીના વિદ્વાનોના સાહિત્ય મેળવીને હિંદુસ્તાની શખ્ષેનોનો એક મૂળ કોશ રચવાનો પ્રયત્ન થવો જોઈએ.

આવા કોશની રચનાને સારુ વહેવાકે પગલાં લેવા માટે, તેમ જ પારિભાષિક શખ્ષેનો પસંદગી જોવા અનેક પ્રશ્નોને નિકાલ આણું. માટે, એક નાની પ્રતિનિધિત્વ સમિતિ નીમંવી જોઈએ. આ એ ભાષાઓને એકધીજની વધારે નજીક આણું. અને હિંદુસ્તાની ભાષાના વિકાસને ઉનેજન આપવું, ને એ રીતે એ એ ભાષા બોલનારાયોની વચ્ચે સહૃભત પેહા કરવો છાપું છે, એમ જોયો માનતા હોય, એવા ઉર્દુ તેમ જ હિંદીના પ્રતિષ્ઠિત હિંમાયતીયોની એ સમિતિ બનાવવી, અને સમિતિ બંને એટલી વહેલી બોલાવવી, એવી અમારી સૂચના છે.”

આપણે આશા રાખીએ કે આ નિવેદનના લેખકો સર્વ પક્ષો સ્વાક્ષરે એવા હિંદુસ્તાની શખ્ષેનો મૂળ કોશ તૈયાર કરવાને તરથી પગલાં દેશે, અને આ કામને માટે તેમ જ ‘અનેક મોટા પ્રશ્નોનો નિકાલ આણું માટે’ જે સમિતિ તેમણે નીમયા ધારી છે તે તરત જ નિમારો. જે કામ ઝપાટમાં ઉકેલવું હોય તો સમિતિ નાની હોવી જોઈએ એ વસ્તુ પર હું ભાર મણું છું.

## ૨૬. મદ્રાસમાં હિંદુસ્તાનીનું શિક્ષણ

[ મદ્રાસની કોન્ફેસ સરકારે ધ્યાનાની શાળાઓમાં હિંદુસ્તાનીનો વિષય દાખલ કર્યો તે સામે વિદેશદર્શને તરેછ તરેહનાં ને અધિનિત પણ પગલાં કટલાક લોકે લીધાં. તે વિષે ગાંધીજીને પણ ફરિયાદ ગઈ. રાન્જની સરકારે ભાહાર પાડેલો ખુલાસો અને પછી ગાંધીજીએ તે અંગે લખેલ ‘મહાસભાવાદીઓ, સાવધાન’ દેખમાંથી તે અંગેનો ભાગ નીચે આપ્યો છે.]

૧

મદ્રાસ સરકારે ગઈ દ્વારા નીચેનું લાહોરનામું ખાહાર પાડયું છે :

આ પ્રાંતની નિશાળોમાં હિંદુસ્તાનીનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો છે તેને અંગે ધ્યાન ભરમાનનારો પ્રચાર ચાલી રહ્યો છે. સરકાર આ ભાગની પોતાની નીતિ સ્પષ્ટ કરવા ધ્યાં છે, જેથી આ વિષે જે કંઈ ગેરસમજ પેદા થની સંભવિત હોય તે દૂર થાય.

આપણા પ્રાંત હિંદુસ્તાનના રાજ્યીય જીવનમાં તેનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે તેને મારે, હિંદુસ્તાનમાં જે ભાષા સૌથી મોટી સંખ્યા બેલે છે તે ભાષાનું બ્યવહારું જીવાન આપણા જીવાનોને હોય એ જરૂરનું છે. તેથી સરકારે આપણા પ્રાંતની લાધરિઝૂલોના અભ્યાસક્રમમાં હિંદુસ્તાનીનો વિષય દાખલ કરવાનો હરાવ કર્યો છે. સરકાર એ સ્પષ્ટ કરવા ધ્યાં છે કે, કાઈ પણ પ્રાથમિક શાળામાં હિંદુસ્તાની દાખલ કરવામાં આવનાર નથી, અને એવી નિશાળોમાં તો ફક્ત માતૃભાષા જ શીખવવામાં આવશે. હિંદુસ્તાની ફક્ત લાધરિઝૂલોમાં જ — અને ત્યાં પણ પહેલાં, બીજા અને ત્રીજા ઘોરણુમાં જ, એટલે ક શાળાના જીવનના છ્ડા, સાતમા ને આઠમા વરસમાં જ — દાખલ કરવાની છે. તેથી તે લાધરિઝૂલોમાં કોઈ પણ રીતે માતૃભાષાના શિક્ષણમાં અંતરાયદ્વારા નહિ થઈ પડે. માતૃભાષાનો અભ્યાસ તો પહેલાંની જેમ જ કરવવામાં આવશે, અને એક વર્ગમાંથી બીજા વર્ગમાં ચારવવાનું હિંદુસ્તાનીની અણુચાવડતને લીધે અટકી પડશે નહિ; પણ તેનો આધાર, પહેલાંની પેઢે, સામાન્ય આવડત ઉપર અને માતૃભાષા સહિત અન્ય વિષયોમાં મેળવેલા હેડડા ઉપર રહેશે. હિંદુસ્તાની ફરજિયાત એ જ અર્થમાં રહેશે કે, તેના વર્ગીમાં હાજરી આપવાનું ફરજિયાત રહેશે, અને વિદ્યાર્થીઓ તામિલ, તેલુગુ, મલયાલમ કે કન્નડની અવેજીમાં હિંદુસ્તાની નહીં લઈ શકે, પણ એમાંની એક ભાષા ઉપરાંત તેમને હિંદુસ્તાની શીખવાની રહેશે.

વળો સરકારે એવો પણ હુકમ કરી દીધેલો છે કે, આ વરસે હાઈસ્ક્યુલોમાં ચોથા ધોરણુંથી માંડીને — અને આવતાં એ વરસમાં દાઈસ્ક્યુલના સૌથી ઉપલા ધોરણું સુધી — ડેળવણી માતૃભાષા દ્વારા જ અપાવી જોઈએ, જે પ્રદેશોમાં એ ભાષાના પ્રચારને લાઘે પ્રશ્ન અટપણે ન બનતો હોય ત્યાં બધે આ પ્રમાણે કરવાનું છે. માતૃભાષાનું મહત્ત્વ અભ્યાસક્રમમાં શરૂઆતથી આખર સુધી જળવાશે. સરકાર માધ્યમિક સ્કૂલસર્ટિફિકેટ પરીક્ષાને લગતા નિયમોમાં એવો સુધારો કરવા માગે છે કે, એ પરીક્ષા આપનાર સર્વ વિદ્યાર્થીઓને માતૃભાષામાં પોતાના વિચારો સારી રીતે પ્રગટ કરતાં આવડે એ ઇરજિયાત ગણાવું જોઈએ. આમ સરકારે આ પ્રાંતની ડેળવણીની યોજનાનાં માતૃભાષાનું મહત્ત્વ લક્ષ્યમાં રાખ્યું છે, અને વસ્તુતા: માતૃભાષાએ અત્યાર લગી લોગવ્યું છે તેના કરતાં વધારે ઊચા મહત્ત્વને રથાને તેને પહોંચાડવાને સરકાર પગલાં લઈ રહી છે.

૬૦ ૫૦, ૧૯-૯-૧૯૩૮

૩

મારા પર કાગળો ને તારોનો વરસાદ વરસી રહ્યો છે, તેમાં તે મોકલનારાઓ જેને મદાસના મુખ્ય પ્રધાનનાં ભયાનક દુર્વત્તનો માને છે તેને વિષે ઇરિયાદો કરેલી છે. એમાંથી એ બાબતો, જેને વિષે લિંગુસ્તાનમાં ધર્ણી જગાએ વિરોધી ટીકા થયેલી છે, તે હું ચૂંટી કાહું છું. એ બાબતો તે એમની લિંગુસ્તાની વિષેની નાિત, અને પિડેટિંગનો વાસ હળવો કરવાને તેમણે કરેલો ક્રિમિનલ લો એમેંડમેંટ એકટનો ઉપયોગ એ એ છે.

\*

\*

\*

હવે રાજ્યાં સામેની જે એ મોકા ઇરિયાદો છે તેને વિષે એ શાખ કહી લડી. લિંગુસ્તાની આપણી રાજ્યભાષા, એટલે કે પ્રાંત પ્રાંત વચ્ચેના વહેવારની ભાષા છે કે થવાની છે, એ આપણી જાહેરતો જે સાચી દાનતર્થી કરેલી હોય, તો લિંગુસ્તાનીનું શિક્ષણ ઇરજિયાત કરવામાં અયોગ્ય કશું નથી. ઈંગ્લાંડની નિરાગોમાં લોટિન ઇરજિયાત દર્તી અને કદાચ દજુ દર્શે. એના અભ્યાસથી અંગ્રેજના અભ્યાસમાં અંતરાય નથી આવ્યો, પણ જિલ્ડું એ મદાન ભાષાના ગાનને લાધે અંગ્રેજ ભાષા સમૃદ્ધ બની છે. ‘માતૃભાષા પર સંકટ આવી પડશું છે’ એવી જે ખૂબ પાડવામાં આવે છે, તેમાં કાં તો અજાન રહેશું છે, કાં તો દંલ રહેલો છે. અને જ્યાં એ ખૂબની પાછળ સાચી લાગણી છે ત્યાં

ને લોકો આપણાં બાળકોને હિંદુસ્તાની માટે રોજરો એક કુલાક આપવાની આનાકાની કરે છે, તેમની દેશભક્તિ કેવી છીજરી છે તે હેખાઈ આવે છે. આપણે જો અભિલ ભારતીય રાષ્ટ્રીયતાદ્વારી ડાપું મેળવું હોય, તો પ્રાંતીયતાદ્વારી ડાયલું લાંગવું જ જોઈએ. હિંદુસ્તાન એક દેશ અને એક રાષ્ટ્ર છે, કે ધણા દેશ અને ધણાં રાષ્ટ્ર છે? એ એક દેશ છે એમ જેઓ માને છે, તેમણે રાજીજુને પોતાને પૂરેપૂરે રેકા આપવો ધરે છે. રાજીજુની પાછળ જો લોકમતનું બળ નહીં હોય, તો તેઓ પોતાનું પહ ગુમાવી એસશે. પણ જો એમની પાછળ લોકમતનું બળ ન હોય તો એમની પસે જખરદસ્ત અહુમતી છે એ વિચિત્ર ગણ્યાય. પણ એમની પસે અહુમતી ન હોય તેથી શું? તો એમણે પ્રધાનપદ છોડી દેવું જોઈએ, પણ પોતાની બાંડમાં બાંડી શક્ષાંઓ તો તેમનાથી ન જ છોડી શકાય. એમની અહુમતી એ જો મહાસલાના સંકલપની પ્રાતિનિધિ ન હોય, તો એ અહુમતીની કરી કિંમત નથી. મહાસલા કંઈ અહુમતીને વરેલી નથી; એ તો આ રાષ્ટ્રને ઓછામાં ઓછા સમયમાં મહાન અને સ્વતંત્ર અનાવે એવી જે જે વસ્તુઓ હોય તેને વરેલી છે. . . .

૬૦ અંં૦, ૧૧-૬-'૩૮

## ૨૭. હિંદુસ્તાની, હિંદી અને ઉર્દૂ

હિંદી-ઉર્દૂના સવાલ વિષે તીખો વાદવિવાદ પેદા થયો છે અને હજુ ચાલુ છે એ બહુ ઐધની વાત છે. મહાસલાએ પોતાના કામકાજની ભાષા તરીકે હિંદુસ્તાનીને સ્વીકાર કરેલો છે અને આંતરપ્રાંતીય સંસર્ગને માટે એને અભિલ ભારતીય ભાષા તરીકે કલ્પેલી છે. એ પ્રાંતીય ભાષાઓને નાભૂષ કરી તેનું સ્થાન લેવા માટે નથી, પણ તેમાં પૂર્તિ કરવા માટે છે. કાર્યવાહક સમિતિએ થોડા વખત પર કરવા ફરાવથી (જુઓ પ્રકરણ ૧૮, ખાંડ ૨) આ આખતની બધી શાંકા શાંકાં પડવી જોઈએ. જે મહાસલાવાદીઓને અભિલ ભારતીય કામ કરવાનું છે તેઓ જે માત્ર અને લિપિમાં હિંદુસ્તાની શીખવાની નકલીકુદ લેશે તો આપણે એક રાષ્ટ્રભાષાના ધ્યેયની દ્વિષામાં ધણાં પગલાં આગળ ધર્પીશું. ખરી હરીકાઈ હિંદી અને ઉર્દૂ વચ્ચે નથી, પણ હિંદુસ્તાની અને અંગેજની વચ્ચે છે, એ સખત લડાઈ છે. હું લારે ચિંતાથી એ નિહાળા રહ્યો છું.

હિંદી-ઉર્ડુવાદને કંઈ પાયો જ નથી. મહાસલાની કલ્પના પ્રમાણેની હિંદુસ્તાનીનું ચોકસ રૂપ હજુ ધડાવું રહ્યું છે. મહાસલાતું કામકાજ જ્યાં સુધી કેવળ હિંદુસ્તાનીમાં જ ન ચાલે તાં સુધી એ અનવાનું નથી. મહાસલાએ મહાસલાવાદીઓના ઉપયોગ માટે શખ્ફડોરો નિયત કરવા પડશે, અને એક આતાએ શખ્ફડોરો દ્વારા અહારના નવા શખ્ફો પૂરા પાડવા પડશે. એ ભગીરથ કામ છે, પણ આપણે જો અરેખર જીવતી, વિકસતી અભિલ ભારતીય ભાષા જોઈતી હોય, તો એ કામ કરવા જેવું છે. અત્યારે જે સાહિત્ય — ચોપડીએ, માસિકા, સામાલિકા, હૈનિકા — ઉર્ડુ કે હેવનાગરી લિપિમાં લખેલું મોજૂદ છે, તેમાંથી ક્યાને હિંદુસ્તાની ગણવું, એ આ આતાએ નક્કી કરવું પડશે. એ ગંભીર કામ છે, અને એ જો સફળ કરવું હોય તો તેમાં અથાગ પરિશ્રમની જરૂર રહેશે. હિંદુસ્તાનીનું ચોકસ સ્વરૂપ ધડવા માટે હિંદી અને ઉર્ડુ એ બંનેમાંથી શખ્ફો લેવા જોઈએ. તેથી મહાસલાવાદીએ એ બંને ભાષાતું લલું ધર્યાનું જોઈએ, અને બંનેની સાથે બંને એટલો સંસર્ગ રાખવો જોઈએ. અનેક પ્રાંતીય ભાષાએથી સમૃદ્ધ એવા વિકસતા રાયની વિવિધ જરૂરિયાતોને પહોંચા વળવા ચા હિંદુસ્તાનીમાં એક એક શખ્ફના ધાણું પર્યાયો હોવા જોઈશે. બંગાળના કે દ્વાણિણના શ્રોતાવર્ગો આગળ એલેલી હિંદુસ્તાનીમાં સંસ્કૃતમાંથી ભિતરી આવેલા શખ્ફોનો મોટો લાંડેળ હોવો જોઈશે. એ જ ભાષણ પંજાબમાં અપાય તો તેમાં અરથી કે કારસીમાંથી આવેલા શખ્ફોનું ધાણું મશણું હશે. મોટે ભાગે જાઝા સંસ્કૃત શખ્ફોનું ન સમજનાર મુસલમાનોના બનેલા શ્રોતાવર્ગ માં પણ એમ જ કરવું પડશે. તેથી આપા હિંદુસ્તાનમાં જઈને બોલનાર વક્તાવીએ હિંદુસ્તાની શખ્ફબંડેળ પર એવો કાખું મેળવવો પડશે કે જોથી તેઓ હિંદુસ્તાનના તમામ ભાગના શ્રોતાજનો આગળ કશા ક્ષોલ કે અડયણું વિના એલી શકે. આ બાબતમાં પહીલ ભાલવિધિજીનું નામ સૌથી પહેલું કલમે ચેઠે છે. હિંદી બોલનાર તેમ જ ઉર્ડુ બોલનાર શ્રોતાજનો આગળ સરખી સરળતા અને જરૂરથી એલાતા મેં એમને જોયા છે. એમને યોગ્ય શખ્ફ ન જડી આવ્યો હોય એવું મેં કઢી જોયું નથી. એવું જ આણું લગવાનદાસને વિષે છે. તેઓ એક જ ભાષણું બંને ભાષાના પર્યાયવાચી શખ્ફો સાથે સાથે વાપરે છે, અને છતાં ભાષણુની સુદૃષ્ટા ઓછી ન થાય એની કાળજ રાખે છે. મુસલમાનોના આ લખતી વખતે મને એકલા મૌલાના મહમુદઅલીનો જ વિચાર આવે છે. એમનો શખ્ફબંડેળ બંને પ્રકારના શ્રોતાજનોને અનુકૂળ

આવે એઠલી વિવિધતાવાળો હતો. વડોદરા રાજ્યની નોકરીમાં મેળવેલું એમનું ગુજરાતીનું સાન એમને બહુ કામ આવતું.

મહાસલાથી સ્વતંત્ર રીતે પણ હિંદી અને ઉર્દૂ ભાષાઓનો વિકાસ થવો તો ચાલુ રહેશે જ. હિંદી મેટે ભાગે હિંદુ વાપરશે, અને ઉર્દૂ મુસલમાન. પરસ્તુઃ વિદ્યાન કંઈ શકાય એટલે અંશે હિંદી જાણુનારા મુસલમાનો પ્રમાણમાં બહુ જ એણા છે, જેકે હિંદી-ભાષી પ્રેરણમાં જન્મેલા મુસલમાનોની ભાતૃભાષા ઉર્દૂ હશે એમ હું માનું છું. હજરો હિંદુ એવા છે જેમની ભાતૃભાષા ઉર્દૂ છે, અને સેંકડો એવા છે જેમને ઉર્દૂ વિદ્યાન કહેવા એ અનુચ્ચિત ન ગણાય. પંડિત મોતીલાલજી એમાંના એક હતા. ડૉ. તેજ બહારુર સમુદ્ર ખીજ એક એવા છે, આવાં અનેક ઉદાહરણો સહેગે આપી શકાય એવાં છે, એટલે આ બહેનોની વર્ણે કશા કલદ હે ગંદી હરીકાઈ હોવાનું કશું કારણ નથી. શુદ્ધ હરીકાઈ હુમેશાં હોલી જોઈએ.

મારી પાસે આવેલી હાડીકોનો પરથી જાણાય છે કે, મૌલવી સાહેબ અધ્યાત્મ હક જેવા સમર્થ નિદ્ધારની હેખરેખ નીચે ઉસમાનિયા યુનિવર્સિટી ઉર્દૂની ભારે સેવા કરી રહી છે. યુનિવર્સિટીએ મોટો ઉર્દૂ શાખાકોશ જ્ઞાન્યો છે, વિજાનનાં પુરત્કો ઉર્દૂમાં તૈયાર થયાં છે ને થાય છે, અને એ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રમાણિકપણે ઉર્દૂ માર્કેટે અપાય છે. એટલે એ ભાષાનો વિકાસ થયા વિના રહેવાનો નથી. અને જે આજે અખુદ્વાળી સગને લીધે સર્વ હિંદીભાષી હિંદુઓ તાં ભીલી રહેલા સાહિત્યનો લાલ ન ઉદ્ઘાટને, તો એમાં વાંક એમનો છે. પણ એ સર્ગ નાખુંદ થયે જ છુટકો છે. કેમ કે આ ડોમો વર્ણનો અત્યારનો કુસંપ એ રોગમાત્રની પેડો થોડો વખત જ ચાલવાનો છે. લલું હો કે ખૂંરં, પણ એ ડોમોની જરૂર હિંદુસ્તાનમાં જાંડી દટાયેલી છે. તેઓ પડેશી છે, એક જ ભૂમિનાં સંતાન છે. તેઓ જેમ અદ્યીયાં જન્મી છે તેમ અહીંયાં જ મરવાને નિમાયેલી છે. તેઓ સ્વેચ્છાએ એકતા ન સાધે તો કુદરત તેમને શાંતિમાં રહેવાની ઝરઝ પાડેશે.

અને જેવું હિંદુઓને વિષે તેવું જ મુસલમાનોને વિષે. મુસલમાનો જે હિંદી સાહિત્ય સમેલન અને નાગરી પ્રચારિણી સભાના વિવિધ પરિશ્રમના ફળનો લાલ ન ઉદ્ઘાટને તો એટ તેમને જરૂરો. જે ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાન બોલે છે, અને જે ઉર્દૂ કે દેવનાગરી લિખિમાં લખાય છે તે ભાષા હિંદી, એવી બાધ્યા સ્વીકારવામાં હિંદી સાહિત્ય સમેલને એને માટે મોઢું એવું જે પગલું લીધું છે, તેની મુસલમાનોએ ગર્વ અને હર્ષથી

નોંધ લીધી નથી, એ ઘેણની વાત છે. આમ એ વાખ્યા, હિંદુસ્તાનીની મહાસભાએ કરેલી વ્યાખ્યાને બરાબર મળતી આવે છે. એકલી ઉર્દૂ કે એકલી હિંદી કાયમ રહેશે એવું સ્વચ્છું સેવનારા ટેલાક પણ છે એ હું જાણું છું. હું માનું છું કે, એ હમેશાં સ્વચ્છું રહેશે અને એ અલગ સ્વચ્છું છે. ધર્મસામને તેની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ છે તેમ જ હિંદુધર્મને તેની પોતાની છે. ભવિષ્યનું હિંદુસ્તાન એ એના સંપૂર્ણ અને સુખદ સંયોગરૂપ હશે. એ રાજ્યામણો દ્વિસ જ્યારે આવશે ત્યારે એમની તમામ ભાષા તે હિંદુસ્તાની હશે. પણ છતાં ઉર્દૂનો વિકાસ ચાલુ રહેશે અને તેમાં અરથી ને ફારસી શાખદોનું ગ્રાધાન્ય હશે, અને સંસ્કૃત શાખદોળના ગ્રાધાન્યવાળી હિંદીનો પણ વિકાસ ચાલુ રહેશે. તુલસીદાસ અને સુરદાસની ભાષા મરી ન શકે, તેમ જ જે ભાષામાં શિશ્વલીએ લખ્યું તેનો પણ નાશ સંભવતો નથી. પણ અને ભાષા બોલનાર સારામાં સારો વર્ગ હિંદુસ્તાની બહુ જ સારી રીતે જાળુંતો હશે.

કિતમાનજાઈ, ૧૯-૧૦-૩૮

૬૦ વિ. ૩૦-૧૦-૧૯૩૮

## ૨૮. રાજ્યભાષાનું નામ

એક મુસલમાન મિત્ર, જેએ પોતાને જૂના મહાસભાવાદી કર્યાકર્તા તરીક આપ્યાવે છે, તેએ જાળ્યાવે છે :

“... એક વિરોધાભાસ કે સરતચૂક્થી હિંદની ‘રાજ્યભાષા’ની ચર્ચા દરમાન રહી ગયો છે તે તરફ આપનું ચ્યાન એંચવા દિચ્છું છું. મને ચ્યાન છે ત્યાં સુધી, આ વિષયમાં મહાસભાએ કરેલા ઠરાવમાં ‘હિંદી’ નહીં પણ ‘હિંદુસ્તાની’ શાખ મુજબામાં આગ્યો છે. આપ પોતે પણ આપનાં તમામ ભાષણે તેમ જ લાભાંગુમાં હમેશાં ‘હિંદુસ્તાની’ શાખ જ વાપરતા આવ્યા છે. આ સ્થિતિમાં એ જીના હિંગારી-ભરેલી છે કે ધાણુાખરા મહાસભાવાદીએ મહાસભાના ઠરાવની આમન્યા લોખને ‘હિંદી’ શાખનો જ ઉપયોગ કર્યે જાય છે. આ જોયા શાખપ્રયોગથી મહાસભા હેઠળનાં જુદાં જુદાં મંણોમાં પુંકળ જેરસમજ ફેલાવા પામી છે. મારી દશ્યિએ તો ‘હિંદી’ અથવા ‘ઉર્ડૂ’ એમાંથી એડ શાખ કર્યાયે કરી ન વાપરતાં એકેએક મહાસભાવાદીએ રાજ્યભાષાનો ઉલ્લેખ કરતી વેળાએ કેવળ ‘હિંદુસ્તાની’ શાખનો જ પ્રયોગ કરવા નેર્દિયે.”

ઉપલી સ્વચ્છાને હું ખરા અંતઃકરણુથી ર્સીકારું છું. રાજ્યભાષાનું નામ હુક્ત એક જ છે અને તે ‘હિંદુસ્તાની.’

સેગાંબ, તા. ૨૫-૧૨-૩૮

## ૨૯. હિંદુસ્તાનીનો શાખદક્ષાશ

સવાલ : તમે હિંદુસ્તાનીનો શા અર્થ કરો છો ? શું તમે હિંદી - ઉર્દૂ મેળોનો એક સામાન્ય શાખદક્ષાશ પસંદ કરો છો ?

જવાબ : હું તો તમારાથી આગળ વધી ગયો છું. મને ખ્યાલ છે કે, મૌલવી અભિનુલ હક સાહેબે એક શાખદક્ષાશ તૈયાર કર્યો છે જેમાં હારીવાળા હિંદી શાખદક્ષાશમાંના તમામ ઉર્દૂ શાખદો તથા ઉસમાનિયા શાખદક્ષાશમાંના તમામ હિંદી શાખદો લીધા છે. મૌલવી સાહેબના આ શાખદક્ષાશને મંજૂર કરવા કોઝેસને મેં ખાસ ભલામણું કરી છે, અને નવા શાખદોને સારુ મૌલાના અખુલ કલામ આજાદ તથા રાજેન્ડ્રભાષુની સમિતિ સંચયની છે.

હું ૦ બું, ૨૯-૧-'૩૬

## ૩૦. રાષ્ટ્રભાષાના પ્રવારકોને

[ તા. ૨૪-૬-૧૯૩૬ ને ૩૦ રાષ્ટ્રભાષાપ્રવારની વર્ધા સમિતિ તરફથી ચાહતા આધ્યાત્મનમંહિના વિધાર્થીઓને આપેલું વ્યાપ્તયાન — ‘સખી બેલી’ માસિક, અંક ૧, પું ૧, પા. ૨ ઉપરથી નોચે ઉતાર્યું છે. ]

હજુ રાષ્ટ્રભાષા બની નથી; હજુ તો એનો જન્મ જ થયો છે. હજુ હિંદીમાં પૂરતા એવા અંથો નથી મળતા કે જે વડે વિજ્ઞાન જેવા વિષયો ભાણુવાતા હોય. હા, બંગાળી ઉર્દૂમાં એવા કટલાક અંથો તૈયાર થયા છે. પરંતુ બંગાળીથી વધારે આબાદી ઉર્દૂએ કરી છે ઉસમાનિયા યુનિવર્સિટીએ સૌથી વધારે કામ કર્યું છે. એહે આ કામમાં લાણો ઇપિયા પણ ખર્ચ્યા છે. એને ત્યા વિજ્ઞાન જેવા અધિરા વિષયો જીંચામાં જીંચી શ્રેણીઓમાં ઉર્દૂ મારફત શીખવાય છે. હિંદીમાં હજુ એવું થયું નથી.

મહામના માલવીયજીએ હિંદુ વિશ્વવિદ્યાલય સ્થાપી બહુ મોદું કામ કર્યું છે. એવું કામ મારા જેવામાં કચ્ચાંય નથી આવ્યું. બીજા દેશોમાં પણ એવું કામ નથી થયું. સાંચે જ માલવીયજી તો ભારતભૂપણું છે, એમાં કરો સંહેજ નથી. પણ એ વાતનું દુઃખ છે કે, એમના હિંદુ વિશ્વવિદ્યાલયમાં પણ વિજ્ઞાન જેવા કઠણું વિષયો હિંદી ભાષા મારફત ન ભાણુવાતાં અંગે મારફતે જ ભાણુવાય છે. આ પોટને દૂર કરવી જોઈશે. એ જ તમારું બધાનું મિશન છે — જવાબદારી છે.

રાષ્ટ્રભાષાના પ્રચારકોને હિંદી અને ઉર્ડુ એ બે ઉપર પૂરો કાળું હોવો બેઠિયો. જ્યાં સુધી એવું નહિ થાય ત્યાં સુધી તમે સાચા પ્રચારક નથી થઈ શકતા. માલવીયજી મહારાજને જુઓ; ડૉ. ભગવાનદાસને જુઓ. તેઓ જો મુસલમાન ભાઈઓની સભામાં જય છે, તો બિલકુલ ઉર્ડુ જખાનમાં વાત કરે છે. મુસલમાન કદી એમને પરાયા નથી સમજતા. એ રીતે, ભાષામાં તે મુસલમાન જ જણાય છે. માલવીયજી બંગાળોઓ જેઠે બંગાળીમાં જ વાતચીત કરે છે; હિંદી બોલનાર જેઠે સુંદર હિંદીમાં.

( અહીં વચ્ચે એક પ્રશ્ન કર્યો - માલવીયજી અને ભગવાનદાસજી તો અપવાદ છે ! )

તમારો આ ખ્યાલ એટો છે. તમારે પણ એમની પેઠે અપવાદરપ અનવાનું છે. જ્યાં સુધી તમે એવા અપવાદરપ નહીં બનો, ત્યાં સુધી તમે અસલ રાષ્ટ્રભાષાપ્રચારક નથી થઈ શકતા. હા, પૈસા કમાવાના હેતુથા તમે ૨૫-૩૦ રૂપિયા તો કમાતા રહી શકો છો. પણ એનાથી તમારા દેશને કશો લાલ નથી ભળી શકવાનો. તો પછી તમને તો શો જ કાયદો થયો ? પણ પણ ચારો અરીને પોતાનો નિર્વાદ કરી લે છે.

જ્યાં સુધી તમે હિંદી ઉર્ડુ બેઠિમાં પૂરતા વિદ્ધાન નહિ બની જાઓ, ત્યાં સુધી રાષ્ટ્રભાષાની સાચી સેવા નહિ કરી શકો. રાષ્ટ્રભાષાપ્રચારકોએ તો હિક હિક વિદ્ધાન અનવાનું છે. આ કલાને હાંસલ કર્યા વિના સાચા પ્રચારક દરજિન્ન નહિ થઈ શકો. તમે પૂછી શકો છો કે, જો બંગાળી અને ઉર્ડુમાં સારું સાહિત્ય મોળૂં છે તો તેને જ રાષ્ટ્રભાષા કેમ ન માનતી ? હા, એ કહેવું હિક છે. પણ હું જેઓ છું કે, હિંદી-ઉર્ડુના મિશ્રણ સિવાય એવી ડોઈ બીજી ભાષા નથી કે જે રાષ્ટ્રભાષા બની શકે. હિંદી-ઉર્ડુ મિશ્રણ બહુ સહેલી ભાષા છે. ધારે ધારે એ મિશ્રણમાં ઊંચું સાહિત્ય પણ, તમારી મહેનતથી, તૈયાર થઈ શકે છે. આ આશા છે જ અને તેથી જ મેં હિંદી-ઉર્ડુના સહેલા મિશ્રણને રાષ્ટ્રભાષા બનાવવા પર જેર દીધું છે. આમજનતાની ભાષા આ જ થઈ શકે છે. તેથી જ તેને પસંદ કરી છે. એને બોલનારની સંખ્યા સૌથી મોટી છે. . . . તમે જેઓ અધ્યાપનમંદિરમાં આવ્યા છો તેમણે કદણું મહેનત કરી બને ભાષાઓ શરીરી લેવી જોઈએ અને કાકાસાહેબને કાંઈક આરામ લેવાની અનુરૂપતા કરી આપવી જોઈએ.

## ૩૧. રોમન લિપિ વિં દેવનાગરી

૧

મારા જાણવામાં આવ્યું છે કે, આસામમાં કેટલીક જાતિઓને દેવનાગરીને બદલે રોમન લિપિમાં વાંચતાં લખતાં શીખવવાની શરૂઆત થઈ છે. મેં ભારો અભિગ્રાહ દર્શાવ્યો જ છે કે, હિંદુસ્તાનમાં સર્વમાન્ય થઈ શકે એવી ઝાઈ એક લિપિ હોય તો તે બાલુ દેવનાગરી જ છે. પછી લદે તેમાં સુધારા કરવામાં આવે. શુદ્ધ શાખીય કે રાષ્ટ્રીય સુદ્ધા પર દેવનાગરીની શૈક્ષિક સુસલભમાન લાઈએ રહેચુંછુંએ ન સ્વીકારે ત્યાં સુધી ઉર્દૂ અથવા ફારસી લિપિ પણ બાલુ જ રહેશે. પણ ઉપલી ચર્ચા માટે એ વાત અપ્રતુત છે. આ લિપિઓની જોડે રોમન લિપિનો મેળ ખાય એમ નથી. રોમન લિપિના હિંમાયતીઓ તો ઉપલી બને લિપિઓ રદ કરવાનો ભત આપશે, પણ વિજ્ઞાન તેમ જ ભાવના બેઠ દર્શિએ રોમન લિપિ નહિ ચાલી શકે. રોમન લિપિનો મુખ્ય લાલ એટલો જ છે કે, ભાપવામાં તથા ટાઈપ કરવામાં એ લિપિ સગવડવાળી છે. પણ કરોડો માણસોને એ શીખતાં જે મહેનત પડે એ જોતાં એ લાસની આપણને કશી કિંમત નથી. કરોડોને તો દેવનાગરીમાં કે પોતપોતાના પ્રાંતની લિપિમાં લખેલું પોતાને ત્યાંનું સાહિત્ય વાંચવાનું હોય, એટલે તેમને રોમન લિપિ જરાયે મદ્દરાય ન થાય. કરોડો હિંદુઓ અને સુસલભમાનો માટે પણ દેવનાગરી શીખવી સહેલી છે, કેમ કે બણીખરી પ્રાંતિક લિપિઓ દેવનાગરીમાંથી જ જોતરી આવી છે. મેં આમાં સુસલભમાનોનો સમાવેશ જાણી જોઈને કર્યો છે. દાખલા તરીકે, અંગાળના સુસલભમાનોની માતૃભાષા અંગાળી છે. જેમ તામિલનાડુના સુસલભમાનોની તામિલ છે. ઉર્દૂના પ્રચારની હાલની હિલચાલનું સ્વાભાવિક પરિણામ એ આવશે કે, હિંદુભરના સુસલભમાનો પોતપોતાની પ્રાંતિક માતૃભાષા ઉપરાંત ઉર્દૂ પણ શીખશે. ઝાઈ પણ સંન્દેશોમાં કુરાનેશરીકુરાનેશરી પદવા તેમને અરથી તો શીખવી જ રહી. પણ કરોડો હિંદુ સુસલભમાનો રોમન લિપિનું પ્રયોગન તો અંગેજ શીખવા સિવાય બીજે કૃષાયે નથી. એ જ પ્રમાણે હિંદુઓને તેમના ધર્મશ્રદ્ધો ભૂળ ભાષામાં વાંચવા દેવનાગરી શીખવવાની જરૂર પડવાની, અને તેઓ એ શીખે જ છે. આમ દેવનાગરી લિપિને સર્વમાન્ય બનાવવાની પાછળ મજબૂત કારણ છે. રોમન લિપિ દાખલ કરીએ તો એ નરી બોણરાય જ થાય, અને એ કદી લોકપ્રિય ન બને. વળી આવાં બહારનાં દ્વારા સાચી લોકજનગૃહિ થશે ત્યારે

જીડી જ જવાનાં છે. એવી પ્રણક્ષય જગૃતિ ધાર્યા કરતાં ધણી વહેલી આવવાની છે. હતાં કરોડોને એવું ભાન કરાવતાં વખત લાગરો. એ સંચામાં નાખીને બનાવી શકાય એવી વસ્તુ નથી. એ તો અગમ્ય રીતે આવે છે અથવા આવતી લાગે છે. દેશના કાર્યકર્તાઓ તો માત્ર લોકમાનસ પારખીને એના આગમનને લ્યારિત કરી શકે.

૬૦ બં'૦, ૧૨-૮-'૪૮

૨

૫૦ — આપને અંગેજ ભાષા પ્રત્યે અણુગમો હોવાથી રોમન ( અંગેજ ) લિપિનોયે અણુગમો થયો છે. નહિ તો દેવનાગરી તથા કારસી લિપિની જગ્યાએ આપે તેની નિઃસ્ક્રોચયપણે હિમાયત કરી હોત.

૬૦ — તમારી ભૂલ છે. મને બેમાંથી એકેયનો અણુગમો નથી. પણ કોઈ વસ્તુ કે કોઈ મનુષ્ય તેને ન ધરે તે જગ્યા પચાવી પડે તે સામે મને વાંધ્યો છે. રોમન લિપિનોયે હિંદુસ્તાનમાં કાયમતું સ્થાન છે. પણ તે હિંદી લિપિઓનું સ્થાન ન લઈ શકે. જે મારું ચાલતું હોય. તો બધી પ્રાન્તીય ભાષાઓ માટે દેવનાગરી લિપિ જ હોય, અને રાષ્ટ્રભાષા માટે દેવનાગરી તથા કારસી. અરથી લિપિ ( જે કારસીમાંથી ઉદ્ભવી છે.) મુસ્લિમોને માટે તેટલી જ જરૂરી છે જેટલી હિંદુઓ માટે દેવનાગરી. રોમન લિપિની હિમાયત તેના ગુણો પર નથી થઈ, પણ ઝડપાના તોડકે. પશ્ચિમમાં તે લગલગ સર્વત્ર વ્યાપક છે એ સિવાય તેનામાં કરો ગુણ નથી. પણ તેણે સર્વે પ્રાન્તીય ભાષાઓની માતા અને બધીયે જાણીતી લિપિઓમાં સૌથી વધારે પૂર્ણ એવી દેવનાગરીનું, કે ઉત્તર હિંદુસ્તાનના લાઘો હિંદુ-મુસ્લિમાનો જેમાં કખે છે તે કારસીનું સ્થાન ન જ લેવું જોઈએ. લિપિની લિનતા હિંદુ મુસ્લિમાનને જુદા રાખે છે એમ માતીએ તોયે એક તઠરથ અને અપૂર્ણ લિપિને સ્વીકારવાથી તેઓ એક થઈ શકવાના નથી. પણ જે બનો ડોમો પરસપરના ગ્રેમને લીધે બનો લિપિએ શાખવાની મહેનત લેશે, તો તેઓ એક થઈ શકશે. રોમન લિપિનું પોતાનું મહાન અને અદ્વિતીય સ્થાન છે જ. તેથી વધારે જાંચું સ્થાન મેળવવાની તેણે આકાંક્ષા ન રાખવી જોઈએ.

૬૦ બં'૦, ૧૨-૪-'૪૮

## ૩૨. સંસ્કૃતની પુત્રીઓ માટે એક લિપિ

ભારતવર્ષની ને ભાષાઓ જન્મથી કે સ્વેચ્છાસ્વીકારથી સંસ્કૃતની પુત્રીઓ છે, તે બધી એક લિપિમાં લખવાનો પ્રશ્ન પ્રણ આગળ વરસો થયાં પડેલે છે. છતાં આક્રમણુરીલા પ્રાંતીયતાના આ હિન્દોમાં એક લિપિની હિમાયત કદાચ અવિનયઃપ ગણ્યાય. પણ દેશમાં અક્ષરસાનપ્રયારની જે શુંખેશ ધર્મધોકાર ચાલી રહી છે તેને અંગે એક લિપિના હિમાયતીઓનું કહેવું કાને ધરવાની લોડાને ફરજ પડવી જોઈએ. હું એવો હિમાયતી વરસો થયાં રહ્યો છું. હું દક્ષિણ આર્દ્રિકામાં હતો ત્યારે હિંદુમાં વસતા અસુક ગુજરાતીઓને દેવનાગરી લિપિમાં કાગળ પણ લખતો, એ મને યાદ છે. એક લિપિના એવા સ્વીકારથી પ્રાંત પ્રાંત વચ્ચેના વ્યવહારમાં બહુ સુગમતા થશે, અને વિવિધ પ્રાંતિક ભાષાઓ શીખવાનું આજે છે તેના કરતાં અનંત ગણ્યું વધારે સહેલું થઈ પડશે. દેશના સુશિદ્ધિન લોડા જે બેગા મળીને વિચાર કરે અને એક લિપિના વાપરનો નિશ્ચય કરે, તો તેનો સર્વાંગિક સ્વીકાર સહેલાઈથી થાય. જે કરોડો માણસોની નિરક્ષર છે તેઓ તો તેમને કઈ લિપિ શીખવાય છે અને વિષે ઉદ્ઘાસીન છે. મેં કશ્યું છે એવું સુપરિણ્યુઅ જે આવે તો હિંદુસ્તાનમાં દેવનાગરી ને ઉર્દૂ એ એ લિપિ જ ચાલે, અને દરેક રાષ્ટ્રવાદી એ એ લિપિ પર કાયુ મેળવવાની પોતાની ફરજ સમજે. મને હિંદી ભાષાઓ વિષે બહુ અનુરોગ છે. જેટલી લિપિઓ શીખી શકાય તેટલી શીખવાનો મેં પ્રયત્ન પણ કર્યો છે. મારી પાસે માત્ર સમય હોય તો સિંગેર વરસની ઉંમરે પણ વધારે હિંદી ભાષાઓ શીખવાની સ્કૂલીં મારામાં છે. મારે માટે તો એ વિનોદનું સાધન થઈ પડે. પણ આ ભાષાઓ માટે મારા મનમાં આઠલો બધો પ્રેમ હોવા છતાં, મારે કંયુલ કરવું જોઈએ કે, હું અંધી લિપિઓ શીખ્યો નથી. પણ આ સર્વ સહેલાઈ ભાષાઓ જે એક લિપિમાં લખતાં હોય, તો મુખ્ય પ્રાંતભાષાઓનું કામયલાઉ જાન હું બહુ થોડા વખતમાં મેળવી લિએ. અને પ્રમાણાભક્તા કે સુંદરતાની ભાખતમાં દેવનાગરીને શરમાવા જેવું કશ્યું નથી. હું આશા રાખ્યું છું કે, જેઓ અક્ષર જાનપ્રયારની પ્રષ્ટિમાં રોકાયેલા છે, તેઓ મારી સૂચનાનો દ્વારાભર વિચાર કરી જોશે. તેઓ જે દેવનાગરી લિપિનો સ્વીકાર કરશે, તો ભાવિ પેઢીઓનાં અપાર પરિશ્રમ ને સમય બચાવશે ને તેમના આશીર્વાદ મેળવશે.

સેગાંબ, ૩૦-૭-'૩૬

૫૦. ૫૦, ૬-૮-'૩૬

## ૩૩. રાજ્યભાષાપ્રચાર

### એક રચનાત્મક કાર્ય

[ ‘રચનાત્મક કાર્યક્રમ’ એ ચોપાનિયામાં રાજ્યભાષાપ્રચાર અને માતૃભાષાપ્રેમ અંથે વિવેક લખિતો ભાગ નીચે આપ્યો છે.]

આપણી માતૃભાષા કરતાં આપણે અંગેલ ભાષા પ્રયે વધારે પ્રેમ રામતા થયા તેને લીધે સુશિક્ષિત અને રાજકીય માનસવાળા વર્ગો અને જનસમૂહ વચ્ચે જોંડી ખાઈ ગેઢા થયેલી છે. હિંદુસ્તાનની ભાષાઓ એથી દરિદ્ર અની છે. જોંડા ને અટપટા વિચાર માતૃભાષામાં વ્યક્ત કરવાનો વૃથા પ્રયત્ન કરતાં આપણે ગોથાં ખાઈ એ ધીએ. વિરાનના પારિલાખિક શખદોને માટે આપણી પાસે સમાનાર્થક શાખદો નથી. એનું પરિણામ બહુ દુઃખ આવ્યું છે. જનસમૂહ આધુનિક માનસથી અળગો પડી ગયેલો છે. આપણે આપણા જમાનાની ફળું એટલા નજીક ધીએ કે, હિંદુસ્તાનની મહાન ભાષાઓ પ્રયેના આ દુર્લક્ષથી હિંદુસ્તાનની જે અસેવા થઈ છે, તેનું માપ આપણાથી નીકળા શકે એમ નથી. એ વાત સહેલે સમજાય એવી છે કે, આ બૂરાઈને આપણે દૂર ન કરી શકીએ ત્યાં લગી જનસમૂહનું માનસ બંધનમાં જડકાયેલું જ રહેવાનું. જનસમૂહ સ્વરાજની રચનામાં કશા સંગીન ફાળો નહિ આપી શકે. દરેક વ્યક્તિ પૂર્ણ સ્વરાજની હિસ્થાપનમાં પોતાનો ફાળો સિધી રીતે આપે એ અદિંસા પર રચાયેલા સ્વરાજમાં આવશ્યક છે. જનસમૂહ જ્યાં લગી એકએક પગલું તેના પૂરા રહસ્ય સાથે સમજશે નહિ, ત્યાં લગી પોતાનો ફાળો પૂરેપૂરો આપી નહિ શકે. એકુંએક પગલું તેમની પોતાની ભાષામાં ન સમજવાય ત્યાં લગી એવી આશા રાખવી ફેંગાટ છે.

તે ઉપરાંત અભિલ ભારતના પરસ્પર વ્યવહારને માટે પણ આપણને હિંદના ભાષાસમૂહમાંથી એવી એક ભાષા જોઈએ છે, જે આપણી પ્રજાની મોટામાં મોટી સંખ્યા અત્યારે પણ જાણતી ને સમજતી હોય, ને જે ભીજાઓ સહેલાઈથી શાખી શકે એવી હોય. આ ભાષા નિર્વિવાદપણે હિંદી છે. ઉત્તર ભારતના હિંદુ અને મુસ્લિમાન અને તે એલે છે ને સમજે છે. તે જ્યારે ફારસી લિપિમાં લખાય લારે ઉર્દુ કહેવાય છે. મહાસલાએ ૧૯૨૮માં કાન્પુરની એટુકમાં પસાર કરેલા ગ્રસિદ્ધ ફરાવમાં આ અભિલ ભારતીય ભાષાને હિંદુસ્તાની નામ આપ્યું હતું. અને ત્યારથી, ઓછામાં ઓછું સિદ્ધાંતરૂપે તો, હિંદુસ્તાની

રાજ્યકાયા રહેલી છે. ‘સિદ્ધાંતરૂપે’ હું એટલા માટે કહું શું કે, મહાસભાવાદીઓએ પણ એનો અમલ કર્યો નથી. મેં આ કંડિકામાં જે ચિતાર દોર્યો છે તે ૧૯૨૦ પહેલાં ગ્રવર્તતી સ્થિતિનો છે. ૧૯૨૦થી જનસમૂહની રાજ્યદારી ડેળવણીને માટે હિંદુસ્તાનની ભાષાઓનું, તેમ જ રાજ્યદારી માનસવાળું હિંદ સહેલાઈથી બોલી શકે અને જુદા જુદા પ્રાંતના મહાસભાવાદીઓએ વાર્ષિક અધિવેશન વખતે તેમ જ મહાસમિતિની એક્ઝિક્યુટિવ બોલાય ત્યારે સમજી શકે એવી એક ર્યાખલ ભારતીય રાજ્યકાયાનું, મહત્વ સ્વીકારવાનો ધરાદાપૂર્વક પ્રયત્ન થવા માંડયો. પણ મને કહેતાં ખેદ થાય છે કે, ધણ્યા મહાસભાવાદીઓએ આ ફ્રાવનો અમલ કર્યો નથી. અને તેથી મહાસભાવાદીઓએ અંગ્રેજુમાં બોલવાનો અને પોતાને ખાતર ભીજાઓને અંગ્રેજુમાં બોલવાની ફરજ પાડવાનો આગ્રહ રાખે છે એવા, મારા મત પ્રમાણે શરમ ભરેલો, હેખાવ આપણે જોઈએ છીએ. અંગ્રેજુએ આપણુંને મોહપાશમાં ધેર્યા છે તે હજુ તૂટ્યો નથી. એ મોહથી ધેરાયેલા હોઈ આપણે હિંદુસ્તાનની તેના ધૈયે પ્રત્યેની પ્રગતિ રેડી રહ્યા છીએ. આપણે અંગ્રેજ શાખવામાં જેટલાં વરસ ગાળોએ છીએ એટલા ભલિના જો હિંદુસ્તાની શીખવામાં ગાળવાની તકલીફ ન લઈએ, તો જનસમૂહ વિષેનો આપણો પ્રેમ બહુ છીછરો હોવો જોઈએ.

ઉપર મેં કહું તેમાં ( સ્વભાવાના પ્રેમ અંગે કહેવા સારુ ) મારે જાયે જ કાઈ ઉમેરવાની જરૂર હોય. કેચો હિંદુસ્તાનને એકેદેશ ગણે છે તેમને માટે આ એ વસ્તુએ એકુથીજ જોડે સંકળાગેલી છે.

બારડાલી, ૧૩-૧૨-૧૯૪૧

#### ૩૪. પરહેશી ભાષાની ગુલામી

[ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય પદ્ધતિબાનને પ્રસંગે આપેલા વ્યાખ્યાનમાંથી ]

આ સ્થાને એક પછી એક પક્તા આવતા ગયા અને બોલતા ગયા, તો મને થયું કે કાઈક તો હિંદીમાં બોલશે, કાક તો ઉર્દૂમાં — અને ઉર્દૂમાં કે હિંદીમાં નહીં તો સંસ્કૃતમાં તો બોલશે ! અરે, કાઈ મરારી કે બીજી દેરી ભાષામાં તો બોલશે. પણ એ આપણા ભાષમાં ન હતું. આ તે શું ?

આપણે ગુલામીમાં પડ્યા છીએ અને જેમણે આપણું ગુલામ રાખ્યા છે તેમની ભાષાની આપણે ગુલામી સ્વીકારી છે. અંગ્રેજેને આપણે ‘અમુક

બગાડડુ, તમુક બગાડડુ' કહીને ધર્થી ગાળો દુર્છે છીએ. મેં પણ ધર્થી વસ્તુ માટે અમની નિંદા કરી છે. પણ આપણી નિત્યવ્યવહારની ભાષા અંગ્રેજ બનાવી મુકવાને માટે મેં અમને કદી ગાળો નથી દીધી. દોષ આપણો છે. અંગ્રેજ શીખવામાં આપણે કેટલાંય વરસ ભર્યો નાંખીએ છીએ ! અંગ્રેજની જેમ અંગ્રેજ બોલતાં શીખવાની આપણી મહેચણ રહે છે, અને ડોર્ચ અંગ્રેજ આપણી પીઠ થાબડે અને કહે, 'શાખાશ ! તમે તો ભૂલ વિનાનું અંગ્રેજ બાલો છો,' તો આપણી ભાતી ઝૂલે છે. પણ આપણે દરેક જણ જેટલાં શક્તિ અને અમય અંગ્રેજ જાણુવા માટે આપીએ છીએ, તેને સાદ્ય ગણિતથી હિસાબ કરીએ, તો આપણને ખરાર પડે કે, દેશને કેટલાં હજર વર્ષોની આપણે ખાર લગાડીએ છીએ.

અને જ્તાં આ બધું હિંદુ વિશ્વવિદ્યાલયમાં બની રહ્યું છે ! હિંદુ સભ્યતાનું જીવંત પ્રદર્શન અહીં થાય છે એમ વક્તાઓએ કહ્યું. પણ આવું એ પ્રદર્શન છે ? માલવીયજી મહારાજે તો પૈસા એકદા કર્યા, માયા પગાર આપીને સારા અધ્યાપકો લેગા કર્યા. પણ વધારે એ શું કરે ? અમનો દોષ શો ? જમાનાનો દોષ છે. હિંદીએ અંગ્રેજનું સ્થાન ન લીધું, અને એક પ્રકારનો 'ધો' ચાલ્યો, તેને અધ્યાપકો વસા થયા અને શિષ્યોએ બિચારાએ જે મલયું તે લઈને સંતોષ માન્યો. હવે વિદ્યાર્થીઓને એક વરસુ સૂચયું ? તેઓ અનેક વાર તોક્ષાન કરે છે, કારણે અકારણે હડતાળ પાડે છે, અને 'ભૂખ-હડતાળ' સુર્ખી પણ જાય છે. તો શું તેઓ એક વાત ન કરે ? પોતાની રાષ્ટ્રભાષામાં શીખવાને માટે તેઓ આટલાં તોક્ષાન કરતા હોય તો ? અહીં રૂપી વિદ્યાર્થીએ આંગ્રેઝ પ્રાંતમાંથી આવ્યા છે એમ કહેવાય છે. શા સારુ તેઓ સર રાધાકૃષ્ણનની પાસે જર્દારે આગઢ ન ધરે કે, અહીં એક આંગ્રેઝ વિભાગ કાઢો, અને — હિંદી શીખવાની તેમની દાનત ન હોય તો — તેલુગુમાં અમને શીખવો ?

જાપાન આજે ગવાઈ રહ્યું છે. અને મેં ખરી રીતે બહુ મોટો દેશ કદી માન્યો નથી — જોકે અશિયામાં તો એ મહાન દેશ ગણ્ય છે, કારણે એણે પદ્ધિમની પ્રજાઓને સંક્રાન્ત મુકાબલો કર્યા છે. ત્યાંના હજરો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અંગ્રેજમાં પોતાનું જાન અને શિક્ષણ નથી મેળવતાં, પણ જાપાની મારક્ષતે મેળવે છે. જાપાની લિપિ પણ કઠણું છે, પણ તે છોડીને તેઓ રોમન પસંદ નથી કરતા. જ્તાં ડોર્ચ પદ્ધિમની ભાષાઓનો તેઓ ખહિષ્કાર

નથી કરતા. અંગ્રેજુ, હેંચ વગેરે ભાષા જેણી જરૂર હોય તે શરીરે છે, અને પોતાનાં વિચાર અને જાનને સમૃદ્ધ કરવાને માટે તેની મહદ્દ લે છે, અને ખીલું ભાષાઓની સમૃદ્ધિને જાપાનીમાં ઉત્તારીને પોતાના દેખની સેવા કરે છે. આનું કારણું એ છે કે, તેમનાં મન સંવાદ તાળાં છે, અને પરિણામે તેઓ મેળવે છે તેનો લાલ આભા દેખને મળે છે.

પણ અહીં ? અહીં તો આપણું ને તંત્રનો નાશ કરવો છે તે જ તંત્રના કારકુનો, વડીલો, બેસિસ્ટર થવાના મનોરથે રહે છે. ખૂબી તો એ છે કે, આટલાં વર્ષોં આપીને પણ અંગ્રેજું ભાષાને આપણે જાણતા નથી ! મારી પાસે અંગ્રેજું જાણુનારાઓના પુષ્ટકાં કાગળો આવે છે, એમાં મોટી મોટી ડિગ્રીવાળાઓના કાગળો પણ હોય છે. પણ એનું અંગ્રેજું જોઈને આપણું ચીતરી ચડે. કારણું સ્પષ્ટ છે. બધા કંઈ માલવીયજું અને રાધાકૃષ્ણન થઈ શકતા નથી. હું એક પછી એક અંગ્રેજું ભાષણું સાંભળતો જતો હતો અને મને થતું હતું કે, આપણી જનતા ભલી છે, ધીરજવાળી છે, ઉદ્ઘારતાવળી છે; નહીં તો ને લાલા એ સમજું શકતી નથી તે કલાકના કલાક ધીરજવાળી સાંભળવાને બદલે તેઓ આપણું ગાળો ન સંભળાવે ? ને આ મારા કથન વિષે તમને શક હોય તો હું હાથ ઊંચા કરવાને તમને અતાવી શકું હતું કે, કેટલા એઓછા અહીં અંગ્રેજું જાણુનારા છે -- વિદ્યાર્થીઓમાંથી પણ કેટલા એઓછા અહીં ને ચાલી રહ્યું છે તે સમજું શક્યા છે.

ખીલું એક વાત તરફ તમારું ધ્યાન એંચું. માલવીયજું પુષ્ટકાં પૈસા મળે છે, એટલે પ્રવેશદારનો દરવાનો મોટો જરૂરદસ્ત છે. એ પણ કેવો છે ? એની ઉપર વિશ્વવિદ્યાલયનું નામ લખ્યું છે તે અંગ્રેજુમાં -- અને તે અંગ્રેજું અક્ષરો પોણો ભાગ રોકે છે, જ્યારે હિંદીમાં નામ લખ્યું છે તે જાણું ખીંચાયા જીવનાગરી અને ઝારસી લિપિમાં નામ લખત તો કેવું શોભાત ! એ જોઈને ગમે તેને થાત કે, માલવીયજુએ સ્થાપેલા વિશ્વવિદ્યાલયનો, સર રાધાકૃષ્ણનનો અહીં હિંદુ અને ધર્મલાભી સંસ્કૃતનો સમન્વય સાધવાનો ઉદ્દેશ છે. અહીં તો ઉર્દૂ હિંદી અને ભાષા એલાય છે, લભાય છે, ત્યાં એ એ લિપિમાં નામ હોત તો કેવું રૂંડું લાગત ! પણ આટલાં વર્ષોં અંગ્રેજુને આપી આપીને આપણું મનને એવો થાક ચડ્યો છે અને આપણી યાદશક્તિ અને કલપના એટલી ભાલી થઈ ગઈ છે કે; આટલી સાદી વાત આપણું સુઝતી નથી.

અને હિંદી ન જાણુનારને હિંદી શીખવું બહુ મુશ્કેલ છે? હું તો ડોઈ જુદ્ધને પણ, જે તે ગુજરાતી, બંગાળી કે મરાડી જાણુતો હોય તો, ત્રણ મહિનાની અંદર હિંદી શીખવી હેવાનું થીકું જરૂરું એમ હું. દૃષ્ટિશની ભાષાઓ — તામિલ, તેલુગુ, કાનડી, મલયાલમ — પણ સંસ્કૃત શાખાથી ભરેલી છે; અને જે આપણામાં થોડી દેશભક્તિ અને ધર્મ હોય, તો આપણે અધી જ ભાષાઓ. દેવનાગરીમાં લખવાનો આચાર ધરીએ. આ ભાષાઓના ડોરોમાં ધ્રણ શાખાન્ય છે, અને લિપિઓ પણ એકખીનાને મળતી છે. જે આપણા મનને થાક ન ચુક્કો હોય તો સહેલે આપણે પાંચ જ દેશી ભાષાઓ જાણતા હોઈએ. ઉર્દૂ પણ શીખવી મુશ્કેલ નથી,— આપણા પંડિતો જેમ હિંદીમાં સંસ્કૃત શાખા ભરે છે તેમ જે ઉર્દૂ મોલવીએ. એમાં હાંસી હાંસીને અરની ઝારસી શાખા ન ભરતા હોય તો.

એક છેવટની વાત. દરેક વિદ્યાપીડિમાં એકાદ ખાસિયત હોય છે, નેને લીધે એ જાણીતી થાય છે. આકસ્માઈ ડેમિયનને વિષે તો એ વાત સાચી છે જ. પણ આપણે તો આપણી વિદ્યાપીડિને પણ પશ્ચિમની ‘શાહીચૂસ’ અનાવી છે. આપણું ઉપરના આડંબરો તો લીધા છે, પણ જે લેવાની વસ્તુ તે લીધી નથી. આપણું પ્રણની સાથે સંબંધ રાખ્યો નથી, પ્રણની જે ખરી ભૂખ તે ખાંગી નથી. આપણું વિદ્યાપીડિની વિરોધતા કર્ત એ જાણું મુશ્કેલ પડે છે. કહેવાય છે કે, તમારે ત્યાં છજનેરી અને ભીજા ઉદ્ઘોગોની તાલીમ જેવી મળે છે તેવી ભીજે કુચાંય નથી મળતી. પણ એને હું વિરોધતા ન કરું. અહીની વિરોધતા તો એ હોય કે, આપણું મુસલમાનોને અપનાવતાં શીખીએ. અધીગઠથી ડેટલા અહીં આવે છે? ડેટલા મુસલમાનોને આપણે અહીં આકર્ષ્ય છે? ધન તો આપણને મળે છે, અને ધ્યાનરક્ષાંયે માલવીયજ થોડાં વર્ષ રખારે જીવશે તો નાનુંય ધન મળશે. પણ ધનથી હું મચ્છું છું એ થોડું જ થાય એમ છે? હું તો આ વિશ્વવિદ્યાલય મારકેતે હિંદુ મુહિલમની એકહિલીનો સંહેશો મળે એમ મચ્છું છું. મુસલમાનોને બોલાવીએ અને તેઓ ન આવે તો દરકાર નહીં, પણ તમે બોલાવો તો ખરા. આપણું આરલી પ્રાચીન સભ્યતા — જેને તિલક મહારાજે ૧૦,૦૦૦ વર્ષ પ્રાચીન કહી છે અને ભીજા પંડિતોએ એથીએ પ્રાચીન તરીક વર્ણવી છે — તે ને આટલાં વર્ષ કાયમ રહી છે, તો તેનું કાયમ એ છે કે, એ બંધુત્વતો સંહેશ ફેલાવે, દુશમનોને દોસ્ત બનાવે. હિંદુ સભ્યતા જ એવી છે કે જેમાં ગંગાની જેમ અનોક સ્થોતો લળી ગયા છે —

‘હિંદુસ્તાની’ શાખા પણ આપણો ક્રમાં છે? — એટલે આજે એ પ્રાર્થના કરવા ધર્મથું છું કે, તમારું વિશ્વવિદ્યાલય પોતાની એ વિશેષતા બનાવે કે, તે ખીલું સભ્યતાઓમાંથી નેટલું લેવાનું છે તે લે અને જગતની આગળ સભ્યતાઓ અને ડોમેની હાર્ડિક એકતાનો નમૂનો રજૂ કરે. અંગ્રેજ તમને આ કરવામાં મદદ નહીં કરે. એ તો તમે આપણા અંગ્રેજમાંથી મેળવી શકશો, આપણાં શાસ્ત્રોમાંથી મળશો — જો શાસ્ત્રો તમે મારી દર્શાવે વાંચશો તો.

૫૦ ૫૦, ૧-૨-૪૨

### ૩૫. અંગ્રેજનું સ્થાન

૫૦ — આપામાં આવ્યું છે કે, આપે બનારસમાં એમ કહેલું કે કાઈ હિંદીએ અંગ્રેજ ભાષા શીખવી કે એલવા પાપ છે; જ્ઞાન આપ એ ગોઝારી ભાષાનો જ્યારે આપને સગવડ હોય ત્યારે દૂર્ઘટી ઉપયોગ કરો છો, તેથી આપના ઉપર દંલનો આરોપ મૂકવામાં આવે છે.

૭૦ — આ અહેવાલ સાચ ખોટો છે. પણ એક વાર એક જૂહાણું બણાર પડે પછી તેને પહોંચ્યો વળવાનું કામ બહુ જ કરણું થાય છે. મારે વિષેનાં ધાર્યાં જૂહાણુંએનો આવેનું ધર્તિલાસ છે. તેને પરિણામે થોડો વખત લાગણુંએ ઉશ્કેરાતી, પણ પછી મારા તરફના કંશ પ્રયત્ન વિના જ તે અસત્યો દટાઈ જતાં. તેમ જ આ પણ શરીર જરૂરો જે અસત્યને કરો. પાયો જ ન હોય, તેનાથી કદી કાઈને તુકસાન કરી શકાતું નથી. આ સવાલનો જવાબ હું આપું છું તે મારી આધૃતની રક્ષા માટે નહિ, પણ મારો મૂળ સુદો વધારે સમજનવા માટે જ. દંલનો આરોપ જતે જ આ જૂહાણુનો જવાબ આપી હે છે. કારણ કે, અંગ્રેજ ભાષાનો દૂર્ઘટી ઉપયોગ કરવાનું મેં કાઈ આજાંડાલમાં શરી કર્યું નથી. આ આરોપ સાચ તકલાદી ગળાવો જોઈતો હતો. હવે મારું કહેલું સમજાવું હું અંગ્રેજ ભાષા અને અંગ્રેજનો પ્રેમી છું. પણ મારો પ્રેમ વિવેક અને બુદ્ધિયુક્ત છે. આથી હું દરેકને તેમને ધર્યાનું સ્થાન આપું છું. એટલે અંગ્રેજ ભાષાને સ્વભાવાઓ કે અભિલ લારતની રાષ્ટ્રભાષા સ્વભાવિક હિંદુસ્તાનનું સ્થાન લેવા હેતે નથી; તેમ જ અંગ્રેજો પ્રયેતા મારા પ્રેમને કારણે તેમને હાથે મારા દેશથિંદુંએનાં હિતોનું તુકસાન થાય તે સહન કરી

શકો નથી. આંતરરાષ્ટ્રીય વલારો માટે અંગ્રેજ ભાષાનું અથવાં મહત્વ હું સ્વીકારું છું. જે ખાસ હિંદીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં હિંદુસ્તાનનાં હિંતો રજૂ કરવાં પડે છે તેમને માટે એક વધારાની ભાષા તરીકે તેનું શાન અનિવાર્ય છે. વળી પાશ્ચાત્ય વિચારો અને વિજ્ઞાનશાસ્કોમાં ડેક્ઝિયું કરવા માટે અંગ્રેજ ભાષા એક ખુલ્લી ભારી જેવી છે. આ લોકોનેથે હું એક જુહો વર્ગ પાડું. તેમની મારફતે આપણી ભાષાઓમાં પાશ્ચાત્ય શાન હેલાય એમ હું ધર્મછું. પણ હિંદુસ્તાનનાં બહુસંખ્ય બાળકો પર બોલે પડે અને એક પરદેશી ભાષા દ્વારા તેમની ખુદ્દિનો વિકાસ કરવાના પ્રયત્નમાં તેમની ભીલતી શક્તિઓ ખર્ચાઈ જાય, તે મને ગમતું નથી. આવી કૃતિમ શિક્ષણપદ્ધતિ નિર્માણ કરવા માટે જેઓ જવાબદાર છે તેઓ પાપ કરે છે, એમ હું અવસ્થ માનું છું. એવી સ્થિતિ દુનિયાના ડેર્ચ પણ ભાગમાં હોય એવું જાણું નથી. આથી પ્રણને જે તુકસાન થયું છે તે તાંત્રનું હોવાથી તેનો સાચો આંક આપણે કાઢી શકતા નથી. એથી થેવા તુકસાનની પારાનારતા હું જોઈ શકું છું, કારણ કે હું દેશના મૂંગાં અને પિસાયેલા કરોડોના ગાડ સંસર્ગમાં રોજ આવું છું.

૫૦ બ'.૦. ૧-૨-૪૨

## ૩૬. હિંદુસ્તાની

મહાસભાના અંધારણની ૨૫મી કલમ આ પ્રમાણે છે:

“(ક) મહાસભા, મહાસમિતિ અને કાર્યવાહક સમિતિનાં કામકાજ સામાન્યપણે હિંદુસ્તાનીમાં ચલાવવામાં આવશે. ઐલનાર હિંદુસ્તાની ન ઐલી શકે, અથવા જ્યારે જ્યારે પ્રમુખ પરવાનગી આપે, ત્યારે અંગ્રેજ ભાષા અથવા ડેર્ચ પણ પ્રાંતિક ભાષા વાપરી શકશે.

(ખ) પ્રાંતિક સમિતિનું કામકાજ તે તે પ્રાંતની ભાષામાં ચલાવવામાં આવશે. હિંદુસ્તાની પણ વાપરી શકશે.”

મહાસભાએ આ દૂરાવનો અમલ કહેવા જેટલે અંશે કર્યો નથી, એ વરતુ જેહજનક છે. એમાં દોષ મહાસભાવાદીઓનો છે. તેઓ હિંદુસ્તાની શાખવાની તકલીફ લેતા નથી. વિદ્ધાન અંગ્રેજની બરાબરીનું અંગ્રેજ ભાષાનું શાન મેળવવાનું અશક્ય કામ કરવામાં એમનો ભાષાઓ શાખવાનો પ્રયત્ન

સમાસ થતો લાગે છે. પરિણામ અતિ હુંખદ આવ્યું છે. એને લીધે પ્રાણિક ભાષાએ દરદ અની છે, અને અભિલ ભારતની રાષ્ટ્રભાષા — જેને મહાસભા ‘હિંદુસ્તાની’ ને નામે એળાએ છે — તેને અસેડી તેનું સ્થાન અંગ્રેજીએ લીધું છે. વળી એને લીધે કરોડોના જનસમૂહની અને પોણા જેટલા અંગ્રેજ ફેણવણી પામેદાની વચ્ચે સાગર જેવું અંતર પડી ગયું છે; અને આ લોડા પ્રજાના સ્વાભાવિક નેતાઓ થઈ પડેલા છે એટાં કારણું માત્ર એટાં જ છે કે, સુશિક્ષિત વર્ગમાં ગણ્યાય એવા તેઓ એકલા જ છે. વળી સરકારે ઝાટેલી નિશાળો સિવાય થીને જેને ફેણવણી કહી શકાય એવા લાયુટરની સગવડ પણ નથી. અંગ્રેજ ભાષાને ખસેડીને તેને સ્થાને હિંદુસ્તાનીને સ્થાપનાનું લગ્નીરથ કામ મહાસભાને કરવાનું છે. ઉપરનો હરાવ પસાર થતાં તેણે આ કામ માટે એક સંસ્થા કાઢવી જોઈતી હતી; હજુ પણ કાઢવી ઘટે છે. પણ તે જે ન કાઢે તો મહાસભાવાદી વ્યક્તિઓએ અને અભિલ ભારતીય રાષ્ટ્રભાષા ખીંચવાના કામમાં રસ ધરવતાર માણસોએ તે કાઢવી જોઈએ.

પણ હિંદુસ્તાની એટલે શું? ઉર્દૂ અને ડિંદીથા લિંગ ‘દિંદુસ્તાની’ નેવી કાઈ ભાષા નથી. કેટલીક વાર ઉર્દૂને હિંદુસ્તાની કહેવામાં આવે છે. ઉપર આપેલી અંધારણુંની કલમમાં મહાસભાએ ‘હિંદુસ્તાની’ એટલે ઉર્દૂ એવો અર્થ કહેવેલો હતો શું? ઉર્દૂ કરતાં વધારે નિશાળ જનસમૂહને જાણીતી હિંદીનો એમાં ત્યાગ કહેવેલો હતો શું? એવો અર્થ હાંસીપાત્ર લેખાય. મહાસભાએ કહેવેલો અર્થ તો દિંદી અને ઉર્દૂની શાખશુદ્ધ મેળવણી એવો હૃદ્ભાતી રીતે હતો, ને એવો જ હોઈ શકે. એવી મેળવણી લેખનમાં થયેલી પ્રયત્નિત નથી. પણ એવી ભાષા ઉત્તર ડિંદમાં વસતા કરોડો નિરક્ષર હિંદુ મુસલમાન બને બોલે છે. એ લેખનમાં વળરાતી નથી તેથી અપૂર્ણ છે; અને લેખનની ભાષાએ એ જુદા વલણ લીધાં છે, ને એ એ પ્રવાહો એકખીનથી ફૂર ભાગે છે, તેથી તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે. એટલે ‘હિંદુસ્તાની’ શાખનો અર્થ ડિંદી અને ઉર્દૂ છે. તેથી હિંદી પણ, જે તે ઉર્દૂનો ત્યાગ કરે, પણ ભૂળ ભાષાના કુદરતી અંધારણ અને માધુર્યમાં ક્ષતિ આવવા દીખા વિના, શાખશુદ્ધ રીતે શક્ય હોય એટલા પ્રમાણમાં, ઉર્દૂને પોતામાં બેળવવાનો પ્રયાસ કરે, તો પોતાને ‘હિંદુસ્તાની’ કહેવડાણી શકે છે. ઉર્દૂ પણ એ જ પ્રમાણે કરી શકે છે. આ એ પ્રવાહો જે આને એકખીનથી ફૂર ભાગવાનો જાય હેખાય છે, તે બેની મેળવણી કરવા મથનાર કાઈ હિંદુસ્તાનીની સ્વતંત્ર સંસ્થા નથી.

આ શુલ ડાર્યે હિંદી સાહિત્ય સમેલન તેમ જ અંજુમનો-તરફ્ફીએ-ઉર્દું કરી શકે છે. હિંદી સાહિત્ય સમેલને ૧૯૭૭માં તેની વાર્ષિક એટાનો પ્રમુખ થવા મને નોતર્યો ત્યારથી મારો તેની સાથે સંબંધ રહેલો છે. અભિલ લારતની રાષ્ટ્રભાષા વિષેના મારા વિચાર મેં એ સમેલન આગળ રજૂ કરેલા. ૧૯૭૫ માં હું સમેલનની એટાનો ફરી વાર પ્રમુખ થયો ત્યારે, 'ઉત્તર લારતના હિંદુ તેમ જ મુસ્લિમાન ઓલે છે અને હેવનાગરી અથવા ઝારસી લિપિમાં લખાય છે એ ભાષા તે હિંદી', એવી વ્યાખ્યા હું તેની પાસે સ્વીકારાવી શક્યો હતો. તેને પરિણામે સ્વાભાવિક રીતે સમેલનના સભ્યોએ એ વ્યાખ્યાનો અમલ કરી શકાય એટાલે અંશે પોતાનું હિંદી રાન વધારવું ધર્તાનું હતું, અને હિંદુ તથા મુસ્લિમાન બને વાંચી શકે એવું સાહિત્ય ઉત્પન્ન કરવું ધર્તાનું હતું. અને સારુ એ સભ્યોએ ઝારસી લિપિ શીખવી ધર્તાની હતી. એ સુંદર તક તેમણે ગુમાવી લાગે છે. પણ એ કામ કરી ન કરવું એના કરતાં મોડું પણ કરવું સારું છે. તેઓ હવે જગીને કામે લાગશે ખરા ? તેમણે અંજુમન સાથ આપે તેની રાદ જોતા ઐસવાની જરૂર નથી. અંજુમન સાથ આપે તો ભારે વાત કહેવાય. એમાંથી એક પણ મંડળ, જો બીજાની જોડે હળામળાને કામ કરે તો, આ કામ કરી શકે એમ છે. મારી સ્થયના એ છે કે, બીજે પક્ષ કર્દી કરે યા ન કરે એનો વિચાર કર્યા વિના, દરેક મંડળે સ્વતંત્રપણે પોતાનું કર્તાબ્ય કરવું. જે મંડળ મારી યોજનાનો અમલ કરશે તે પોતે જે ભાષાનું પ્રતિનિધિ છે તે ભાષાને સમૃદ્ધ બનાવશે, અને અતે આખા રાષ્ટ્રને ઉપરોગી થઈ પડે એવી ભાષાની મેળવણી તૈયાર કરવાનું શેષ મેળવશે.

હિંદી ઉર્દુના સવાલે કોમી ઇપ ધારણું કર્યું છે એ દુર્દીવની વાત છે. એમાંથી ને પક્ષ ધારે તે બીજાને માન્યતા આપીને તે ભાષાનો સ્વીકાર્ય એવો અંશ ઉદ્ઘાર ભાવે પોતામાં લેળવી લઈને બાળ સુધારી શકે છે. જે ભાષા પોતાની વિશિષ્ટતાને હાનિ પહોંચાડ્યા વિના બીજી ભાષાઓમાંથી વિના સાડાચે શાખદો લેશો, તે ભાષા પોતાના શષ્ઠ્યભૌણને સમૃદ્ધ બનાવશે. અંગેજ ભાષાએ એ જ પ્રમાણે બીજી ભાષાઓમાંથી છૂટે હાથે શાખદો લઈને પોતાની શષ્ઠ્યસમૃદ્ધ ધણી વધારી છે.

## ૩૭. હિંદી + ઉર્દુ = હિંદુસ્તાની

નીચેના કાગળની તારીખ ૨૬મી જાન્યુઆરી છે, અને તે મને રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવ્યો હતો. મને તે સેવાઆમમાં ૩૧મીએ મળ્યો :

“તમારા અનારસ હિંદુ વિશ્વવિદ્યાલય પદ્ધીદાન સમારંભ વખતના લાખણુની મારા પર ખૂબ અસર થઈ છે. આસ કરીને ડેળવણીના વાહન તરીકે હિંદુસ્તાનીનો ઉપયોગ કરવા બાબતના તમારા ઉદ્ગારો ખણ્ડ સમયેચિત હતા. પણ હિંદુસ્તાની જેવી ડોઈ ભાષા આપણા દેશમાં અસ્તિત્વ ધરાવે છે એમ શું તમે સાચે જ માનો છો ? ખરું પ્રોત્સાહની ડોઈ ભાષા છે જ નહિ, અને લય છે કે, તમે અનારસમાં જેની વકીલાત કરી તે હિંદુસ્તાનીની નહિ પણ હિંદીની હતી, અને બધા જ મહાસભાવાદીઓ આમ કરતા આવ્યા છે. મને આશ્રમ્ય થાય છે કે, તમે જે ખરેખર ધર્મથી હોય છો તે ખુલ્લું કેમ નથી કહી હેતા ? કહો કે તમે હિંદી જ ચાહો છો. શા માટે તમે તેને હિંદુસ્તાની કહો છો, અથવા — એથીયે ભૂંડું થોડા વર્ષ પર કરતા હતા, પણ જેનો ડોઈ એ ઉપયોગ કર્યો નહિ તેમ — હિંદી-હિંદુસ્તાની કહો છો ?

“મહાત્માજી, તમે કહો છો કે તમને ઉર્દુનો દેખ નથી. છતાં તમે તેને કુરાનની લિપિમાં લખ્યાતી અને મુસલમાનોની ભાષા તરીકે જાહેર રીતે કહી હતી. તમે એમ પણ કહેલું કે, મુસલમાનોને ગમે તો ભલે તેની સંલાણ લે. અને બીજી ભાષુયે તમે હિંદી સમેતનના વાર્ષિક મેળાવડાઓમાં કેટલીયે વાર પ્રમુખ થયા, અને ત્યાં હિંદીની વકીલાત કરી તથા તે માટે લાખો રૂપિયા ભેગા કર્યા. ઉર્દુના પ્રચાર માટેની ડોઈ પણ સભાના તમે કુચારેથે પ્રમુખ થયા છો, અથવા થવાનું ફળુયે કખૂલ કરશો ? અને ઉર્દુના લાલ માટે એક પાર્દીયે કદી બેગી કરી છો ?

“કંટાળી જવાય ત્યાં સુધી મહાસભાવાદીઓને મેં એમ બોલતા સાંભળ્યા છે કે, મુસલમાન લેખકોએ દ્વારસી શણદો અને હિંદી લેખકોએ સરેકુલ શણદોને દ્યાળવા જોઈએ; તેને પરિણામે જે ભાષા નીપણશે તે હિંદુસ્તાની થશે.

“મહાત્માજી, તમે પોતે એક સારા લેખક છો. તમારે જાણું જોઈ એ કે, વડાયેલા લેખકોની એક એક ભાસ શૈલી હોય છે; તેથી તેઓ જે ભાષામાં

લાખતા હોય અને એક ખાસ શૈલી માટે પંક્તિયેવા હોય, તે ભાષામાં આવતા દ્વારસી કે સંસ્કૃત શબ્દોને તેઓ ટાળી શકે જ નહિ. એટલે તમારી આ શિખામણું તહેન અવહેવારું છે.

“પણ આમાંથી એક માર્ગ કાઢી શકાય. આમાંથાં એક પ્રાંતમાં, દ્વા. ત. યુક્તાપ્રાંતમાં, લાખરસ્કુલનાં ધોરજોં સુધી ઉર્દુ અને હિંદ્રી બનેને ફરજિયાત કરેલા. આથી જે પ્રાંતમાં એ બને ભાષાઓ ફરજિયાત શીખવાતી હશે તેમાં આવતાં પચાસેક વર્ષમાં એક ભાષા ઉત્પન્ન થશે. જે ભાષા સ્વાલાવિક રીતે આપણું હશે તે રહેશે, અને બીજુ જેને કૃતિમ રીતે આપણે પોતા પર લાદીએ છીએ તે આપણું જીવનમાંથી ખરી ખડશે. એ તો હેખાતું છે કે, આપણે બને ભાષા શીખીશું તો વગર કણે આપણે તે જ ભાષાને આપણું વિચારોનું વાલું અનાવીશું કે જે વધારે વધાયેલી, વધારે સુંદર, વધારે આકર્ષક, વધારે અર્થાલર (થોડા શબ્દમાં વધારે કહેનારી), અને વધારે ભાવનિકર્ષક (ભાવોને ખરાખર પ્રકટ કરુનારી) હશે. દેશી ભાષાઓનો માર્ગ વધારે નિર્વિદ્ધ અને સહેલો કરવા ઉપરાંત એને પરિણામે હિંડુઓ અને મુસ્લિમાનોના સામાજિક જીવન વર્ણને અંતર ક્રાપવામાંથે જ્ઞાની ઘણી મદ્દ થશે. એકખીજનાં સાહિત્ય દ્વારા એકખીજનાં આદર્શો અને માન્યતાઓ માટે આપણે સમજણું અને સમજાવ કેળવી શકીશું. સંભવ છે કે, હિંદ્રી અને ઉર્દુના આ મિશ્રણમાંથી હિંડુસ્તાની કંઈ શકાય એવી એક નવી ભાષા ઉહ્ભાવે. અનેના જ્ઞાનમાંથી શ્રીપત્રવાર્થી તે સ્વાલાવિક ભાષા બનશે.

“મહાત્માજી, દેશમાં એક જ રાષ્ટ્રભાષા હોવી જોઈએ એમ જે તમે પ્રામાણિકપણે માનતા હો, તે જેને ભાતરી છે કે તમે મારી સ્થયના સ્વીકારશે. અને તેની દેશને ભલામણું કરશો. પણ મારી ભાતરી છે કે તમે તેવું કશું કરવાના નથી. કારણું કે, નમે હંમેશાં હિંદીની જ ભલામણું કરતા આવ્યા છો, અને તેને જ દેશ પર લાદ્યા આવ્યા છો. અને તમે એ પણ જાણતા હશો કે, જે હિંદ્રી અને ઉર્દુ બનેને ફરજિયાત કરવામાં આવે તો ઉર્દુ હિન્દીને ખાઈ જશે, કેમ કે ઉર્દુ હિંદ્રી કરતાં વધારે સુધા, સુધરેલી, ભાવનિકર્ષક અને સુંદર છે. પણ મારી સ્થયના બનેને સરખી તક આપે છો. જે તમને લાગતું હોય કે, હિંદ્રી જ દેશની સ્વાલાવિક ભાષા છે, તો તે ઉર્દુને ગળા જશે એમ તમે ભાતરી રાખી શકો. ગયે વર્ષો તમે મને લખ્યું હતું તેમ, બને ભાષાઓ ફરજિયાત કરવાની તમને સત્તા નથી, એ બદાનાનો આશરો લેવામાં કાંઈ અર્થ નથી.

દેશને ભાલામણુ કરવાની માત્ર તમે મહેનત લેશો, તો તેવી ને અસર થવાની હશે તે થશે.”

દેખકે પોતાની સહી કરી છે. પણ કાગળ મને ‘અંગત’ તરીકે લખેલો હોવાથી હું નામ આપતાં અટકું છું. નહિ તોયે નામનું મહત્વ નથી. મને માલુમ છે કે, આ દેખકના જેવી જ ધીન ધણા મુસલમાનોની માન્યતા છે. મારા છન્નકારથી બગડેલું સુધ્યું” નથી. પણ એવી તારીખના ‘હરિજનબંધુ’માં પ્રસિદ્ધ થયેલા મારા ૨૩મી જાન્યુઆરીના દેખથી દેખકની મારા પોતા પ્રત્યેની લાગણું શાંત થવી જોઈએ.

દેખક સાથે હું પૂરેપૂરો સંમત છું કે, નેચો એક જ અભિલ લારતીય ભાષા ચાહે છે તેમણે સૌચે આને હિંદી અને ઉર્દૂ બંને શીખી જોઈએ. જેઓ તેમ કરશે તેમો આપણને એક સામાન્ય (રાજ્ય) ભાષા આપશે. આમપ્રણ ને શૈલી વધારે સમજ શકતી હશે અને જે વધારે લોકપ્રિય બનશે, તે જ અભિલ લારતીય ભાષા બનશે — પછી લલે તેનું રૂપ હિંદુ હોય કે મુસ્લિમ હોય. પણ મારી સૂચના જે સર્વેને ગળે જિતરે, તો ભાષાનો પ્રશ્ન રાજકોય મુદ્દો અને જ્ઞાનનું મૂળ થતો અટકશે.

દેખકના આ મત સાથે હું મળતો થતો નથી કે, ઉર્દૂ હિંદી કરતાં “વધારે ધડાયેલી, વધારે સુંદર, વધારે આકર્ષક, વધારે અર્થભર અને વધારે ભાવનિર્દ્દર્શક” છે. દેખક કહે છે તેવા સર્વે ગુણો કોઈ પણ ભાષામાં સ્વયંભૂ હોતા નથી. જેવા બોલનારા અને લખનારા તેવી તેમની ભાષા ધડાય છે. અંગેનેએ જેવી અંગેજ બનાવી તે કરતાં તેનામાં મૂળથી જ વધારે ગુણ નહોતા. ધીન શબ્દોમાં, ભાષા માણુસની બનાવેલી વસ્તુ છે, અને જેવા બનાવનારા તેવી બને છે. દરેક ભાષામાં ભીલવાની અપાર શક્યતા રહેલી છે. અવાનીન બંગાળી બંકિમ અને રવીન્દ્રનાથ જેવી નિપળવી તેવી થઈ છે. આથી, જે એ સાચું હોય કે હિંદી કરતાં ઉર્દૂમાં સર્વે પ્રકારના વધારે ગુણો છે, તો તેનું કારણું એ કે હિંદીના ધડનારા કરતાં તેને ધડનારા વધારે શક્તિશાળી માણુસે હશે. એ ભાષાનમાં હું કરો અભિપ્રાય રજૂ કરી શકતો નથી. કારણું કે મેં ઐમાંથી એક્ઝિનો ભાષાવિશારદ તરીકે અભ્યાસ કર્યો નથી. મેં તો મારાં જહેર કામો પૂરતું જ બનેનું જાન મેળાવ્યું છે.

પણ હું પૂછું છું કે, શું સાચે જ હિંદી અને ઉર્દૂ એકખીનથી એવી જુદી ભાષાઓ છે કે જેવી, દાખલા તરીકે, બંગાળી અને મરાઠી છે? ઉર્દૂ

એ હારમી લિપિમાં લખાતી, અને સંસ્કૃત કરતાં અરથી અને હારમીમાંથી નવા શાખાનો લેવાનું વલણ ધરાવતી, હિંદીમાંથી જ જિતરી આવેલી ભાષા નથી હું? ને એ ડામો વર્ચ્યે એદિલી ન હોત, તો આ પરિણામનું સ્વાગત થયું હોત. અને જ્યારે આજનાં વેરાઝર શરી જરો — તેમ એક હિવસ થવાનું જ છે — ત્યારે આપણા વંશને આપણી આજની તકરારો પર હસરો, અને અસંખ્ય લેખકો અને એલાનારાઓની વિવિધ રૂચિઓ અને (ભાષાની) મૂડીઓમાંથી તથા અનેક ભાષાઓમાંથી જેમ હાવતું આવ્યું તેમ વિના ચીવટે સ્વીકારેલા શાખાની ભીચીથી બનેલી હિંદુસ્તાની ભાષા માટે અલિમાન ધરાવશે.

લેખકની એક ગેરસમજ મારે સુધારવી ધરે છે. એ એમ માનતા ભાગે છે કે, હિંદુસ્તાની આગળ જતાં બધી પ્રાન્તિક ભાષાઓની જગ્યા લઈ દેશે. મારી એવી કલ્પના નથી, અને અભિલ ભારતીય ભાષાનો વિચાર કરનારા ભીજાઓની પણ નથી. તેમની કલ્પના હિંદુસ્તાનને અંગ્રેજનું સ્થાન આપવાની છે. આજે તો અંગ્રેજ ભાષા ભણેલાઓની વર્ચ્યેના પરસ્પર બ્યવહારનું લગભગ વાહન બનેલી છે, અને તેને પરિણામે તેમની અને પ્રજાની વર્ચ્યે મોઢું અંતર પડી ગયું છે. જે હિંદુસ્તાનની પ્રજાનો સૌથી મોટો ભાગ જે ભાષા બાલે છે તેને જ આંતરપ્રાન્તીય બ્યવહારો માટે સામાન્ય ભાષા અનાવીએ, તો જ આ હુંઘદ પરિણામ ટાળી શકાય. આથી હિંદી અને ઉર્ડુ વર્ચ્યે લડાઈ નથી, પણ એક ભાજુ તે એ અને ભીજુ ભાજુ અંગ્રેજ વર્ચ્યે છે. પરસ્પરની આજે દેખાતી એદિલી ઉપરાંત, અને બહેનોના માર્ગમાં ધાણું મોઢું વિન્દ હોવા છતાં, આ લડાઈના વિજયી અંત વિષે કશી રાંકા જ નથી.

લેખકને હિંદી સાહિત્ય સમેલન સાથેના મારા સંબંધ સામે વાધો છે. એ સંસ્થા સાથેના મારા સંબંધ માટે મને ગર્વ છે. એજુ પોતાની કારકિર્દી માટે કશું જ શરમાવા જેવું નથી. હિંદી નામ બને ડામો માટે સમાનપણે લાગુ પડતું હતું. બનેએ હિંદીમાં લગ્યાં છે અને તેને સમૃદ્ધ કરી છે. મારા તે સંસ્થા સાથેના સંબંધની પાછળ કેટલો અર્થ રહેલો છે તેનો લેખકને ઘ્યાલ જ નથી એમ ભાગે છે. મારી પ્રેરણાથી તેણે ઉલાપણ જ નહિ પણ (ગણાવું તો) દેશભક્તિ તથા ઉદ્ઘર્ષાયે દેખાડીને, હિંદીની એવી વ્યાખ્યા ધડી કે, તેમાં ઉર્ડુ પણ આવી જાય. લેખક પૂછે છે, કાઈ ઉર્ડુ પરિષદમાં હું કંઈ ભજ્યો છું કે? કાઈ હિવસ ગંભીરતાપૂર્વક મને એવું તેકું જ મળ્યું નથી. મળ્યું હોત, તો હિંદી સાહિત્ય સમેલનમાં તેવાવાળાઓ જેડે મેં જે શરત કરી રેવી જ

તેમની સાથે પણ કરત. મેં ઉર્દુ' તેવાવાળાઓને કહું હોત કે, ઓતાઓ આગળ મને ઉર્દુની એવી વ્યાખ્યા મુકવાની પરવાનગી આપે કે જેમાં દેવનાગરીમાં લખાતી હિંદીને પણ સુમાસ થાય. પણ આવી તક મને મળી જ નથી.

પણ ૧૯૮ ફેઝુઆરીના મારા લેખમાં મેં સૂચયથું છે તેમ, હું એક એવી સંસ્થા કાઢવા પછ્યું ખરો કે જેના સભ્યો હિંદી અને ઉર્દુ અનેની શૈલીઓ અને લિપિઓની હિંમાયત કરે, અને તે ઉદ્દેશથી પ્રયાર કરે, અને આશા રાખે કે, છેવટે એ અનેમાંથી એક જ સ્વાભાવિક રૂપ ધરાવનારી હિંદુસ્તાની નામની આંતરમાન્ત્રીય ભાષા નિર્માણ થશે. પછી હિંદુસ્તાનીને હિંદી અને ઉર્દુ સાથેને સંબંધ હિંદી + ઉર્દુથી નહિ દર્શાવાય, પણ હિંદુસ્તાની=હિંદી=ઉર્દુથી દર્શાવાશે.

૬૦ બં૦, ૮-૨-૧૯૪૨

### ૩૮. હિંદુસ્તાની શીખો

“સતકર્મના આરંભ ધરથી કરવો.” મહાસલાની ભલામણુ સુજાપ જેએ રાષ્ટ્રકાણમાં માનતા હોય તેમણે ઉર્દુ ‘શીખો’ લેવું આવસ્યક છે એમ જ્યારે મેં જમનાલાલજીના મિત્રો સમક્ષ કહું, ત્યારે મારા પોતાના મનમાં ઉપરની અંગ્રેજી કહેવત યાદ આવી ગઈ, અને સેવામાંથી જ મેં ઉર્દુના પ્રયારનું સતકર્મ શરૂ કર્યું. પરિણામે મને વેગભર્યો અને સારો જવાબ મળ્યો ગયે ખુખ્ખવારે, એટલે ૨૫મી ફેઝુઆરીએ, વર્ગની શરૂઆત થઈ. નાનાં મોટાં, સ્વીપુરુષ, લગભગ બધાં જ તેમાં દાખલ થયાં. અડધા અડધા કલાકના એ સભ્યવિલાગમાં તેએ ઉર્દુ ‘અણજાદ’ (કર્ઝો) શીખો ગયાં. આ છપારો ત્યાં સુધીમાં તો તેએ અક્ષરોનાં જોડાણની રીતો પણ જાણી ગયાં હશે. એટલે કે, માત્ર ત્રણેક કલાકમાં તેમણે લગભગ પૂરી બારાઘડી અને ‘જોડાઘડી’ પણ શીખો લીધી હશે. એક જ દ્વિસમાં ચાર જ કલાકમાં આ શીખો લેનાર એક વ્યક્તિને હું જાણું છું.

ઉર્દુ વાંચવાની મુશ્કેલી છે ખરી. એ તો મહાવરાથી જ ટળે. પણ પછ્યા હોય લારે બધું જરણ લાગે છે. સ્વદેશપ્રેમ તે પછ્યાશક્તિને જગત કરવા પૂરતો થવો જોઈએ.

૬૦ બં૦, ૮-૩-'૪૨

૫૦ — મારે શું કરવું એ આપ મને કહેશો? હું વર્ધા દરાવતે માનનારો છું.

૭૦ — એનો અર્થ એ કે, જો મહાસલાની માગણી સંતોષવામાં આવે તો તમે બુદ્ધપ્રયત્નમાં પૂરો ભાગ લેશો. પણ ગમે તેમ થાય તોયે, રચનાત્મક કાર્યક્રમ વિષેનો વધનિા દરાવ તમને ચૌદિવિધ રચનાત્મક કાર્યક્રમમાં તમારો પૂરો દ્વારો આપવા નોતરે છે. તેથી, અને તેનાથી સ્વતંત્ર રીતે પણ, તમારે હિંદુસ્તાની શીખવી જોઈએ, જેથી તમે જનસમૂહની જોડે સંપર્ક સાધી શકો. અને હું અતાવી ગયો છું તેમ, આજે જ્યાં સુધી ઉર્દૂ હિંદી મળાને એકરસ ન થઈ જાય, જ્યાં સુધી હિંદુસ્તાની = ઉર્દૂ + હિંદી છે. આટલો પારિથમ પ્રેમપૂર્વક કરતાં તમને સંક્રાય કે આનાકાની ન હોવાં જોઈએ. તમારો દદ નિશ્ચય તમારું કામ સરળ કરી મુક્શરો. તમે કંઈક દિનની તો જાણો જ છો. તેમાં તમારે સારી પેડે પ્રગતિ કરવી જોઈએ. દ્વારસી લિપિ શીખવી બહુ સહેલી છે. તેના ઉં અક્ષરો માટે બહુ ઓછી ભૂળ સંજ્ઞાએં છે. અક્ષરો જોડવામાં કંઈક મુસ્કેલી આવે છે ઘરી, પણ ભૂળાકારો અને અક્ષરોનું જોડાણું શીખતાં, જો રોજનો એક કલાક આપો, તો વધારેમાં વધારે અહૃવાડિયું લાગે. પછી તો રોજ અડદી કલાક મહાવરો પાડવાનો રહ્યો. એમ કરતાં જ મહિનામાં તમને ઉર્દૂનું કામચલાઉ જાન મળો રહેશો. એ લિપિઓની અને એક જ ભાષાના એ પ્રવાહોની તુલના કરવામાં બહુ રસ પડે એવું છે. આ બધું તો સાચું પડે, જો તમને દેશ અને દેશની પ્રણાને વિષે પ્રેમ હોય. અધરી અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવવાના પ્રયત્નથી આપણાં મન થાકી ન ગયાં હોય તો પ્રાંતિક ભાષાઓ શીખવી એ આપણને હળવો અમ લાગે, અથવા કહો કે તેમાંથી વિનોદ મળો રહે. પણ એવડા રૂપમાં હિંદુસ્તાની શીખવી એ તો રચનાત્મક કાર્યક્રમનું પ્રથમ પગરણ છે. તમારે જો દેશનાં ગરીબમાં ગરીબ માણુસો જોડે અનુસંધાન સાધતું હોય, તો તમારે નિયમિતપણે કાંતવું પણ જોઈએ; અને ઉપરાંત એ કાર્યક્રમમાંની અનેક ચીજો કરવી જોઈએ. એ કાર્યક્રમનો સંપૂર્ણ અમલ તે સાચામાં સાચા અર્થમાં પૂર્ણ સરાજની સ્થાપના છે.

## ૩૯. હિંદુસ્તાની બોલીનો ધર્તિહાસ

૧

ડૉક્ટર તારાચંદ, જેમણે રાષ્ટ્રભાષાના પ્રશ્નનો સારો અભ્યાસ કર્યો છે, તેએ શ્રી. કાકાસાહેબને તેમના એક પ્રશ્નના જવાબમાં તા. ૨ હેઠુંઆરીને રોજ ક્ષેપેલા પત્રમાં લખે છે:

“હિંદુસ્તાની અને મજલાષા બન્ને બોલયાલની લાપાએ હતી. પહેલાં જ્યારે એ કેવળ બોલયાલના કામમાં આવતી તારે તેમની શી સ્થિતિ હતી એ કહેલું મુશ્કેલ છે. ધર્તિહાસ પરથી એટલું જણાય છે કે, બારમી સદીમાં સચાદ સલમાને એક ‘દીવાન’ (કાબ્સાંગ્રહ) હિન્દીમાં લખ્યો હતો. પરંતુ આ ‘દીવાન’માંનું એક પણ કાબ્ય અત્યારે નથી મળાનું. તેરમી સદીથી હિન્દી કે હિંદુસ્તાની મળા આવે છે. ચોરમી અને પંદરમી સદીમાં હિંદુસ્તાનીનું હીક ડીક સાહિત્ય દાદ્દિયામાં તૈયાર થઈ ગયું હતું. આ સાહિત્યની લાપા ઘડી બોલી છે; તે આધુનિક હિન્દીનો આધાર છે. મજલાષાનો સોણમી સદી પહેલાંને કાઈ લેખ હજુ સુધી જોવામાં નથી આવ્યો. પૃથ્વીરાજ-રાસાના ડેટલાંક પદો મજલાષામાં છે. પરંતુ પૃથ્વીરાજ-રાસાના રચનાકાળ વિષે અને ખાસ કરીને તેના મજલાષાવાળા લાગના કાળ વિષે કાઈ નિશ્ચય નથી. ધણ્યાખરા લોડા તેમને સોણમી સદીનો જ માને છે.

“મજ પહેલાં રાજસ્થાનીનો, ડિંગલનો રિવાજ હતો. રાસો મોટે ભાગે ડિંગલમાં જ લખાયેલો છે. મજના સૌથી પહેલા કવિ સુરદાસ છે. તે સોણમી સદીના છે.

“હિંદુસ્તાનીનું સૌથી પહેલું સાહિત્ય મુસલમાનોનું લખેલું જ મળે છે. મુસલમાન સાધુસંતોએ હિંદુસ્તાનીમાં ધર્મની વ્યાખ્યા કરી છે અને સુકીમતના સિદ્ધાંતો વર્ણાયા છે. પછી કવિઓએ કાવ્યો લખ્યાં. આ સાહિત્ય મુસલમાનોનું ક્ષેપેલું હોવાથી તેમાં હિન્દી અને ફારસીના શાખાનું મિશ્રણ છે. એના ધ્વનિઓમાં ફારસી અરથીના ધ્વનિ, જેવા કે કુ ગ જ, મળા ગયા છે. આ ધ્વનિઓ મજમાં નથી, પણ આધુનિક હિન્દીમાં છે.

“ મેરઠ અને હિલ્લીની આજુઆજુની બોલી મુસલમાનોએ પોતાના ઉપરોગમાં લીધી. તે બોલી આજે પણ હિલ્લી અને રોહિલખંડ વચ્ચેના કાગમાં એલાય છે. આ બોલીને ઘડી બોલી (હિંદુસ્તાની) કહે છે.

“ હિંદુસ્તાની, આધુનિક હિન્દી અને ઉર્દૂ આ જ બોલીનાં પણ રૂપ છે. આધુનિક હિન્દી એ હિંદુસ્તાનીનું સાહિત્યક રૂપ છે, જેમાં સંસ્કૃતના તત્ત્વ અને તદ્ભવ શબ્દો છૂટથી અને મોટા પ્રમાણમાં વપરાય છે. ઉર્દૂમાં ફારસી અને અરથીના તત્ત્વમાં શબ્દો બહુ લગેલા છે. હિંદુસ્તાની એટલે સાહિત્યની એ લાખ જોનો આધાર ઘડી બોલી છે, પણ જે ડેવળ સંસ્કૃતના તત્ત્વમાં શબ્દોને કે ડેવળ અરથી ફારસીના તત્ત્વમેને અપનાવતી નથી, પણ બનેમાંથી તત્ત્વમાં શબ્દો લે છે. ડોઈની લખવાની શૈલી સંસ્કૃત તરફ હો છે, ડોઈની ફારસી તરફ. પરંતુ હિંદુસ્તાની લખનારા બનતા સુધી સંસ્કૃત અને અરથી-ફારસી બનેના શબ્દોની અતિશયતાથી બચે છે.

“ મારું કહેવું એમ છે કે, આપણે ન તો હિન્દીને, (જેમાં અરથી-ફારસી શબ્દો દૂર રાખીને સંસ્કૃત શબ્દો સાથે વધારે મેળ છે) અને ન તો ઉર્દૂને, (જેમાં સંસ્કૃત શબ્દોને દૂર રાખીને ફારસી અરથી શબ્દો સાથે મેળ છે) દેશની આમલાખા માનવી જોઈએ. કાં તો હિંદુઓની હિન્દી અને મુસલમાનોની ઉર્દૂ માનીને બનેને એકસરખું સ્થાન આપવું જોઈએ; અથવા હિંદુસ્તાની જે આ બનેની વચ્ચેની લાખ છે તેને આમલાખા, આખા હિન્દની લાખ માનવામાં આવે એવી ઝાંશિશ કરવી જોઈએ. ‘હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે’ એમ કહેતા રહીશું ત્યાં સુધી જગડો એંધો નહિ થાય. કાં તો ઉર્દૂને પણ રાષ્ટ્રભાષા માનો, અથવા જે લાખ સંસ્કૃત અને અરથી-ફારસી બનેના મૂળ ખણનામાંથી શબ્દો લઈ શકે તેને સ્વીકારો.

“ મને તો વિશ્વાસ છે કે, મારું નિવેદન સત્ય પર નિર્ભર છે. પણ હું જાણું છું કે, લાવનાના વંટોળથી સત્યની જ્યોત ઝાંખી થાય છે અને તેનો પ્રકાશ ધરે છે. આ વંટોળમાંથી દેશને બચાવવામાં આપ મદ્દ કરો એમ હું ધૂચું છું. ભાષાનો સવાલ એ સમાજનો સવાલ છે. અને સમાજનો પ્રશ્ન એ સ્વરાજનો પ્રશ્ન છે. ભાષાના પ્રશ્નના નિવેદ પર સ્વરાજનો થોડોધણો આધાર અવશ્ય છે. તથી હું તેમાં રસ લઈ છું, અને આપની મદ્દ મેળવવા ભાગ્યશાળી થઈ એમ ધૂચું છું.”

૩

### ડોક્ટર તારાચંદ અને હિંદુસ્તાની

[ શ્રી. મુરલીધર શ્રીવાસ્તવ એમ. એ. એ પ્રશ્નપેશી માટે નીચેનો પ્રશ્ન મોકલ્યો હતો ]

“ જ્યારે મનમાં ડોઈ વસ્તુ માટે પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે માણુસ ધતિહાસને પણ વિકૃત બનાવવા એસી જાય છે. ડૉ. તારાચંદ પણ આપની પેડે હિંદુસ્તાનીના ચુસ્ત હિમાયતી છે. તેમને પોતાનો મત ધરાવવાને આપના કે મારા એટલો જ અધિકાર છે. તેમણે એમ સાખિત કરવાને પ્રયત્ન કર્યો છે કે, હિંદુસ્તાની ( ખડી ઓલી ) નું સાહિત્ય પ્રજ્ઞલાષાના સાહિત્ય કરતાં વધારે જૂનું છે. અને એ સાખિત કરવાના ઉત્સાહમાં તેમણે, ૧૬મી સહી પહેલાં વ્રતમાં ડોઈ ચીજ લખવામાં નથી આવી, એમ કહીને વજ લાષાના ધતિહાસને બહુ ખોટી રીતે રણૂ કર્યો છે. તેમના મત પ્રમાણે ૧૬મી સહીમાં વજ લાષામાં લખનાર સુરદાસ જ પહેલા કવિ હતા. ગઈ તા. ૨૬મી માર્ચના ‘ દરિજન ’માં આપે આ વિદ્ધાન ડોક્ટર સાહેબના એક પત્રનું અવતરણ આપ્યું છે, અને ‘ દરિજન ’ની પ્રતિક્રિયા અને પ્રચાર વ્યાપક છે એટલે આ ભૂલનાર ઘ્યાન હોરવાનું આવસ્થક થઈ પડે છે. સુરદાસ પહેલાંના વજ સાહિત્યને માટે કૃષીરની — અમીર ખુશરો જેમની કવિતાઓમાંની કેટલીક વજ લાષામાં પણ છે, તેમની વાત ખાળું રાખીએ તો પણ — કવિતાઓ વાંચી લેવા “પૂરતી થઈ પડ્શે. સુરદાસ પહેલાંના અનેક સંતો અને ભક્તોની અનેક નાની નાની કવિતાઓ વજ લાષામાં ભળી આવે છે, અને હિંદી સાહિત્યના ડોઈ પણ ગ્રામાખ્યિક ધતિહાસમાં જોઈ શકાય છે.”

પત્રમાંથી પ્રસ્તુત પ્રશ્ન સાથે જેને સંબંધ નથી એવો ભાગ મેં કાઢી નાખ્યો છે. આ પત્ર મેં કાકાસાહેબ કાલેલકરને મોકલ્યો હતો. તેમણે તે ડૉ. તારાચંદને મોકલ્યો હતો અને ડૉ. તારાચંદ તેનો નીચે આપેલો જવાબ મોકલ્યો છે, જે પોતે જ પોતાની કથા કહે છે :

“ વજ લાષાનું સાહિત્ય ૧૬મી સહી કરતાં વધારે જૂનું નથી એવો અભિપ્રાય મેં આપ્યો હતો તેનાં કારણો આ પ્રમાણે છે :

૧. વજ લાષા એક આધુનિક લાષા છે. તે તૃતીય પ્રાકૃત અથવા ‘ ન્યૂ ઇન્ડો-આર્યન ’ વર્ગની મનાય છે. આ વર્ગનો જન્મ મધ્યમ પ્રાકૃત અથવા ‘ મિડલ ઇન્ડો-આર્યન ’ વર્ગમાંથી થયો છે. દુલંઘે મધ્યમ અને તૃતીય પ્રાકૃત

વચ્ચેની અવસ્થાઓએ નિશ્ચિતરૂપે મળતી નથી. પરંતુ મોટા લાગના વિદ્ધાનો એ વિશે એકમત છે કે, મધ્યમ પ્રાકૃતનો સમય હ્ર. સ. પ્રો' ૧૦૦ થી હ્ર. સ. ૧૦૦૦ સુધી રહ્યો.

૨. મધ્યમ પ્રાકૃતો, જે ફક્ત બોલીએ જ હતી, તેમને મહાવીર અને ખુદે ચલાવેલાં ધાર્મિક આંદોલનોને આગણે પોતાનો સાહિત્યિક વિકાસ કરવાનું ઉત્તેજન મળ્યું. આ પ્રાકૃત ભાષાઓમાં પાલી સૌથી મહત્વની ભાષા બની ગઈ, કારણ કે તેને બૌધ્ધોના પવિત્ર ધર્માંથી લખવાને માટે મધ્યમરૂપે સ્વીકારવામાં આવી હતી. મહત્વની દાખિયે બીજું સ્થાન અર્ધ-માગધીનું હતું. તેમાં જેનોના ધર્માંથી લખાયા, આ ઉપરાંત પણ બીજુ ડેટલીક પ્રાકૃત ભાષાઓએ તે સમયે પ્રયોગિત હતી. દાખલા તરીકે, મહારાષ્ટ્રી જેમાં ગીત અને કાવ્ય લખાતાં, અને શૈરસેની જેનો ઉપરોગ નાટકમાં સ્વીપાત્રોની ભાષારૂપે કરવામાં આવતો.

૩. હરિદ્વી સનની છુટી સદી આવતાં સુધીમાં પ્રાકૃત ભાષાઓ બધિયાર અને ખૂટ ભાષાઓ અની ગઈ હતી. ત્યારે પણ સાહિત્ય તો એ ભાષાઓમાં લખાતું, પણ તેમનો વિકાસ અટકી પડ્યો હતો. આ જ સદીમાં સામાન્ય બોલયાલની ભાષાઓ — જેમાંથી સાહિત્યિક પ્રાકૃતનો જન્મ થયો હતો — નો સાહિત્યની દાખિયે ઉપરોગ થવા લાગ્યો. પ્રાકૃત ભાષાઓના સાહિત્યિક વિકાસનો આ પ્રકાર અપભ્રંશને નામે ચોળાયા છે. તેનો સમય હ્ર. સ. ૧૦૦થી હ્ર. સ. ૧૦૦૦ સુધી રહ્યો. આ અપભ્રંશ ભાષાઓમાંની એક નાગર ભાષાએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ઉત્તર હિન્દુસ્તાનના ધણાખરા ભાગોમાં આ જ નાગરનાં વિવિધ રૂપો સાહિત્યિક અભિવ્યક્તિનાં વાહન તરીકે વપરાવા લાગ્યાં. પરંતુ નાગર અને એનાં વિવિધ રૂપો ઉપરાંત શૌરસેની જેવી બીજુ ડેટલીક પ્રાકૃત ભાષાઓના અપભ્રંશનો પણ વિકાસ થયો હતો.

૪. હિન્દુસ્તાનની આધુનિક ભાષાઓ અથવા તૃતીય પ્રાકૃતનો વિકાસ આ અપભ્રંશ ભાષાઓમાંથી થયો છે. નાગર પોતાના એક પ્રકાર દ્વારા રાજસ્થાની અને ગુજરાતી ભાષાઓની જનની બની. એ પ્રકારને ટેસ્સિટોરીએ પ્રાચીન પદ્ધતિભી રાજસ્થાનીનું નામ આપ્યું છે.

શૌરસેની અપભ્રંશનું રૂપ હેમયંડના ( હ્ર. સ. ૧૧૭૨ ) પ્રાકૃત બ્યાકરણમાં પ્રગટ થયું છે. પરંતુ શૌરસેની અપભ્રંશનો નાગર સાથે સંબંધ નિશ્ચિત કરવો સુશકેલ છે. એમ જણાય છે કે, શૌરસેની અપભ્રંશના રૂપમાં બીજાં પણ પરિવર્તન થયાં અને તે પ્રાચીન પદ્ધતિભી હિંદી, અવહિય, કાવ્યભાષા વગેરે કહેવાયાં.

૫. આ ભાષા આવતાં મધ્યમ પ્રાકૃત ભાષાઓ રંગભૂમિ પરથી ખરાળના જાય છે અને તૃતીય પ્રાકૃત અથવા ન્યૂધન્ડો-આર્થિન ભાષાઓનાં સમય રાંધાય છે. પુરાણા પશ્ચિમી હિન્દી, જે નવીન મધ્યદેશીય ભાષાનું પહેલામાં પહેલાં સ્વરૂપ છે, તે ૧૧મી સદીમાં નિશ્ચિત હેપ ધારણું કરતી જાણાય છે. આ જ પુરાણી પશ્ચિમી હિન્દીમાંથી ઉત્તર મધ્ય દેશની હિંદુસ્તાની (ખરી) નીકળી, મધ્યદેશની મજ નીકળી અને દક્ષિણાંથી ઝુંદેલી નીકળી, બાંધી સદીમાં આ બધી મેળવીએ હતી. પછીની સદીઓમાં તેમણે સાહિસિક રૂપ ધારણું કર્યું.

૬. ભાષાઓના વિકાસના મારા આ અધ્યયન પરથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે, હિંદુસ્તાની (ખરી) ભાષાનો જ સાહિસિક ભાષાના રૂપમાં સૌથી પહેલાં વિકાસ થયો. ૧૪મી સદીનાં છેલ્લાં પચીસ વરસથી માંડીને આજ સુધી આપણું ને હિંદુસ્તાની (દક્ષિણી ડર્બી) નો સળંગ ધતિહાસ મળે છે. બીજુ માજુ ૧૫મી સદી પહેલાંની મજ ભાષાનો ધતિહાસ બહુ શાંકાસ્પદ છે.

૭. સોણની સદી પહેલાંના કહેવાતા મજભાષા-સાહિત્યનો વિચાર કરીએ.

(અ) પૃથ્વીરાજ રાસોનો કર્તાં ચંદ બરહાઈ પહેલો કવિ હતો, જેણે મજ (પિંગળ)નો ઉપયોગ કર્યો કહેવાય છે. તે પૃથ્વીરાજ (૧૨મી સદી)નો સમકાલીન મનાય છે. રાસો વિષે એક વજનદાર મત એવો છે કે એ નકલી કાવ્ય છે. શુહુલર, ગૌરીશંકર હીરાચંદ એઓઝા, અયર્સન અને ખીળ વિદ્વાનોને તેની પ્રામાણિકતામાં સહેલ છે. તેની ભાષામાં આધુનિક અને અપ્રયાલિત ભાષાનું વિચિત્ર મિશ્રણ છે. તેનું કથાવસ્તુ ધતિહાસની નિરૂપ જાય છે અને તેના કર્તાં વિષે પણ શક છે. આ પ્રમાણેને આધારે પંડિત રામચંદ્ર શુક્લ એવા નિર્ણય ઉપર આવ્યા કે, ‘આ અંથ સાહિત્યના કે ધતિહાસના વિદ્યાર્થીને માટે કશા ઉપયોગનો નથી.’

(આ) અમીર ખુશરો થીનો અંથકાર છે, જેને માટે મજના લેખક હેવાનો હાવો કરવામાં આવે છે. ઈ. સ. ૧૩૨૫ માં તે સૃષ્ટુ પામ્યો. હિન્દીમાં તેની કવિતાઓ, સમસ્યાઓ હિન્દીઅર્થી કાવ્યોનો કોઈ આધારભૂત હરતલિભિત અંથ હજી સુધી મળ્યો નથી. લાહોરના ગ્રેફેસર મહમદ શેરાનીએ નિર્ણયિક રીતે સાયિત કરી દીધું છે કે, ‘ખાલિકખારી’ (હિન્દી અને ફારસી શાખાનો પદ્ધતિંદ્ર કાશ), જેને ખુશરોની કૃતિ માનવામાં આવે છે, તે તેની ન હોઈ શકે. તેની હિન્દી કવિતાની ભાષા એટલી આધુનિક છે કે, ભાષાભાષાના કોઈ સાધારણું જાણુકારના પણ ખ્યાલમાં આવ્યા વગર ન રહે કે એ ભાષા ૧૪મી કે ૧૫મી

અનીની નથી. તેની મોટા ભાગની કૃતિઓ તદ્દન આધુનિક હિન્દુસ્તાની અથવા ખડી બોલીમાં છે અને કેટલીક પર વજની છાપ છે. ડૉ. હિદ્યાયત હુસેને ખુશરોની કૃતિઓની એક પ્રામાણિક સ્થાની તૈયાર કરી છે. તેમાં તેઓ તેની હિન્દી કવિતાઓને સ્થાન નથી આપી શક્યા. ખુશરોના પિજાળાં અને દેવલરાની નામના કાવ્યનો એક ભાગ, જેમાં હિન્દીની પ્રશાંસા કરવામાં આવી છે, તે કેટલાક હિન્દી લેખકોએ વાંચ્યો છે. એ ઉપરથી તેઓ એ નિર્ણય પર આવ્યા કે, ખુશરો હિન્દીનો પ્રશાંસક અને કવિ હતો. પરંતુ એ ભાગ ધ્યાનપૂર્વક વાંચતાં એ વસ્તુ રૂપણ થાય છે કે, તાં ખુશરોએ વજ કે હિન્દુસ્તાની વિરો વાત કરી નથી. આવા નજીવા પ્રમાણને આધારે વજ ધર્મિકાંતનો સંબંધ હોય ખુશરો સાથે જોડવો એ શાખસંમત ન કહેવાય.

(ફ) ત્યાર પછી એમ કહેવામાં આવ્યું છે કે, નામહેવ, રૈદાસ, ધનો, પીપો, સેન, કંઈક આદિ સતો અને ભક્તો વજના કવિ હતા. તેમની વાણી અને પદ ગુરુગ્રંથમાં આપવામાં આવ્યા છે. તેમને કેટલે સુધી પ્રામાણિક ગણ્યવાં એ એક અણુભિકલ્યો પ્રશ્ન છે. નામહેવ ૧૩મી સદીમાં થયેલા એક મરાડી સંત હતા. તેમણે હિન્દીમાં કાઈ લખ્યું હતું કે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, કારણ કે ગુરુગ્રંથનું સંક્લન ૧૭મી સદીની શરૂઆતમાં થયું હતું. ખીજ સતો અને ભક્તોની કૃતિઓનાં કાઈ આધારભૂત દસ્તલિભિત પણ નથી ભળતાં.

આ જંતો અને ભક્તોમાં પંદરમી સદીમાં થયેલા કંઈર સૌથી વધારે પ્રમ્યાત છે. ગુરુગ્રંથમાં તેમની ઘણી કૃતિઓ ભળે છે. તેમની ભાષા પર પંનાભીની જાગ્રત્તાસર અસર છે. કાશીની નાગરી પ્રચારિણી સલાયે રાય બણાદુર સ્થામસુંદરદાસે સંપાહિત કરેલી કંઈરની અંધાવલિ પ્રસિદ્ધ કરી છે. આ અંધાવલિ ધી. સ. ૧૫૦૪ ના એક દસ્તલિભિત પરથી તૈયાર કરવામાં આવી છે, એમ કહેવાય છે. પરંતુ આ સાલની પ્રામાણિકતાના સંબંધમાં પણ ગંભીર સંક્રાંતિ જીવનવામાં આવી છે. (બુઝો : ડૉ. પીતામ્બરદાસ બહુવાનકૃત ‘હિન્દી કાવ્યમે નિર્ણયવાદ’). ગમે તેમ હોય તોપણ આ સંસ્કરણની ભાષા પણ ગુરુગ્રંથમાંના પદોની ભાષાને ભળતી છે, અને તેમાં પંનાભીની ઘણી અસર છે. કંઈરે પોતે કહ્યું છે કે તેમણે પૂર્વી બોલીનો ઉપયોગ કર્યો છે. અને તેમની અનેક એવી કૃતિઓ છે, જેમની ભાષા પર રાજસ્થાનીનો બહુ પ્રભાવ દેખાય છે. આ સ્થિતિમાં કંઈરના અંધાની ભાષા વિષે નિશ્ચિતપણે કાઈ કહેવું મુશ્કેલ છે. પંડિત રામચંદ્ર શુક્લે આ પ્રશ્નો ઉકેલ કરવાનો પ્રયત્ન આમ કહીને કર્યો છે :

કુઝીરે પોતાની સાખીઓમાં સાખુકરીનો અને રમૈની તથા શખ્દોમાં કાબ્લાષા કે વજનો ઉપયોગ કર્યો છે.

પરંતુ તેમનો આ ઉકેલ લાગે જ સંતોષકારક કહેવાય, કારણ કે તેથી કુઝીરના પોતાના કથનનું ખંડન થાય છે. બીજું આધારભૂત દસ્તાવેજોના અલાવે એ સિદ્ધ કરવું પણ સંભવિત નથી.

૮. આમ, આ સાહિત્યિક કૃતિઓની જેટકી વધારે શાખ્યોળ કરવામાં આવે તેટલા ભારપૂર્વક એ નિર્ણય પર આવવું પડે કે, આ કૃતિઓની ભાષાઓ વિષે લોકોનો સામાન્ય રીતે જે અભિગ્રાય બંધાયો છે તેને માટે ખરું જોતાં ખૂલ્લું જોષો આધાર છે. ડેટલીક બીજું બાબતો પણ આ નિર્ણયને પુષ્ટિ આપે છે. એ તો એક જાણીતી વાત છે કે, ડાઈ પણ ખોલી કે ભાષાની પાછળ કોઈ મજબૂત સામાજિક બળ ન હોય લાં સુધી તે સાહિત્યિક પદ અને પ્રતિક્રિયામાં કરી શકતી નથી. આ બળ કાં તો ધાર્મિક હોય અથવા રાજકીય હોય. ખોલી અને અર્ધભાગધીની પ્રતિક્રિયા વધી, કારણ કે એ બંને ખૌદ અને જૈન સુધ્રારાની વાહન અની હતી. હિન્દુસ્તાનને મુસ્લિમ ઉપરોક્તિ અને બાહસાહેની મદ્દને પરિણામે સાહિત્યિક દરજનો ગ્રામ થયો. રાજસ્થાની જે ૧૪ મી, ૧૫ મી અને ૧૬ મી સર્તીમાં ઉત્તર હિન્દુસ્તાનના એક મોટા ભાગની સાહિત્યિક ભાષા હતી, તેનો વિકાસ અને તેની લોકપ્રિયતા મેવાડના મદદન સિસોટિયાના બળને આભારી હતાં. મેગલેઓ મેવાડના રાણ્યોળે હુરાબા ત્યાર પછી રાજસ્થાની પણ એક સ્થાનિક ભાષા અની ગઈ.

આમ, આપણે વજ ભાષાનો વિચાર કરીએ છીએ તારે ૧૬ મી સર્તી સુધી તેને ટેકા આપનાર કોઈ રાજકીય કે ધાર્મિક આંદોલન તેની પાછળ જાણું નથી. વજ કોઈ સત્તાનું રાજકીય કેન્દ્ર નહોંનું. શ્રી. વલ્લભભાઈની વજમાં આવીને વસ્ત્યા અને ત્યાં તેમણે પોતાના કૃષ્ણભક્તિના સંપ્રદાયનો પ્રચાર શરૂ કર્યો તે પહેલાં મજનું એક ધાર્મિક કેન્દ્ર તરીકે પણ કશું મહત્વ નહોંનું. વલ્લભના આંદોલને હોખીતી રીતે જ વજ ભાષાને જે વેગ આપ્યો તેથી કરીને તે એક સાહિત્યિક ભાષાનું ઇપ ધારણું કરી શકી. ઉત્તર હિન્દુસ્તાનમાં સુરદાસે તથા વલ્લભભાઈના બીજા શિષ્યો(અષ્ટ ઇપ)એ વજ ભાષાના પ્રશુલ્લને દ્વારા કર્યું; અને પરિણામે તેનું એક ઇપ હૂર હૂર બંગાળમાં કૃષ્ણભક્તિ વ્યક્તા કરવાના એક માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યું.

૬. કથીર અને ખીળ લક્ષોની કવિતાઓ — તેમની અસલ ભાષા લલે ગમે તે હશે — ખાસ કરીને મોઢે કરવામાં આવતી અને એ રીતે તેમનો મૌખિક પ્રચાર જ અધિક થતો. જ્યારે મજનું પૂર વહેવા માંડયું ત્યારે સહેલાઈથી તેમની કૃતિઓ પર પણ મજની અસર પડી અને તેમાં મજપણું આવી ગયું.

૭. જે કારણોને લઈને હું માનું છું કે મજલાખામાં, ૧૬ મી સદી પહેલાનું કહી શકાય એવું, કંઈ અસલ સાહિત્ય નથી, તે કારણો મેં ઉપર સંકેપમાં આપ્યા છે. પણ હું એકદે જ આવા વિચારનો છું એમ નથી. પ્રચાગ વિદ્યાપીઠના હિન્દી વિલાગના અધ્યક્ષ ડૉ. ધીરેન્દ્ર વર્મા — જેએ ખરેખર હિન્દુસ્તાનીના ખાસ પક્ષપાતી નથી — તેમણે પણ પોતાના હિન્દી સાહિત્યના ધર્તિહસમાં અને મજ ભાષાના વ્યાકરણમાં આ જ વિચારો વ્યકૃત કર્યો છે. તે વિચારો તેમના એ પુરતકામાં જોઈ શકાય છે.”

સેવાઆમ, ૬-૬-'૪૨

(‘હરિજન-સેવક’માંથી)

## ૪૦. રાષ્ટ્રભાષા વિષે દસ્ત પ્રક્રિયા

૧. પ્ર૦ — ફારસી લિપિનો જન્મ હિન્દુસ્તાનમાં નથી થયો. મોગલોના રાજ્યમાં એ હિન્દુસ્તાનમાં આવી, જેમ અંગેનેના રાજ્યમાં રોમન લિપિ આવી છે. પણ રાષ્ટ્રભાષા માટે આપણે રોમન લિપિનો પ્રચાર નથી કરતા. તો પછી ફારસી લિપિનો પ્રચાર શા માટે કરવો જોઈએ?

૨૦ — જે રોમન લિપિએ ફારસી લિપિ જોઈનું ધર કર્યું હોત તો તમે કહો છો એમ જ થાત. પણ રોમન લિપિ માત્ર મૂર્ખિયર અંગેણ અણેલાની રહી છે, જ્યારે ફારસી તો કરોડો હિન્દુ મુસલમાન લખે છે. એ લિપિ કખનારની અને રોમન લિપિ કખનારની સંખ્યા તમારે શોધી કાઢ્યો.

૩. પ્ર૦ — હિન્દુ મુસલમાનની એકતા માટે ઉર્દૂ શીખવાનું કહેતા હો તો હિન્દુસ્તાનમાં ઘણા મુસલમાનો ઉર્દૂ નથી જાણુતા. બંગાળના મુસલમાનો બંગાળી એલે છે. મહારાષ્ટ્રના મરાહી એલે છે. ગુજરાતમાં પણ તેઓ ગામડાંમાં ગુજરાતી એલે છે. દક્ષિણ હિન્દુસ્તાનમાં પણ તામિલ વગેરે જ એલના હશે. આ બધા મુસલમાનો પ્રાન્તીય ભાષાને મળતા હિન્દુસ્તાનીમાં

જે શખ્દો હેઠ તે વધારે સહેલાઈથી સમજ શકે છે. ઉત્તર લારતની તમામ ભાષાઓ સંસ્કૃતમાંથી જન્મેલી છે અને તેથી તે ભાષાઓમાં બહુ જ સમાનતા છે. દક્ષિણ લારતની ભાષાઓમાં પણ સંસ્કૃતના ધણી શખ્દો આવી ગયા છે. તો પણ આ બધી ભાષા મોલનારાઓને અપરિચિત એવી અરથી કારસીના શખ્દોવાળા ઉર્દૂનો પ્રચાર શા માટે કરવો જોઈ એ?

૭૦ — તમારા સવાલમાં વળૂહ છે ખરું, પણ તમારી પાસે જરા વધારે વિચાર કરાવું. મારે કખૂલ કરવું જોઈ એ કે, કારસી લિપિ શીખવાના ભારા આગ્રહમાં હિન્દુ મુસ્લિમ ઐક્યનો પ્રશ્ન છે જી. દેવનાગરી અને કારસી લિપિ તેમ જ હિંદી અને ઉર્ડૂ ભાષા વચ્ચે ઝડપો વર્ણાયથી ચાલ્યા કરે છે. તેણે તેરી ઇપ પકડવું છે. હિંદી સાહિત્ય સમેલને છેક ૧૮૨૫ માં કારસી લિપિને હિંદીની વ્યાખ્યામાં સ્થાન આપ્યું. મહાસલાઓ હિંદુસ્તાની નામ આપ્યું. બન્ને લિપિની દ્શિટ આપી. એટલે હિંદી અને ઉર્ડૂને રાષ્ટ્રભાષા ગણ્યી. આ બધામાં હિંદુ મુસ્લિમ ઐક્યનો સવાલ રહ્યો જ હતો. મેં તે આજે નવો નથી ઉઠાવ્યો. મેં તેને મૂર્ત્ત સ્વરંપ આપ્યું ને પ્રનાહપતિત પણ છે. એટલે જો આપણે રાષ્ટ્રભાષાને સંપૂર્ણતાએ ભીલવવા માગીએ, તો હિંદી ઉર્ડૂ અને દેવનાગરી કારસીને સરખાં સ્થાન આપવાં વટશે. છેવટે તો જેને લોડા વધારે પચાસશે તે જ વધારે ફેલાશે.

ધણીભરી પ્રાંતીય ભાષાઓનો સંસ્કૃત સાથે નિકટ સંબંધ છે અને તે તે પ્રાંતના મુસલભાનો પણ તે જ ભાષાઓ બોલે છે એ સાચું છે, અને એથી તેઓને દેવનાગરી લિપિ અને હિંદી સહેલાં પડે એ અરોભર છે, એ કુદરતી લાલ મારી ચોજનામાંથી જતો નથી. એની સાથે જ કારસી લિપિ શીખવાનો લાલ ઉમેરાય છે એમ હું કહું. તમે એને બોને માનો છો. એટલે તમને એ વસ્તુ લાગે છે. લાલ ગણ્યું કે બોને એ તો શીખનારની કૃતિ ઉપર અવલંબે છે. એનામાં દેશપ્રેમ ડાલ્ખરાતો હશે તો એ કારસી લિપિને કે ઉર્ડૂ ભાષાને બોને કદી નહિ ગણે. અને મારી ચોજનામાં તો અળાતકારને સ્થાન જ નથી. જે લાલ સમજશે તે જ બન્ને લિપિ ને બન્ને ભાષા શીખશે.

૩. ૫૦ — હિંદુસ્તાનનો ધણો મોટો ભાગ નાગરી લિપિ જાળે છે, કારણ કે ધણી પ્રાંતીય ભાષાઓની લિપિ નાગરી છે અથવા નાગરીને મળતી છે. પંચાય, સિંધ અને વાયવ્ય સરહદના પ્રાંતમાં નાગરીનો પ્રચાર એછો છે, પણ એ લોડા સહેલાઈથી નાગરી નહિ શીખી શકે?

૭૦ — આનો જવાબ ઉપર આવી જય છે. સરહદ આન્તરાળને અને ખીજામોને દેવનાગરી શીખવાપણું તો રહે જ છે.

૪. ૩૦ — ભાષા મુખ્યત્વે એલવા મારે છે. એલવા અને વાતચીત કરવા મારે લિપિની જરૂર નથી. લિપિ અહુ ગોણુ વસ્તુ છે. જે રાષ્ટ્રભાષા માતૃભાષાની લિપિ દ્વારા શીખવામાં આવે, તો તે વધારે સહેલાઈથી ન શીખી શકાય? અને જો એમ કરવામાં આવે તો રાષ્ટ્રીય દિશિયે શું નુકસાન છે?

૭૦ — તમારું કહેવું સાચું છે. પ્રાંતીય ભાષા મારાફતે જ જે હિન્દી ને ઉર્દુ શીખવાય તો સહેલાઈથી શિખાય એમ હું માનું છું. એવો પ્રયાસ દક્ષિણ ભારતમાં થાય છે એવું મારી જાણુમાં છે, પણ તે પદ્ધતિસર નથી થયો. તમારો વિરોધ બધો લિપિનું શિક્ષણ થોડાડિપ છે એવી માન્યતા ઉપર રવાયેલો જોડ છું. હું લિપિનું શિક્ષણ એટલું કદણું ગણુંતો નથી. પણ પ્રાંતીય લિપિ મારાફત રાષ્ટ્રભાષાપ્રચાર થાય એનો મને વિરોધ હોય જ નહિ. લોકોમાં જિસાહ હોય, ત્યાં ધર્થી રીતો એકસાથે ચાલશે.

૫. ૩૦ — માનીએ કે, જ્યાં સુધી પંજાબ, સિંધ અને વાખવ્ય સરહદના લોકો નાગરી નથી શીખી ગયા ત્યાં સુધી તે લોકોની સાથે ભળવા મારે ઉર્દુ જાણવાની આવસ્યકતા હોય. તો એટલા મારે થોડાકે ઉર્દુ શીખી દેવું. જેઓ પ્રચારક છે તે ઉર્દુ શીખી દે. પણ આખા હિંદુસ્તાને ઉર્દુ શીખવાની શા જરૂર છે?

૭૦ — આખા હિંદુસ્તાને શીખવાનો અહીં સવાલ જ નથી. હું માનતો જ નથી કે આપું હિંદુસ્તાન રાષ્ટ્રભાષા શીખશે. જેઓને રાષ્ટ્રમાં ભરમણ કરતું છે ને સેવા કરવી છે, તેઓને જ સારુ આ સવાલ છે. તેઓની સેવાશક્તિ એ ભાષા ને એ લિપિ શીખવાથી વધે છે એટલું તમે કણૂલ કરી દો, તો તમારો વિરોધ અથવા તમારી શાંક શાંત થાય.

૬. ૩૦ — રાષ્ટ્રભાષા નાગરી અને ઉર્દુ બન્ને લિપિમાં હાલ લખાય છે. જેને જે લિપિમાં શીખવી હોય તે લિપિમાં શાખે દરેક દ્રજિત્ત બન્ને લિપિ જાણવી જ નોર્ડ એ એવો આગહ શા મારે?

૭૦ — આનો પણ એક જ જવાબ. મારો આગહ છતાં તેમાં જેઓ લાલ જોશે તે જ તેનો સ્વીકાર કરશે. એક જ લિપિ ને એક જ ભાષાથી જેને સતોપ રહેશે તે મારી દિશિયે અરધી રાષ્ટ્રભાષા જાણુનાર કહેવારો. આપું પ્રમાણપત્ર જોઈએ તેઓ બન્ને લિપિ ને બન્ને ભાષા શીખશે. એવાની

પણ સારી સંખ્યા દેશમાં હોવી જોઈએ એની તમે ના નહિ પાડો. જે એવી સંખ્યા વધતી ન જાય તો હિંદી ઉર્દૂનું સમિલન નહિ થવા પામે, મહાસલાની વ્યાખ્યા પ્રમાણેની એક હિન્દુસ્તાની ભાષા કઢી તૈયાર નહિ થાય. હિન્દુ મુસ્લિમાન અને એકભીજને સહેલાઈથી સમજ શરૂ એવી ભાષા ઉત્પન્ન થાય, એ હમેશાં પૂર્ણવા જેવું છે. એવું સ્વભાવ આપણે ધણું સેવીએ છીએ. કાઈ દિવસ તે ખરું પણ પડ્યો.

૭. પ્ર૦ — જે લોકો રાષ્ટ્રભાષા નથી જાણુતા એવા અહિંદી પ્રાંતના લોકોએ એકસાથે અને લિપિમાં રાષ્ટ્રભાષા શીખી, એ વધુ પડતો એનો ન કહેવાય ? પહેલાં એક લિપિ દ્વારા સારી રીતે શીખી લેવામાં આવે તો પછી બીજી લિપિ શીખી લેવી એ તો રમતની વાત છે.

૮૦ — આની ખરુર તો અનુભવે પડી રહેશે. જેએ બેમાંથી એકેય લિપિ નથી જાણુતા તેએ બને લિપિ એકસાથે નહિ શાખે એમ હું માનું છું. તેઓ સ્વેચ્છાએ એક અથવા બીજી લિપિ પ્રથમ લેશે ને પછી બીજી પ્રથમનાં પાઠયપુસ્તકોમાં શાખ્યો લગભગ એક જ હશે. મારી દૃષ્ટિએ મારી યોજના એક મહાન અને આવશ્યક પ્રયોગ છે, રાષ્ટ્રને પુષ્ટિ આપનાર છે, અને મહાસલાના ફરાવનો અમલ કરવામાં બહુ મોટો દ્વારા ભરનાર છે. એથી મને આશા છે કે, લાખો સેવકો અને સેવિકા તેને વધાવી લેશે.

૮. પ્ર૦ — ભાષાના કલેજરમાં દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થયાં જ કરવાના. એને કાઈ રોકી ન શકે. તેથી રાષ્ટ્રભાષામાં વિદેશી ભાષાના જે ધણ્ય શાખ્યો આવી ગયા છે અને જી થઈ ગયા છે એને કાઢી ન શકાય. પણ રાષ્ટ્રભાષાની પરંપરાથી લિપિ તો નાગરી ચાલી આવી છે. વચ્ચે મોગલ રાજ્યના વખતમાં દ્વારસી લિપિ આવી ગઈ. હવે મોગલ રાજ્ય નથી. તેથી જેમ ગુજરાતી મરાડીમાં ધણ્ય દ્વારસી, અરણી અને અંગ્રેજ શાખ્યો છે છતાં પોતાની લિપિ એ ભાષાએએ છોડી નથી, તેવી જ રીતે રાષ્ટ્રભાષાએ પણ વિદેશી શાખ્યો રાખવા છતાં પોતાની પરંપરાગત નાગરી લિપિને શા માટે ન વળગી રહેતું ?

૯૦ — પરંપરાગત વસ્તુને છોડવાની અહીં વાત નથી; તેમાં ઉમેરો કરવાની છે. હું સંસ્કૃત જાણુતો હોઈ તેમાં અરથીનો વધારો કરું તો શું ચોંડું ? કદાચ સંસ્કૃતને પુષ્ટિ ન મળે ? ને અરથીને પણ ? મારો અરથીનો પરિચય તો વધે જ ને ? સુરાનવુદ્ધિનો કાઈ દ્વારા હોય ?

૬. પ્ર૦ — ભારતીય ભાષાઓનું ઉત્ત્યારણ વ્યક્ત કરવા સૌથી વધારે લાયક નાગરી લિપિ છે; અને હાલની ફારસી લિપિ એ માટે બહુ જ દોપુણું છે, એ સાચું નથી શું?

૭૦ — તમે ડીક કહો છો. પણ તમારા વિરોધમાં તમારા આ પ્રશ્નને સ્થાન નથી, કેમ કે અહીં છે એનો વિરોધ જ નથી, પરસ્પર વધારે કરવાની વાત છે.

૧૦. પ્ર૦ — રાષ્ટ્રભાષાની શી આવશ્યકતા છે? એક માતૃભાષા અને ભીજી વિશ્વભાષા એ એ ભાષા બસ નથી? આ બ'ને ભાષા માટે એક રોમન લિપિ હોય તો શું જોડું?

૭૦ — તમારો આ સવાલ આશ્વર્ય પમાડે છે. અંગ્રેજ વિશ્વભાષા તો છે જો, પણ તે કંઈ હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા થઈ શકે? રાષ્ટ્રભાષા ભાષા માણ્યસોએ તો જાણવી જ રહી. તેઓ અંગ્રેજ ભાષાનો મોણે કેમ ઉઠાવી શકે? હિંદુસ્તાની રાષ્ટ્રભાષા સ્વભાવે છે, કેમ કે તે લગભગ એકનીસ કરોડની માતૃભાષા છે. એકનીસ કરોડની ભાષા ભાકીનાનો મોટો ભાગ સહેલાઈથી સમજ શકે એ સંભવે છે. પણ અંગ્રેજ તો ભાગ્યે એક લાખની પણ માતૃભાષા ગણ્યાય. એ હિંદુસ્તાને એક રાષ્ટ્ર થવું હોય અથવા હિંદુસ્તાન એક રાષ્ટ્ર હોય તો હિંદુસ્તાનને એક રાષ્ટ્રભાષા તો જોઈએ જો. તેથી મારી દાખિએ તો અંગ્રેજ વિશ્વભાષા તરીકે જ રહે ને શોખે, અને રોમન લિપિ પણ વિશ્વલિપિ તરીકે રહે અને શોખે — રહેશે અને શોખશે, હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા કે લિપિ તરીકે કઢી નહિ.

૭૦ બ'નો, ૨૯-૪-૧૯૪૨

## ૪૧. એક યુક્તિભાજ

૫૦ — રાષ્ટ્રભાષા, જેને આપ હિંદુસ્તાની કહો છો, તેના એક ભાગ તરીકે ઉર્દૂ શીખવાની આપની સવાહ તો જાણે બહુ સારી છે. પણ નિઝામ રાજ્યમાં ઉર્દૂ માટે જે પ્રયાર ચાલી રહ્યો છે, તેને વિષે આપ શું કહો છો? તેલુગુ ભાષાની એક પરીક્ષાના પ્રશ્નપત્રમાં પહેલો સવાલ આ પ્રમાણે છે:

“સમૃદ્ધતાના ઉપયોગ માટે હિન્દને સારુ એક સર્વસામાન્ય ભાષા વિના ન ચાલે એમ હોય અને હિંદુસ્તાનનો પક્ષ જે સખળ હોય તો મને લાગે છે કે, આ યુનિવર્સિટીએ તો તરત જ ઉર્દૂને શિક્ષણનું વાહન બનાવવી લેઈ એ — આસ કરીને એથા માટે કે તે આ પ્રાંતની માતૃભાષા છે. એ ભાષા વધારે સમૃદ્ધ બને ત્યાં લગી

નેચો રાહ જેવા માગતા હોય તેઓ મોટી ભૂલ કરે છે ને તેમની હલીલ ચક્રવાચ જેવી છે. યુનિવર્સિટીએ જ્યાં લગી જ્ઞાનની સર્વ શાખાઓમાં એ ભાષાનો કશો ઉપયોગ ન કરે ત્યાં લગી તે ફરિદ જ રહેવાની.”

યાદ રાખવા જેવું એ છે કે આ પ્રદેશના મોટા ભાગના લોકાની માતૃભાષા ઉર્દૂ નથી પણ તેલુગુ છે. પરીક્ષામાં પ્રશ્નપત્રો દ્વારા ઉર્દૂની તરફેણુંનો પ્રચાર ચલાવવાની આ યુક્તિભાળું વિષે આપનું થું કહેવું છે?

ઉ૦ — આ રીતમાં યુક્તિ અને વિચિત્રતા બને છે એ હું કખૂલ કરું છું. જે પ્રશ્નની ભાવભાષા તીવ્ય ભલભેદ પ્રવર્તે છે તેને વિષે પ્રચાર કરવાને પરીક્ષાના પ્રશ્નપત્રનો ઉપયોગ કરવો ભાગ્યે જ ઉચિત ગણ્યા. નિઝામ રાજ્યની પ્રજાની માતૃભાષા ઉર્દૂ નથી એ પણ હું સ્વીકારું છું. વસ્તીના ડેટલા ટકા તેલુગુ જાણે છે એની મને અખર નથી. રાજ્યભાષાની મારી કલ્પનામાં મહાન પ્રાંતભાષાનું સ્થાન છીનવી લેવાની વાત નથી આવતી, પણ રાજ્યભાષાનું શાન પ્રાંતભાષાના શાન ઉપરાંત મેળવવાની વાત છે. વળી કરોડો માણ્સો અભિલાષાની રાજ્યભાષા કરી પણ શીખશે એવી અપેક્ષા હું નથી રાખતો. રાજ્યદારી માનસવાળાઓ અને જેમને આંતરપ્રાંતીય વહેવારો કરવાના હશે તેઓ તે શીખશે. એક પત્રલેખક તો કહે છે કે, મારે રાજ્યભાષાનાં અહલે પડોશના પ્રાતોની ભાષાઓ શીખવાની સલાહ લોડાને આપવી. એ કહે છે : “આસામવાસીને દિંદી અથવા ઉર્દૂ, અને હવે આપના કહેવા પ્રમાણે હિંદી અને ઉર્દૂ જાણવા કરતાં બંગાળી જાણવાથી વધારે લાભ છે.” અંગ્રેજ માત્ર થીજી ભાષા તરીકે જ નહીં પણ સર્વ ઉચ્ચ શિક્ષણના વાહન તરીકે શીખવાનો અસંખ્ય ઘોળે આપણે માથે ન હોત, તો આપણા પડોશીઓની ભાષા, તેમ જ અભિલાષાની સંપર્કને માટે રાજ્યભાષા પણ, શીખવી, એ આપણને ખાળકની રમત જેવું સહેલું લાગત. મારો એવો મત છે કે, જે કોઈ છોકરો કે છોકરી ભારતવર્ષની છ ભાષા ન જાણે તો તેના સંસ્કાર અને શિક્ષણમાં ઉછ્વાપ રહી ગણ્યા. અંગ્રેજ સિવાયની કોઈ ભાષા — પોતાની માતૃભાષા સુધ્યાં — શીખવાના વિચારમાત્રી અંગ્રેજ જાણુનારા હિંદીઓ થથરે ત્યારે એ તેમના મગજને થાક બખાની અચૂક નિશાની ગણ્યાની જોઈએ. કેમ કે વાંધો ઉદ્ઘાવનારાઓ મેટે ભાગે અંગ્રેજ જાણુનારા હિંદીઓ હોય છે. આશમવાસીઓને દિંદી ઉપરાંત ઉર્દૂ શીખતાં કરી મુસીબત આવતી મેં જોઈ નથી. અને હું જાણું છું કે, દક્ષિણ આર્કિકામાં તામિલ અને તેલુગુ મજૂરો એકુભીજની ભાષા ઘોલી શકતા, અને તેમને હિંદીનું પણ કામગ્યલાઓ શાન

હતું. તેમણે હિન્દી શીખવી જોઈએ એવું તેમને ડોઈએ કહ્યું ન હતું. ડોઈક રીતે તેમને સ્વયંસ્કૃતિથી ખખર પડેલી કે તેમણે હિન્દી જાણવું જોઈએ. બેશક તેઓ વિદ્યાન ન હતા, પણ પરસ્પરના વહેવાર માટે તેમણે જે આવસ્થાક હતું તે શીખી લીધેલું. તેમણે તેમના પડોશી ઝુલુઓની જાપા પણ જાણી લીધેલી. ન જાણે તો પોતાનો કામધંધી ચલાવી ન શકે. એટલે ધાર્થાખરા હિન્દીઓ પોતાની માતૃભાષા ઉપરાંત હિન્દની ઘીજ એ ભાષાઓ, ઝુલુ ભાષા, અને લાંગીતૂરી અંગેજ પણ જાણુતા હતા. એ કહેવાની જરૂર નથી કે, એમાંના ધણ્ણા એક પણ ભાષા લખી જાણુતા નહોતા, અને ધાર્થાખરા પોતાની માતૃભાષા વ્યાકરણુંછી વિના જ લખી શકતા હતા. આમાંથી નીકળતો બોધપાઠ દેખીતો છે.

તમે જો લિપિનો સવાલ કરે મૂડો તો તમારા પડોશીની ભાષા વિના ગ્રયતને ને વિના મુસીબતે શીખી શકો છો; અને જો તમે તાળ હો ને તમારું મગજ થાકી ન ગયું હોય તો તમે ચાહો તેટલી લિપિઓ કરી મુસીબત વિના શીખી શકો. એ અભ્યાસ હેમેશાં રસપ્રદ અને સ્કૂર્ટિફાયક હોય છે. ભાષાઓનો અભ્યાસ એ એક કળા, ને તે પણ કીમતી કળા છે.

૬૦ વાં, ૧૭-૫-'૪૨

## ૪૨. હિન્દુસ્તાની પ્રચાર સભાની સ્થાપના

૧

હિન્દુસ્તાની પ્રચાર સભા, જેનો ઉલ્લેખ મેં ‘હરિજનસેવક’માં કર્યો હતો, તે સ્થપાય છે. તેનું કાચું ખોખું તૈયાર થઈ ગયું છે. તેથોડા ભિત્રોને મોકલવામાં આવયું છે. થોડા જ વખતમાં સભાની ચોજના વગેરે જનતા સમક્ષ મૂક્ખવામાં આવશે. ડેટલાક લોકોનો ખ્યાલ બંધાઈ ગયો છે કે, આ સભા હિન્દી સાહિત્ય સંમેલનની વિરોધી હશે. જે સંમેલન સાથે ૧૯૧૮થી મારો સંખ્યાંધ બંધાયેલો છે, તેનો વિરોધ જાણી ખૂલ્યાને કેમ કરી શકું? વિરોધ કરવાનું સખળ કારણ પણ હોવું જોઈએ ને? પણ એવું કાંઈ છે નહિ. હા, એટલું છે કે, ઉર્દૂના સંખ્યાંમાં સંમેલનના ડેટલાક સભ્યો કરતાં હું આગળ જાઉં છું. તેઓ માને છે કે હું પાછળ જઈ રહ્યો છું. એનો નિર્ણય તો સમય જ કરશે. સંમેલન

પ્રત્યે મારા મનમાં કાંઈ વિરોધભાવ નથી, એ સ્પષ્ટ કરવાને માટે મેં શ્રી પુરુષોત્તમદાસ ટંડન સાથે પત્રવ્યવહાર કર્યો, અને તેને પરિણુભે સમેલનની સ્થાયી સમિતિએ નીચે પ્રમાણે હરાવ કર્યો છે :

“હિંદી સાહિત્ય સમેલન પોતાના આરંભકાળથી જ હિંદીને રાષ્ટ્રભાષા માનવું આંધું છે અને માને છે. ઉર્દૂ એ હિંદીમાંથી ઉત્પન્ન થયેલી અરધી-કારસી મિશ્રિત એક વિરોધ સાહિત્યિક શૈલી છે. સમેલન હિંદીને પ્રચાર કરે છે; તેને ઉર્દૂ રામે વિરોધ નથી.

“આ સમિતિનો અલિપ્રાય છે કે, મહાત્મા ગાંધીની પ્રસ્તુત હિન્દુસ્તાની પ્રચાર સભાના સભાસહો હિંદી સાહિત્ય સમેલન અને તેની ઉપસમિતિએમાં રામાસહો રહી શકે; પરંતુ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના પદાધિકારીએ પ્રસ્તુત હિન્દુસ્તાની પ્રચાર સભાના પદાધિકારી ન બને, એ વ્યાવહારિક દાખિયે ઉચિત છે.”

આથી વધારે ઉદ્ઘરતાની મેં આશા નહોતી રાખી. મારો એવો અલિપ્રાય હતો અને જુદુ પણ છે કે, પદાધિકારીએ એકના એક રહી શકત તો અથડામણુનો સવાલ જ ન જિદ્દત; આમાં કંઈક જીકી શકે છે. પરંતુ અને તરફથી સજ્જનતાનો વ્યવહાર થતાં અથડામણ થઈ જ ન શકે. હિન્દુસ્તાની પ્રચાર સભાની સર્જણતાથી રાષ્ટ્રભાષાનો સવાલ રાજકોરણના ક્ષેત્રમાંથી અદાર નીકળશે. તેનો સંબંધ રાજકોરણ સાથે કદી હોવો નહોતો જોઈતો.

૬૦ બં૦, ૩-૫-૧૯૪૨

## ૨

[ ગાંધીજી, રાનેન્દ્રભાષુ, વગેરેની સહીથી, તા. ૨-૫-૧૯૪૨ ને રોજ, નીચેનું જહેરનામું બદાર પડયું હતું : ]

લોગેંબેં રાષ્ટ્રભાષાકો ફૈલાનેકા કામ કરનેસે યહ પતા ચલા દે કે જિસ ભાષાકો કાંચેસને “હિન્દુસ્તાની” કા નામ હિયા હૈ વહ મિલીજુલી ઉર્દૂ-હિન્દીકા આસાન રૂપ હૈ. યહી જ્યાન હૈ જે ઉત્તર હિન્દુસ્તાનમેં એલી ઓર સમજી જતી હૈ ઓર છસીકા હિન્દુસ્તાનક દૂસરે હિસ્સેમાં બી લોગ અહૃત કુછ સમજતે ઓર બરતતે હૈ. છસીકા સાહિત્યિક ( અધ્યાતી ) રૂપ હિન્દી ઓર ઉર્દૂ એક દૂસરેસે દૂર હોતે ચલે જ રહે હૈન્. જરૂરત છસ બાતકી દે કે ધન હોનોં હોણોકા બી એક દૂસરેકે નજીદીક લાયા જાય ઓર દેશકે ઉન હિસ્સેમાં જણા દૂસરી જ્યાનેં એલી જતી હોય, હિન્દુસ્તાનીકા રાષ્ટ્રભાષાકે તૌર પર ફૈલાયા જાય. છસ લિયે હમ એક એસી સભા અનાના ચાહુતે હોઈ જે આસાન હિન્દી ઓર આસાન ઉર્દૂ હોનોંકા સાથ સાથ પ્રચાર કરે ઓર જિસકા હર મેમ્બર

હિંદુસ્તાનીકી ઘન હોનોં શક્યોંકા ઔર લિપિયોંકા જને ઔર જરૂરતકે વડૃત બરત સકે. છસસે એક તો યદુ હોગા કિ સારે દેશમેં એક આસાન ઔર સાથે જાયાન ચલ જાયગી ઔર દૂસરે, હોતે હોતે છસી આસાન જાયાનમેં એસા અદ્ય યા સાહિય પૈદા હોને લગેગા જિસમેં જાચે ખ્યાલો ઔર ભાવોંકા બી નાહિર કિયા જ સકેગા. છસ કામોકા પૂરા કરનેકે લિયે હમ લોગ “હિંદુસ્તાની પ્રચાર સભા” કે નામસે આજ તા. ૨-૫-૧૯૪૨ કે એક સભા બનાતે હોય.

૩

[ તે સભાનાં હેતુ અને કામ અગે તેના બાધારણુમાં નીચેના કલમો છે : - ]

“૩. હેતુ (મફક્ષણ) — રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીકા પ્રચાર કરના, જે સારે હિંદુસ્તાનકા સામાજિક (સમાજ), રાજનૈતિક (સયારી), કારવારી ઔર ઐસી દૂસરી જરૂરતોંકે લિયે દેશભરમેં કામ આ સકે, ઔર અલગ અલગ ભાષાઓં (જાયાનોં) બોલનેવાલે સ્થૂલોમેં મેલજોલ ઔર ભાતચીતકી ભાષા બન સકે.

નોટ — હિંદુસ્તાની વધુ ભાષા હૈ જો ઉત્તર હિંદુસ્તાનની શહરોં ઔર ગાંધોંક દિંદુ, મુસલમાન આદિ સખ લોગ બોલતે હોય, સમજતે હોય ઔર આપસુકે કારણારમેં બનતે હોય ઔર જિસે નાગરી ઔર ક્ષારસી હોનોં લિખાવટોમેં લિખાપદ્ધ જાતા હૈ ઔર જિસકે સાહિત્યિક (અદ્યી) રૂપ આજ હિંદી ઔર ઉર્દૂકે નામસે પહુંચાને જતે હોય.

૪. સભાંક કામ — હેતુ સફળ કરનેકે લિયે સભાંક કામ છસ તરફ કિયે જાયેં ગે —

(૧) હિંદુસ્તાનીકા એક ડોશ (લુગત) તૈયાર કરના જિસ પર સખ ભરોસા કર સકેં. હિંદુસ્તાનીકા વ્યાકરણ (ક્રવાયણ) તૈયાર કરના ઔર અલગ અલગ સ્થૂલોક લિયે ઐસે હી દૂસરે સંદર્ભઅંથ (હવાદેકી કિતાબોં) બનાના.

(૨) સ્થૂલોમેં પદ્ધનેક લિયે હિંદુસ્તાનીકી કિતાબોં તૈયાર કરના.

(૩) હિંદુસ્તાનીમેં આસાન કિતાબોં છાપના.

(૪) હિંદુસ્તાનીકા પ્રચાર કરનેકે લિયે જગહ જગહપર પરીક્ષાઓં (ધન્તિલાન) લેના, ઔર ઐસી હી પરીક્ષાઓં લેનેવાલી સભાઓંકા મંજૂર કરના ઔર મદદ હેના.

(૫) હિંદુસ્તાનીમેં પારિભાષિક શખદોંકા (છસ્તવાહી લક્ઝનોંકા) ડોશ તૈયાર કરના.

૬. સૂખેકી સરકારોં, શહેરોં ઔર જિલોડે એડોં ઔર રાષ્ટ્રભાષા (કોન્ફીન્સિયન્સ) કી સંસ્થાઓંસે હિન્દુસ્તાનીકા લાગ્ભી વિષય મનવાનેકી કોણિશ કરના.

૭. ઉપર લિખે હુએ ઔર એસે હી ઔર કામોડે લિયે સલાકી શાખાઓં ખોલના, સમિતિયાં યાની કમિટીયાં બનાના, ચંદ્ર અંકડ્ટ કરના, હિન્દુસ્તાની મેં ડિનાયેં નિકાલનેવાલોડો મદ્દ હેઠા, મદરસે, પુસ્તકાલય (કિતાબઘર), વાચનાલય (પદ્ધાધિર), ઉસ્તાદોડે સ્કૂલ, રાન્નિશાળાયેં ઔર છસી તરફથી ઔર ભી સંસ્થાઓં ચલાના.

૮. જો સંસ્થાઓં ધન કામોભે હાથ બંટા સકે ઉન્હેં અપને સાથ લેના યા અપની સલાસે જોડું લેના.

૯. એસે ઔર સથ જતન કરના જિનસે સલાકે કામ પૂરે હો સકેં.

નોટ — ધસ સલાકી માલમિલકિયતસે સલાકા કોઈ સલાસદ સલાસદી હૈસિયતસે નિષ્ઠ ફાયદા ન ઉઠા સકેગા.”

## ૪

હિન્દુસ્તાની પ્રચાર સભાએ પોતાનું કામ બરાબર શરૂ કરી દીધું છે. એ મંડળ સભાના સંદેશ અને મિશન વિષે આજ્ઞાવાળા કાર્ય કર્તાઓનું અનેલું છે. સલાનો સંદેશ એ છે કે, હિન્દી રાષ્ટ્રભાષા અંગ્રેજ નથી પણ હિન્દુસ્તાની એરલે કે હિંદી વત્તા ઉર્દૂ છે. મહાસભાના હિન્દુસ્તાની વિષેના ફરાવના ગ્રણેતા હિંદી સાહિત્ય સમેવનના આત્મા સમા, શ્રી. પુરુષોત્તમદાસ ટંડન હના. તેમણે જ મને સમજ પાડી કે, આજની ધરીએ હિન્દુસ્તાનીનો અર્થ હિંદી વત્તા ઉર્દૂ થયેં જોઈએ. મહાસભાની ઐટુકામાં જે લોકો હાજર રહે છે તે બધાને આ વાતની સર્વ્યાધની પ્રતીતિ થશે, કેમ કે કોઈ મહાસભાવાદી જ્યારે હિંદી બોલે છે ત્યારે ઉર્દૂ જાણુનારા માણુસો તેની વાત પૂરેપૂરી સમજ શકતા નથી, અલિકુલ ન સમજતા હોય એમ પણ બને. એ જ વાત ઉર્દૂ બોલનારાઓને પણ લાગુ પડે છે. તો આપણી વાત બધા બરાબર સમજે એમ આપણે ધ્રચ્કીએ તો, માલીય અને બાધુ લગવાનદાસને મેં બોલતા સાંભળ્યા છે તેવી, બન્નેના મિશનાંના એલી આપણે વાપરવી જોઈએ. તેથી હિન્દુસ્તાની એલીના બન્ને પ્રકારો બોલવાનો મહાવરો હિન્દી રાષ્ટ્રવાદીઓએ રાખવાની જરૂર છે. એ બન્ને પ્રકારો એક સરખી સરળતાથી જે ન એલી શકે તેને હિન્દુસ્તાની બોલતાં નથી આવડતું

એમ કહેવાયાં એટલે જ હિન્દુસ્તાની બરાબર જાળવાનો દાવો કરનારને અને — ઉર્દૂ અને નાગરી—લિપિઓનો પણ બરાબર પરિચય હોવો જોઈએ. ધારણા સમયથી હેખાતી આ ખામી દૂર કરવાનો આશય એ હિન્દુસ્તાની પ્રચાર સભાની સ્થાપનાનાં મુખ્ય કારણો પેકીનું એક છે. તેના સંસ્થાપકો હિન્દી સાહિત્ય સમેલનના સભ્યો હતા અને છે. પરંતુ માત્ર હિન્દીના પ્રચારથી તેમને સતોપન થયો. તેથી સમેલનની સંમતિથી તેમણે હિન્દુસ્તાની પ્રચાર સભા સ્થાપી છે. સ્વાભાવિક રીતે જ સભાનું પ્રથમ કાર્ય અધિક હિન્દી જાળુનાર લોડેને ઉર્દૂ શાખા લેવાને સમજાવવાનું અને તેમને તે માટે સગવડ કરી આપવાનું હોવું જોઈએ. એ હેતુથી હું લાલમાં અંજુમાન—તરફી—એ—ઉર્દૂના વિદ્ધાન મંત્રી, મૌલાના અભદ્રલ હક સાહેબ સાથે સહાય અને દોરવણીને માટે પત્રવ્યવહાર કરું છું. સભાની કાઉન્સિલે ઉર્દૂની પહેલી પરીક્ષા ૨૨ મી નવેમ્બરે રાખવાનું હશવ્યું છે. એને અંગેની અભ્યાસક્રમ સાથેની બીજી વિગતો જેમ અને તેમ જલદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પરીક્ષામાં જેમને ઐસવાની ઘણ્ણા હોય તેમને, પોતાનાં નામો આચાર્ય શ્રીમત્યારાયણ અગ્રવાલને, હિન્દુસ્તાની પ્રચાર કર્યેરી. વર્ધા, ને સરનામે મોકલી આપવા વિનાંતિ છે. મને આશા છે કે, જે લોડેનો હિન્દી સાહિત્ય સમેલનાં પરીક્ષાયો પાસ કરી છે તે અધિક આ આવતી ઉર્દૂ પરીક્ષા પાસ કરવાની હોંશ રાખશે. અલખત જેએ હિન્દી નથી જાળુતી તેમને પણ એ પરીક્ષામાં ઐસવાનું આમંત્રણ તો છે જ. કોઈ પણ સમયે કાઈ પણ ભાવાના જાનથી આપણું માનસ ઉત્ત્રત થાય છે અને તે ભાષા ઐલાનારા લોડા સાથે આપણે વધારે ધાડા સંપર્ક કેળવી શક્યાએ છીએ. તો પછી જે લોડા માત્ર હિન્દી જાળે છે તેમને ઉર્દૂના જાનથી અને માત્ર ઉર્દૂ જાણે છે તેમને હિન્દીના જાનથી કેટલો કીમતી લાલ થાય ? જે જીવંત હિન્દુસ્તાનીનો અવતાર થવાનો હશે તો તે હિન્દી અને ઉર્દૂ સ્વાભાવિક રીતે અને પ્રસન્નતાથી એકરૂપ થાય તો જ થશે. એવી એકરૂપતા આ અને ઐલીએ પર એકસરખો કાખું ધરાવનાર ધારણા લોડા નહિ નાપણે તો અશક્ય છે.

## ૪૩. ગુજરાતમાં હિન્દુસ્તાની પ્રચાર

ગુજરાતમાં અત્યારે હિન્દુસ્તાની પ્રચારનું કામ, કાકાસાહેબે મારી સાથે મસ્લન કરી ધરેલી ચોજના પ્રમાણે, લાઈ અમૃતલાલ નાણુવરી ચલાવી રહ્યા છે. અને થીજી પ્રવૃત્તિ હિંદીપ્રચારની, હિંદી સાહિત્ય સમેલન તરફથી નિર્મિત રા. લા. પ્ર. સમિતિ, વર્ધા, તરફથી ચાલે છે. બને પ્રવૃત્તિ રાષ્ટ્રભાષાના પ્રચાર અથે ગણ્ય છે. હિન્દુસ્તાની પ્રચાર સભાનો તો હું પ્રણેતા પણ ગણ્યાં. કોંગ્રેસની સને ૧૯૨૫ની કાનપુરની એટાંમાં હિન્દુસ્તાની નિષે દૂરવ થયો, પણ એને અમલ કરવાને સારુ જોઈતા ઉપાયો ન લેવાયા; તેથી એના પ્રચાર અથે સને ૧૯૪૨ની ૨૭ મેએ હિન્દુસ્તાની પ્રચાર સભા વર્ધમાં સ્થપાઈ. સભાએ હિન્દુસ્તાની વાખ્યા આ પ્રમાણે કરી છે :—

“હિન્દુસ્તાની વહ ભાવા હું જે ઉત્તર હિન્દુસ્તાનક શાદરોં ઔર જાંબોક હિન્દુ, મુસલમાન આદિ સાથ લોગ એલાતે હૈન, સમજતો હૈ ઔર આપસકે કારબારમેં બરતતો હૈન, ઔર જિસે નાગરી ઔર ઝારસરી હોનોં લિખાવટોમેં લિખા પડ્યા જાતા હૈ ઔર જિસકે સાહિત્યિક (અધ્યાતી) ઇપ આજ હિંદી ઔર ઉર્દૂ કે નામસે પહુંચાને જાતો હૈન.”

પણ સભાનું કામ થાળે પાડી શકાય તેના પહેલાં તો ઓગરટના કોંગ્રેસના દૂરવને અંગે સરકારે ધણ્યાને જેલમાં પૂર્યા. તેમાં મુખ્ય સ્થાપકનો સમાવેશ થયો. શ્રી. નાણુવરી અલાર હતા. તેમને લાગ્યું કે, હિન્દુસ્તાની પ્રચારનું કામ તેમણે શરી હેતુ જોઈએ. તેમણે એ કામ ઉપાડીને દેશની સેવા કરી છે એમ હું માનું છું.

હિંદી અને ઉર્ડૂ એક જ રાષ્ટ્રભાષાની એ સાહિત્યિક શૈલી છે. આ બંને શૈલીઓ આજે તો એકખીજથી દૂર થતી જાય છે. રાષ્ટ્રભાષા હિન્દુસ્તાની દૃષ્ટિઓ આ બંને શૈલીઓને એકખીજની નજીક લાવવાની જરૂર છે. બને લિપિના અને શૈલીના શાન વિના એમ કરવું અશક્ય છે.

હિન્દુમુસ્લિમ વિભવાદ ભાવામાં પણ ધૂસી ગયો છે. અચ્યપણુથી જ હિંદુ-મુસ્લિમ એકુંની મને ધૂન રહી છે. ભાવામાં ધૂસેલો વિભવાદ મટાડવા ખાતર પણ અને લિપિના અને શૈલીના શાનની જરૂર છે.

કોંગ્રેસનું કામ જે ઈંગ્રેજ વિના ચલાવવાનું હોય, અને હોબું જ જોઈએ, તોય બંને શૈલી અને લિપિનું શાન મેળવા લેવાનો દરેક કોંગ્રેસીનો ધર્મ છે.

આમ થતાં હિંદી ઉર્દૂ એકથિનમાં ભળી જરો અને આમ પ્રસરેલી લાખા સ્વાલાવિક હિંદુસ્તાની હરો.

એવો અશ કરવામાં આવ્યો છે કે, બંને શૈલીને બંને લિપિ શીખવાના ધગશ હિંદુમુસલમાન બેઠને હોણી જોઈએ કે એક જ ને? આ સવાલની પાછળ હું ગેરસમજ જોઉં છું. લાખાના જાનમાં જે લાઈ બહેન વધારો કરશે તે મેળવશે, જે નહિ કરે તે ગુમાવશે. વળી જેને એકચ વહાલું છે તે તો વિશેષ મહેનત કરનેથી બંને શીખશે.

એટલું પણ યાદ રાખવાનું છે કે, પંજાબ વગેરે પ્રાન્તોમાં કે પ્રદેશોમાં હિંદુ મુસલમાન વગેરે બધા ઉર્દૂજ જાણનારા છે. એ બધાને પહોંચી વળવું પ્રત્યેક દેશપ્રેમીને ધર્મ છે.

હિંદુસ્તાન નેવા વિશાળ દેશમાં તો જેટલી લાખા આપણે શીખીએ તેટલા આપણે દેશસેવાને સારુ વધારે લાયક જનીએ છીએ.

અંને લિપિ ને બંને શૈલી માત્ર સેવકો જ કેંગ્રેસી જ શાખે કે બધા? મારો જવાબ એ છે કે, બધા હિંદી કેંગ્રેસી હોવા જોઈએ; એટલે બધાએ બંને લિપિ ને શૈલી શીખવાની જોઈએ. ખરું જોતાં આ સવાલ જ અપ્રસ્તુત છે. ડેમ કે રાષ્ટ્રભાષા શીખવાનો શોખ બહુ થોડાં જ ભાઈબહેનોને થયો છે. હનર એ હનર કે લાખ એ લાખ પરીક્ષામાં બેસે તેથી આપણે મલકાઈ જવાનું કર્દ્યા જારી નથી. એકલી હિંદી કે એકલી ઉર્દૂ શીખનાર પણ, આપણે ધર્યાએ એટલા, અહિંદી કે અઉર્દૂ પ્રદેશોમાં નથી મળતા.

નેને ઉર્દૂ શીખવું હોય તે અંબુમાનો પાસેથી શાખે ને હિંદી શીખવું હોય તે હિંદી સાહિત્ય સંમેલન પાસેથી શાખે તે બસ નથી? નથી જ. તારે તો કેંગ્રેસનો પ્રસ્તાવ થયો અને હિંદુસ્તાની પ્રચાર સલાની આવશ્યકતા જેલી થર્મ. બંનેનાં ક્ષેત્રો અંક્યેલા છે ને મારી દાણીએ સંકુચિત છે. હું ધર્યાં ખરો કે, અંને બહેનો એકથિનને અપનાવી લે. એવો શુલ્ક દિવસ આવે ત્યારે હિંદુસ્તાની પ્રચાર સલાનું કામ પૂરું થયું સમજાશે. એવો સંઝેગ ન આવે ત્યાં લગી હિંદુસ્તાની પ્રચાર સલાએ પોતાનો ધર્મ પણવો રહ્યો. હું એવી આશા રાખું ખરો કે, બંને બહેનો આ મેળ સાધનારી બહેનને સાંઘે એટલું જ નહિ પણ વધાવી લે.

ગુજરાતમાં હિંદી પ્રચાર ને હિંદુસ્તાની પ્રચારમાં કાર્ય કરતારામાંના ધર્યા તો મારા સાર્થી છે. તેમાંના ડેટલાકે મારી પાસે માર્ગસ્રૂયન માર્ગું છે.

આ નિવેદન એ માર્ગ સૂચને છે. જેઓ હિંદી સાહિત્ય સમેલન નિર્મિત વર્ધા સમિતિનું કામ કરે છે, તેઓને જો હિંદુસ્તાની પ્રચાર વિષેના મારા વિચારો રૂપે, તો તેઓ એ કામ પણ જાંચકી લે. અને જે વિધાર્થીઓને હિંદી શૈલી અને દેવનાગરી લિપિ જ શીખવી હોય, તેઓને સુખેથી એ શીખવે ને સમેલનની જ પરીક્ષા સારુ તૈયાર કરે. પણ તેઓ પોતે પ્રચાર બંને શૈલી અને બંને લિપિનો કરે ને જેટલાને તેમ કરવા તૈયાર કરી શકે તેને તૈયાર કરે. જ્યાં લગી ભાષાનો દેશકલ્યાળુની સાથે સંબંધ છે ત્યાં લગી હિંદુસ્તાની પ્રચાર અત્યાવશ્યક માતું છું. બંને પ્રવૃત્તિ વચ્ચે દેખાવ કરી ન હજો.

હવે સવાલ એ જાહેર કે, આજ સુધી જેઓ માત્ર ઉર્દૂ શીખ્યા હોય અથવા હવે પક્ષી શીખીને આવે તો તેઓએ શું કરવું? આવા લોકોએ બાકીની ઉર્દૂ કે નાગરી લિપિ અને શૈલી શીખી લઈ બંને લિપિમાં લેવાતી હિંદુસ્તાની પરીક્ષામાં બેસવું. જેમને બેમાંથી એક લિપિ અને શૈલી આવડે છે, તેમને તો પ્રશ્નપત્ર છોડવાનું બહુ સહેલું થઈ ગાડે.

સેવાયામ, ૨૭-૧૨-'૪૪

#### ૪૪. એક પ્રક્રિતરી

[ વર્ધા સમિતિના મંત્રી શ્રી. વાહંત આનંદ કોસલયાયન તા. ૮-૧૨-'૪૪ ના રેઝલાફીને પૂછેલા પ્રશ્નો અને ગાંધીજીએ લખીને આપેલા તેના ડિસ્ટર.]

ગ્રૂપ ૧ સન ૧૯૪૨ મેં જિસ સમય હિંદુસ્તાની પ્રચાર સલાકી સ્થાપના કુર્ચથી, ચૈસા લગતા હું કિ ઉસ સમય આપડી ઘણા ઔર પ્રયત્ન થા કિ જે લોગ હિંદુસ્તાની સલાક મેળ્યર હો વે રાષ્ટ્રભાષાકી હોનોં શૈલિયાં તથા હોનોં લિપિયાં અનિવાર્ય તૌર પર સીખેં. કચા આજ ભી આપ કેવલ મેળ્યરોંસે હી ઉકા જાનકી અપેક્ષા રહ્યે હું અથવા ચાહતે હું કિ દેશકે સભી આભાદ્રાદૃષ્ટ હોનોં શૈલિયાં તથા હોનોં લિપિયાં અનિવાર્ય તૌર પર સીખેં?

ગ્રૂપ ૧ જાહેર હું કિ સલાકે સભ્યકે લિયે કમસે કમ વહી કૈદ હો. જે આપને બતાયી હૈ. સલાકા ઉહેશ તો વિધાનસે સ્પષ્ટ હૈ. મેરી ચાહ અવશ્ય હું કિ સભ હિંદ્વાસી હોનોં લિપિ સીખેં, ઔર હોનોં હિંદુ મુस્લિમ સમજ સંકે ઐસી ભાષા બોલે.

૩૦ ૨ હિં. પ્ર. સલાકે કાર્યક્રમકે બારેમેં કુછ લોગ સમજતે હોય કી ખસકા ઉદ્દેશ્ય હોનોં શૈલિયાંકા પ્રચાર કરના માત્ર હૈ. કિંતુ કોઈકોઈ કહતે હોય, નહીં, હોનોં શૈલિયાંકે પ્રચારકે અતિરિક્ત એક તીસરી શૈલી — જે ન ઉર્દુ કષ્ટલાયેગી, ન હિંદી, બલિક હિંદુસ્તાની — કા પ્રચાર કરના ભી હૈ. સન '૪૨ મેં આપકા કહના થા કી હિંદુસ્તાનીએપી સરસ્વતી તો પ્રગટ હી નહીં હુંઈ. કથા આજ ઉસ સમયસે કુછ લિન રિથ્યાતી હૈ? યદિ આજ ની અપ્રગટ હૈ તો હિં. પ્ર. સલા પ્રચાર કિસ ચીજકા કરેગી?

૩૦ ૨ હિંદી ઔર ઉર્દુ શૈલી ગંગા યમુના હે. હિંદુસ્તાની સરસ્વતી હૈ. વધુ અપ્રકટ હૈ ઔર પ્રકટ ભી. સલાકા પ્રયત્ન ઉસે પૂર્ણ પ્રગટ કરનેકા રહના ચાહિયે.

૩૦ ૩ હિંદી સાહિત્ય સંભેદનક અંતર્ગત અનેક સંસ્થાઓં દેવનાગરી લિપિ ઔર હિંદીકા પ્રચાર કર રહી હોય. અંગુમન તરફીએ-ઉર્દુ ઝારસી લિપિ નથી ઉર્દુકા. કથા હિંદુસ્તાની સલા ધન હોનોં સંસ્થાઓંક કાર્યક્રમ એક્સાથ મિલાકર કરનેવાલી તીસરી સંસ્થા માત્ર હોણી? અથવા ઉન્કે કાર્યક્રમ અતિરિક્ત કોઈ તીસરા કાર્ય કરનેવાલી હોનોં સંસ્થાઓંક કાર્યક્રમ પુરક સંસ્થા હોણી? અથવા હોનોંક કાર્યક્રમ વ્યર્થ કર અપના હી તીસરા કાર્ય ચલાનેવાલી સંસ્થા અનેગી?

૩૦ ૩ હિં. પ્ર. સલા હોનોંકી પુરક હોણી, હોનોસે મહદ માંગેગી. લેકિન મસ સલાકા કાર્ય હોનોસે લિન હોણા ઔર સમજે તો અલિન ભી. હોનોંક કાર્યક્રમ વર્થ કરે તો ખુદ વર્થ હો જાયેગી. સંગમકે સિવાય સરસ્વતી કેસી?

૩૦ ૪ કથા દૃષ્ટિથું ભારત તથા અન્ય અ-હિંદી પ્રાતોડે લિયે હિંદુસ્તાની પ્રચાર સલાકા નીતિ તથા કાર્યક્રમ વહી રહેણા, જે અન્ય પ્રાતોડે લિયે? અર્થાત હોનોં લિપિયોં તથા શૈલિયાંકા અનિવાર્ય પ્રચાર?

૩૦ ૪ ખસ સલાકા કાર્ય તો સારે દેશકે લિયે હોણા — હોના ચાહિયે. પ્રાંત ૨ કી લિનતાકે લિયે પ્રણાલીમેં લિનતા આ સકતી હૈ.

૩૦ ૪ કથા દૃષ્ટિથું ભારત તથા અન્ય અ-હિંદી પ્રાતોડેં પિછલે અનેક વર્ષોસે રાષ્ટ્રલાપા પ્રચારકા જે કાર્ય ચાલુ હૈ, હિં. પ્ર. સલાકા મસ નથી પ્રઘટિસે ઉસ કાર્યક્રમ વૈસે હી ચાલુ રખનેમેં કોઈ બાધા તો ઉપરિથિત ન હોણી?

૩૦ ૪ બાધા હોણી નહીં ચાહિયે, અગર હોનોં મિલકર કામ કરે.

## ૪૫. અભિલ ભારતીય હિંદુસ્તાની પ્રચાર સમેલન

[ અભિલ ભારતીય હિંદુસ્તાની પ્રચાર સમેલન-વર્ષો ( તા. ૨૬/૨૭-૨-૪૫ ) ના પ્રમુખપદ્ધતિ ગાંધીજીએ આપેલાં ત્રણું વ્યાખ્યાનો ]

૧

સોમવાર તા. ૨૬-૨-૪૫ મૌનવાર હોવાથી ગાંધીજીએ સમેલનને લખાને કરેલા પ્રાસ્તાવિક નિવેહનમાંથી :—

મુખ્ય અધ્યાપક શ્રીમન્નારાયણના આમંત્રણુથી આપ સૌ અહીં એકઢા થયા છો, તેથી મને ખુશી થાય છે. ડૉ. અધ્યકુલ હક સાહેંગ આજ જ આવવાના હતા; ઉમેદ છે કે કલે જરૂર આવી પહોંચશે. તેમની મહદ્દ આ હિંદુસ્તાની પ્રચાર સભા તરફ હું લેવા ચાહું છું. એમ જ શ્રી. ટંડનજી આવવાના હતા, અને તે આવશે તેથી હું રાજ થયો હતો. લાઈ શ્રીમન્નારાયણુએ એમને તાર પણ કર્યો હતો. પણ તે ખીમાર પડી ગયા અને તે કારણુથી નથી આવી શકતા, એથી દુઃખ થાય છે. આપણે આશા રાખીએ કે તેઓ જલદી સાજ થઈ જય.

આપની સામે જે કામ છે તે એક રીતે જોતાં નાનું છે અને ખીજ રીતે જોતાં તેવું જ મોદું છે. આપણે જે કરવાનું છે તે નાનું છે, પરંતુ તેના પરિણામને હિસાયે તે બહુ જ મોદું છે. ડૉ. તારાચંદ આપણને કહે છે કે, આજ જે ભાષાને આપણે અનેક નામોથી કહીએ છીએ તે મૂળમાં એક જ ભાષા હતી, કે જે ઉત્તરમાં હિંદુ મુસલમાન બોલતા હતા. દુઃખ છે કે, જે એક હતા તે એ થઈ ગયા, અને તેમની ભાષા પણ એ નેવી થઈ ગઈ છે કે થતી જય છે—હિંદી અને ઉર્દૂ. ટંડનજીની મહેનતથી, કાનપુરમાં કોંગ્રેસે બેઝ ઓલી શરૂ એવી ભાષાને ‘હિંદુસ્તાની’ નામ આપ્યું અને લિપિએ એ રાખી — નાગરી અને ઉર્દૂ. પરંતુ તે હરાલ પ્રમાણે કોંગ્રેસ કામ કરી શકી નહિ. એ કામને, સ્વ૦ જમનાલાલજીના પ્રયાસથી, આ સભાએ ઈ. સ. ૧૯૪૨માં ઉપાડી તો લીધું. પણ એ તો ચાલ્યા ગયા. ૧૯૪૨માં કોંગ્રેસના નેતાએ અને ભીજા ગિરફ્તાર થઈ ગયા. તેઓમાં હું પણ હતો. માંદગીને કારણે હું દૂટયો. ભીમારીમાં પણ મેં લાઈ નાણુંટીનું હિંદુસ્તાની બાધતનું કામ જોયું. તેથી મને ખુશી થઈ, અને મને લાગ્યું કે એ કામમાં સફળતા મળી શકે છે. જે એક ભાષા

પહેલાં બને ઓલતા હતા તે આજ કેમ એક બની નથી શકતી, એ હું નથી જાણુતો. ઉત્તરના એ જ હિંદુ મુસલમાનોના વંશજ આપણે છીએ કે જેઓ એક ઓલી ઓલતા હતા અને લખતા હતા. હિંદી ઉર્દૂને અલગ બનાવવામાં ને મહેનત પડે છે તેનાથી અધી પણ મહેનત, જૂની ઓલીને જીવતી કરવામાં પડવી ન જોઈએ. ઉત્તરના ગામડાંમાં રહેનારા હિંદુ મુસલમાનો એક જ ઓલી ઓલેં છે, અને કોઈ લખે પણ છે. આપણી આ મહેનત કેવી રીતે સફળ કરી શકીશું તેનો વિચાર કરવાનું આપનું કામ છે. અને તે વિચાર પ્રમાણે કામ કરવાનું .એ હિંદુસ્તાની પ્રચાર સલાનું કામ છે. કુમનેરીને લીધે દિવસભર બની શકે એટલો વખત હું માન રાખું છું, એ વાતનો મને ઘેહ છે. આ ગણ માસમાં કદાચ ગણ વાર દિવસમાં ઐલનું પડયું હતું. આજે તો સોમવારનું જ મૌન છે. પરંતુ મને ઉમેદ છે કે, મારા મૌનથી ન આપણા કામમાં કરી બાધા આવશે કે ન આપના કામમાં કશી અગવડ થશે.

હવે આ સમેલન હું આપના જ હાથમાં છોડું છું. ભાઈ શ્રીમત્તારાયણ બાડાનું કામકાજ કરશે અને કરાવશે.

આજનું સમેલન મારી હાજરીમાં બરોઅબર સાડાપાંચ લગ્ન એસશે. કલે હું મારા બીજી નિયારો આપની સામે મૂકીશ. . . .

૨

( તા. ૨૭ ભાઈ એડકમાં શરીમાં આપેણ વ્યાખ્યાન )

ભાઈ એંઝે અને બહેનો,

આપને જેટલો વખત આપવા હું ધચ્છું છું તેટલો આપી નથી શકતો તેનું મને હુઃખ છે. તેને માટે મને માફ કરશો. મારું મૌન આપો દલાડો ચાલે છે. તે એવું નથી કે તૂઠી જ ન શકે. પરંતુ, જેટલા દિવસ રહી શકાય તેટલા રહું અને મારું કામ હીક રીતે ચાલે, એમ ધચ્છું છું; તેથી મૌન રાખું છું. જે હું મારી તાકાત એકદમ ખર્ચી નાખું તો એક માસમાં લાગેની જાઉં. મારો સત્યાગ્રહ અને મારી અહિંસા મને એમ નથી શરીરવતાં. જ્યાં જરૂર હોય તાં દ્વારે હાથે તે લુંટાવું. પણ હું કંજૂસ પણ થઈ શકું છું. આજે એ કંજૂસાઈ ચાલે છે.

હિંદુસ્તાની પ્રચાર સલા શું છે તે હું આપને કહી દઉં. હિંદુસ્તાની પ્રચાર સલાનો હેતુ એ છે કે, વધારેમાં વધારે લોકા હિંદી અને ઉર્દૂ શૈલીએ

અને નાગરી તથા ઉર્દૂ લિપિઓ શાખે. એક દાડો એવો હતો કે જ્યારે ડિસ્પ્રેસમાં રહેનાગયો તો એક જ ભાષા બોલતા હતા. એમનાં જ ફરજન આપણે છીએ. આજ આપણને લાગે છે કે, હિંદી ઉર્દૂ એકખીલથી ફૂર થતાં જય છે. હિંદીવાળાઓ કઢણું સંસ્કૃત અને ઉર્દૂવાળાઓ કઢણું અરથી ફારસી શણ્ણો વીણી વીણને વાપરી રહ્યા છે. હું માનું છું કે આ ચીજ ચાલનારી નથી. ગામડાના લોકોને તો રોટલાની પરી છે. તેઓ જે જાયાન આજ સુધી બોલતા આવ્યા છે, તે જ આગળ પણ બોલતા રહેશે.

હિંદી અને ઉર્દૂના કે એ નોખા નોખા ફિરકા પેશ થયા છે, અને રોકવાનું કામ મારા અને જમનાલાલળ જેવાં લોકનું છે. હું બેઠેને કહેવાનો કે, તમારો આ ઢંગ સારો નથી. તમારા આ બડા બડા શણ્ણોને ગામડાના લોક સમજશે પણ નહીં. જે આપણે બંને લિપિઓ શાખી જઈએ તો આખરે અને ભાષાઓ એક થઈ જશે. લિપિઓનો સવાલ એટલો વાંડા નથી. ભલે હમેશને માટે એ લિપિઓ રહે, અથવા બેઠેને હોઈને દરેક પ્રાંત ગોત્રોતાની લિપિમાં રાષ્ટ્રકાણ લખવા લાગે તોય કર્શી ફરદત નથી. પરંતુ ભાષા તો એક જ થઈ જવી જોઈએ. આપણે આજ આગસું બની ગયા છીએ. અંગ્રેજુને બોલ્ને આજે આપણા માથા ઉપર છે. પણ અંગ્રેજુય એટલી કઢણું નથી; દસ મહિનામાં અંગ્રેજ શાખી શક્તિને છીએ. પરંતુ આપણે તો અંગ્રેજુમાં વિચાર કરવા તથા વિદ્યાઓ શાખવા ચાહીએ છીએ, તેથી વખત લાગે છે. અંગ્રેજ પાણી જિંહાનાં ચૌદ ઉમદા વરસ આપણે અરથાદ કરીએ છીએ, અને એટલું કર્યા છતાં પણ પૂરી રીતે શાખવા પામતા નથી. આંગે જે અંગ્રેજ જાણુનારને કહે કે, તમારી વાત હિંદુસ્તાનીમાં સમજલવો, તો તે કહે છે, હું કેવી રીતે સમજાનું? કઢણું કે, લાણુતર અંગ્રેજુમાં થયું હોવાને લીધે તે પોતાના વિચારો હિંદુસ્તાનીમાં પ્રગટ કરી નથી શકતા. તો પછી છોકરાઓને એ હિંદુસ્તાની શી રીતે શાખવશે? આવી આપણી દુર્દીશા છે. તેમાંથી આગસ પણ પેશ થાય છે.

તો એ લિપિઓ શાખવામાં ડરવાનું શું? કોઈ કહે કે, આહ દશ બીજ સારી લિપિઓ છે તો તે કેમ ન શાખવી? હું તો કહું છું કે, દસિણુંની પણ એક લિપિ તો શાખી લો. લાં ભાષાઓ પણ ચાર છે તેથી આપ ભડકશો નદિ.

આપ હિંદુસ્તાનમાં રહો છો; હિંદુસ્તાનીમાની સેવાભિદમત કરવા છચો છો. તો તેને માટે એ લિપિઓ શાખવાથી ડરવું શું? ભાષા તો એક જ

શીખની છે ને? આપણું કમનસીબ છે કે, એ લિપિઓ આપણે લેવી પડે છે. પણ હું તો હિંહતી બધી ભાષાઓ ખુશીથી શીખી લઈ. હિલમાં રોાખ હોય તો મહેનત કરું પડે છે. આપની સંખ્યા આજ બહુ જ થોડી છે; લલે થોડી હો. પણ આપ તો એ લિપિઓ શીખી લેજો. એનું પરિણામ તેવું મોહું હશે, એમાં હું જવા ભાગતો નથી.

કેટલાક મુસલમાનો મોટી મોટી વાતો કહેતી વખતે જે શખ્સો વાપરે છે તે સાંભળોને હું ગભરાઈ જાઉં છું, જેકે એમની સાથે સારી પેઠે હું બેસ્તો જાહો હોઉં છું. તો એવું શું કરું હોય? મને એનો જવાબ મળ્યો છે અને તે મેં આપની સામે મૂક્યો છે.

૩

( સમેલનના ઉપરાંહાર રૂપે કરેલું વીજું વ્યાખ્યાન )

ડૉ. તારાચંહને પોતાનું વ્યાખ્યાન જલદી પૂરું કરવા હું કહી ન શક્યો, કેમ કે હું પોતે એમની એ વાતોમાં ગરક થઈ ગયો હતો. એમણે એવી વાતો કરી કે જે તેઓ પંડિતોની સભામાંથે કરી શકતા હતા. આપણે તો પંડિતો નથી. તોય સૌની સાથે હું પણ તે રસથી સાંભળતો હતો. અને એમણે કાઈ વસ્તુ એ વાર ન કહી, તેથી મેં એમને રોક્યા નહિ.

શ્રી. આનંદ કોસલ્યાયનલુણે જે કહ્યું તે હું સમજ્યો. તે દાાતા દાાતા બોલ્યા છે. હિંદી સાહિત્ય સમેલનની તરફથી એમણે એમ કહ્યું કે, અની શકે તો એ લિપિઓના એજને કાઢી નાંખવામાં આવે. હું આજે પણ હિં. સા. સમેલનમાં છું. તેમાં હું મારી મેળે નહોંતો ગયો. જે કામમાં જમનાલાલજી જતા તેમાં તે મનેય ઘસડી જતા હતા. તે મને ઈદ્દોર લઈ ગયા. ત્યાં મેં નવી વસ્તુ આપી. તેને બધાએ હડપ. કરી લઈ લાધી. મેં કહ્યું હતું કે, હિંદી એ ભાષા છે કે જેને હિંહું મુસલમાન અને બોલે છે ને અને લિપિમાં લખે છે. મારો આ પ્રસ્તાવ મંબૂર થયો. પછીથી મેં એને સમેલનના નિયમોમાં દાખલ કરાવ્યો. પછી તે બહલાઈ ગયો એ બીજી વાત છે. તેથી કરીને જે આજ હું એમાંથી નીકળી જાઉં તો મને દુઃખ નહિ થાય.

આપણામાં કેટલાય એવા છે કે જે હિંદી અને ઉર્દૂની મેળ કરવાની ડાશિશ કરે છે. કોઈ કહે છે, એની જરૂર છે? હું તો સાચી લોકશાહી —

‘અમોકસી’ બાહું છું. ઇકતા હામાં હા મેળવવાથી અમોકસીમાંથી ‘હિપોકસી’ — દંલ બની જાય છે. તેથી મેં કહ્યું કે, ઇકતા હામાં હા ન લખુવી, પણ પોતાનો સાચો ભત અતાવવો.

હું નથી ઈચ્છતો કે, હિંદી મટી જાય કે ઉર્દૂ નષ્ટ થઈ જાય. હું તો ઇકતા એટલું જ ધર્મછું છું કે, એઉ મારું કામ કરી દે. સત્યાગ્રહનો કાયદો છે કે તેમાં એક હાથની તાળી હોઈ શકે છે. તે વાગતી નથી, પણ તેથી કાઈ છરકત નથી થતી. આપ એક લાઘ લાવશો તો ભીજો આપોઆપ હડી જરો. હક્કાણે નાગપુરમાં જે વાત કહી હતી તેને તે વખતે હું સમજું ન શક્યો. ‘હિંદી યાને ઉર્દૂ’ એ મેં સ્વીકાર્યું નદી. તે વખતે તેમની વાત માની લેત તો સારું થાત. દોસ્ત બનવા આવ્યા હતા, પણ વિરોધ કર્યો અને દુઃખમનશા બન્યા. પરંતુ મારે દુઃખમન તો ડાઈ છે જ નહિ. પણી હક્કાણે પણ મારા દુઃખમન શી રીતે બની શકે? તેથી જ અમે આજ એક મંચ ઉપર ખડા થઈ ગયા છીએ. નાગપુરમાં ભારતીય સાહિત્ય સંમેલન કર્યું હતું; પરંતુ તાં તેનો આરંભ થયો અને તે ખતમ પણું તાં જ થયું; કેમ કે એહા દોસ્ત અનવા પરંતુ બની ગયા દુઃખમન જેના. તો તેનાથી શેં કશ્યદો થાત? તે હિંદુસ્તાની નહિ પણ ભારતીય સાહિત્ય સંમેલન હતું. તેથી કરીને લારના ભાષણુમાં મેં સંસ્કૃત શાંદ લર્યા હતા. આજ પણ જો એની આગળ બોલવું પડે તો એમ જ કરું.

આનંદજી કહે છે કે, એ લિપિઓ શીખવામાં બહુ મુસીબત ઉદ્ઘાવવી પડશે. હું કહું છું કે એમાં કશીય મુશ્કેલી નથી; અને જો મુસીબત હોય તોય તેને પાર કરવી જ જોઈશે. કેમ કે એ જો પાર કરવામાં ન આવે તો ભીજી એથીય ભારે મુસીબતોનો મુંકાખલો આપણે કેમ કરીને કરી શકોશું? હું હિંદુ-મુસ્લિમ-એકતા માટે જરું છું. હું માનું છું કે હિંદુસ્તાનીના પ્રચારથી હિંદુ-મુસ્લિમ-એકતા થશે. પરંતુ અત્યારે એ લાલચ હું નહિ અતાવું.

હું કહું છું કે હિંદી ને ઉર્દૂ એઉનું લખું થાયો. એમની માર્કેત મારે કામ લેવું છે. હિંદુસ્તાની આજે હૃદાત છે, પણ આપણે તેને કામમાં નથી લાવતા. આ જમાનો હિંદીનો છે અને ઉર્દૂનો પણ છે. તે એ નદીઓ છે. તેમાંથી હિંદુસ્તાનીની ક્રીજ નથી પ્રગત થવાની છે. તેથી જો એ એ સુકાઈ જાય તો મારું કામ નથી ચાલી શકતું.

ગામડાના લોક મારી ભાષા સમજ લેશે. જેમાં અરથી, ફારસી કે સંસ્કૃતના શબ્દો હાંસીને લર્યા હોય તેવી ભાષા તેઓ નહીં સમજ શકે. જે હિંદી સાહિત્ય સંમેલન કહે કે, અમે તો સંસ્કૃતનિષ્ઠ હિંદી જ ચલાવીશું તો મારે માટે તે મરી જાય છે. ગામડાની જ્યાન તો એક જ ચીજ છે. તે એ નથી હોઈ શકતી; પણીથી થાઓ તો થાઓ. હિંદીવાળા ખંચ્છે છે કે, હું હિંદીને જ ડંકો વગાડ્યા કરું, ઉર્દૂનું નામ ન લડ્ય. પણ હું તો અહિસામાં માનનારો સત્યાગ્રહી છું. હું એ શી રીતે કરી શકું? હું એકલો આ કામ નથી કરી શકતો; તેમાં સૌની મદ્દ જોઈએ. હું મહાતમા છું તો તેનું કારણ એ જ છે કે, હું મારી મર્યાદાઓ સમજુને તેમની બહાર નથી જતો. તેથી જ મૌલિક હક્કસાહેબ આવ્યા છે. મારી પાસે પાંખો નથી. બડા અડા બુજર્ગેને એટલા જ માટે બોલાવ્યા છે કે તેઓ મને પાંખો આપી દે. જે તે આપશે તો હું જરૂરિય અને કંઈશ, જુઓ, કામ તો અચ્છું થઈ ગયું ને? નહિ તો ખાખમાં પડયો જ છું : ‘ખાકસાર’ થઈ જઈશે.

હિંદી સાહિત્ય સંમેલનમાં હું પણ એક મોટો માણુસ ગણાઉં છું. પણ એ દરજાનેથી નહિ ગણ સામાન્ય રીતે હું કહેવા માણું છું કે, હિંદી સાહિત્ય સંમેલનની સામે કશું કામ નહિ થાય. પરંતુ એઉ લિપિઓ શીખવાની તકલીફ તો મંનૂર કરવી જ જોઈશે. હું તો આનંદજ મારફતે કામ કરાવવા ચાહું છું.

મને કહેવામાં આવ્યું કે, મુસ્લિમ ઓકરા તો નાગરી લિપિ નથી શીખતા. મેં કહ્યું, તમે નથી ઓયું, તેમણે જાયું. એક લિપિ શીખી લીધી તો તેથી શું? આનંદીશી વાતથી આવડું મોદું દિલ થાય છે. આ જ વાત મેં હજરત મોહાની સાહેબને પણ કલી હતી. પણ તે વખતે આ કામ ન ચાલ્યું, કેમ કે સત્યાગ્રહ શરૂ થઈ ગયો. હું એમ નથી કહેતો કે આપ અધા જેલમાં જાઓ. પણ હું ગયો. બીજા જે જેલમાં પણ છે તે પણ કાઈ મુખ્યતાની વાત નથી. જવાહર, રલ્યુલભાઈ, મૌલાના સાહેબ જેલમાં એહા છે તે કાઈ પાશલ નથી. જે તે ખુશામત કરીને બહાર આવી જશે તો મારી નજરમાં તે મરી જશે. જે તેઓ અંદર જ મરી જશે તો હું એક પણ આંસુ નહિ પાડું; કંઈશ કે તે હીક મર્યાદા કે, ત્યાં એહા એહા પણ તેઓ હિંદની સેવા કરી રહ્યા છે.

જે હિંદી અને ઉર્દૂ મળી જાય તો ગંગાયમુનાથી પણ બડી સરસ્વતી હૂગલી જેવી બની જશે. હૂગલી ગંઢી છે; હું તેનું પાણી નથી પિતો. પણ આ હૂગલી જે બની ગઈ તો તે ભારે ખૂખુસ્કુરત હશે.

હવે રહી પૈસાની વાત. આપમાંથી કે પૈસા આપવા ધ્રુષ્ટે તેઓ મને યા શ્રીમન્નારાયણજીને આપે. દરેક પોતાની શક્તિ પ્રમાણે પૈસા આપવા જોઈએ. નેણો આપે તે કામને માટે આપે; નામને માટે ડાઈ પૈસા ન આપે.

### સંમેલનના ઠરાવો

૧. આ સંમેલનનો અભિમાય છે કે, હિંદુસ્તાની જયાન ફેલાવવા તથા તેની આખાડી કરવાને માટે એ વસ્તુની જરૂર છે કે, હિંદી જાણુનારા ઉર્દૂ લખાવટને અને ઉર્દૂ જાણુનારા નાગરી લખાવટને જલદીમાં જલદી શીખ્યી લે; અને કે લોકા આ એમાંની એકનેથ ન જાણું હોય તેઓ પણ એકનેથ શીખ્યી લે, કે જેથી બધા લોક હિંદુસ્તાનીનાં ઉર્દૂ હિંદી એ એવિ ઇપો વાંચી અને સમજ શકે અને એ રીતે હિંદુસ્તાનીને વિકાસ અને પ્રગાર થઈ શકે.

૨. દેશના બધા લોક એ વાત માને છે અને સમજે છે કે, આપણું રાષ્ટ્રીય જીવનને મજબૂત કરવા તથા અલગ અલગ પ્રાંતોના લોકોમાં મળવા કરવાની તથા વ્યવહારની એક ભાષા અનાવવાને માટે એ જરૂરનું છે કે, હિંદુસ્તાની જયાનની આખાડી કરવામાં આવે અને એની ઇપરેણા ડાઈ કરવામાં આવે; કારણ કે, આ માટે આ જ ભાષા સૌથી વધુ કામની છે.

આ સંમેલન નક્કી કરે છે કે, પંદર સુધી સભ્યોની એક સમિતિ ખનાવવામાં આવે કે જે હિંદુસ્તાની ભાષાના કાશો તૈયાર કરે, ભાષાનું વાકરણ નક્કી કરે, તેના શબ્દનું લાડોળ વધારે, તેમનું ઇપ બાધે, અને તેમાં સારી સારી અને કામની ચોપડીઓ લખાવે. ડાઈ સભ્યની જગ્ગા ખાલી થશે તો તેને બાકીના સભ્યો પૂરી શકશે. સમિતિનો એક નિમંત્રા ('કન્વીનર') રહેશે કે જે ચોગ્ય વખતે ને જગ્ગાએ સમિતિની બેઠક ઘોલાવ્યા કરશે.

આ સમિતિ પોતાના કામનો એક ખરડો તૈયાર કરશે ને વિગતવાર ખર્ચનો અંદાજ કાઢશે; તેને મહાત્મા ગાંધી પાસે મંજૂરી માટે મોકલશે, અને મહાત્માજીને વખતોવખત પોતાના કામનો હેઠાલ આપતી રહેશે.

આ સમિતિના સભ્યોનાં નામ મહાત્મા ગાંધી, ડૉ. તારાચંદ અને સૈયદ સુલેમાન નદ્વી પણી જાહેર કરશે.

## પુરખથી

[ પા. ૫ ૬૫૨ ] લીલી ૧૨માં ‘કાર્યને સાધવાના ઉપાયો’નો હલ્દેઅ કરીને જણાયું છે કે, “જે ઉપાયો માતૃભાષા વિષે સૂચવ્યા છે તેવાં જોઈતા ફેરફાર સાથે, રાષ્ટ્રીય ભાષા વિષે પણ લાગુ પડી શકે છે.” માતૃભાષા અંગે સૂચવેલા તે ઉપાયો એ વ્યાખ્યાનમાં નીચે પ્રમાણે છે :— ]

“માતૃભાષાને ડેળવણીનું વાહન કરવું એ ધૃત હોય તો તેનો અમલ થવા સારું આપણે શાં પગલાં લરવાં જોઈએ એ વિચારવું જોઈએ. દ્વારાલો આપ્યા વગર એ પગલાં મને જેવાં સ્ફેર છે તેવાં કખી નાખું છું :

૧. અંગ્રેજ જાણુનાર ગુજરાતીએ, જાણે અનાણે પણ પરસ્પર વ્યવહારમાં અંગ્રેજનો પ્રયોગ ન કરવો.

૨. જેને અંગ્રેજ અને ગુજરાતી બંનેનું સારું શાન છે તેણે અંગ્રેજમાં જે સારાં ઉપયોગી પુસ્તકો કે વિચારો હોય તે પ્રણ આગળ ગુજરાતીમાં મૂકવાં.

૩. ડેળવણી મંડળોએ પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવાં.

૪. ધનાદ્ય પુરુષોએ ગુજરાતી મારફત ડેળવણી આપવાની શાળાઓ જરો જરો સ્થાપવી.

૫. ઉપલી પ્રવૃત્તિની સાથે જ સરકારને પરિષ્ઠોએ અને ડેળવણી મંડળોએ અરજી કરવી કે, બધી ડેળવણી માતૃભાષા મારફતે જ અપાવી જોઈએ. અદાલતોમાં ને ધારાસભામાં વહેવાર ગુજરાતી મારફત થવો જોઈએ ને પ્રણનું બધું કાર્ય તે જ ભાષામાં થવું જોઈએ. અંગ્રેજ જાણુનારને જ સારી નોકરી ભળી શકે છે તે પ્રથા બદલી નોકરોને લાયકાત પ્રમાણે, ભાષાભેદ રાખ્યા વિના, પસંદ કરવા જોઈએ. ગુજરાતી ભાષામાં તેઓને જોઈનું શાન મળે એવી શાળાઓ સ્થપાવી જોઈએ, એવી અરજી પણ સરકારને જવી જોઈએ.

ઉપરની ચોજનામાં એક આપત્તિ જોવામાં આવશે. તે એ છે કે, ખારા-  
સભામાં તે મરાડી, સિંહી ને ગુજરાતી સભાસહેદે છે ને વખતે કાન્ડી પણ  
હોય. આપત્તિ મોટી છે પણ અનિવાર્ય નથી. તેથણે વર્ણે એ નિષ્યણી ચર્ચા  
થર્ડ કરી છે ને કોઈક હિન્દે પણ લાખ પ્રમાણે નવા વિભાગો થવા જોઈશે  
એમાં શાંકા નથી; પણ તેમ થતાં સુધી હિંદી અથવા સભાસહની પોતાની  
લાખમાં લાખણું આપવાનો અભિવાર તેને મળવો જોઈએ. આ સૂચના  
અત્યારે હાસ્યરૂપે જણાય તો ક્ષમા મારી એટલું જ કહીશ કે, ધર્મી સૂચનાઓ  
પ્રથમ દૃષ્ટિએ ને આરંભમાં હાસ્યજનક જણાય છે. દેશની ઉત્તિનો આપાર  
કેળવણીના વાહનના શુદ્ધ નિર્ણય ઉપર રહેલો છે એવો મારો અલિગ્રાય છે.  
તેથી મને મારી સૂચનામાં ભારે રહસ્ય માલૂમ પડે છે. માતૃભાષાની કિંમત  
વધશે, તેને રાજ્યપદ મળશે, ત્યારે તેમાં આપણે નથી કર્શી તેની રાક્તિએ  
જોવામાં આવશે.”

## મૂલ્ય

- આકૃતા સાહેબ ૫૬  
 અક્ષરજ્ઞાન, -અને ચારિન્ય ૫૦,૫૧; -નો  
     પ્રચાર (અને લિપિનો પ્રક્રિયા) ૧૮-૨૧,  
     ૩૫, ૩૮, ૩૯, ૬૭, ૮૪  
 અભિલાષ ભારતીય સાહિત્ય મરિયદ, ૩૯,  
     ૩૮,૩૬,૪૬,૫૨,૫૪,૬૧,૬૨,૬૬,૬૯  
 અભિલાષ ભારતીય હિન્દુસ્તાની પ્રચાર  
     સંમેલન ૧૨૨, તેના ઠરવો ૧૨૮  
 અગ્રવાલ, શ્રીમત્રારાયણ ૧૧૭,૧૨૨,૧૨૮  
 અહાલતની ભાષા ૮, ૧૫, ૭૦, ૧૨૮  
 અપક્રંતા ભાષાઓ ૧૦૩  
 અખદુલ કાદર, મૌલાના ૬૨  
 અખદુલ લ્ક, મૌલવી ૪૭, ૫૬, ૭૨, ૭૮,  
     ૮૦, ૧૧૭, ૧૨૩, ૧૨૯, ૧૨૭  
 અખુલ કલામ આજાહ, મૌલાના ૮૦,૧૨૭  
 અમીર ખુશરો ૧૦૨, ૧૦૪  
 અયોધ્યાનાથ, મંડિત ૪૫  
 અરણી લિપિ ૬,૩૭,૫૩ (જીએઓ ઉર્દૂ લિપિ);  
 અર્ધમાગધી ૧૦૩, ૧૦૯  
 અલીકાઈ એંસ ૫૩  
 અવહૃથ્ય ૧૦૩  
 અરારક, ડૉ. ૪૮  
 અંગ્રેજ વેગારી માટે ભાષાનિયાર ૧૮  
 અંગ્રેજ સરકાર અને એક રાષ્ટ્રજ્ઞાન ૧,  
     ૨,૮, ૧૮,૩૨, ૮૭; -અને શિક્ષણ-  
     પ્રક્રિયા ૬૧  
 અંગ્રેજ અને ગાંધીજી ૬૦; (જીએઓ પછીનું  
     પણ); -નું સ્થાન ૨, ૧૫, ૩૨, ૪૩,  
     ૬૬, ૬૧, ૧૧૨; -નો ધરો લેવા જેવો  
     ૩૩, ૬૩; -રાષ્ટ્રજ્ઞાન થઈ શકે ૧,૩,  
     ૧૦, ૧૧, ૧૨, ૧૭,૧૮, ૨૫, ૩૨, ૩૭,  
     ૪૧, ૪૩, ૪૫, ૪૮, ૫૧, ૬૩, ૧૧૨  
 અંગુમને-તરફી-એ-ઉર્ડૂ ૬૩, ૧૧૭,  
     ૧૧૯, ૧૨૧  
 આહિલ સાહેબ ૫૮  
 આનંદ કોસલયાયન ૧૨૦,૧૨૫,૧૨૬,૧૨૭  
 અર્થ સંસ્કૃતિ ૫૪,૫૬,૭૬ (જીએઓ હિન્દી  
     હિન્દુ સંસ્કૃતિ અણુ)  
 અસ્ત્રામની સંસ્કૃતિ ૫૫, ૭૬, ૮૮  
 ઉર્ડૂ ૩,૪,૬,૧૫,૨૧,૩૩,૪૨,૪૬,૫૨,૫૩,  
     ૫૬,૫૭,૫૮,૬૭,૬૮,૬૯,૭૮,૮૦,૮૬,  
     ૯૨,૯૬-૭,૧૦૮; -ની જ્વાળા ૬૬-૭,  
     ૮૮; -લિપિ ૧,૩,૧૫,૨૪,૩૫,૩૮,૪૨,  
     ૪૮, ૪૯, ૫૭, ૬૦-૧, ૬૬, ૮૮, ૯૮;  
     -લિપિનું શિક્ષણ ૯૮-૯, ૧૦૮,૧૦૯;  
     -રાખ્ય ૯૧, ૯૨, ૯૩, ૯૮  
 ઉર્માનિયા યુનિવર્સિટી ૭૮, ૮૦  
 એની ઐસર્ટ ૬, ૧૦  
 કખીર ૧૦૮, ૧૦૫, ૧૦૬, ૧૦૭  
 કરાંચી ટ્રોન્ઝેસ-ઠરાવ ૨૪  
 કાકાસાહેબ ૩૦, ૩૧, ૩૪, ૩૬, ૩૭, ૮૧,  
     ૧૦૦, ૧૦૨, ૧૧૮  
 કાનપુરને ઠરાવ ૧૬, ૮૫, ૧૧૬  
 કાંગડી ગુરુકુલ ૨૨

- કુશને-થરીએ ૮૨  
 કૃષ્ણસ્વામી, સ્વઠો ન્યાયમૂર્તિ ૧૧  
 કોંગ્રેસ અને શાષ્ટ્રકાયા ૧૬, ૨૩, ૨૪, ૪૪-૯,  
 ૪૮, ૫૭, ૭૬, ૭૮, ૮૧, ૯૮-૯, ૧૧૬, ૧૧૮,  
 ૧૨૨; -ની સરકાર અને હિન્દુસ્તાનીનું  
 શિક્ષણ છૈ, જે; -માં રાજ્યકાયાનો  
 ઉપયોગ ૭, ૬, ૨૩, ૪૬, ૪૮, ૭૭, ૮૬,  
 ૧૧૮, ૧૨૨; -શું કરે? ૭૭, ૮૦, ૯૨, ૧૧૮  
 અડી બોલી ૧૦૦, ૧૦૧, ૧૦૪, ૧૦૫  
 અંધીજી, અને અંગ્રેજ (જુઓ અંગ્રેજમાં)  
 -અને હિંદી ૩૩, ૧૨૬, ૧૨૭; -અને  
 હર્દી ૧૨૬; -અને હિન્દુસ્તાની પ્રચાર  
 સભા ૧૧૪, ૧૧૮; -અને હિંદી સાહિત્ય  
 સમેલન (જુઓ હિં. સા. સમેલનમાં)  
 ૧૨૫, ૧૨૭; -સાહિત્ય પ્રત્યે દિશા ૩૬;  
 -સામે ઇન્ડિયાએ ૫૨, ૫૭-૬૦, ૬૧,  
 ૬૩, ૮૩, ૯૪-૯  
 (આ ઉપરાંત તેમના વિચારે ૪૦  
 અંગે તે તે (વિષયમાં જુઓ)  
 ગુજરાત કેળવણી પરિષદ ૧-૫  
 ગુજરાતમાં રાખ્યકાયા પ્રચાર ૩૦, ૧૧૮-૨૦  
 ગુરુમંથ ૧૦૫  
 ગોપન્યા ચોધરી ૩૦  
 ગૌરીશંકર એઝા ૧૦૪  
 ગ્રિયર્સન ૧૦૪  
 ઘૈતન્ય ૩૬, ૩૭, ૪૪  
 જગદીશ એઝ ૩૩  
 જમનાલાલજી ૬૮, ૧૨૨, ૧૨૪, ૧૨૫  
 જવાહરલાલજી ૬૧, ૭૦, તેમના વિચારે  
 ૭૦-૨, ૧૨૭  
 લખાંનનો હાખલો ૮૭-૮
- દાનલ, પુરુષોત્તમદાસ ૫૩, ૫૪, ૯૧  
 ૧૧૪, ૧૧૬, ૧૨૨  
 દાયોર (જુઓ રવીન્દ્રનાથ)  
 દિલ્ક, લોકમાન્ય ૪૪, ૮૮  
 દેસિસ્ટોરી ૧૦૩  
 તારાયંદ, ડૉ. ૧૦૦, ૧૦૨, ૧૨૨, ૧૨૫,  
 ૧૨૮; -ની હિન્દુસ્તાનીની વ્યાપ્તિ ૧૦૧  
 તિરુવેલ્લુષર ૩૬  
 તુકારામ ૩૬  
 તુલસીદાસજી ૩૩, ૭૬; -રામાયણ ૪૪  
 દક્ષિણ ભારતમાં હિંદી પ્રચાર ૧૧, ૧૩,  
 ૧૭, ૨૩, ૨૫-૬, ૨૭-૯, ૪૦, ૪૮-૫૦,  
 ૧૨૧; -અને કોંગ્રેસ સરકાર ૭૪-૫  
 દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભા (જુઓ:  
 ઉપર 'દ. લા. હિં. પ્રચાર')  
 દ્વાનાંદ સરસ્વતી ૧૦  
 દેવનાગરી ૧, ૩, ૬, ૧૫, ૧૬, ૨૦, ૩૩, ૩૪,  
 ૩૮, ૪૩, ૪૮, ૫૩, ૫૭, ૬૪, ૬૬, ૬૮,  
 ૮૨-૪, ૯૮, ૧૦૮-૯, ૧૧૨-૧, ૧૨૭  
 દેશી ભાષાઓ (જુઓ 'પ્રાંતભાષાઓ')  
 દ્રાવિડ -પ્રાંતો અને ભાષાઓ ૫, ૭, ૧૦,  
 ૧૧, ૧૩, ૧૭, ૨૫, ૨૭, ૩૨ (જુઓ દ.  
 ભારતમાં હિંદી પ્રચાર ખણ)
- ધનો ૧૦૫  
 ધારાસભાની ભાષા ૮, ૧૨૫-૩૦  
 ધીરેન્દ્ર વર્મી ૧૦૭  
 નરસિંહ મહેતો ૩૭  
 નાગર ભાષા ૧૦૩  
 નાગરી (જુઓ દેવનાગરી)  
 નાગરી પ્રચારિણી સભા ૭૮, ૧૦૫  
 નાયુવડી, અમૃતલાલ ૧૧૮, ૧૨૨  
 નામહેલ ૧૦૫

- નિગમ રજ્ય અને ઉર્દુપ્રચાર. ૧૧૧-૨  
 ખસ્તિમ હિંમાં પ્રચાર ૩૦  
 પંલભમાં પ્રચાર ૩૦  
 પાલી ૧૦૩, ૧૦૬  
 પીતાંબરકાસ બડવાન ૧૦૫  
 પીયો ૧૦૫  
 પૂર્વ હિંમાં પ્રચાર ૨૬-૩૦  
 પ્રકુલ્યાંડ રાય ૩૩  
 પ્રકૃત ભાષાઓ ૧૦૨-૩  
 પ્રાંતકાષાઓ ૮, ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭,  
     ૧૮, ૨૧, ૨૨, ૨૩, ૩૧, ૩૪, ૩૮, ૪૩, ૪૪,  
     ૪૬, ૫૨, ૫૪, ૬૪, ૭૦, ૮૪, ૮૬, ૯૧, ૧૧૨,  
     ૧૨૫, ૧૨૮-૩૦. —અને રાષ્ટ્રભાષા  
     (જુઓ ‘રાષ્ટ્રભાષા’માં). —અને અંગ્રેજ  
     ૮૫, ૧૦૧, ૧૧૨, ૧૨૪ —માટે એક  
 લિપિ ૧૬-૨૧, ૩૪-૫, ૩૬, ૩૮, ૪૩, ૫૭,  
     ૬૪, ૬૬, ૮૮-૪, ૮૯  
 પ્રાંતલિપિઓ ૮૨, ૧૧૩ (જુઓ ‘સંસ્કૃતની  
     પુરીઓ’માં). —દ્વારા રાષ્ટ્રભાષા પ્રચાર  
 ૧૦૬, ૧૨૪  
 ફારસી લિપિ (જુઓ ઉર્દુ લિપિ પણ)  
     ૬, ૧૫, ૨૧, ૫૩, ૧૦૭-૮, ૧૧૦-૧  
 ફારસી અરથી શબ્દો ૩, ૪, ૬, ૭, ૨૧, ૩૩,  
     ૫૬, ૫૮-૯, ૬૮, ૭૭, ૭૯, ૮૬, ૯૪, ૧૦૧,  
     ૧૨૪  
 અનારસીદાસ ચતુરેદી ૩૦, ૩૪  
 અંકુમચંડ ૯૬  
 અંગાળમાં રાષ્ટ્રભાષા પ્રચાર ૧૪, ૨૬,  
     ૩૦, ૩૨  
 અંગાળી રાષ્ટ્રભાષા ? ૪, ૪૪  
 આણા રાધવાનાસ ૨૬-૩૦  
 અિરલા ધનશ્યામદાસ ૩૪  
 ઝુંક ૧૦૩  
 ઝુહલર ૧૦૪  
 ઝુંદેલી ૧૦૪  
 જગવાનહાસ, બાયુ ૭૭, ૮૧, ૧૧૬  
 ભારતીય સાહિત્ય ૩૭, ૩૮ (જુઓ  
     અ. લા. સા. પરિષદ પણ)  
 ભજમહાયલી, મૌલાના ૭૭  
 ભજમહ શોરાની, પ્રે. ૧૦૪  
 ભજારાષ્ટ્રી ૧૦૩  
 ભજાવીર ૧૦૩  
 ભજાસલાને રાષ્ટ્રભાષા (જુઓ ‘કોંગ્રેસ’માં)  
 ભાનપત્રોની ભાષા ૧૭  
 ભાતભાષાઓ (જુઓ પ્રાંતકાષાઓમાં)  
 ભાલવીયળ ૩, ૨૬-૭, ૭૭, ૮૦, ૮૭, ૮૮,  
     ૮૯, ૧૧૬  
 ભુનરી, કનૈયાલાલ ૩૭, ૫૬, ૫૮  
 મોટિલાલજ, પંડિત ૭૮  
 થાડુણ હુસેન ૪૫, ૪૬  
 યુદ્ધપરિષદમાં હિંદુસ્તાની ૧૮  
 રમાહેવી ચોઘરી ૩૦  
 રત્નિન્દ્રનાથ ટાગેર ૩૩, ૪૪, ૫૬, ૮૯  
 રાજસ્થાની ૧૦૩, ૧૦૪, ૧૦૬  
 રાનાઓ ને ભાષાની સેવા ૮, ૬૭  
 રાનજી ૭૫, ૭૬  
 રાનેન્દ્રભાયુ ૫૦, ૫૩, ૯૧, ૭૨, ૮૦, ૧૧૪  
 રાધાકૃષ્ણન, સર ૮૭, ૮૮  
 રામકૃષ્ણ ૪૪  
 રામચંડ શુક્ર ૧૦૪, ૧૦૫  
 રામમોહન રાય, રાજ ૧૧, ૪૪  
 રામાનંદ બાયુ ૩૦  
 રાષ્ટ્રભાષા, —અને અંગ્રેજ ૧, ૬, ૧૨, ૨૫,  
     ૩૧-૨, ૪૧, ૬૬, ૭૬, ૮૫, ૮૯, ૮૭, ૯૦,

૬૧-૨, ૬૭, ૧૧૧, ૧૨૪ (જુઓ અંગેણ  
માં પણ).  
—અને એક લિપિનો પ્રક્ર ગુંઘવી  
ન નાંયો ૨૧, ૪૩, ૧૨૪;  
—અને ધર્મ કોમ ઈ ૫૬, ૫૩, ૫૬, ૧૧૮;  
—અને પ્રોત્સાહા ૨૧, ૨૩, ૨૫, ૩૧, ૩૩,  
૩૪, ૪૧, ૪૨, ૪૩, ૫૩, ૫૬, ૫૮, ૭૪, ૭૫,  
૭૬, ૭૭, ૮૭, ૧૦૮ (તેમનું તુલનામણક  
વ્યાકરણ) ૭;  
—અને સાધારણનો વિચાર ૨-૩, ૧૨;  
—કઈ હોવી જોઈએ ? ૧, ૬, ૨૫, ૪૦-૧,  
૪૩-૪, ૪૩, ૫૬, ૫૭, ૬૬, ૬૮, ૭૦,  
૭૬, ૮૧, ૧૧૧;  
—નાં માઠચપુસ્તકો વિષે ૩૪, ૧૧૦;  
—નાં લક્ષણો ૨, ૬, ૪૦-૧, ૪૧, ૮૧,  
૮૪, ૧૧૧;  
—ની એ શોલી—સાહિત્યિક રૂપો ૪૭, ૫૧,  
૫૩, ૫૬, ૬૩, ૬૮-૯, ૭૮, ૭૬, ૮૧, ૮૨,  
૮૮, ૧૦૮, ૧૧૪, ૧૧૬, ૧૧૭, ૧૧૮;  
—તું નામ ૩૩, ૪૨, ૪૪, ૪૬-૭, ૫૩, ૫૪,  
૫૬, ૫૭, ૬૦, ૬૧, ૬૨, ૬૮, ૭૬, ૮૫, ૮૪,  
૧૦૧, ૧૨૨ (જુઓ હિંદી, હિન્ડી-  
હિન્ડુસ્તાની, હિંદુસ્તાની માં પણ)  
—તું મૂર્ખ જ્ઞાન ? કોને માટે ? ૧૦૮,  
૧૧૨, ૧૧૭, ૧૧૮;  
—તું વ્યાકરણ ૭, ૪૨, ૬૨, ૧૦૦;  
—તું શાખાલંઠાળ ૩, ૬, ૧૫, ૩૩, ૪૧,  
૪૭, ૫૫-૬, ૫૮, ૬૦, ૭૩, ૭૭, ૮૩, ૮૭;  
—તું શિક્ષણ ૬૫, ૬૬, ૭૪, ૭૫, ૮૨, ૮૫,  
૧૦૬-૧૦;  
—તું સાહિત્ય કેવું જોઈએ ? ૩૪;  
—નો કોશ ૭૩, ૮૦;  
—નો પ્રચાર (કાર્ય સાધયાના વ્યાયો)

૫, ૭૮, ૧૩, ૧૭, ૧૮, ૨૩, ૨૭, ૨૯,  
૩૦-૧, ૪૧-૨, ૪૭-૮, ૬૩, ૧૧૫, ૧૨૬;  
—એક નચનાકાર્ય ૮૫, ૮૮, ૯૫;  
—અને બહેનો ૪૦, ૪૮; —અને  
ચારિન્યશુદ્ધિ ૪૬;  
—નો પ્રચારક (પ્રતિજ્ઞા ને તૈયારી)  
૪૬, ૫૦, ૫૧, ૮૧, ૧૨૦;  
—માટ કોશાખાતું ૭૭, ૮૦;  
—સાંસ ગણ પણો ૫૧

૨૭ટ્રાલિપિ —નો પ્રક્ર ૧, ૩, ૪, ૬, ૧૫, ૩૪,  
૪૨, ૫૭, ૬૦, ૬૪, ૬૫, ૬૬, ૬૮, ૮૨-૩,  
૧૦૭-૮, ૧૨૪, ૧૨૭;  
—એ છે ૧, ૩, ૬, ૧૫, ૪૬, ૫૦, ૫૭, ૬૦,  
૬૪, ૬૬, ૭૦, ૭૬, ૭૮, ૮૮, ૮૨-૪, ૮૮,  
૯૩, ૯૮, ૧૦૮, ૧૨૨, ૧૨૪;  
—અને શીઓ ૭૬, ૬૩, ૧૦૮, ૧૧૦,  
૧૨૫, ૧૨૭;  
—એક કઈ ને કેમ થઈ શક ૩, ૬,  
૩૮, ૬૫, ૮૨-૩, ૧૦૮, ૧૨૪ (જુઓ  
૭૬, દેવનાગરીમાં પણ)  
રાષ્ટ્રીય એકતા ૩૪, ૩૮, ૪૦, ૪૨, ૪૬, ૫૭,  
૬૫, ૬૬, ૭૪, ૭૬, ૭૮, ૮૬ (જુઓ ‘હિન્ડ-  
મુસ્લિમ એકતા પણ’)

રેફાસ ૧૦૫  
રેખાન લિપિ ૩૮, ૬૬, ૭૦, ૮૨-૩, ૧૦૭, ૧૧૧  
લિપિ અને અક્ષરજ્ઞાનપ્રચાર (જુઓ  
અક્ષરજ્ઞાન પ્રચારમાં) —રાષ્ટ્રભાષા માટે  
(જુઓ ‘રાષ્ટ્રલિપિ’)  
લિપિયોની રક્ષા (કરાંચી ઠરાવ) ૨૪,  
૩૪, ૬૪; લિપિયોનું શિક્ષણ ૧૨૪,  
૧૨૬, ૧૨૭  
લિપિ-સુધાર ૩૦, ૩૫, ૩૬, ૭૦

લેખ રામન ૪૧  
 વલ્લભભાઈ ૧૨૭  
 વલ્લભભાઈય ૧૦૯  
 વાઇસરોય ૧, ૧૮  
 વિજયરાધવાચાટિયર, સર ગી. ૨૩  
 વિવેકાનંદ ૪૪  
 'વિદ્યાળ ભારત' ૩૦  
 માન્યભાઈ ૧૨૦, ૧૦૨, ૧૦૪, ૧૦૫, ૧૦૬,  
 ૧૦૭  
 શિક્ષણમાં રાષ્ટ્રભાવા ૫, ૧૧, ૨૨, ૨૩  
 શિલ્પિ, મૌલાના ૪૭, ૭૨  
 શૃંગાર રસ ૩૪, ૩૭  
 શીરસેની ૧૦૩  
 સ્થાનમાં દરદાસ, પાંડિત ૪૭, ૧૦૫  
 સુપ્રે, સર તેજપણાંડુ ૧૮  
 સંસ્કૃતાની પુનીઓ ૫, ૨૮, ૩૪, ૪૨, ૪૩,  
 ૬૬, ૮૨-૩, ૮૪, ૧૦૮; —સંસ્કૃતાનુ  
 ક્રાન ૧, ૭, ૨૨, ૪૨, ૫૧  
 સંસ્કૃત શાસ્ત્રો ૩, ૬, ૭, ૨૧, ૨૮, ૩૩, ૪૨,  
 ૫૪-૬, ૫૮, ૬૨, ૬૮, ૭૭, ૭૯, ૮૮, ૯૪,  
 ૧૦૧, ૧૦૮, ૧૨૪, ૧૨૭;  
 સંસ્કૃત, આર્ય, ધર્મભાઈ, હિંદુ  
 (તે તે નામમાં જુઓ)  
 સુરદાસ ૭૮, ૧૦૦, ૧૦૨, ૧૦૬  
 સુલેમાન નહાની, રૈથ ૧૨૮  
 સેન ૧૦૫  
 સ્વભાવા, જુઓ પ્રાંતભાવાંગા,  
 સ્વરાજ અને જાપાના પ્રશ્ન ૮, ૧૫, ૨૪, ૨૫,  
 ૩૨, ૩૮, ૪૨, ૪૫, ૪૬, ૫૭, ૬૪, ૮૫,  
 ૬૬, ૧૦૧, ૧૦૮, ૧૨૪ (જુઓ હિંદુ  
 સુસ્તિમ એકતા પણ)

હજરત મોહાની ૧૨૭  
 હરિહર શર્મા, પાંડિત ૩૧  
 'હિંસ' ૫૬, ૫૮  
 હિંદુયત ફુસેન, ટો. ૧૦૫  
 'હિંદુ સ્વરાજ' ૧  
 હિંદી (ચાંદ્યા-રાષ્ટ્રભાષા) ૧, ૪, ૬,  
 ૧૨, ૧૫, ૨૭, ૨૮, ૨૧, ૨૫, ૩૧, ૩૨, ૩૩,  
 ૩૪, ૩૫, ૪૧, ૪૨, ૪૪, ૪૬, ૫૦, ૫૪, ૫૬,  
 ૫૭, ૫૮, ૬૦-૧, ૬૭, ૬૮, ૭૮, ૮૫, ૯૩,  
 ૯૭, ૧૨૫ (શાસ્ત્ર) ૪૭, ૯૨, ૯૮; —નું  
 ચાકરણ ૭  
 હિંદી અને હિંદુ (નોખી? નેકુલે) ૩, ૪,  
 ૬, ૨૧, ૩૭, ૪૨, ૬૫, ૭૮, ૮૧, ૯૨, ૯૬-૭;  
 —એ શૈલી તરીકે, (જુઓ રાષ્ટ્રભાષાની  
 એ શૈલી); —નો દત્તહાસ ૪, ૬, ૪૭,  
 ૫૩, ૫૮-૯, ૬૧, ૬૭, ૧૦૦..., ૧૨૨-૩;  
 —નો જવડો ૩, ૬-૭, ૨૧, ૩૮, ૪૨,  
 ૪૭, ૫૫, ૫૭-૮, ૬૮, ૬૬, ૭૨, ૭૬, ૭૮,  
 ૭૯, ૮૩, ૯૭, ૧૨૩, ૧૨૪  
 હિંદી-હિંદુ ૭, ૬, ૧૬, ૨૧, ૬૨, ૬૩, ૮૧  
 'હિંદી અને હિંદુ' ૮૧  
 હિંદી પહોંચાન સમારંભ (એંગ્રેઝ)  
 ૪૦, ૬૨; (મદ્રાસ) ૪૨, ૫૬.  
 હિંદી સંસ્કૃત ૫૪, ૫૫, ૭૬, ૬૦  
 હિંદી સાહિત્ય અને શૃંગારરસ ૩૪  
 હિંદી સાહિત્ય સંમલન ૫, ૧૨, ૨૬, ૨૮,  
 ૩૪, ૩૫, ૪૪, ૪૬, ૪૭, ૫૦, ૫૪, ૫૮,  
 ૬૧, ૬૭, ૬૯, ૭૮, ૮૩, ૯૭, ૧૧૩-૧;  
 —અને હિંદુસ્તાની પ્રચાર સભા  
 ૧૧૩-૪, ૧૧૯, ૧૨૦-૧, ૧૨૫, ૧૨૭;  
 —ની પરીક્ષાઓ ને પાઠ્ય પુસ્તકો  
 ૩૦, ૩૩-૪; —ની પરીક્ષાઓ અને  
 હિંદુસ્તાની પ્રચાર ૧૧૭, ૧૧૮, ૧૨૦

હિંદુનહિંદુસ્તાની (હિંદી અને હિંદુસ્તાની)

૨૫, ૩૨, ૩૩, ૩૭, ૪૦-૧, ૪૪, ૪૬-૭, ૫૧,

૫૪, ૫૭, ૬૨, ૬૫, ૬૮, ૬૪

હિંદુ-સુસ્તિમ એકતા (રાષ્ટ્રભાષા ને વિષિ

સાથે સંબંધ) ૧, ૩, ૨૦, ૨૧, ૨૨, ૩૨,

૩૫, ૩૮, ૪૨, ૪૬, ૫૨, ૫૪, ૫૫, ૫૬,

૫૮, ૬૯-૭, ૬૮, ૬૬, ૭૮, ૮૩, ૮૬, ૯૩,

૯૫, ૯૭, ૧૦૧, ૧૦૭-૮, ૧૧૮, ૧૨૩,

૧૨૬ (જીવો રાષ્ટ્રીય એકતા ઘણુ)

હિંદુ વિશ્વવિદ્યાલય ૮૦, ૮૬, ૮૬, ૮૦, ૮૪

હિંદુ સંસ્કૃતિ ૮૭, ૮૮, ૮૬, ૮૦

હિંદુસ્તાની (વ્યાપ્તા; રાષ્ટ્રભાષા છે.)

૬, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૧,

૩૩, ૩૮, ૪૨, ૪૬, ૪૮, ૪૩, ૪૪, ૪૭,

૫૦, ૫૨, ૫૮, ૭૪, ૭૬, ૮૦, ૮૫,

૯૧, ૯૨, ૯૭, ૧૦૧, ૧૧૧, ૧૧૪, ૧૧૮.

(રાષ્ટ્ર) ૬૦, ૧૨૨; —યોલી રૂપે

૭ ૮૨; (ડૉ. તારાચંદ્રનો ભત) ૧૦૪,

૧૨૬; —યોલીનો ધર્તિહાસ ૧૦૦.

...=હિંદી+હિન્દી ૬૨, ૬૫, ૬૮, ૬૬, ૧૧૯,

૧૨૧, ૧૨૬, ૧૨૭; =હિંદી=હિન્દી ૬૮;

—અને હિંદી સાહિત્ય સંમેળન ૬૩,

૧૧૩; —ના ધ્વનિઓ ૧૦૦; —ના પ્રચાર

માટે નવી સંસ્થા જોઈએ ૬૨, ૬૮,

૧૧૩; —ના ભાષણ માટે એ શૈલી

નાખુંબી જોઈએ ૭૭, ૮૧, ૯૬, ૧૧૬;

—નું ૩૫ (કેમ ઘડાય) ૭૭, ૮૦, ૮૧,

૧૧૦, ૧૧૭, ૧૧૮, ૧૨૪; —નું શાખા-

ભાડોળ (શાખાકોરા) ૭૭, ૮૦, ૧૦૦;

—નું સાહિત્ય ૭૭, ૮૧, ૬૨ (એ શૈલી,

જીવો રાષ્ટ્રભાષામાં); —નો ધર્તિહાસ

૧૦૪, ૧૨૨; —શીખો ૬૮-૬

હિંદુસ્તાની પ્રચાર સલા ૧૧૩-૪, ૧૧૮,

૧૨૦, ૧૨૨; —નું અંગારણ અને કાર્ય

૧૧૫-૬, ૧૨૩; —નો ઉદ્દેશ અને સંહેદ્રા

૧૧૬, ૧૧૭, ૧૨૨-૩

હુંપીકોરા, પરિત ૩૧

હેમચંદ્ર, ૧૦૩

SUPER 8MM

